

શ્રી મોહનયશરિરિક સમારક અંથમાદા—દ્વિતીય પુષ્પ

દી ધ૰ ત પ સ્વી

# શ્રી જિનત્રાદ્વિસૂરી જીવન-પ્રભા।

ખાતાદ્વારા, દીર્ઘતપસ્વી, થાજુટીથોલ્ડારક

મહારક શ્રી જિનત્રાદ્વિસૂરીશરળ મહારાજની

જ ન ગા થા।



: પ્રેરણ :

રાન્તરૂતી શ્રી ગુલાબમુનિ મહારાજ



: પ્રચોક્કઃ :

કુલચંદ હરિચંદ હોઠી

મહુવાડે

ઃ પ્રકાશક :

શા. જવેરયંદ કેશરીયંદ જવેરી  
શ્રી અનદિતસ્થાન ગાન-કાંડાર

તથા

શ્રી મહાપીરસ્વામી કુન્ડલ દહેરાસરના।

દ્વારીએ વતી  
પાયધૂની, મુંબઈ. ડા.



વીર સં. ૨૪૭૬

સં. ૨૦૦૬

ધ. સ. ૧૬૫૩



મુલ્ય

વાચન-મનન



ઃ સુદ્રક :

મહેતા અમરયંદ બહેચરદાસ  
શ્રી બહાદુરસિંહજી પ્રિ. પ્રેસ  
પાલી તા ચુા (સૌ ૨૧૦૫)

## સમ ર ણાં જ લિ

પૂજયપાઈ પ્રાતઃસ્વરણીય, કિયાપાત્ર, જશ-  
નામકમી, વચનસિદ્ધ, પુષ્ય પ્રલાવક  
ખુનિ શ્રી માહનલાલજ મહારાજ

આપના પ્રશિષ્યરતન, ભાલઘણયારી, દીર્ઘ-  
તપસ્વી, ધીર, મંલીર, થાણુતીથોકારક, શાંતમૂર્તિ  
ચેમનિષ્ઠ, ભદ્રારક જૈનાચાર્ય શ્રી જિનઅસ્થિ-  
સૂરીજ મહારાજશીની લુવન-પ્રભાના તેજ-  
કિરણોમાં ભક્તિભાવપૂર્વક આપશીનું નામ જોડી  
ધન્યધન્યતા અનુભવું છું.

ભવદીય,  
કુલચંદ હરીચંદ હોશ્યી

## માનવ ધર્મ

પર્યાષણના દિવસોમાં આપણે સૌચે પોતાની જાતનું સરવેષું કરવાનું જોઈએ. ૩૬૦ દિવસ ભયા પણ માનવધર્મ પ્રાપ્ત કર્યો? આત્મશુદ્ધિ કેટલી થઈ? ગ્રાન, ચારિત્ર શુદ્ધ પ્રાપ્ત કરી કે તે માટે પ્રયત્ન કર્યો? આમ ન કરીએ અને પર્વ ઉજવીએ તેને રોચાયથી? આત્માની ઉત્ત્રતિ માટે આત્મશુદ્ધિ કરવી જોઈએ. તપ, સંયમ, વિવેક વગર ઉત્ત્રતિ પ્રાપ્ત ન થાય. કેવળ કાનથી બ્યાખ્યાનો સાંભળવાથી કશું મળે નહિ. સાંભળેલ ઉપદેશનું મનન કરવાનું જોઈએ અને તેને આચરણમાં ઉતારવાનું જોઈએ.

માનવ-જીવન એ કોમતી વરસુ છે. અંતિમ સમય આવે છે ત્યારે ડોર્ઢી એક ધરી પણ આ દુનિયામાં રહી શકતો નથી. પછી તે રાજ, મહારાજ કે મોટો પ્રધાન હોય. માનવી-જીવન અધર્મ, અશુદ્ધિ દૂર કરવા માટે છે. પૂજન, રત્વન, મનન, નામ સમરણ, તીર્થયાત્રા વગેરે ઉપાયો ફણેવામાં આવ્યા છે. પણ આ બધું શુદ્ધ મનથી, અંતસ્તું થઈને કરવાનું જોઈએ ત્યારેજ ધર્મનો પ્રકાશ મળે. મોહ-આયાના આવરણોને દૂર કર્યો વગર આત્માનો પ્રકાશ દેખાશે નહિ. માનવધર્મ એળાએ અને આવા પર્યાષણ પર્વના પવિત્ર દિવસમાં માનવધર્મ જીવનમાં ઉતારી આત્મશક્તિ, આત્મશુદ્ધિ અને આત્મશાંતિ મેળવો.

શ્રી કૃતારજનાયક



પરમપ્રભાવક જૈન ચાસનહીપક પૂજયપાદ શ્રી મહુ મોહનલાલજ મહારાજ





## ખારા ગુરુદેવ

આચાર્ય શ્રી જીનકલિસૂરીશ્વરજી મહારાજ મારા પરમ ખારા ગુરુદેવની હતા.

હું એક સામાન્ય જૈનેતર, બાળક ધર્મના સંરક્ષાર અને ગુરુદેવની ચરણ સેવાથી ડેવી રીતે જિનેશ્વરદેવનો રાગી અને ગુરુભક્તા ઘન્યો તે એક જાણુવા નેવી કણાણી છે.

મારા જન્મ જૈનેતર જાટ (પાટીદાર) કુળમાં લગભગ ૧૬૪૧ માં થયો. મારી ૧૦-૧૧ વરસની ઉભરમાં મારા માતા ગુજરી ગયા. મારા પિતાજ ભેરાજીરાડ નોભાગામમાં શીવજી રામજી, બાલા રામજી, ધેનરચંદજી ચેરાયાને ત્યાં કામકાજ માટે રહેતા. તેઓ શેડ સ્થાનકવાસી ધર્મ પાળતા. સ્થાનકવાસી મુનિઓ આવતા તેમની સેવાનો લાલ જીપરોક્ત શેઠનું કુદુંંબ લેતું હતું. હું પણ તેમની સાથે જતો તેથી મને પણ તેમનો પરિચય રહેતો. એક વખત સ્થાનકવાસી મુનિઓની સાથે મને મોકદ્યો, સાથે ભીજ જૈન છોકરાઓ હતા તેથી હું પણ ગયો. અમે સાથે સાથે અધ્યા ભાગુતા હતા અને એ રીતે હું નમરક્ષાર મહામંત્ર શીખ્યો. શ્રી ઇપચંદજી મહારાજ મારા તરફ ખૂબ ભાવ રાખતા અને મને લખતાં વાંચતા શીખવતા. મને પણ તેમાં આનંદ આવકા લાગ્યો. પહેલાં તો મને ધાર્મિકસ્થૂગ્રા સુધે

અતાં નહોતાં પણ ધીમે ધીમે બાદ રહેવા લાગ્યું. શ્રી ઇપચંદજી મહારાજની મારા પર ધણી અમતા હતી.

શ્રી ઇપચંદજી મહારાજ ખૂણ પીપાડસીરી પાસેના રીયાં આમના વીસા ગોસવાળ ભુણેણ ગોત્રના હતા. તેમણે સં. ૧૯૩૬ ના નગોરમાં શ્રી સૂર્યમલજી મહારાજ પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી હતી. તેઓ વ્યાકરણું, કાચ્ય, સાહિત્યના સારા અભ્યાસી અને વિદ્યાન હતા. તેમણે ધણું અંથો પણ લખ્યા છે. સં. ૧૯૫૭ માં રાખપુરમાં મેં તેમની પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી. મારા મોટાભાઈ વીરચંદજી તથા મારા નાનાભાઈ ગીરધારીજી પણ તેમના શિષ્યો બન્યા હતા. તેમણે નાના-મોટા પરિસરો ધણું સંચા હતા. સં. ૧૯૬૧ માં અમે સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે ઉત્ત્વાસ્થી ગિરિરાજની પાંચ યાત્રા કરી હતી. બરવાળામાં તેમને સંવેગી દીક્ષાના ભાવ જાગ્યા હતા પણ શારીરિક પરિસ્થિતિ સારી ન હોવાથી હૃદયથી તેઓ સંવેગી રહ્યા હતા. સં. ૧૯૭૦ માં આવણું શુદ્ધી ૧૪ ના પાદ્ધિક પ્રતિક્રિમણ કરતાં મોટિશાંતિ બોલતાં બોલતાં નાગોર મારવાડમાં તેઓ સ્વર્ગવાસી થયા. ગુરુદેવે મને સ્વમ આપી શનુંઝ્ય જવા પ્રેરણું કરેલી તેથી હું વિહાર કરી પાલીતાણું આવ્યો. અને સિદ્ધાચળમાં મારા સહભાગ્યે મને ગુરુદેવ શ્રી જુનન્જદ્ધિસ્તુરિજી મળી ગયા. મારો અતમા આનંદથી નાચી ઉઠ્યો. મેં ગુરુદેવના ચરણમાં માં જુનન સમર્પણ કરી દીધું. ગુરુદેવ તો એટલા અધા ઉદાર અને સૌભ્યમૂર્તિં હતા કે મને તેમણે પ્રેમ-પૂર્વક સ્વીકારી લીધો. અને સં. ૧૯૭૫ ના વૈશાખ શુદ્ધ ૬ ના ગિરિરાજ શ્રી શનુંઝ્યની છત્ર-છાયામાં પાલીતાણું ગુરુદેવનો શિષ્ય બન્યો. એ વરસે ગુરુદેવની સેવામાં રહ્યો. વળી ચંચળ મને ઉધારો કર્યો અને મારવાડ તરફ નીકળી પણો. ગુરુ સેવાની અણુમોલ ધરીએના લાભથી વંચીત રહ્યો પણ પૂર્વપુર્ણના ઉદ્ય ચેંગે અને ગુરુવર્ણની કૃપાદિષ્ટી પાંચ વરસે પાછો ગુરુસેવામાં હાજર થઈ ગયો. ગુરુદેવની તો એજ અમિભરી દાખિ એ સમયે પણ રહેલી હતી. પછી તો શાન, ભક્તિ

અને સેવાના મંત્રો જીવનમાં તાણમાણાણું પેઠે વણુંતા ગયા. પુષ્પ-રાશિ ગુરુદેવે અસીમ કૃપાથી સ્તોત્રો, છદ્રો, શાસ્ત્રો અને તત્ત્વજ્ઞાન વગેરે ખૂબ શીખયું અને મારો એડો પાર થઈ ગયો. આ ઘન્યે ગુરુદેવે મારા મહોપકારી હતા. ગુરુદેવના પુષ્પ પ્રભાવથી હું મારી આત્મપરિણૃતી શાંત અને ધર્મ ભાવનામાં રાખ્યો શક્યો. મારી નાનાણી સાચળી તથીયત છતાં મારા ગુરુદેવ મારી રક્ષા કરતા અને કરે છે. મેં ગુરુદેવ શ્રી જીનત્રાંદ્રિસ્તુરિજીને કોધ કોધ સમયે અજ્ઞાન-પણે અશાતા ઉપજાવી હુશે પણ એ કૃપાસિંહુંચે તો મારા તરફ અમીદાંજ વરસાવી છે. મારી તો ભાવના છે કે મારા પુલ્ય ગુરુવર્યના પુષ્પ પ્રતાપે માઝે જીવન છેલ્લી ધડી સુધી સમાધિપૂર્વક શાંતિમાં પસાર થાઓ.

ઉત્ત્ર વર્ષ મેં ગુરુદેવની સેવા કરી અને ગુરુદેવની દીર્ઘતપશ્યા, યોગદાનિ, પુષ્પપ્રભાવ, ધર્મપ્રભાવનાની તમના, અદ્રિકતા તથા શાસનના ઉદ્ઘોતની જાંખના તેમ જ ગુરુદેવશ્રી મોહનલાલજ મહા-રાજના નામને ઉભ્યવળ કરવા માટેની તાલાવેલી વગેરે ઉદાત ભાવનાથી મારા જીવનમાં જ્ઞાન અને સેવાનો પ્રકાશ પથરાયો.

આવા પુષ્પરાશિ ગુરુવર્યની હું તેમનાં જીવનના અંત સુધી સેવા કરી શક્યો. તથી હું મારી જતને કૃત્ય કૃત્ય માનું છું. ગુરુદેવ તો એમ જ કહેતા “ગુલાખ ! મારા તરફ મોહ ન રાખતો. જિનેશ્વરના માર્ગમાં મર્સત રહેને.”

એ મારા તો પરમ ર્થારા ગુરુદેવ હતા. તેમની જીવનપ્રભા પહેલા પ્રકાશિત કરવામાં આવી હતી પણ એ શાંતમૂર્તિં, તપેનિધિ ગુરુ-દેવના સ્વર્ગંવાસ પણી ધણ્યા ધણ્યા. અક્તાજનોએ તેમના ચરિત્રની માંગણી કરી. ગુરુભક્તા શ્રી હરિયંદ્રાધ માણેકચંદ તેમજ શેઠ શ્રી રવજીબાધ સોજપાળ ને. પી. વગેરેની તે માટે ભાસ ભાવના હતી. અને શ્રી મહાનીર-સ્વામી દર્શારાસરના દુર્દીઓએ એ ભાવના વધાવી

લીધી. શાંતમૂર્તિં શ્રી જિનભદ્રવિજય મહારાજશ્રીએ યુગવીર આચાર્ય, શત્રુંભ્ય તીર્થદર્શન આદિના લેખક શ્રી યશોવિજયજી જૈન યુર્કુળના નિયામક ભાઈ કુલચંદ હરિચંદ દોશી મહુવાકરની યાદી આપી. ભાઈ કુલચંદભાઈ તો ગુરુદેવના પરમભક્તા છે તેમ જ ગુરુદેવના પરિયતમાં માટુંગા તથા પાયધૂની આવતા હતા. તેઓ ગુરુદૂળના કામ પ્રસંગે સુંભાઈ આબ્યા. વંદનાથે પાયધૂની આબ્યા. કામ સેવા માટે વિનિતિ કરી. મેં પૂજ્યપાદ ગુરુદેવના ચરિત્ર માટે વાત કરી અને સંસ્થાની જવાયદારી હેવાથી સમય એઠો મળતા છતા હર્ષપૂર્વક તેમણે મારી સૂચના વધાવી લીધી. મારી પાસેનું લાખાણું મેં આપી દીધું અને મારા મનનો ભાર ઉત્તરી ગયો. મને આનંદ અને સંતોષ થયો.

ગુરુદેવના ચરિત્રને ગુરુદેવ તરફની પૂર્ણ લાગણીથી પ્રેરાધને સર્વીંગ સુંદર, રસપ્રદ અને વિધવિધ જીવનપ્રસંગોથી મધ્યમધતું બનાવવા માટે કુલચંદભાઈ મહુવાકરને ખરેખર ધન્યવાદ ધરે છે.

મારા વચનને માન્ય રાખી જૈનસમાજના પીઠ અને વિદ્ધાન કાર્યકર શ્રી જૈન એ. કોન્સર્વન્સના ઉપપ્રમુખ અને શ્રી જૈન સ્વયંસેવક મંડળના પ્રાણસમા શ્રી મોહનલાલ હીપચંદ ચૈરાકસીએ ગુરુદેવની જીવનપ્રભાની પ્રસ્તાવના હર્ષપૂર્વક લખી આપી છે તે માટે તેમને પણ ખરેખર ધન્યવાદ ધરે છે.

આ જીવન પ્રભાના પ્રકાશન માટે જે જ ગુરુદેવના ભક્તોએ સહાયતા કરી છે તે સૌને ધન્યવાદ ધરે છે.

પૂજ્ય ગુરુદેવના ચરિત્રમાંથી સૌ અહેન ભાઈએ પ્રેરણું મેળવી પોતાના જીવનને ઉનને એ જ અભ્યર્થના.

શ્રી મહાવીરસ્વામી દેરાસરળ ઉપાશ્રય,  
પાયધૂની સુંભાઈ ઉ.  
સં. ૨૦૦૬ નાશાવણું વદી ઉને ગુરુવાર }  
} ગુરુદેવના નિર્ણયુણી અંતેવારી  
} ગુલાભમુનિ

## શ્રી સ્થંભળ પાર્શ્વનાથાય નમઃ પ્ર સ્તો વ ના।

---

‘દીર્ઘતપસ્વી જિનત્રાદ્ધિસુરિજીવન-પ્રભા’ નામા આ પુરસ્તકની પ્રસ્તાવનામાં કલભને અતિમંત કરતાં પૂર્વે મારે જણાવવું જોઈએ કે જેમના જીવન સંબંધે, અરે અમણુ જીવનના વર્ણોમાં સ્વપ્રશ્રેષ્ઠ સાધનારા અતુક્રણીય કાચો અંગે, વધુ વિરસ્તાર ન કરવામાં આવે તો પણ, પ્રારંભમાં ને વિશેષણુ વાપર્યું છે એ ઉપરથી સહણ જુંગીનો જ્યાલ સહજ આવે તેમ છે, ‘દીર્ઘતપસ્વી’ શાખથી જ જીવનની પવિત્રતા અને હૃદયની સ્વચ્છતાનો ભાવ સમજાય છે. એક રીતે કંઈયે તો સંત, મહાંત, કે સાધુ-મહાત્માના જીવન એટલે સમજુને સ્વીકારેલ, આત્મશ્રેષ્ઠ સાહ, દીપ્રિય-દમનને કષાય છેદનનો કપરો કષ્ટ પૂર્ણું ને કાંટાળો માર્ગ. એમાં ‘તપ’ તો અત્યપદે જોઈએ જ. એ નિના દમન-છેદન [૩૫] જોડીને ન તો છુટી પાડી શકાય કે ન તો મૂળમાંથી ઉભેડી શકાય. એ સાથે એ વિશેષતા સંકળાયેલી હેવાથી જ આ અંથની રચના જન્મ પામી અને પ્રસ્તાવના લખવાનું મારે ભાગે આવ્યું. આ સંતે ડેવળ આત્મંકલ્યાણુની એક દાષ્ટિ ન રામતાં સાથેસાથ જૈનધર્મની પ્રભાવના થાય, જૈન સમાજનો અભ્યુદ્ય થાય, એવા કાચો પણ કણ્ણો છે. એ કાર્યવાહીના આદેખનથી જે બોધદાયી સામગ્રી આપણુને પ્રાપ્ત થાય છે એ એણી મૂલ્યવાન નથી જ. નીતિકારોએ કણ્ણું છે કે— એરોપકારાય સંતાં વિભૂતયઃ અથીત મહાત્માઓ પરોપકાર પરાયણુ જ હેય છે એ વાત આપણું આ ચરિત્ર નાયકને માટે અક્ષરશઃ સત્ય છે.

જન-મસ્થળ, મૈત્રી, યત્તિરીક્ષા અને સંવેગી સાધુ જીવનમાં પ્રવેશના પ્રસંગે. પર નજર ફેરવીએ છીએ ત્યારે એ મુદ્દા ને નેત્રો સામે તરવરે છે. તે આ રહ્યા આચરણું ને પ્રગતિ.

શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે—

કમ્બુણ બ્રહ્મણો હોઇ, કમ્બુણ હોઈ ખતિઓ ।  
વર્દીસો કમ્બુણ હોઇ, સુદ્રો હોઇ કમ્બુણ ॥

અર્થોત् ત્યાગ અને શિપળ જેના જીવનમાં વણુયેલા છે, તે ખાલિણુ, શરણ્યુભતિનું રક્ષણુ કરે તે ક્ષત્રિય વાણિજ્ય જેનો વ્યવસાય છે તે વૈષ્ય અને સેવા આપે તે શુદ્ધ અર્થોત् વર્ણુ માણસના જન્મ આશ્રયી નહીં પણ એની ‘કરણી’ આશ્રયી છે. એ ઉપરથી બીજે મુદ્દો એક અંગ્સુ ઉકિત પ્રમાણે— A man is the Creature of Circumstance. એટલે કે ‘આત્મા નિમિત્તવાસી’ છે. એવા તારવી શકાય. આમ નહોત તો તો નાના ગામડામાં રહેતા, જાતિએ ગૌડ ખાલિણુ અને વ્યવસાયે કૃપિકાર કુદુંબમાં જન્મેક ‘રામકુમાર’ ભગવંત શ્રી મહાવીર દેવના સંધમાં પ્રથમ પદ બોન-વતી સાધુ સંસ્થામાં ક્યાંથી આવતે અને એમાં પણ સૂર્પિદ જેવા અતિ મહત્વના અધિકારે સ્થાપન થતે !

જીની ભગવંતોએ પાંચ સમવાયનું સ્વરૂપ જે રીતે ખતાવ્યું છે તે વધ્યાર્થું છે. એમાં પૂર્વભવનો પુન્યોદાય અને આ ભવનો પુરુષ-પાર્થ ખરે જ ડોધ અદ્ભુત ભાગ ભજવે છે. માનવી કલ્પી ન શકે તેવું પરિણામ નજર સામે ઘનતાં દર્શાવે છે. ‘જીવન-પ્રભા’ ના પાના ફેરવતાં આ વાતના નિતરાં દર્શાવે થાય છે. આ પ્રકારના ચરિત્રા દોરી, જેમણે સિદ્ધ હરત લેખકપણું પ્રાપ્ત કર્યું છે એવા શ્રીયુત ભહુવાકર પણ પોતાની કલમને સરળ વાણીમાં આકર્ષક રીતે વહાવતા, પ્રકરણોને વિવિધ સ્વાંગ સળવતા, નવનવા રથળોના વિહાર વર્ણવતા અને પરમાર્થના કાર્યોની નોંધ લેતાં આગળ વધે જય છે. પ્રકરણનાં મથાળે મૂકેલા ચિત્રા પણ એહાં ભાવવાહી નથી.

‘શતુંજ્યનો ચમતકાર’ નામા અકરણુ કથા નાયક રામકુમારના જીવનમાં પણ ચમતકારી નિવડે છે. યતિ જીવનમાં ચૂદુ, ભીકાનેર, નાલ આહિના રમણીય મંદિરો તેમજ જિરનાર અને શતુંજ્ય જેવા મહાન તીથીનાં દર્શન થાય છે. એ વેળા જૈન ધર્મ પ્રત્યેતી અદ્વા વૃદ્ધિ પામી ચુકે છે અને ધ્યાનવૃત્તિ હીક હીક ભીલી હોય છે. સાહસ અને તપદારા દેહ-દમન પણ દષ્ટિગોચર થાય છે એ સર્વને માથે કળશ સ્થાપનકૃપ કાર્યનો એ કાળે પ્રતાપશાળી અને વચન-સિદ્ધ ગણ્યાતા મુનિ મહારાજ શ્રી મોહનલાલજીના સમાગમથી જ થાય છે. તેઓશ્રીના વરદ હરતે વાસક્રોપ પામી શ્રી યશોમુનિજીના શિષ્ય તરીકે ‘જાદ્ધિમુનિ’ નામથી સંવેગી સાધુ બને છે અને વૃદ્ધ એવા દાદા ગુરુના સંપર્કમાં રહેવાનો તેઓશ્રીની સેવા કરવાનો ને ચોગ, ચારિત્રનાયકસુરીને સાંપડે છે એ તેઓશ્રીના ભાવી જીવન ઘડતરમાં સંગીન પાયાની ગરજ સારે છે. જાદ્ધિસુરિજીના પરિયયમાં આવવાર હરકોઈને એ વાત અનુભવમાં આવ્યા વગર રહેવાની નહીં કે વચનસિદ્ધિને વરેલા સ્વર્ગસ્થ મુનિરાજ શ્રી મોહનલાલજીના કેટલાક ગુણો તેઓશ્રીના આ પ્રશિષ્યનું હૃદય અજવાણે છે. કદાચ અહો વિશિષ્ટ જ્ઞાનમરિમાના દર્શન નહીં લાધે પણ અંતરની સરલતા તો દર્શણું જેવી નિર્મણ જણ્યાશે. સાંપ્રદાયિક પૂર્વગ્રહ નજરે પણ નહીં ચઢે. સૌ કોઈનું કલ્યાણું થાવ એવી ભાવના ઉઝલે પગલે રમતી અનુભવાશે. એ કારણે ધણ્યાને અનુભવ બોલે છે કે દાદા ગુરુ માઝક તેઓશ્રી પણ વચનસિદ્ધ હતા. અરે, મંત્રતંત્રના ગ્રાતા હતા. એનું તથ જેવા કરતાં અહો એટલું કહેવું પર્યોત્ત લેખાશે કે તેઓશ્રીએ જુદા જુદા સ્થળે ધર્મ ઉન્નતિના અને શાસન પ્રભાવનાના કે કામો કયો છે એમાં ઉપર વર્ણવેલી પ્રકૃતિનો ચોગ જરૂર કારણભૂત છે. વિદ્ધતા કરતાં ચારિત્રની વિશુદ્ધતા અને હૃદયની નિર્મણતા હૃપ ગુણું બુગલે સુંદર ભાગ ભજવેલે છે.

જેનવસ્તીવાળા ગામોને દેવ મંદિરથી અલંકૃત કરવા, અરિહંત-

પ્રભુના મનોહર બિંધોની પ્રતિષ્ઠા કરવી, ધર્મકરણી માટે ઉપાશ્રમ ઉભા કરવા, અગર તો તપકરણીદરા આદગણમાં ધાર્મિક વાતા-વરણના સર્જન કરવા એ સાધુજીવનમાં સહજ છે. એ કાર્યોની પ્રેરણું સુનિ મહારાજેના ઉપહેઠને આભારી છે. જુદા જુદા પ્રદેશોમાં પગલા માંડતાં સાધુ-સંતો આ જાતના પવિત્ર કાર્યોના માર્ગદર્શક હોય એમાં આસ્કર્ય નથી અને ચરિત્રનાયક પણ એમાં પાછળ નથી રહ્યા. આ દળદાર પુસ્તકમાં એ સર્વ વર્ણવેલું જ છે. અહીં જે વાતની ખાસ નોંધ સેવાની છે તે એ કે જેમ સનિમત્ર સુનિ શ્રી કર્પૂરજિન્યાળે સ્વ કલ્યાણ સાધવા સાથે ઉપહેશ દરા શાનનો પ્રચાર વિરતાર વધાર્યો, અને સમાજને ઉપયોગી બાબતો ઉપાસક સુમૂહને સમજાવી એની ઉન્નતિ થાય તેવા કાર્યોના શ્રી ગણેશ વિહાર દરખ્યાન કર્યો, તેમ આપણું આ ચરિત્રનાયક પણ વર્તતા નથનપદમાં આવે છે. કુસંપતું કાસળ કહાઉવા કમર કસે છે. હાનિકારક ઝઠી-એને જડમૂળથી હુખેડી નાંખવાના કાર્યમાં પીછે હઠ નથી કરતાં અને ઉપરછલી વાહવાહના મોહમાં અંનાઈ જર્દ ખરી વાત કહેતા જરા પણ જબરાતા નથી. એમ કરવા જતાં કેટલીક વાર સ્વાધ્યાયને ક્ષતિ પહોંચવાના પ્રસંગ પણ આવે છે. માનસિક બોજ વધે છે છતાં જૈક્યની ભાવનાથી રંગાયેલ આ મહાત્મા આરંભેલ કાર્યને અધ્યવચ્ચ મૂકૃતા નથી જ. આ વાતની પ્રતિતી ધર્મ-ઉદ્ઘોત ‘ગ્રામો-દ્વાર’ જેવા પ્રકરણું વાંચવાથી થાય તેમ છે. લાડવાશ્રીમાલી અને ખીઓને સ્વામીવાત્સલ્યમાં સ્થાન અપાવવા ઇપ કાર્યો અને નારી-જાતિ માટે ‘ઝડુધર્મ’ પાલન અંગે કરેલ કાર્યવાહીથી સમજાય તેમ છે.

સમાચારી ખરતરમચ્છની પાળતા છતાં આચાર્યશ્રીને અન્ય અચ્છ પ્રત્યે કોઈ જાતનો વિરોધ ન મળે. પણ આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભમૂરીખરણ માફિક શ્રી જિનત્રાઙ્કિસ્રી પણ સ્વ શિષ્ય પરિવાર સહિત સર્વ સાથે ભળે છે. ધર્મ પ્રભાવનાના કાર્યોમાં પુરસ્પર સાથ હે છે અને તેઓશ્રીનો એ ગુણું ભદ્રિક સ્વભાવી અને

સેવાભાવી શિષ્ય મુનિ શ્રી ગુલાભવિજ્યળમાં ઉત્તરેલો આને નજેરે જોવાય છે. ‘શાનદાન’ તું મહત્વ ઓછું નહીં આંકનાર આ. સુરિલુ વિદ્યાધામે ઉભા કરાવે છે. પાઠશાળાએ સ્થપાવે છે. જ્યાં સાધુ-મહારાજના પગલા સામાન્યતઃ હુલ્લબ ગણ્યાય છે અને વરસીના માપ માપતા જ્યાં જૈન ધરોની સંખ્યા આંગળાના ટેરવે ગણ્યાય તેટલી હોય છે, વળી જ્યાં અજ્ઞાનતા અને પોતી પ્રથાએ પરંપરાથી ઉત્તરી આવીને જડ ધાલી બેઠી હોય છે એવા ગામડામાં વિચરણું, જડર પડે ચોમાસું રહેવું અને ઉપહેશવારિનો સતત ધોખ વહેવડાલી વર્ષો જુના અધારા ઉકેચી, શાનરવિનો અરિમાત્રા પ્રગટાવે તેવા પ્રકાશ પાથરવા ઉઘમ કરવે એ આ સંતના વિહારમાં જંગીનો સુદ્રાલેખ બન્યો હોય એમ દેખાય છે.

આપણું ચરિત્રનાયક જેમ શરીરી તપ કરવાની લગતીવાળા હતા. તેમ એકાંત મેળવી ધ્યાન મન બનવામાં પણ લાલાયિત હતા. એ તો સૌ ડોર્ચ સારી રિતે જાણે છે કે દરેક ધર્મમાં ધ્યાન અંગે જુદી જુદી પદ્ધતિએ દર્શાવેલી હોય છે. જૈનધર્મ આત્મકલ્યાણના ધેયને વરેલો હોવાથી ધ્યાનના એ પ્રકાર. ધર્મધ્યાન અને શુક્લધ્યાન પર એ ખાસ ભાર ભૂકે છે. આમ છતાં એમાં પણ મંત્ર સાધનાને સ્થાન છે. નમસ્કાર યાને પંચપરમેષ્ટિપ મહામંત્ર ઉપરીત થીજા મંત્રો પણ દર્શાવાયા છે અને એની સાધનાની રિતો પણ વર્ણિતેલી દર્શિગોચર થાય છે. વીતરાગ પ્રલુ તો નિરંજન નિરાકાર હોવાથી સંસારી જીવોનું ભલુ કે ભુંકુ કરતા નથી. અર્થાત ક્રાંત પણ પ્રકારના ફળદાતા બની શકતા નથી. પણ તેએ સરખી સર્વગુણુસંપત્ત વિજૂતિને નેત્રો સામે રાખી સાધક આત્મા ધ્યાન આદિ છિયાએ. દારા સ્વાત્માને કર્મમળના કીચડભાંથી બહાર આણી શકે છે. આ કર્યાંમાં તીર્થીકર હેવોના યક્ષ-મક્ષણી યાને દેવયોનિમાં વર્તતા ઉપાસકો સહાયક બને છે. પણ આ ક્રાંત એ પ્રકારના હેવોની આરાધના વિના બનતું નથી. એ અંગે સાધક માટે સાધના કરવાના જુદા જુદા ઉપાયો

વર્ષાવેલા છે. આટલા લંબાખુથી ઉલ્લેખ કરવાનું કારણ એ જ કે આપણું કથા નાયકને આ પ્રકારની સાધનામાં શરૂઆતથી જ રસ પેદા થયો હતો. સાધનાનો પ્રભાવ પણ જણાયો હતો. એટલે તેઓ ‘મહુણીભદ્રવીર’ની કે ‘ધંટાકરણ મહાવીર’ની સાધનામાં અને સ્થાપનામાં અદ્ધા ધરાવતા અને અન્યને માર્ગદર્શક પણ બનતા. ખંભાતના માણેકચોક ઉપાશ્રયના ઉદ્ઘાર પ્રકરણમાંથી, સોળતાની દેરીના જણોદ્ધાર વૃત્તાન્ત પરથી અને મુંબદ્ધમાં પાયદુની પર આવેલ શ્રી મહાવીરપ્રભુના દેવાલયમાં હેઠળના ભાગે સ્થાપન કરેલ ‘શ્રી ધંટાકરણ મહાવીર’ ની મૂર્તિ પરથી એ વાત સહજ તારવી શકાય છે.

પૂજય મુનિમહારાજ શ્રી મોહનલાલજીના રમરણ્યાર્થે સુરતમાં સ્થાપન કરવામાં આવેલ જીનભંડારની ઉલ્લતિ અંગે ચાલુ પ્રથાને બાળુએ રાખી ને દીર્ઘદર્શી પગલું ભર્યું તે, અને એ પૂજયની પંલઅ-ક્રેશરીના પ્રમુખરસ્થાને ઉજવાયેલી જ્યન્તિ પ્રસંગે વીરચંદ રાધા-પળવાળા પ્રસંગની યાદ આપી ડેટલીક મુદ્દાની વાતો વર્ણવી તે, તેઓશ્રીના હૃદયમાં રમતી શાસનદાઝ અને શાસનપ્રભાવના સુચયવે છે.

‘ઠાણુ’ નગરીના આવડોમાં ખારવર્ષી કુસંપ હતો તે ટાળી, પવિત્ર એવા શ્રીપાળ રાસમાં આવતા આ મહત્વના સ્થાનને પુનઃ જનતાની નજરે આખુનવામાં અને શ્રી મુનિસુશ્રત સ્વામીનો ને નવિન પ્રાસાદ આને આપણું સર્વની ચક્ષુ સામે તીર્થ સ્વરૂપે ખડો છે અને ને શ્રી સિદ્ધયક્ષળના મહાનપ્રભાવને રજુ કરી રહેલ છે એની સ્થાપનામાં આપણું આ કથા નાયકે અતિ અગત્યનો ભાગ ભજવ્યો છે. મુંબદ્ધ વાસીઓ માટે ‘અમાશી’ માઝેક ‘ઠાણુ’ પણ તીર્થધામ બન્યું છે. રવી-વાર જેવા રજના દિવસે સેંકડો ભાવિકો આ સ્થળમાં ઉત્તરી પડે છે અને પ્રલુદર્શનથી પોતાના આત્માને પાવન બનાવે છે, એ સૂરજની દીર્ઘદિષ્ટને આભારી છે.

પોતાના જવનની શરૂઆતમાં અનોખી<sup>9</sup> છાપ ઐસાડનાર ‘ચુરુ’ અને ‘ખીંકનેર’ તેઓઓની નજર બહાર નથી રહ્યા.

પોતાનામાં રહેલી ઉપરેશ શક્તિનો પ્રભાવ એ રથગોમાં ડેવી અસર જન્માવે છે એ સારુ પ્રકરણું ડાદ અને ૪૦ જોવા જરૂરી છે. ‘મહુરા ‘મિલન’નામાં ૪૧ મું’ પ્રકરણું સાચે જ આજના વાતાવરણમાં મહુરતા પ્રસરાવે તેવું છે. એમાં સાચી સાધુતાની હૃદય ડાલાવે તેવી વાત છે ‘નમ્યા, એ પ્રલુને અમ્યા’ જેવી ઉક્તિનું રહ્ય આવા અનાવો પરથી જ સમજાય છે. દાદા ગુરજી એવા શ્રી મોહનલાલજી મહારાજના નામથી ચાલતી ‘શ્રી મોહનલાલજી જૈન-લાયબેરી’ના ઉદ્ઘાર અર્થે, એને દેશકાળને અનુરૂપ સ્વર્ગ-સંજાવી, નમૂનેદાર અનાવવા માટે શ્રી જિન કર્દિખ્યરિએ રિદ્ધિનો આંક તો ઠીક ઠીક ઉચ્ચે ચઢાવ્યો છે. એને મૂર્તસ્વરૂપ અપાતું જોવા એ નથી રહ્યા પણ અંત ઘડી સુધીની તેઓશીની એ માટેની અભિક્ષાપા પોતાના વિનિત શિષ્ય શ્રી ગુલાબમુનિના હાથે પુરી થશે એવા સંતોષ સાથે સિધાવ્યા છે. તેઓશીનો આખરી સંદેશ પણ એ ‘સેંદ્રલ લાયબેરી’ સંબંધે છે.

સાધુ નામ તે સાધે કાયા, પાસે ન રાખે કોઈની માયા,  
લેવે એક અને હેવે ન હો, ઉસકા નામ સાધુ કહો.

આ હિંદી દુઃખામાં સાધુજીવન માટે સુંદર વ્યાખ્યા બાધેલી છે. પ્રથમ લીટીમાં સ્વકલ્યાણું અને અકિંચનતાને આગળ ધ્યો છે એને ભીજી લીટીમાં ‘લેવે એક’ કહેતાં પ્રલુસરણમાં જાગૃત રહેવાતું દર્શાવ્યો, ‘હેવે ન હો’માં ન આપે આશીર્વાદ કે ન આપે આપ એવો ગૂઠ અર્થ ભયો છે.

‘જીવન-પ્રભા’ના પાનામાં ઉપર વર્ણવેદી સાધુતાના ડગલે ને પગલે દર્શન થશે. એમાં પરમાર્થના પ્રસંગે ખીચોખીય ભરેલા છે. તપ, જ્ય., તીર્થયાત્રા, પ્રતિધા, અને પ્રાસાદ નિમોણ જેવા પવિત્ર કાયો જેમણું વરદ હરતે ભારતના બિન બિન પ્રહેરોમાં થયાં છે. એતી મનોરમ શૈકીમાં આદેખાયેલી કદ્ધાણી આ અંથ પુરી પાડે છે. પાછ વિહારથી અગણ્યિત માધ્યલનો પ્રદેશ ઉલ્લંઘનાર, શ્રમણુ

આચારના આકરા પરિસહે સમભાવે સહન કરનાર, અને સામાન્ય જીવનમાંથી સાહસ અને પુરુષાર્થના બળે સન્માન્ય પદ પ્રાપ્ત કરનાર 'રામકુમાર' માંથી 'જિનત્રાદ્વિસુરિ' બનેલ આત્મા હોઈ 'મહાત્મા' પદ મેળવનાર-વિભૂતિ માનવભવ સરળ કરી અછ. સ્વ જીવન ધન્ય બનાવી અછ. એની કથા છે. એ નિતિં સત્ય છે. અને હજરો માનવો માટે બોધપાઠ્યપ નિવડે એવી યાદ પણ પાછળ મુક્કી જનારી પ્રેરણુદ્ધારી કથની છે એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નહીં લેખાય. આવા આત્માએ માટે જીની ભગવંતોએ 'જ્ય જ્ય નંદા-જ્ય જ્ય લદા' નો ધોાપ સુકરર કર્યો છે. અને લેખકે એ પ્રકરણું મથાળું 'મૃત્યુ મરી ગયું રે લોલ' બાંધી એ ધોાપ પાછળનો આશય રસ્પષ્ટ કર્યો છે.

જીવન ચરિત્રો આપણું જેવા વિષમકાળમાં જીવનાર માનવો માટે 'દ્વિવાદાંડી' ની ગરજ સારે છે. સાગરમાં ઘરાએ ચઢી જતાં વહાણું નેમ દ્વિવાદાંડી બચાવે છે તેમ આ ભવસાભરમાં પવિત્ર જીવનનો રાહ દર્શાવી આ પુસ્તક માર્ગદર્શક અને છે. લેખકશ્રીની કલમ પણ સુહાસર વાતોને વર્ણવતી, આશયને રહેસ્ટ કરતી અને વિસ્તાર થવાના ભયને નજર સામે રાખી પટને સંકેલી લેતી નવલ્પદ્ધાની શૈલીએ, સરળતાનો સધિયારો લધ કુચકુદમ જારી રાખે છે. નવનવી વાતોમાં અવગાહન કરાવતી છતાં, મૂળ ધ્યેયને લક્ષ બહાર નથી ઝરતી. એટલે જ અંતમાં કઢી દહ્યં કે તેઓશીના હાથે લખાયેલ અન્ય ચરિત્ર અંથી માફ આ 'જીવન-પ્રભા' પણ હજરોનો આદર પામશે અને પ્રભા વિસ્તારશે.

<b>મોહમ્મદી</b> આવણ વદ ૮ મંગળવાર જન્માધ્યમી	}	<b>મોહનલાલ દીપચંદ ચોકસી</b>
---	---	-----------------------------

## આચાર્યશીના અનુપમ ઉપકારે।

---

પરમપૂજ્ય આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી જીનરિફિસ્ક્યુરિશરાજ મહા-  
રાજ સાહેબના અનુપમ ઉપકારે। જૈન સમાજ ઉપર એ ઘટ-  
નાને પુરાવો લેવા કયાં જવું પડે તેમ છે ? આચાર્યશીની રિફિ-સિલ્ફિનાં  
સંખ્યાભંગ કિર્તિસ્તંભો સમાજના હિતાર્થે ડેર ડેર જોઇ શકીએ  
તેમ દશ્યમાન છે. તેઓશી સુંખધમાં પ્રથમ વિહાર કરનાર વિદ્યાનુ  
અને પ્રસિદ્ધ નામ મોહનલાલજ મહારાજના એક પ્રભર શિષ્યરત્ન  
હતા. અને સુંખધમાં લાલભાઈ ઉપર આવેલ શ્રી મોહનલાલજ જૈન  
સેંટ્રલ લાઈફ્રેરીની સ્થાપના કરવામાં આચાર્યશીની એક પ્રશસ્ત  
સિદ્ધિ આજે પણ શાનદાનનું અરણું વહાંથી રહી છે અને તેનો લાભ  
આખાલ-વૃદ્ધ સૌ ડોર્ચ લાઈ રહ્યું છે. જૂના કાળમાં શાનનો આ  
જતનો પ્રવાહ ચાલુ કરવાનું અતિ કિણુ કાર્ય ઉપાડી તેને પારે  
પહેંચાયું એ સિલ્ફિનું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી. આ પુરતકા-  
લય માટે એક મોટું ફંડ ઉલ્લં કરવાની તેઓની ભાવના હતી, તદ્દનુ-  
સાર પોણોલાભ ઇથીઆ નેવી એક સારી રકમ એઓશીના સહૂ-  
પદેશથી એકનિત થયેલી પડેલી છે. પૂજ્ય આચાર્યશી સરલ, શાંત  
સ્વભાવના અને અતિ નાન્સેવાભાવી તરફે પોતાનું જીવન વીતાવી  
ચુક્યા છે. ધર્મભાવનાને જાગૃત રાખવામાં અને સમજથુપૂર્વીક કિયા-  
આદિમાં ખૂબ રસ ઓતાજનોમાં તેમણે ઉત્પન્ન કરી ટકાવી રાખવાના  
પ્રયાસો જીવનભર સેવ્યા છે. અને તેથી ભાવિકજ્ઞનતા ઉપર તેમની  
ઉંડી છાપ અદ્દાપિર્યાન્ત જીવન્ત રહેલી છે.

સુરતથી સુંખ સુધીમાં જ્યાં દાખિપાત કરીએ ત્યાં અનેક  
રથને જીનમંદિરે। અને ઉપાશ્રેયા બંધાવવામાં જે જેહમત ઉઠાવી છે

તે અનુપમ છે. આ રસ્તાપર ટેર ટેર ભંડિરો અને ઉપાશ્રો એમની જૈતર્યર્મ પ્રત્યે અનેડ સેવાના નમૂનાફે આપણે આને જોઈ રકીએ છીએ. એનો લાભ અનેક ભાવિકળવો આને લઈ રહ્યા છે અને પોતાનાં જીવનને ધન્ય ગણુવામાં આવે એ સ્થિતિ ઉત્પન્ન કરવા માટે પૂજ્ય આચાર્યશ્રી પ્રત્યે તેઓનાં ભરતકો આને પણ વંદના-પૂર્વક નમે છે.

શ્રી ધંટાકષુણુંની મૂર્તિ પાયધુની ઉપર આવેલ મહાવીર સ્વામીનાં દેરાસરમાં રથાપિત કરી વર્ષો જૂની ભાવિક ભાઇ-ઝેનોની માંગ તેઓશ્રીએ પૂરી પાડી સમાજની અનેઓભી સેવા અન્યાની ભાત પાડી છે એ સુકંતકં સ્વીકારવું જોઈએ. આને એ મૂર્તિ ભક્તિભાવના માટે અનેક ભાઇ-ઝેનોની ભક્તિનું કેન્દ્ર બની રહી છે.

આ ઉપરાંત થાણ્યામાં એક નમૂનોદાર દેરાસર બંધાવવામાં તેમણે ને પરિશ્રમ સેવ્યો છે તે અનેડ અને અદ્વિતીય છે. આને થાણ્યાનું દેરાસર તીર્થભૂમિ સમાન યદ્ય પડ્યું છે અને સુંબદ્ર વાસીઓને ખાસ કરીને આસપાસના નજીકના રથગોમાં વસતા જીનો માટે એક રમણીય રથાન છે. કલા-કારીગીરી અને ચિત્રા-પણેથી સુંદર રીતે શાણગારવામાં આવેલું આ જીનમંદિર કલા અને ધર્મનો સચોટ આદર્શ પૂરો પાડે છે અને મનોરભ્ય ધાર્મિક ભાવના સાધના અર્થે પણ આ રથળ પ્રસિદ્ધિને પાભ્યું છે. આચાર્યશ્રીની આ રિદ્ધિ સિદ્ધિ-એઓએ સમાજમાં એઓશ્રીને સદાય જીવન્ત ચિર:રમણીય રાખ્યા છે. એમના જીવનના ઉદાત્ત તત્ત્વોને જીન ભાઇએ અને ઝેનોના અનુસરે એજ એમના જીવનની યથગાથા છે. પ્રભુ એઓશ્રીની રમતિઓને તાજ રાખે અને સમાજ તેનું યથાશક્ય અનુસરણ કરે એજ અક્યર્થના.

શાંતિનગર  
માટુંગા।

૬૦

૨૪૭ સોજપાળ

## એ બોલ

દસ વર્ષ પહેલાં હું અમદાવાદથી ગુરુકુળના નિયામક તરીકે  
પાલીનાણું આવ્યો. તે અરસામાં આચાર્યશ્રી જીનજાદ્વિસ્ત્રિજી પાલી-  
તાણા પધાર્યો હતા. ગુરુકુળમાં રિથરતા કરી હતી. તેજ વખતે  
તેઓશ્રીની દીર્ઘતપશ્ચભી, ચોગસિદ્ધિ, રૂન-પ્રભા, વયોવૃદ્ધ હોવા  
છતાં નવીન વિચારે. “ ગુરુકુળ જેવી સંસ્થાએ પાંચ-દસ ગુરુકુળો  
જેન જગતમાં શ્રું ન થાય છે આવી સુંદર ડેળવણીના ધામ સુભી  
સંસ્થાએ. તો થચી જ જોઈએ? ” જગતાએ જગતાએ ગુરુકુળોની  
જરૂરિયાતની દીર્ઘદિષ્ટ તેમનામાં જોઈને હું ચક્કિત થયેલો.

મારા બનેવી શ્રી હરિચંહ માણેકચંહ તેમના અનન્ય ભડકત  
છે તે હું સુંખાઈ ગયો. ત્યારે જાણ્યું. પછી તો તેઓશ્રી મારા બહેનના  
માણુંગાના શાન્તિ-સદનમાં પદ્ધાર્યાં હતા. ત્યારે વિરોધ દર્શનનો લાભ  
મળતો. મારા ભાણેજ મયંકકુમારને જળે ગાંડો થયેલી અને ઓપન  
રેશન કરાવવાની વાતોથી બધાં ચિંતિત હતા તે વખતે આચાર્યશ્રીએ  
મંત્રોચ્ચાર અને ધાર્મિક પાઠના પવિત્ર પાણીથી કુમારને રોજ સુંકલ  
કર્યાનો ચ્યામટકાર તો. આંખે દીડી વાત છે. મારા સહભાગ્યે ગુરુકુળના  
સ્વર્ગવાસના દિવસે હું ગુરુકુળના કાંબે સુંખાઈમાં હતો. તે વખતની  
તેઓની આત્મશક્તિ જોઈને પણ તાજુથ થયેલો.

અમારા ગુરુકુળના સંસારીપણુના પ્રસુખ અને હાલ બોડેલી  
પરમાર ખત્રી જેન આશ્રમ માટે રાત-દ્વિસ પૂર્ણ ખાંતથી જત-  
મહેનત કરનાર શાંતમૂર્તિ શ્રી જીનભદ્રવિજયજી મહારાજશ્રીની ભાવના

થઈ કે આચાર્યશ્રીની જીવન-પ્રભા મારે લખવી, મારી પાસે વિશેષ વિગતો તો નહોંતી પણ આચાર્યશ્રીના અંતેવાસી અનન્ય ગુરુભક્ત શ્રી ગુલાભમુનિ મહારાજે આચાર્યશ્રીના જીવનના અનેક પ્રસંગો મને સંભળાવ્યા એટદ્વિ જ નહીં પણ સમય મેળવી તેની વીગતો લખાવી આપી, ઉપરાંત જુદા જુદા સમાચાર પત્રમાં આવેલાં ઉલ્લેખો મને આપ્યા અને પ્રસંગે પ્રસંગે માર્ગદર્શન આપ્યું. લમ્બાભર ૮-૧૦ ફ્લોડીંગ થશે તેમ અંદાજ હતો પણ ડર્મિઓ. ઉભરાતી આવી અને આજે ડર્પ પૃથ્વીમાં આચાર્યશ્રીની જીવન-પ્રભા વાંચકો સમક્ષ રજુ કરતાં ધ્યનતા અનુભવાય છે.

ગુરુદેવના જીવનના અનેક પ્રસંગો પ્રેરણાત્મક છે. તેઓશ્રીની ઉદ્ઘારતા, દીર્ઘતપશ્ચયી અને સૌભ્યતા આચાર્યશ્રીની જીવન-પ્રભાના દર્શન કરવે છે.

પરમ પૂજય ગુરુદેવ શ્રી મોહનલાલજી મહારાજના રમરાધુર્યાં વર્ષો પહેલાં શર થયેલ અને સમૃદ્ધ શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરીનું ભવ્ય મકાન અને એ ગાનમાંહિરનો વિકાસ એ આચાર્યશ્રીની અંતિમ ભાવના હતી. આચાર્યશ્રીએ તે માટે ભારે જહેમત ઉઠાવી હતી. આચાર્યશ્રીના ભક્તો અને તે સંરથાના પ્રાણું સમા ફરસીએ એ અંતિમ ભાવના ક્યારે મૂર્તિમંત કરશે!

ગુરુદેવની જીવન-પ્રભાના તેજ કિરણો આપણું હૃદયમાં પ્રકાશ પાથરો એ જ અદ્યર્થના.

**પાદીતાણા**  
 સં. ૨૦૦૮ નેટ શુદ્ધ ર  
 (આચાર્યશ્રીની દ્વિતીય જ્યંતી)
 

**કુલચંદ હરિચંદ હોશી**  
**અહુવાકર**



જસપરા નીવાસી શાહ હીપચંહ જસરાજ

જન્મ સં. ૧૯૪૨

આસો શુદ્ધ ૧૪

સ્વર્ગવાસ સં. ૨૦૦૪

આસો વહી ૧૦



આચાર્ય શ્રી લનગડજિસુરિ અવન પ્રભાના પ્રકાશન માટે  
જે જે ભાગ્યશાળી ભાઈ-હેઠોએ સહાયતા કરી છે  
તેની શુભ નામાવદી.

---

- |      |   |                       |
|------|---|-----------------------|
| ૧૦૧) | શા. હરીચંદભાઈ માણેકચંદ                                | માણુંગા               |
| ૧૫૦) | શા. મનસુખભાઈ તારાચંદ                                  | સુંખર્દ નેપચુન કુંપની |
| ૨૫૦) | શા. દીપચંદ જસરાજ હા. રતીલાલ દીપચંદ                    | દાદર                  |
| ૧૦૧) | શા. કુલચંદભાઈ માણેકચંદ                                | માણુંગા               |
| ૧૦૧) | શ્રી સિહેચંદ વર્ધમાન તપ આયખીલ ખાતાના<br>મેમ્બરો તરફથી | દાદર                  |
| ૧૦૧) | શ્રી. રાકૃમલજ ધરાની હા. કેશરીમલજ                      | (લાલવાડી)             |
| ૫૧)  | શા. રતનજી જેચંદની કુંપની વાળા<br>નાગરદાસ ગોવીંદજી     | સુંખર્દ               |
| ૫૧)  | શા. ભગવાનદાસ ગોવીંદજી                                 | સુંખર્દ               |
| ૫૧)  | સા. છગવાલાલ કાળીદાસ હા. લલ્લુભાઈ                      | મુંખર્દ               |
| ૫૧)  | શા. માનમલજ ઉત્તમચંદજી હાઇવાળા                         |                       |
| ૫૧)  | શા. બીમરાજજ દેવચંદજી                                  | નેધપુર                |
| ૫૧)  | શા. વેણુભાઈ હકમચંદ જવેરી હા. સુંદરભાઈ                 | ખંભાત                 |
| ૫૧)  | એક ગૃહસ્થ હા. ધનુભાઈ                                  |                       |
| ૫૧)  | શા. કુંદનમલજ મોતીલાલજ મહેતા                           | નેસલમેર               |
| ૫૧)  | શા. મનુભાઈ સુણચંદની પેઢી હા. અમનલાલજ                  | માલવાડી               |

૨૧)	શા. ચુનીલાલ માણેકચંદ	કૃષ્ણ-માંડળી
૨૫)	શા. ચુનીલાલ કેશવલાલ હા. શાન્તિભાઈ	બોટાદ
૨૫)	શા. આશારીયાભાઈ નથુભાઈ	
૨૫)	શા. પ્રેમચંદભાઈ અલાલચંદ દમણીઆ	મુંખધ
૨૫)	શા. પોપટભાઈ જામનગરવાળા	મુંખધ
૨૫)	શા. ઉદ્યમભાણુજી પ્રેમચંદજી ગોમાળીની કુંઠ	મુંખધ
૨૫)	શા. ખીમજીભાઈ પુણુરી	કૃષ્ણ-કોડાય
૨૫)	શા. રૂપરાજજી મોંગીલાલજી	કુરલા
૨૫)	શા. મોહનલાલ વખતચંદ	ખંભાત
૧૫)	શા. હીરાલાલ રાયચંદ ભણુશાલી	મુંખધ
૧૫)	શા. વાડીલાલ બાસાભાઈ હ. રમણુલાલ	ખંભાતવાળા
૧૧)	શા. જુહારમલજી ઉત્તમચંદ બાદ્ધણુ	બોરીવલી
૧૧)	શા. લાલચંદ કરતુરચંદ	માદુંગા
૧૧)	શા. શાંતિલાલ વાડીલાલ	ખંભાત
૧૧)	શા. શાંતિલાલ ઉત્તમચંદ	પારડી
૧૧)	શા. રાયચંદ કંગરસી દોશી	મુંખધ
૧૧)	શા. જુવરાજજી હસ્તીમલજી બાદ્ધણુ	કુરલા
૧૧)	શા. લક્ષ્મીચંદજી તારાચંદજી સચેતી	ઉમરગાવ રોડ
૭)	શા. રતનચંદ ખીમચંદ જવેરી	મુંખધ
૫)	શા. કુલચંદજી ઇટેચંદજી	સાઢી
૫)	શા. કેશવલાલ વૃજલાલ	સુરેન્દ્રનગર
૫)	શા. તારાચંદજી અભુલાલજી	માછીસ
૫)	એક સદ્ગુરુચ	

## આ ભા. ૨

ખરતરગચ્છાધીશ શ્રીમહિનભડક્ષસૂરીશ્વરજીના કાળધર્મ પછી ઘણાં શ્રાવકો તરફથી એનેના સરળ ગુજરાતી ચરિત્રની માંગ મુનિરાજ શ્રી ગુલાબમુનિજી પાસે થવા લાગી. સુનીશ્રીએ શ્રી મહા-વીરસ્વામીજી જૈન દેરાસર તરફથી તે વખતના દ્રસ્ટી અવેરી મુલયંદ હીરાયંદ ભગતદ્વારા સંવત ૧૯૬૫ માં હિન્દી ટાઇપથી લખવાણી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલ “શ્રી જિનભડક્ષસૂરીશ્વરજી મહારાજ સાહેબનું જીવન ચરિત્ર” જનતાને આપવા માંયું. પરંતુ ગુજરાતી વાંચક વર્ગની માંગ તો આધુનિક શૈલીએ લખાયેલ ચરિત્રની રોજગારોજ વધતી જ રહી. આથી સુનીશ્રી ગુલાબમુનિએ એ સંબંધી સર્વ સામગ્રી સંપ્રદીત કરવા પ્રયત્ન આદ્યો, પરંતુ આજની ભાવવાળી નૂતનશૈલીએ તેને શી રીતે અંથીત કરવું? અને એ કાર્ય કોણું પાર ઉતારી આપે તેની ચિંતા રહેતી, અચાનક સુનિ શ્રી મોહનલાલજી મહારાજના પરમાગી સુરતના રેઠ ધરમયંદ જીવ્યંદ અવેરીના નથીરા શાન્તમૂર્તિં શ્રી જિનભડવિજયજી મહારાજ પાસે વાત નીકળતાં એઓ-શ્રીએ શ્રી કુલયંદ હરીયંદ દોશીતું નામ વ્યક્ત કર્યું. પાલીતાથુાથી શ્રી કુલયંદભાઈ દોશીતું સુંખ આવવાનું થયું, તે વખતે શ્રી ગુલાબ-મુનિજી અને શ્રી જિનભડવિજયજીની વંદના માટે તેઓ આવ્યા હતા. એ જ પ્રસંગે ચરિત્રની ગુંથણી માટે વાત નીકળતાં તેઓશ્રીએ પણ ચરિત્ર ગુંથણું કરી આપવા સહખ્યો હા પારી. એ કાર્ય તેઓને ભળાવી મનભોજ હુલકો કર્યો, અને યોગ્ય પુરુષને યોગ્ય કાર્યની સોંપણી થવા અદ્દલ પરમ આહલાદ થયો. આજના કપરા સમયમાં અને માથે “યશોવિજયજી જૈન ગુરુકુલ” નો સમગ્ર બોંને લદાયેલો હોવા છતાં ભક્તિનિમિત્ત સાંગોપાંગ સુંદર શૈલીથી ચરિત્ર યોજી આપવા અદ્દલ અમો દ્રસ્ટીએ. અને કહું તો સમગ્ર ગરું અને સમગ્ર ભક્તો ખરેખરાં ઝરણી છીએ. જીવન પ્રભાને સસ્પદ તથા સર્વાંગ

સુંદર લખી આપવા બદ્લ શ્રીયત કુલચંદ્રભાઈ હરિયંદ દોશીનો  
નેટલો ઉપકાર માનીએ એટલો આછો છે.

એ સિવાય આ “જીવન પ્રકા” ને સુવાસીત મહમધતી બના-  
વવા માટે નિભન્નલિખિત મુનિરાજે અને મહાયો એ કાંયો અને  
લખાણ્યથી સ્વસ્વ હૃદયના ભાવપુષ્પો સમર્પિત કાંયો તેઓ સર્વેનો  
આભાર અભે વિસરી શકીયે તેમ નથી જ.

લેખક.	લેખ નામ.	પૃષ્ઠ.
(૧) પૂજન્ય શ્રી ગુલાભમુનિજી	પ્રારા ગુરુહેવ	૩
(૨) શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી	પ્રસ્તાવના	૭
(૩) શેઠ શ્રી રવજી સોન્યપાળ	આચાર્યશીના-	
	અતુપમ ઉપકારો	૧૫
(૪) શ્રી કુલચંદ હરિયંદ દોશી મહુવાકર એ બોલ		૧૬
(૫) શ્રી જીવણુંદ સાકરચંદ જવેરી	પુન્નરાશિ પરિચય	૨૬
(૬) શ્રી મણુલાલ મોહનલાલ પાદરાકર કાંયો	૩૧૧-૩૧૬	
(૭) શ્રી જીવણુંદ સાકળચંદ	કાંય	૩૧૭
(૮) શ્રી મણેશભાઈ પરમાર	કાંય	૩૨૮
(૯) આચાર્યશી જિનરતનસૂરીજી } મ૦ ની આગાધી ઉપાધ્યાય } શ્રી લખધમુનીજી કૃત.	કુલક	૩૨૦
(૧૦) શાસ્ત્રી શ્રી સંસુભરામ કેશવરામ જ્યોતિષી	ક્લોડો	૩૨૩
(૧૧) પંડિત શ્રી જીવેશ્વર જા.	શક્ષાંભળિ	કાંય ૩૨૫-૩૨૮

### ૬૦ જીવેશ્વયંદ કેશરીયંદ

મેનેજંગફ્રાન્ઝીસ-શ્રી મહાનીરસ્વામી જેન ટેરાસરજ અને મંડોવર  
ખરતરગંગ શ્રી જિનદાટસ્ટર શાનભાડારના કરીએ વર્તી:-

સુંખુર પાયહુની } તા. ૨૩-૬-૧૬૫૩ } <td>સં. ૨૦૦૯, ભાડ્યે પૂર્ણિમા શુધ્વવાર</td>	સં. ૨૦૦૯, ભાડ્યે પૂર્ણિમા શુધ્વવાર
---	---------------------------------------

## ચિત્ર-સૂચિ

---

નં.	નામ	પૃષ્ઠ
૧	શ્રી મોહનલાલજી મહારાજ	૩
૨	આચાર્યશ્રી જિડ્ઝિસ્ક્રિઝી	૩
૩	સેવામુર્તિ શ્રી શુલાભમુનિજી મહારાજ	૫
૪	શેઠ રવજીભાઈ સોજપાળ	૧૫
૫	શાહ દીપચંદ જસરાજ	૧૬
૬	શુલાભશ્રી ડીપમુનિજી મહારાજ	૧૨
૭	શ્રી કળામય નૂતન મંદિર-થાણા	૧૬૦
૮	આચાર્ય-ઉપાધ્યાય પદ્મવી પ્રસંગ	૨૦૮
૯	ઘોગીરાજ શ્રીમહ શાંતિસ્ક્રીંખરજી	૨૨૪
૧૦	સૂરિસાટ શ્રી નેમીસૂરિંખરજી	૨૫૦
૧૧	શ્રી હરિચંદ્રભાઈ માણેકચંદ	૨૫૬
૧૨	મૂળનાયક શ્રી મુનિસુવતસવામી-થાણા	૨૭૨
૧૩	ચાહુરીસ સ્થાનો	૩૦૪

---

### ક્ષમા-યાચના

આચાર્યશ્રી જિડ્ઝિસ્ક્રિઝીની જીવન પ્રભાના આદેખનમાં ભાવવથ કે અજણુપણે કોઈ કોઈ પ્રકરણમાં વિશેષતા કે ન્યૂતતા જણ્યાય તો વાચકછંદ ઉદાર ભાવે ક્ષમા કરશે.

પ્રચોક્ક

## સમર્પણનું સર્જન

ગિરિનગર શત્રુંજ્ય જગતના તીર્થધામોમાં અલોકિક અને ચમતકારી છે. ‘શત્રુંજ્ય-તીર્થદર્શન’ નેવું પુસ્તક આજસુધી અહાર પડયું નથી. શત્રુંજ્ય અને તેનું સ્થાપત્ય, કળા, છતિહાસ, મંહિરો તથા કુંડાનો વિગતવાર છતિહાસ, કથાનકો વગેરેથી રસપ્રદ મનોધર નેકેટ તથા ૧૧ ફેટાંઓ કોમિત ૧-૮-૦



## શત્રુંજ્ય-તીર્થ-પદ્મો

ચિત્રકાર પ્રવીષુદ્ધમાર હોશીના તીર્થોધિરાજ શત્રુંજ્ય તથા ગિરિનગર ગિરનારના વિવિધરંગી કળામય ટકાઉ કાપુડ પર અનાવેલા ચિત્રિત પદ્મો.

સાઈઝ ૬ x ૭ ફૂટ, સાઈઝ ૭.૧ x ૬ ફૂટ, સાઈઝ ૬ x ૬ ફૂટ  
તૈયાર છે.

નાની સાઈઝના એઓડર પ્રમાણે થશે.



## માટીના ચમતકારે

ગમે તે ખર્ચ કરતાં ને દરહો નથી મરચાં તે માટીથી મટી અથાના ખરા પ્રયોગો બતાવતું ઉપયોગી પુસ્તક દરેક ઘરમાં હોવું જ નેછો. એકવાર માટીના પાટાનો અનુભવ કરો, અને તમે માટીના ચમતકાર જણો. કોમિત ૧-૦-૦.

## પ્રવીષુદ્ધ કુલચંદ હોશી

જૈન ગુરુકુળ-પાલીતાષ્ણા

## આ નું કે મણિ કા

---

નં. વિષય.	પૃષ્ઠ.	નં. વિષય.	પૃષ્ઠ.
૧ રાંકને લ્યાં રતન	૧	૨૨ કલ્યાણુકારી કામો...	૧૧૬
૨ વસભી વિદ્યાય ...	૨	૨૩ દાદા સાહેભોની હેરીઓનો જ્ઞોંકાર	૧૨૪
૩ પ્રતાપી ભાડી ...	૮	૨૪ શ્રી માણિભદ્રવીરની હેરીનો જ્ઞોંકાર	૧૨૬
૪ અધ્યયન અને સમર્પણુ	૧૪	૨૫ એ પ્રતિષ્ઠાઓ ...	૧૩૪
૫ સાધના ... ...	૧૭	૨૬ જૈન વિદ્યાર્થીગૃહ ...	૧૪૩
૬ ધતિ દિક્ષા ...	૨૨	૨૭ ગુરુદેવનો ભીય જ્યંતી ઉત્સવ ...	૧૪૭
૭ તીર્થયાત્રાનો સંદેશ ...	૨૫	૨૮ સાચી ભક્તિ તો સ્વામીભાઈઓની ...	૧૫૨
૮ શત્રુંભ્યનો ચ્યમતકાર	૩૪	૨૯ પરાઓમાં ધર્મ જગૃતિ	૧૫૬
૯ ગુરુદેવની સેવા ...	૪૧	૩૦ પ્રતિષ્ઠા માટે પ્રયાસ	૧૬૫
૧૦ તીર્થ યાત્રાઓ ...	૪૫	૩૧ થાણુની પ્રાચીનતા	૧૭૦
૧૧ વચન સિદ્ધિ ...	૪૬	૩૨ બાર બાર વર્ષના કલેશનું સમાધાન ...	૧૭૭
૧૨ પાંચ પ્રતિષ્ઠા મહેત્સવ	૫૫	૩૩ દાદરનો ભીય પ્રતિષ્ઠા મહેત્સવ ...	૧૮૫
૧૩ યોગોદ્ધન તથા પંન્યાસપદ્ધતિ ...	૬૨	૩૪ ઐનમૂત્ત કલામય મંદિર	૧૯૧
૧૪ નાગોરમાં એક્યતા ...	૬૬	૩૫ આચાર્ય પદ્ધતી સમારંભ	૧૦૧
૧૫ ઉપકરોની પરંપરા	૭૦	૩૬ પર્યુષણ વ્યાખ્યાનમાં પુષ્પ કે પાપ ! ...	૨૦૮
૧૬ નવાણું યાત્રા અને તપશ્ચર્થી	૭૪	૩૭ તીર્થ ભહિમા અને શાન પ્રચાર ...	૨૧૪
૧૭ સેવામૂર્તિ શિષ્યની પ્રાપ્તિ	૮૧		
૧૮ શ્રી મોહનલાલ જૈન			
શાન મંદિર ...	૮૫		
૧૯ ધર્મ ઉદ્ઘોત ...	૮૫		
૨૦ આમોંકાર ...	૧૦૪		
૨૧ ધર્મ ચર્ચા	૧૧૨		

નં.	વિષય.	પૃષ્ઠ.	નં.	વિષય.	પૃષ્ઠ.
૩૮	શોળીરાજ સાથે		૪૫	શ્રી ધંટાકરણુની	
	ગ્રાન્ઝોષ્ટિ ...	૨૨૦	મૂર્તિની પ્રતિષ્ઠા ...	૨૭૪	
૩૯	ચુરમાં ધર્મ પ્રમાણ	૨૨૧	૪૬ છેલ્દેલા મહોત્સવ ...	૨૮૧	
૪૦	ખીકાનેર અને તીર્થયાત્રા સંધ ...	૨૩૫	૪૭ આખરી સંદેશ ...	૨૮૪	
૪૧	મધુરાં મિલન ...	૨૪૫	૪૮ ધન્ય તપશ્ચયી ...	૨૬૧	
૪૨	ધન્ય વીરચંદભાઈ!		૪૯ મૃત્યુ મરી ગયું રેલોલ ...	૨૬૪	
	ધન્ય આમ સુધારણા	૨૪૨	૫૦ અદ્ધાંજલિ ...	૨૬૦	
૫૩	ગુરુદેવતું પુષ્ય રમારક	૨૫૭	૫૧ પુષ્યોજનલ તપસ્તી ...	૩૦૩	
૫૪	અભ્ય પ્રતિષ્ઠા મહોત્સવ	૨૬૮	૫૨ ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા	૩૦૮	
			૫૩ શુરુ સ્તુતિ આદિ	૩૧૧-૩૨૮	

### શ્રીમાન્ જિનનાનદિસ્ક્રિપ્શન-ગુણુ સ્તુતિ

૧૮ અક્ષરી (ત્રિપાદ-સ્તુતિ)

અદ્યા શુરુ ચણ્ણો, મોહનમુનિના સંવિજ્ઞ વરણા,  
તણુ રિદ્ધિસિદ્ધિ પળવિપળમાં લક્ષ્યલક્ષ્યવધિ;  
મર્દી ક્ષેત્રે શુરુ શ્રીપૂજ પહી સૌભાગ્યવરતી,  
અપિ મુક્તિ નિધિ શ્રિહણુ કરવા વિકસિત થઈ. ૧

જઈ પાલીતાણુા મોહનમુનિથી સંવિજ્ઞ વરતા,  
નિવાયું સૌભાગ્ય શ્રીપૂજપહતું જગવંદી થાવા;  
સુવિહિત પક્ષે ખરતર ગણે નાનદિસ્ક્રિપ્શન.  
હસ્તાણું જેડી જીવન લળી વહે શ્રી સૂરીશરા. ૨

સં. ૨૦૦૮, શુરવાર }      જીવણુલાલ સાકરચંદ અવેરી  
અશાદી એકાદશી }      સુંખ્ય ૧૧. ૩-૭-૫૨




બાતથ્રણચારી હીર્દતપસ્વી, ચારિત્રરત્ન આચાર્ય શ્રી  
જિનકષ્ટુર્ધિસ્તૂરીખરણ મહારાજ



દીર્ઘતપસ્વી

# જિનત્રાંદ્રિસૂરિ લુચન-પ્રભા



રંકને ત્યાં રતન

(૧)

માતાજીના આનંદનો પાર નથી. કેટકેટલા તપ-જપ પણી કેટલાએ વરે આજે પુત્રનું સુખ જેવા મળ્યું. વૈક્ષત્રણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થ લોહાગરજીની પાસેના ગામમાં ગૌડ પ્રાણીઓ કુંદુંબ કૃષિકારતું શ્રમમય જીવન શુદ્ધારી રહ્યું છે. બન્ને ધર્મ-પ્રેમી લલાલોળા અને તપસ્વી છે. પૂર્ણિમાની રાતે જ્યારે ચંદ્ર સોળેકગાએ ભીતી રહ્યો છે. ચાંદની રેવાઈ રહી છે. શીતળતા પથરાઈ રહી છે અને આનંદ આનંદ છવાઈ રહ્યો છે. તે રત્નાંદ્રિસૂરિ રેવા માતાએ એક પુત્રને જન્મ આપ્યો. નાનકડા ગામડામાં પ્રાણી કુંદુંબમાં કૃષિકારતું જીવન જીવતા પ્રાણી પિતાને

પુત્રરત્નની પ્રામિથી આનંદ થયો. પણ બાળકનું જૌદ્વારણું શરીર, સુંદર તેજસ્વી સુખાકૃતિ, ચમકદાર આંખો. વિશાળ લક્ષાટ, હસતું વહન જોઈને માતા-પિતા ચોતાને બાળયશાળી માનવા લાગ્યા. પુત્રના લક્ષણું પારથુમાંથી એ દૃષ્ટિએ ચોતાને આંગણે કોઈ ડેવપુરુષ બૂલ્યો—અટક્યો. બાળયોગે આવી ચડયો છે. અને મહા પાંડિત, મહા ઈર્માંડિ, યોગી અને તપસ્વીના લક્ષણો જોઈ જોઈને માતા-પિતાના આનંદનો પાર નથી. ‘રાંક ને ત્યાં રતન’ એમ માની બાળક રામકુમારને જોઈ જોઈને માતા તો બાળકના ઉછેરમાં લાગી ગચ્છેલ છે. ‘રામકુમાર’ નું હસતું સુખ અને કિલકિલાટ ઘરમાં આનંદ અને શાંતિ સરળવી રહેલ છે. બાળક રામકુમાર ચંદ્રમાની જેમ માતા-પિતાની ગોઢમાં રાત્રિ-હિવસ વૃદ્ધિ પામી રહેલ છે.

રામકુમારનું બાળપણું માતા-પિતાના સહવાસમાં વીત્યું. નાનપણુથી જ બાળક રામકુમારને સંદ્યા-પૂજા તરફ પ્રેમ હતો. ગામડાના તાળ હુધ-હંડી અને સ્વરચ્છ સાઢા ચોરાકથી બાંધ્યો. પણ મજબૂત હતો. ચંચળ અને જિજાસુ સ્વભાવ હોવાથી કોઈ ડેવ-દેવી કે પીર પેગાંબરનું સ્થાન સાંભળે ત્યાં ઢોડી જાય અને બધા પાસે ‘મહા શક્તિ અને ચમત્કાર’ ની માંગણી કરે.

માતા-પિતા ‘રામકુમાર’ની આવી સાધુવૃત્તિ અને બાળપણુથી જ ત્યાગ લાવના જોઈને વિસમય પામતા.

‘માતાજી મારે ચૂરુ જવું છે.’ એક હિવસ બહાર ઝરવા જવાના શોખને લીધે રામકુમારે માતાજીને ચોતાને વિચાર જણ્ણાંન્યો.

‘એટા રામકુમાર ! ચૂરુ તો બહુ ફર છે. તું અમારા રંકનું રતન છે. તારા પિતાની સાથે જતો રહે. ત્યાં ઐતરેામાં તો બહુ મળ પડે,’ માતાએ સમજવવા પ્રયત્ન કર્યો.

‘માતાજી ! આ ગામ અને ઐતરેા તો હું ખુંદી વળ્યે. અહીં બીજું શું જેવાતું છે ? સાચું કહું ! મને ઐતરેા કરતાં મંહિર અને તીર્થસ્થાનો જેવાં બહુ ગમે છે.’

‘ભાઈ ! યાત્રાએ જવું હોય તો પાસેના બોણાગરજી જઈ આવ.’

‘માતાજી ! મારો એક જૈન ભાઈબંધ અને તેનું ડુકુંબ ચૂરુ મંહિરના દર્શાને જાય છે. અને મને તે સાથે લઈ જવા કરે છે. ત્યાં તેમના મહારાજ છે તે બહુ વિદ્ધાન છે.’

‘એટા ! તારા વિના અહીં અમને કેમ ગમશે ! તારા વિના મને તો આવતું પણ ભાવશે નહિ. તારા પિતા દિવસ આખાના પરિશ્રમથી થાકુયા-પાકુયા આવે છે. પણ તને હસતો-રમતો જેઠને તેમને કેટલો આનંદ થાય છે !’

‘માતાજી ! હું બધાની સાથે પાછો આવી જઈશ. મારા પિતાને કણીને મને આજા આપો. ચૂરુના મંહિરના દર્શાન કરી હું પાવન થઈશ. તેમના મહારાજના પણ દર્શાન થશે.’


‘એટા ! તારી ઉત્કૃષ્ટ ભાવના છે તો સુખેથી જા ! પણ વહેલો વહેલો પાછો આવજે. રહે ત્યાં રાકાઈ જતો. તારા વિના મારા દિવસો કેમ જશે !’ ફિલ્હાલ મને છેવદે માતાએ રજી આપી.

રામકુમારને એક મિત્ર હતો. તે બંને હોસ્ટેને કુરવાનો શોઅ. એતરોચે જાય, જંગલમાં કુરે. કોઈ દેવ-હેડં હોયતો પહેંચે અને જ્યારે જુઓ. ત્યારે સાથે ને સાથે. તેના માતા-પિતા જૈનધરીં હતા. પાસેના ચૂરુ થહેરના મંહિરના દર્શને જવાનો વિચાર કર્યો અને મિત્રે રામકુમારને પણ સાથે આવવા કહ્યું, રામકુમાર તો બહાર કુરવા તૈયાર જ હતો. તેણે સાંબળયું હતું કે ચૂરુના ચતિલુ મહારાજ ધણુા વિદ્ધાન છે.

રામકુમાર જન-મથીજ ધર્મભાવના વાગો હતો. તેની અંતરની ઉંડિઉંડી એવી ઈચ્છા હતી કે ચૂરુમાં આ વિદ્ધાન ચતિલુ પાસે અલયાસ કુરવાની તક મળે તો તો એડો પાર થઈ જાય. આ એતરો અને મજૂરી તરફ જરાપણ વૃત્તિ નહોતી. તે તો કોઈ મહાન કાર્યને માટે સરળયેદો હોય તેમ તેના લક્ષણો. ઉપરથી જણુાઈ આવતું હતું.

આ વિચારથી મિત્રની સાથે ચૂરુ જવાનો નિર્ણય કર્યો. માતા પિતાની આજા મેળવી અને જવાના હિવસની આતુરતાથી રાહ જોવા લાગ્યો.





## વसમી વિદ્યાય

( ૨ )

માતાની તો રજા ભળી ગઈ, રામકુમાર તો ચૂડુ જવા તલસી રહ્યો છે. પિતા તેને બહાર મોકલવા રાજ નહોંતા પણ ઘર જેવો સંગાથ અને રામકુમારની માતાજીની સમબલવટથી જવાની રજા પિતાએ પણ આપી.

‘આવતી કાલે તો સવારમાં ભારે લાડીલો રામકુમાર જશે. અરે કોઈ હિવસ ગામ બડાર મોકલ્યો નથી. કાચું કોર્ડ આવાથી કે તાપ-તાડકાથી ભારે રામ કુમાર બિમાર પડી જશે તો ? ત્યાં કોણું સંભાળ રાખશે. મારા લાલ રામકુમાર વિના મને તો ઘરમાં સુનુસુનુ લાગશે. હિવસ આપો કેમ કરીને જશે ! રામ તો રખડવાનું મળે તો ખાવાની પણ પરવા કરે તેવો નથી, શરમાળ તો એવો છે કે જે મળે તે ખાઈને સંતોષ માને,

ભૂખયે। હોય તો પણ એલે નહિ. મારે જીવ તો તેને આંખ આગળથી ફૂર કરવા માનતો નથી, પણ બાળ રાજની હઠ પણ એવી છે કે તે ગયા વિના રહેવાનો નથી. તેની સંભાળ તેનો મિત્ર અને તેનાંમાતા પિતા રાખયે. પ્રભુ ! મારે રામકુમાર ક્ષેમ કુશળ ન આવે ત્યાં સુધી હું મીઠાઈ નહિ આઉં પ્રભુ તેની રક્ષા કરનો.

આજ રાતે માતાને હંલર હંલર વિચાર આંદ્રા. પુત્રના વિચારણા વિચારણી મન સુંનાઈ ગયું. ઉંઘ પણ આવી નહિ. સારા-નરસા અનેક વિચારો આંદ્રા, જરાક આંખ મળી ત્યાં સ્વર્ણ લાદ્યું?


એક તેજસ્વી યોગી ચોતાને આંગણે આંદ્રા છે. પતિ-પત્ની તેમને વંદન કરે છે. નાનકડો રામકુમાર તો યોગીના ચરણુમાં નમી પડે છે. રામકુમારનું જંય લલાટ, ગોડસુખ અને કાન્તિ જોઈને યોગી તેમની પાસે બાળકની બિક્ષા માગે છે અને અને યોગી ઉઠે છે. યોગી બાળકની રેખા જોઈને કોઈ પ્રભાવશાળી તપસ્વી થવાને સર્જયેલા બાળક માટે માતા પિતાને સમજાવે છે. અશુભયો નથ્યોએ યોગીના વચનને સત્કારે છે. અને યોગી રામકુમારને લઈને આકાશમાં ઉડી જય છે.

આ સ્વર્મ કે શું ! વિચારતી માતા પુત્રને નિદ્રામાં જોઈને જરાક શાંતિ અનુભવે છે. પણ પણી તો ઉંઘ ચાલી ગઈ. આખી રાત સ્વર્ણનોના વિચારોજ આવી રહ્યા. મારે રામકુમાર તો આ રહ્યો. પણ સવારમાં તો એ ‘રામ’ યાત્રાએ જવાનો છે. શું મારું સ્વર્ણ સાચું પડશે ! મારે રામ મારી પાસેથી રીસાઈ જશે. નહિનહિ-એ તો નહું સ્વર્ણ છે. મારા ‘રામ’ ને કોઈ નહિ

લઈ જઈ શકે. એ તો મારો આત્માનો આરામ છે. મારો વિસ્તારો છે. મારું રંકનું રતન છે. હું નહિ આપું-નહિ આપું. સવાર થયું અને રામકુમાર ચાત્રાએ જવા તૈયાર થઈ ગયો. માતાએ ભાતું કરી આપ્યું. કપડાં ગોઠવી આપ્યા. પોતાની પાસેથી રૂ. ૫) આપ્યા. કપાળમાં કુમકુમનું તિલક કર્યું અને અશુભરી આંખડીઓએ વિદ્યાય આપી.

‘બેટા ! તું મારો આધાર છે. મારું મોંબું ધન છે. તું ચાત્રામાં શરીરની સંભાળ રાખજો. ખાવા-પીવાની કાળજી રાખજો. પાછો વહેલો વહેલો આવી જણે તારા વિના મને ઘડીએ ગમશે નહિ, વધારે રોકાધશ નહિ કાકા-કાકીની સાથે જ આવી રહેજો. રખે તું તારી ભષુવાંની ધૂનમાં અમને ભૂલી જતો.’ રામકુમારે માતાના પગ અશુદ્ધોથી પખાળ્યા. પિતાને પ્રષ્ટું કર્યો. ધર પડોશીઓા, ગામ, એતરો અને મંહિરો જેતો જાણે જનની અને જન્મભૂમિની કાયમી વિદ્યાય લેતો હોય તેમ ચાલી નીકળ્યો.





## પ્રતાપી ગાડી

( ૩ )

શેઠ કાનમલણનું કુદુંબ તથા રામકુમાર ચૂરુ આવી પહેંચ્યા.  
ચૂરુ શહેરની હવેલીએ, બાલર, અધ્યમાંહિર તથા મનોહર  
મૂર્તિએ. જેઠ જેઠને રામકુમારના અંતરમાં આનંદની ઉર્મિએ  
લહેરાવા લાગી.

ચૂરુના જૈન ભાઈએની ભાવભરી લાગણી તથા સ્વામીલાઈ  
માટેનો અગાધ પ્રેમ જેઠને રામકુમાર તો દિંગ થઈ ગયો.  
કશી સગાઈ ન હોવા છતાં માત્ર સ્વામીલાઈના સગપણુ માત્રથી

ખૂબ આનંદથી ભાતભાતના લોજન જમાડવા અને મહેમાન-ગતિમાં જરાપણું ખામી ન આવે એ રીતનું વર્તન એ રામ-કુમારને મન આશ્રીર્યની વાત હતી, આવી જતના પ્રેમ સંખની રામકુમારના બાળ મન પર ડાડી છાપ પડી અને રામકુમાર જૈનસમાજને લાગ્યશાળી સમાજ માનવા લાગ્યો.

ચુકુ શહેર તો નાનું ગણ્યાય પણ જૈન ભાઈઓ સુધી અને સંતોષી હતા. ધર્માખરો વ્યાપાર પણ જૈનોના હાથમાં જ હતો. ધર્મભાવના પણ સુંદર હતી. ઘેરવેર દસ્તક્ષ, વીસ્વીસ ગાયો-લેંસો તો હોય જ અને તેથી સ્વર્ચ દુધ-હર્ણી ધી-છાશ વગેરેની વિશેષ અતુકૂળતા હતી. બાળકો સુદૃઢ અને કાંતિવાળા હતા. ખીએ પડામાં રહેતી પણ ધર્મભાવના વિશેષ હતી.

‘મથણું હામિ !’ કાનમલ શેડે યતિશ્રીને વંદણું કરી.

‘ધર્મલાલ’ યતિશ્રીએ ધર્મલાલ આપ્યો.

‘સાહેબ ! ધણું વખતથી આપના દર્શાનની ભાવના હતી પણ ગૃહસ્થીના કામમાંથી છુટાય ત્યારે આવી શકાય, વચ્ચે હુકાનનું કામ પણ વધ્યું તેથી નીકળાયું નહિ.’ શેડે કાનમલજીએ ખૂલાસો કર્યો.

‘આ કુમાર કોણું છે તમારા પુત્રનો મિત્ર જણ્યાય છે !’ યતિશ્રીએ તેજસ્વી કુમારને જોઇને પૂછ્યું.

‘સાહેબ ! એ ખાદ્યણું કુમાર છે. મારા પુત્રનો પરમ સ્નેહી છે. ખાદ્યણુકુમાર હોવા છતાં તીર્થયાત્રાનો ખૂબ શોખ છે. તેને અલ્યાસની પણ ભાવના છે. તેનું નામ રામકુમાર છે.’

યતિશ્રીએ મંગલિક સંભળાંયું. યતિશ્રીની વિદ્વતા, સરળતા, પ્રભા અને પ્રેમભાવનાથી રામકુમાર પ્રભાવિત થયો. અલ્યાસની ભાવના જાગી ઉડી અને જો યતિશ્રી રજા આપે તો ત્યાંજ રહી જવા વિચાર ઉદ્ભબાંયો. યતિશ્રી પણ આ તેજસ્વી કુમારના સુલક્ષ્ણા જોઈને આધ્યાર્થી. બન્નેના ભાવોનું એકીકરણ થયું. લોજનનો સમય થઈ જવાથી કાનમલજીએ રજા લીધી. બપોરના ફરી મળવાનું જણ્ણાવી બધા છુટા પડ્યા.

રાજપૂતાના ધીકાનેર રાજ્યના ચુડ શહેરમાં શ્રી બૃહંત ખરતરગાંધીની મોટી ગાઢી હતી. શ્રી પૂજ્યજીની આજાનુસાર યતિવર્ય શ્રી ધસરચંદળ, પ્રેમચંદળ તથા લુલખરામજી નામના પ્રણુ શુરૂઆદ્યો. રહેતા હતા. એ ત્રણે શુરૂઆદ્યો યતિવર્યોના આચારવિચારાથી વિભૂષિત હતા. ઉપરાંત વૈઘ્રક અને જ્યોતિષ વિદ્યાના જાણકાર હતા. ધર્મોપદેશ આપવાની શક્તિ પણ સારી હોવાથી જૈન જૈનેતરો તેનો લાલ લેતા. ખાસ ધીકાનેર નરેશ તરફથી તેમ જ સરકારના રાવરાળ તરફથી તેઓશ્રીને કેટ-લાંએક ગામો બદ્ધીશ આપવાની કોશિષ કરવામાં આવી હતી પરંતુ તેઓશ્રી સેવાલાવી તથા શાંતિપ્રિય હોવાથી તે ઉપાધિમાં નહિ પડતાં તે બન્ને રાજ્યાંયોને ધર્મોપદેશ આપીને પણુંબણ્ણપર્વતા આડે દ્વિષ તેઓના રાજ્યમાં કોઈપણ માણુસ જીવહિંસા ન કરે તેમજ ધોણી, રંગારા, હળમ, ભાડભૂંઝ, ધાંચી, માચી, તેલી તંબોલી અને કંદોઈ વગેરે આરંભ સમારંભના કાચો બંધ રાખે તેવી રાજ આજા કરવામાં આવી અને તેનો અમલ વર્ણીથી આજમુખી બન્ને રાજ્યમાં ચાલુ છે. ઉપરાંત તે બન્ને રાજ્યમાં યતિત્રયના ઉપહેશથી જૈન મન્દિર અને

ઉપાશ્રયના જે જે લાગા-કર રાજહરખારમાં તથા રાજ્યની રૈયતમાં ચાલુ થયેલા તે લાગા પણ આજસુધી ચાલુ રહ્યા છે.

આ પ્રતાપી યતિવર્યોની પરંપરામાં યતિવર્દ્ધ શ્રી પુન-મચંદજી, શ્રી ચીમનરામજી તથા શ્રી કુંગરમલજી નામના પ્રથુ શુદ્ધાર્થીઓ થયા. તેઓ પણ ઉપરોક્ત યતિવર્યની માદ્ક ધર્મશાસ્ક તથા જ્યોતિષ વૈદક અને શાસ્કમાં પ્રવીષુ હતા અને જૈનસમાજ તથા જૈનેતર વર્ગમાં સુપ્રસિદ્ધ હતા.

યતિશ્રી ચીમનરામજીને બાળક રામકુમારની તેજસ્વી મુખા-કૃતિ, વિશાળ લદાટ તથા સુદ્રદ શરીર તેમ જ જ્યોતિષ ફિદ્ધીએ જીવેંટ્ઝુએ રેખાઓ જોઈને રામકુમાર તરફ સ્વાભાવિક ભમતા જાગી. અપોરના આવે ત્યારે બાળક રામકુમારની ભનોડામના જાણી લેવા નિષ્ટંચ કર્યો.

રામકુમારના મનમાં પણ વિજ્ઞાન-પ્રભાયુક્ત, શાંત અને મધુર ભાષી યતિવર્યને જોઈને આકર્ષણુ થયું. આવા શુદ્ધવર્ણ પાસે રહેવાની તક ભળે તો મારી અધ્યયનની તમના પૂરી થાય. હું તીર્થયાત્રાઓ પણ કરી શકું. મારા જીવનને વિશેષ ઉજવણ બનાવી શકાય.

અન્નેના વિચારોમાં એક ધીન પ્રત્યે ભમતા જાગી અને હૈવી સંકેત હોય તેમ પ્રથમ મિલને પરસ્પર આકર્ષણુ થયું.

‘સાહેબ! મારી ભાવના અલ્યાસ માટે છે. આપશીના ચરણુમાં મને રાખો, હું આપનો જીવનભરનો ઝણી ધની રહીશ.’ રામકુમારે પોતાની અલ્યાસની જાખના રજુ કરી.

‘મહારાજથી ! રામકુમારના માતા-પિતા ગૌડ પ્રાણીએ છે. તેના પિતા કૃષ્ણારથે પણ આ બાળક રામકુમાર તેજસ્વી છે. તેને વિદ્યાની પિપાસા છે. આપ તેને આપની નિશ્ચામાં રાખશો. તો રામકુમાર વિદ્યાન અને યશનામી થશે’ કાન-મલાલે રામકુમારની ભાવનાને પ્રદર્શિત કરી.

‘કાનમલા ! જ્યારથી મેં રામકુમારને જેયો છે ત્યારથી હું તેની સુખાકૃતિ-સુલક્ષણો અને રેખાઓ જેઠ રહ્યો છું. આ બાળક મહા ભાગ્યશાળી છે. અવિષ્યમાં’, એક પ્રતિભાશાળી તપ્તસી મહાપુરુષ થવાના બધા લક્ષણો હું જ્યેતિષ દિશિએ તેમનામાં જેઠ રહ્યો છું પણ તેના માતા-પિતા રામકુમારને રજ આપશે !’

‘સાહેબ ! તેમના માતા-પિતા તો બહુ સરળ અને સૌભય પ્રકૃતિના છે. રામકુમારની પોતાની જ જંખના અસ્યાસ માટે છે. વળી હું તેમને સમલવીશ, આપનું વચન પણ તેઓ માન્ય રાખશે આવા ભાગ્યશાળી ઉત્તમ લક્ષણોવાળા સુપુત્રને યશનામી કરવા માટે તેઓ પણ બડભાગી ગણુંશે.’ કાન-મલાલે પોતાની સંમતિ ફર્શાવી.

‘ગુરુવર્ય ! મારે તો આપની છાયામાં જ રહેવું છે. વિદ્યા-અસ્યાસ કરવો છે. તીર્થયાત્રાએ કરવી છે. અને ‘મારા આત્માતું’ કહ્યાણુ સાધવું છે.’ રામકુમારે પોતાની મજૂમ ભાવના રણું કરી.

‘ધન્ય રામ ! ધન્ય તારા માતા-પિતા ! ધન્ય તારી તમજા !’ ગુરુવર્યે ધન્યવાહ આપ્યા.


‘કાનમલલુ! તમે એક કામ કરો. તેના માતા-પિતાને તો તમે સમજાવશો, પણ મારી ઈચ્છા છે કે હું જાતે તેમને સમજાવી બધી રીતે સાંતોષીને પછી રામકુમારને મારી પાસે રાખું તો વિશેષ આનંદ થાય.’

‘હું તેમને સમજાવીશ, બધી રીતે તેમને સાંત્વન આપીશ અને આપની પાસે પણ લઈ આવીશ પછી આપ તેમને સુઝેથી સમજાવશો, ત્યાં સુધી રામકુમાર જાણે અને રહે અને વિદ્યાભ્યાસ કરે.’

‘જહાસુખમ! તમે પણ મારી વતી તેમને ખૂબ સમજાવશો ને શાંતિ આપશોા! કાનમલલુ તેમના કુદુંબ સાથે ગુરુમહારાજને વંદણા કરી રામકુમાર માટે બધી અદ્વામણુ કરી પોતાને ગામ ગયા.

યતિવર્યને રામકુમાર જેવા પ્રતાપી ગાઢીના વારસ મળવાનો આનંદ થયો. રામકુમારને તો માણ્યા મેઘ વરસ્યા.





## અધ્યયન ને સમર્પણ

( ૪ )

અધ્યાખ કરવાની પોતાની ભાવના ફળી તેથી રામકુમાર થતિશ્રીની પાસે હેંશે હેંશે અધ્યાખ કરવા લાગ્યા. પ્રાતઃકાળે વહેવા હડી સૂત્રો તૈયાર કરતા. સવારમાં થતિશ્રી માંગલિક સંભળાવતા તે પોતે શીખી ગયા. શ્રી જીતમસ્વામીનો રાસ પણ કંઈ કરી લીધે. શત્રુંજ્યનો રાસ તો તેમને ખૂબ જ ગમી ગયો. હહેરાસરળુમાં પણ જ્યષ્ઠાપૂર્વક પ્રક્ષાતત-અંગલણા પૂળ-વગેરે ખૂબ આનંદપૂર્વક કરવા લાગ્યા. થતિવર્યું રામકુમારની ધર્મપ્રવૃત્તિમાં સુરચિ જોઈને આનંદ પામતા હતા.

ને કાંઈ ખર્ચ માટે મળતું તેનો ખર્ચ નહિ કરતાં તે ગરીબ-યુરબાને આપી હેતા. કોઈતું હઃખ જોઈને તેમના મનમાં કર્દણા આવી જતી અને રાત હિવસ અધ્યાખમાં લીન રહેવા લાગ્યા.

રામકુમાર હવે તો થતિવર્યનો કાર્યાલાર પણ ધીમે ધીમે ઓછો કરવા લાગ્યા. મંહિરની અધી સંભળ કાળપૂર્વક રાખતા, માંગલિક પોતે જ સંભળાવતા, ચુરુના ભાઈ બહેનો રામકુમારની જીડી મહુરી વાણી તથા શાંત સ્વભાવથી વિશેષ સંતુષ્ટ રહેતા,

‘સાહેબ ! રામકુમારના પિતાજી આવ્યા છે. તેમની માતાની પણ રામકુમારને જોવાની ઉત્કટ ઈચ્છા હતી પણ આટલે દ્વાર ઘર છોડી આવવું મુશ્કેલ.’ કાનમલજીએ એક દિવસ ઓચિતા આવીને વાત કરી.

‘લાગ્યશાળી ! તમે તો બડભાગી છો. તમારો રામ-કુમાર તો પરિશ્રમી-અસ્થાસી-તેજસ્વી અને સર્વે સમૃદ્ધાયને ધણો જ પ્રિય થઈ પડ્યો છે. તેમણે અહીંનું ખંડું કામ પોતે ઉપાડી લીધું છે. હેંશે હેંશે કામ કરે છે, નાનકડા જોળીયામાં મહાન આત્મા એઠેલો છે. મહાપ્રલાવશાળી થશે. તમારા જનમ જન્માંતરના પુષ્યયોગે આવો. પ્રતાપી પુત્ર સાંપડ્યો છે, ચતિશ્રીએ રામકુમારના પિતાને અવિષ્ય કલ્યું છે.’ મહારાજ ! ‘રામ’ અમારું રાંકનું રતન છે. તેની માતા તો તેના વિના ઝુરે છે. પણ આપની છત્રછાયામાં તે અસ્થાસ કરે તે જાણી ચંતોષ થયો છે.’

‘રામ’ મારો તો પ્રાણું ખ્યારો શિષ્ય છે. તેની મનો-કામના તીર્થયાત્રાએ કરવાની છે. તે પ્રાણાણ લલે જન્મયો. પણ તથ અને ત્યાગક્ષારા જૈનધર્મનો ઉદ્ઘોત કરશે. જ્યો-તિષ શાસ્ત્રની દ્યાખિએ હું આ અવિષ્ય ભાણું છું. તમને જરૂર હુંઘ થશે. તેની માતાને તો ‘રામ’નો વિદોગ અસહ્ય થઈ પડશે. પણ તમારા સુપુત્રના યોગ જ એવા બળવાન છે કે તે ઘરમાં રહેવાનો નથી. ત્યાગની રેખા તો એવી છે કે મારી પાસે પણ રહેશે કે નહિ તે કહેવાય નહિ. હેં તમે ‘રામ’ ને મને આપો, હું તમારી પાસે ‘રામ’ની લિક્ષા માણું છું. રામ તમારું કુળ અજવાણશે. જૈનશાસનનો સમર્થ યોગી બનશે.’

‘મહારાજ ! આપ જેવા ગુરુવર્ય યતીવર્ય મારા જેવા સામાન્ય પ્રાણીથું પાસે એક વચન માગો ને હું પુત્રમોહના કારણે ન આપું તો મારું પ્રાણીથુત્વ લાજે. તેની માતાને તો પુત્ર-વિરહ વસ્ત્રો થઈ પડશે. પણ ‘રામકુમાર’નો દદ નિશ્ચય, અશ્વાસની તમન્ના અને તેના લક્ષિયનો વિચાર કરતાં અમારે સંતોષ માનવો પડશે.’ પિતાએ પુત્રનું સમર્પણ કર્યું.

‘ધન્ય તમારી ભાવાના, તમારું સમર્પણું, ‘રામકુમાર’ મારો લાડલો રહેશે. તે રાજકુમારની જેમ ઉછરશે. તેને પ્રાણીથુ-કુમારની જેમ મહા વિદ્યા અપાશે. તે મહા પ્રતાપી અનશે. તમારું-તમારા કુદુંખનું કલ્યાણ થાએઓ.’ યતિશ્રીએ પિતાને સાંત્વન આપ્યું.

‘એટા રામ ! તારી જ્ઞાનની પિપાસા, ત્યાગ ભાવના અને દદ નિશ્ચય જોઈને હું તો ચકિત થયો છું. યતિશ્રીએ જફ કર્યું છે. તે અમારો મોહ છોડયો અને ગુરુવર્યને ચરણે ઘેરી ગયો. તારી માતા તો આંસુ સારે છે. પણ ગુરુવર્યના વચનો દળે તે દિશિથી તને આશીર્વાદ આપું છું. કુળને અજ્વાળને. ધર્મનો ઉધોત કરને.’ આંસુલયે નથે પિતાએ આશીર્વાદ આપ્યા.

પિતાજી ! આપે મને જે મંગળ આશીર્વાદ આપ્યા તે પ્રમાણે હું પ્રાણીમાત્રનું કલ્યાણ કરીશ. મારી માતાને સાંત્વન આપશો. હું માતાની ઝૂખ દીપાવીશ. મારા આત્માનું કલ્યાણ કરીશ. તીર્થયાત્રાઓ કરીશ. ધર્મબોધ આપી જૈન-ધર્મનો જ્યલ્યકાર કરીશ.’ અશ્વિવડે પિતાના પગ પખાજ્યા.



## સાધના

( ૫ )

‘ શુરૂદેવ ! હમણાં હું ‘ ઉવસગગહરં ’ સ્તોત્રનો લય કર્યાં છું. પ્રાતઃકાળના ૪ વાગ્યે ઉઠી જાઉં છું. પ્રાતઃસમરણ કર્યાં પછી હમેશાં ૧૦૮ ઉવસગગહરં જપું છું. આજે તો રાત્રિના મને ધરણેન્દ્ર નાગરાજરૂપે હેખાયા. હું જરાક ચમક્યો. પણ માથા ઉપર છત્રની જેમ ફેણુ ગ્રસારી ચાલ્યા ગયા.

‘ રામકુમાર ! તું ભાગ્યશાળી છે. ‘ ઉવસગગહરં ’ મહા-મંત્ર છે. તેનો લય રૈણ-શોક-વિષનું નિવારણ કરનાર તથા કદ્વાણું કામના પૂર્ણ કરનાર છે. પણ સાવધાન રહેને. કોઈ ચમત્કારથી ડરીશ નહિં.’ શુરૂવાર્યે સૂચના આપ્યી.

‘ શુરૂદેવ ! મારે કોઈ મહામંત્રની સાધના કરવી છે. કૃપા કરો. મને કોઈ મહામંત્ર આપો. હું આપશ્રીની નિશ્ચામાં તેની સાધના કરીશ.’

‘ બેઠા ! વીર ધંટાકરણુનો મંત્ર ચમત્કારી છે તે મહા-પ્રલાવિક જગતા હેવ છે. પણ તું હણુ બાળક છે. મંત્રની સાધના કાચાપોચાથી ન થાય. અખંડ અદ્વાચર્ય, સૌમ્યવૃત્તિ, શાંત પ્રકૃતિ, નિઃસ્વાર્થભાવ તથા દફતા અને ધીરજ હોય તો જ સિદ્ધિ થાય. વળી તે મંત્રનો ઉપયોગ કર્યાણુ આમે માટે જ થઈ શકે. થાડો સમય ‘ ઉવસ્તગહર ’ નો જાપ ચાલુ રાખો પછી જરૂર ‘ વીર ધંટાકરણુની સાધનાનો મંત્ર આપીશ.’

‘ ગુરુહેવ ! ‘ ઉવસ્તગહર ’ નો જાપ હવે પૂર્ણ થયો. અહુમ કરી ‘ વીર ધંટાકરણુનો જાપ શરૂ કરવા આજા આપો. કૃપા કરો. હું આ મહામંત્રની સાધના માટે આપની સુચના પ્રમાણે જ જાપ કરીશ. તપશ્ચિર્યા કરીશ. રાત્રે અણે કલાક હું જાપ કરીશ અને સિદ્ધિ મેળવીશ.’ રામકુમારે પોતાની દદ ભાવના રજુ કરી.

રામકુમારનો અલ્યાસ ઢીક ઢીક ચાલી રહ્યો હતો. યતિ-શ્રીએ ‘ ઉવસ્તગહર ’ સ્તોત્રનો જાપ આપેલો. તેનાથી તેમને ચમત્કાર થયો. તેથી મહામંત્રના જાપને માટે ભાવના જગ્યી. યતિવર્યને પ્રાર્થના કરી. યતિશ્રીએ મહામંત્ર માટેની યોગ્યતા નિષે સાવચેતી આપી અને રામકુમારની દફતા જોઈને તેમને ‘ વીર ધંટાકરણુ ’ નો મહામંત્ર આપ્યો. યતિવર્ય જ્યોતિષ વિદ્યા-વૈદ્ય વિદ્યા અને મંત્રશાસ્ત્રના વેતા હતા. રામકુમારની પાત્રતા જોઈને મહામંત્રને માટે આજા આપી.

રામકુમાર તો રાત્રિના એ વાગે ઉડી જાય છે. ‘ વીર ધંટા-કરણુ ’ ની પ્રલાવશાસ્ત્રી તેજસ્વી છથી સામે રાખી, ધીનો દીવો રાખી ધૂપ કરીને એસી જતા. બણે કલાક જાપ ચાલતો અને

અપમાં એવા તો ભગ્ન અની જતા કે એ કલાક કસાં ચાલ્યા ગયા તેનો ખ્યાલ પણ રહેતો નહોતો. સવારના પ્રાતઃક્રિયામાં પણ પાછા સાવધાન હોય, અસ્થાસ તો ચાલુજ અને થતિ-વર્યાની સેવા પણ ચૂકતા નહિ.

જેમ જેમ જાપ ચાલતો હતો તેમ તેમ રામકુમારનો આત્મા પ્રકુલ્પ-પ્રસન્ન અને પ્રભાવિત રહેતો હતો. ચહેરા પર લાલી ચમકૃતી. આવાપીવાની પરવા નહોતી. અહુમ અને ઉપવાસ-એકાશન ચાલુ હતાં. દિનપ્રતિદિન કોઈ હિંય જયેતિ પ્રકાશના કિરણો. વેરતી હોય તેમ જાંખી થતી અને એ હિંય જયેતિના દર્શનની જાંખના વધુ ને વધુ ચિંતત-મનન ને આત્મધ્યાન તરફ પ્રેરતી.

આજ અખંડ જાગરણ હતું. મંત્રનો સાક્ષાત્કાર કરવાની તાલાવેલી હતી. સનાન કરી પવિત્ર વસ્તુ પહેરી ‘વીર ધંટા-કરણુણુની મૂર્તિની વાસ્ક્ષેપની પૂજા કરી, દીપકની જવલંત જયેતાત અને ધૂપના પમરાટ વચ્ચે મહાયોગી ઐઠા હોય તેમ ધ્યાન મળ્યા અની ગયા. ચાર કલાકના અખંડ જાપ પછી ચમત્કાર થયો. ચક્ષુ ઐલતાં જ બાળુમાં વીર ધંટાકરણુણ પોતે હાજરાહણુર હોય તેમ મહા તેજસ્વી પ્રભાપુંજ બાળક જેઇને રામકુમારણ ચકિત થઈ ગયા. લાંબા ડેશ, લાલ કણોટો અને પ્રકાશના કિરણો વેરતું સુખાર્વિંહ જેઇને ‘વીર ધંટા-કરણુણ’ ના બાળ સ્વરૂપને વંદન કર્યું. બાળકે પોતાના રમણીય લાંબા હાથોએ આશીર્વાહ આપ્યા ને તુરત જ અંતર્ધ્યાન થઈ ગયાં.

‘ઐઠા ! આજ તો અહુમણું પારણું કરી લે. જીને અહુંર

નથી કરવો, પણી અસ્યાસ પણ ન થાય અને ધ્યાનમાં પણ શાંતિ ન રહે.''

'ગુરુદેવ ! આજ તો બીજે અદૃમ શરૂ કરવો જ છે. મને પહેલો અદૃમ તો જરા પણ લાગ્યો નથી. બીજા અદૃમ માટેનું પણ એક કારણ છે. કૃપા કરી મને આજા આપો.' રામકુમારે પ્રાર્થના કરી.

'રામકુમાર ! હું કારણ છે બેઠા ! હું જેઠ રહ્યો છું. તારા સુખાવિંદમાં હું તેજસ્વી આત્મા જેઠ શકું છું. અદૃમ ડેવા છતાં તું ખૂબ પ્રસન્ન છે. હું બીજા અદૃમની આજા તો આપું પણ મને કારણ તો કહીશ ને !

'ગુરુદેવ ! મારી સાધના ઇણી છે. હું સવારના એ વાગે ઉઠીને 'વીર ધંટાકરણુલ' ની સાધના કરું છું. તેમાં હું એવો તો લીન થઈ જાઉં છું કે મને આસપાસનું ભાન પણ નથી રહેતું. કાલે અદૃમનો છેવો દિવસ હતો. હું ધૂપ દીપના પમરાટ વચ્ચે 'વીર ધંટા કરણુલ' ની છણી સામે ધ્યાનસ્થ હતો. મને પ્રકાશનો ભાસ થયો અને મારાં ચક્ષુઓ ખોલું છું ત્યાં તો બાળ સ્વરૂપે 'વીર ધંટાકરણુલ' ના દર્શન થયાં. મારા શિર પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને તુરત જ અંતર્દ્યાન થઈ ગયા. તેથી જ બીજે અદૃમ કરવા ભાવના જગી અને મને અદૃમ કર્યો છે તેનો ઊયાત પણ નથી. મારા અંતરમાં ઉલસ છે. મારા આનંદનો પાર નથી. હું મારા અહોભાગ્ય માનું છું.' રામકુમારે મંત્રસિદ્ધિની વાત કરી.

'બેઠા ! હું ખરેખર ણડભાગી છો. તારો આત્મા નિર્મણ

અને પ્રશ્નાંત છે. બીજો અહુમ કરવાની મારી આજા છે. મારા મંગળ આશીર્વાદ છે. તારી લાવના ઇણી. તારા જીવનમાં પગલે પગલે 'વીર ધંટાકરણું' તને હાજરાહલૂર રહેશે. તું મહા યોગી થઈશા.

યતિવયે ચોતાના પ્રિય શિષ્ય રામકુમારની સાધનાની સિદ્ધિ જોઈને આનંદ અનુભંગે.

આપણું ચરિત્રનાથક હીર્ઘતપસ્તી આચાર્યશ્રી જીન ઋદ્ધિ-સૂરીશ્વરજીના જીવનમાં અહુમ અહુમની હીર્ઘ તપક્ષયો, ગમેતે માંહગી હોય તો પણ રાત્રે બણે વાગે જાગી જઈ ધ્યાનમાં લીન થઈ જવું, તથા 'વીર ધંટાકરણુ' ની સાધના આપણું જાહી છે તેના બીજ ચૂર્ણની ભૂમિમાં યતિવર્ધની નિશ્ચામાં વવાયેલાં અને તેના અંકુરો ધીમેધીમે વધતાં વધતાં મહા વરવૃક્ષની જેમ મહાયોગી સાધકના ઇપમાં વૃદ્ધિ પામતાં આપણું જોઈ શક્યા એ જીવનાંત જીવનતું મંગળમય ફર્શન છે.





## યતિ-હીક્ષા

( ૬ )

જાદુકરણલ અને રામકુમારલ બંને શુદ્ધભાઈઓ એક સાથે ઉછ્વાસ, સાથે અભ્યાસ કર્યો, શુરૂની સેવામાં પણ બન્ને સાથે જ હોય. બન્ને વર્ષેને પ્રેમ અદ્વિતીય હતો. હર-વાર રવાતું પણ સાથે. યતિવર્ય ચીમનીરામલ અને યતિવર્ય પુનમચંદલાંચે આ એ શિષ્યોને યતિ-હીક્ષા આપવાનો વિચાર શ્રી સંઘના આગેવાનોને જણાંયો. અને ખખાને આનંદ થયો.

સં ૧૯૪૮ ના ફાગણ સુહ ૨ નો મંગળ હિંસ આવી પહોંચ્યો. બન્ને ભાઈઓનો ઠાડમાઠથી હીક્ષાનો વરદોડો નીકળ્યો. સંઘના આખાલવૃદ્ધોએ તેમાં હર્ષપૂર્વક ભાગ લીધો. ઉપાશ્રયમાં માનવમેહની વર્ષે શ્રી સંઘની હાજરીમાં યતિવર્ય શ્રી ચીમનીરામલાંચે બન્ને શુદ્ધભાઈઓને યતિ હીક્ષા આપી શ્રી જાદુકરણલને યતિવર્ય શ્રી પુનમચંદના શિષ્ય જાહેર કર્યો. રામકુમારલને શ્રી ચીમનીરામલના શિષ્ય જાહેર કર્યો.

શ્રી સંદે બનનેને આનંદ ઉત્ત્સાહથી વધાવ્યા. બન્ને યત્તિવર્યોએ મંગળ આશીર્વાદ આપ્યા.

‘હેવ-ગુરુ-ધર્મને ભૂલશો. નહિ. ચારિત્ર-સંયમ-તપશ્ચયા-શાન-કિયામાં સહા તત્પર રહેશો. સંઘના ઉદ્યને કલ્યાણ માટે લાવના રાખશો. તીર્થ-યાત્રાએ કરી આત્મશાંતિ મેળવશો. આત્મકલ્યાણની સાધનામાં પ્રયત્નશીલ રહેશો. જૈનશાસનનો ઉદ્યોત કરશો. અને મોક્ષ માર્ગના અધિકારી બનવાની લાવના પ્રદિસ રાખશો.’ યત્તિવર્ય શ્રી ચીમનીરામજીએ યત્તિ-દીક્ષાનો સંહેશ આપ્યો.

બન્ને ગુરુભાઈએ બન્ને ગુરુવર્યોના ચરણમાં સપ્રેમ પ્રાણીપાત કરી વંદણા કરી. શ્રી સંઘના આખાતવૃદ્ધના જ્ય-દ્વાષ વર્ષયે યત્તિ-દીક્ષાના આશીર્વાદ મેળવ્યા. આનંદ ઉર્મિએ ઉછળી રહી. ચૂરુ શહેરનો ઉપાશ્રય હર્ષના નાહોથી શુંલુ રહ્યો. રામકુમારજીનો અદ્યાત્મ વધવા લાગ્યો. રાત્રે ધ્યાન પણ ધરતા. સવારમાં વહેલા વહેલા પ્રાતઃકિયાથી તૈયાર થઈ જતા, શ્રદ્ધા-ગુજનોને માંગળિક સંભળાવતા, યત્તિ-વર્યની સેવા પણ કરતા અને બન્ને ગુરુભાઈએ આનંદપૂર્વક રહેતા હતા. પણ રામ-કુમારજી જુદી માટીના હતા. તેમનામાં ત્યાગભાવના વિશેષ હતી, તપશ્ચયાં તરફ વિશેષ લક્ષ્ય રહેતું. મંત્રસિદ્ધિમાં તેઓ મધ્ય રહેતા. યત્તિ-વર્યની ગાહી, યત્તિ-વર્યની સંપત્તિ અને યત્તિ-વર્યના વારસાની તેમને ચિંતા થઈ પડી. કૃયાં મારી ત્યાગ ભાવના-તપશ્ચયા-મંત્રસિદ્ધ અને કૃયાં યત્તિવર્યની માયા-મમતા અને સંપત્તિ શુરુભાઈ તો બાઢોશ છે. તે વડીલબંધુ છે. શક્તિશાળી છે. બધું સંભાળી શકે તેવા છે. ગાહીના સાચા

વારસ તે જ છે. પણ તેઓ મારા તરફના પ્રેમભાવને લીધે મને આ બધું વળગાડીને ચાહ્યા જાય તો ! હું શું કરે ! હું જવા-બદ્ધારી કેવી રીતે ઉપાડી શકીશ ! મારું ગળું નહિ. એ લાર મારાથી ઉપડે જ નહિ. હું તો અલિસ જ રહીશ. '

આવા આવા વિચારો આવતા ને મન મુંબાઈ ઉઠિતું.

પછી તો ચૂરુ છોડવા નિર્ણય કર્યો. ચાલી પણ નીકળયા પણ અતુલન નહિ, કંઈ લેયેલું નહિ, બહાર કોઈ વખત ગચેલા નહિ તેથી ગલરાયા અને કયાં જવું તેમ વિચાર કરે છે ત્યાં તો યતિ-વર્ષ પુનમચંદળું મોઝેલ ઉંટ ઉપર આવેલા માણુસે પકડી પાડ્યા. લાચાર થઈ પાછા આવ્યા. યતિ-વર્ષો ખૂબ સમનાવ્યા. શિખામણ આપી અને હવે બાળક ખુદી કરી કોઈ હિવસ ન જવા માટે ચેતવણી આપી.

હવે તો યતિ-વર્ષ પુનમચંદળ ચાંપતી દેખરેખ રાખતા હતા, કોઈ કામ માટે તેમને એકલાને મોઝેલતા નહિ, નજીકમાં ગયા હોય અને જરા વિલંબ થાય તો તુરત પાછળ માણુસ મોઝેલ્યો જ હોય. આમ રામકુમારજી તો પૂરા જપતામાં રહેવા લાગ્યા. મન તો સુકૃત થવા તલસતું, અને તક મળે તો ઉડી જવા માટે જંખતું પણ થાડો વખત તો કસોટીમાં ગયો. પછી જરાક જપતો એછો થયો અને સમયની પ્રતિક્ષા કરવા લાગ્યા. તેજસ્વી આત્માને ગાહીની સંપત્તિમાં અકળામણ થવા લાગ્યી. કુરી એ વાર ચાહ્યા ગયા અને બન્નેવાર યતિશ્રી પુનમચંદળ શાધાવીને ચૂરુ લઈ આવ્યા.





## તीર्थयात्रानो संदेश

( ૭ )

રાત્રિના બે પ્રષ્ઠર પૂરા થવા આગ્યા છે. આકાશ વાહનાચોથી ઘેરાયેલું છે. તારલાચો અદસ્થય થઈ રહ્યા છે. ચૂડશહેરના લક્ષાલોગા માનવીઓ નિદ્રાને ખોળે સુઝે સૂતેલા છે. અધું સુમસામ જણ્ણાય છે. વચ્ચે વચ્ચે પહેરેળીરોના પડકાર અને કોઈ કોઈ ફૂતરાચોના અવાજે સંભળાય છે. શહેરપર શાંતિ પથરાઈ રહી છે.

પણ એક યુવાનને અજંપો થયો છે. નિદ્રા વેરણ બની છે. શું કરવું ? કયાં જવું ! કેવી રીતે જવું ! તેના વિચારો આવી રહ્યા છે.

કોઈ કલેશ નથી, કોઈ હુઃખ નથી, કોઈ હ્રદ નથી, કોઈ ચિંતા નથી, કોઈ સુંભવણ નથી. મહાત્મય જેવું નિવાસગૃહ છે, સુખ અને સાધારણી છે. આવા-પીવાની ખોટ નથી. અધારો

ખમા ખમા કરે છે. પિતા તુલ્ય શુરૂવચ્ચનો પ્રેમ અર્થીમ છે. વહીલ બંધુસમા શુરૂઆદ ઝડિકરણણું તો યુવકને માટે પ્રાણુ પાથરે છે. પણ રામકુમાર તો આ સમૃદ્ધિ સુખચેન અને સાહારીથી સુંઝાઈ રહ્યા છે. જ-મથી ત્યાગ લાવના અને શાંત પ્રકૃતિવાળા કુમારને કયાંએ સાચું સુખ હેખાતું નથી. આજે તો આખરી નિર્ષીય માટે મન તલસી રહ્યું છે.

‘શુરૂહેવનો કેવો અપ્રતીમ પ્રેમ છે ! મોટા ભાઈ કેવા પ્રાણુ પાથરે છે ! આ મહાલય, આ સમૃદ્ધિ કેવી માયા લગાડી રહ્યાં છે ! પણ એ સુખચેન માટે હું સર્જાયો નથી. મારે તો અભાસિત મોશ્ન સુખ જોઈએ. બધે વખત હું આ મોહ-માયા છોડી ચાલી નીકળ્યો. પણ મારા પરમ પૂજ્ય શુરૂવચ્ચે મને શોધી કાઢ્યો. હવે તો દુર્દૂર નીકળી જાઉં તો કેવું સારું ! હે અધિકાર્યક હેવ ! હે વિલોકના નાથ ! મને માર્ગદર્શન કરાવો. બસ એ જ માર્ગ ઉત્તમ છે. મારું સ્વર્ણ એ જ દૃશ્યાદે છે. મારે તીર્થયાત્રાએ જવું. તીર્થાધિરાજ મને પોતાની સુહિતપાંખમાં લેશે. મારો બેઠાપાર થઈ જશે. મને આ હેખાતાં સુખચેન કરતાં આત્મકલ્યાણુકારી શાંતિ મળશે જ મળશે.’

ચાલ્યા જવાના વિચારો તો ધોળાઈ રહ્યા હતા પણ કંયાં જવું તે પ્રક્ષ હતો. એ હિવસ પણેલાં એક મધુરું સ્વર્ગન આવ્યું હતું. સ્વર્ગમાં તીર્થયાત્રાનો સર્દેશ મળ્યો હતો. શરૂંજ્ય અને ગિરનારના કંય જીનાકયો અને ચમતકારી મૂર્તિઓના દર્શનની જાંખી થઈ હતી. અધિકાર્યક હેવે જ માર્ગદર્શન આપ્યું ન હોય તેમ સુંઅવણુંનો ઉકેલ મળી જતાં આજે આખરી નિર્ષીય માટે તાલાવેલી લાગી હતી.

ત્રીને પ્રહર પૂરે થવા આવ્યો ને આપણું અરિત્રનાથક  
રામકુમારે દદ નિશ્ચય કરી લીધો.

ઉપાશ્રયમાં ખધાં નિદ્રાધીન હતાં. પૈસા તો હતા નહિ. ખધે વખત ચાલ્યા ગયેલા તેથી હિવસે તો એકલા જવાતું નહિ. આજે રાત્રે જ નીકળી જવાની તક હતી. શુરૂદેવની પાસે જ બન્ને શિષ્યોને સૂવાની બ્યવસ્થા હતી. પણ જરમી અને ઉકળાટથી આપણું રામકુમાર અગારીમાં સૂતા હતા, પાસેજ ઢાઢર હતો. અને નીકળી જવામાં સુગમતા હતી.

જતાં જતાં વિચાર ઉમટી આવ્યો. “ અરે આ પિતા-  
તુલ્ય શુલ્વર્થની છાચા શું હમેશા માટે હું એઈ જેસીશ !  
મારા પરમ પ્રિય શુલ્વભાઈનો આવો અતુપમ પ્રેમભાવ હું  
ક્યાં પામીશ ! હું જાડિ હું પણ ક્યાં જઈશ ! કોને આશ્રી  
રહીશ ! કેટકેટલાં હુઃએ સહન કરીશ ! નથી દમડી, નથી  
દાણીનો, નથી સાધનસામન્યી, કપડાં પણ શરીરે પહેરેલાં માત્ર,  
ગાડા-ગાડી કે ઉંટ-ઘોડાતું સાધન પણ નથી. સગા-સંખારી  
પણ કોઈ નથી. ઉપર આકાશ અને નીચે ધરતી-અરે આ  
સ્થિતિમાં એકલો-અટુલો હું શું કરી શકીશ.”

પણ નહિ નહિ આવી નિર્ભાગતા શા માટે ! હું ભલે  
એકલો છું પણ માર્દ ભાગ્ય મારી સાથે છે. મારા અધિકાયક  
મારી સાથે છે. મારા પાર્થનાથ મારી સાથે છે. મારી ચક્કે-  
શરીમાતા મારી સાથે છે. આ સમૃદ્ધ અને ગાઢીની ઉપાધિ  
કરતાં આત્મશાંતિ અને આત્માનો આનંદ મેળવવા ને ને હુઃએ  
આવશે તે સહન કરીશ. તીર્થયાત્રાએ કરીશ અને એ તીર્થ  
સહીલમાં મારા આત્માને નિર્મણ કરી પ્રભુ મહાવીરના શાસનનો

સેવક બનીશ, તપશ્ચિર્યા એ મારી ઢાલ બનશે. ત્યાગને હું મારો દીવડો બનાવીશ અને જૈનશાસનનો જ્યયજ્યકાર કરવા હું ગામેગામ, શહેર-શહેર વિચરી જનસમાજતું કલ્યાણ સાધવા વથાશક્તિ પ્રયાસો કરીશ.


હું જઈશ-મારા અત્માનો સાહ મને તીર્થયાત્રાએ જવા પ્રેર છે, એ તીર્થયાત્રાનો સંદેશ મારો માર્ગ મંગળમય બનાવશે.

ખસ, આ વિચારપ્રવાહે તેનામાં હિંમત રેડી. વેહનાના દોહીનો ધુંટડો ગળી જઈ, પવિત્ર માર્ગમાં આવનારી સુરક્ષા-લીઓને ટાળવા દઠ નિર્ણય કર્યો.

સ્વાજીની સિદ્ધિ માટે આપણા ચરિત્રનાયક રામકુમાર આદી-શાન ઉપાશ્રય, સમૃદ્ધિ અને સુખ સાહાણી છોડી ચૂપયાપ ચાલી નીકળ્યા. ગુરુદેવની ગાહીને અને ગુરુદેવની છણીને પ્રણીપાત કર્યો. હુદ્ધયના તાર અણુઅણી ઉઠ્યા. એ અશ્વ બિંદુએ ટપકી પડ્યાં. પણ ઉચ્ચ ભાવનાની સિદ્ધિ માટે હુદ્ધયને મજબૂત બનાવી ચાલી નીકળ્યા.

જીવન હાતા ચૂર્ઝની ભૂમિ, તેના મંહિરો, મહાલયો મહેલાએ અને ફરવાને વટાવતા અનેક સંસ્મરણો જાગી ઉઠ્યાં. ચૂર્ઝની છેલ્લી વિદ્યાય વસ્તુ થઈ પડી. જતાં જતાં અશ્રુબિંદુઓથી ભૂમિને પખાળી નૂતન જીવનની કેરીએ શાંતિતું ભાથું લઈને બાધ્ય હો઱ી જાય ત્યાં ચાલી નીકળ્યા.





## ચાંદીનો આદેશ

( ૭ )

‘કુયાંથી આવો છો !’ ધતિશ્રીએ પ્રશ્ન કર્યો.

‘ધતિવર્ય ! હું ચૂરું-ખીકાનેરથી આવું છું.’ રામકુમારે જવાબ આપ્યો.

‘તમારું શુલ નામ !’

‘રામકુમાર !’

‘તમે ધતિ છો !’

‘હુ ! મેં ગયા ક્રાગણુ માસમાં ધતિ દીક્ષા લીધી છે.’

‘તમે તો પગપાળા યાત્રાએ નીકળ્યા છો !’

‘હુ ! કારણુલશ પગપાળા નીકળ્યો છું.’

‘કુયાં કુયાં જઈ આંદ્યા !’

‘હું ચૂરુંથી નીકળ્યો. ખીકાનેર પહોંચ્યો. ત્યાંના રમણીય જૈન મંદિરોના ફર્શેન કર્યો. ત્યાંથી નજુકમાં શ્રી નાનદાદાળનું

પ્રચિષ્ઠ ચમત્કારિક ડેવાલય છે. ત્યાંની યાત્રા કરી ખૂબ આનંદ અનુભંગેથો. પછી તો જિહાસર, સુજનગઢ, લાડનૂં, ડેગાંવ, નાગોર, મૂંડવા, ખજવાના, હેસવાલ, મેડાફ્લેબોધી થઈ જોધપુર પહોંચેથો. જોધપુર યત્તિવર્ય શ્રી હરદેવલુના ઉપાશ્રયમાં સુકામ કરી સરેં જૈન મંહિરેના દર્શાન કર્યાં. ત્યાંથી પાલી જઈ શ્રી નવલખા પાર્શ્વનાથની યાત્રા કરી. અહીંથી ગુંડોચ, ઢોલાડા, શિવગંજ, એડા તથા નાણા થઈ અતે આયુલુના જગવિષ્યાત કલામય મંહિરેની યાત્રા કરવા આવ્યો છું.' રામકુમારલુચે પોતાની પગપાળા સુસાફરીની વાત કરી.

'રામકુમારલુ ! અહીં સુધી પગપાળા આવનાર અને રસ્તાની વિકટતા તથા આવાપીવાની સુશકેલી સહનાર તમને ધન્ય છે. પણ તમે ચૂરુ કેમ છોડ્યું !' યતિશ્રીએ પ્રશ્ન કર્યો.

'યતિશ્રી ! ચૂરુમાં તો હું મારા શુરુદેવ શ્રી ચીમનીરામલુ યત્તિવર્યને લાડલો હતો. પણ મને ગાઢીની સંપત્તિ ને જવાખારી ગમ્યાં નહિ. મને તીર્થયાત્રાની લાવના જાગી અને એકાચેક ચાલી નીકળ્યો.' રામકુમારે રૂપદૂર્ઘટા કરી.

'હવે શું લાવના છે !'

'પગપાળા જૂનાગઢ જરૂર છે. તિર્થોધિરાજ જિરિનગર ગિરનારના ભીંય મંહિરેની યાત્રા કરવાની ભાવના છે.'

'તમે મારી સાથે ચાલો. પગપાળા જૂનાગઢ જરતાં ધણો. સમય લાગશે. તમે પેસાની શીકર ન કરશો. મને પણ તમારી બાતોથી આનંદ થશે.'

'આપની કૃપા !'

રામકુમાર એકાએક ચૂરથી નીકળી ધીકનેર વગેરે શહેરો અને ગામોમાં પગપાળા કરી આણુ આવ્યા. આણુના મંહિરોના દર્શન કરી જૈન શિલ્પ કળા અને ભાગ્યશાળી હાનવીરોની દાનશુરતાને અંજલિ આપી આનંદ અનુભવવા લાગ્યા. અહીં યાત્રાથે આવેલા એક ઘંટિવર્ષનો પરિચય થયો. અને સાથે જૂનાગઢ માટે પ્રયાણ કર્યો.

જૂનાગઢ ધર્મશાળામાં ઉતારો કર્યો. શહેરના મંહિરોના દર્શન કર્યો. ધીજે દિવસે ગિરનારની યાત્રા કરવા ગયા.

સૌરાષ્ટ્રની દક્ષિણ વિશાળકાય પાથરી પર્વતરાજ ગિરનાર જિલ્લો છે. હર હરથી આકાશને લેટતાં સુંદર મનોહર શિખરો, કાળા કાળા રાક્ષસી પત્થરો, સુંદર લીલમ લીલાં જાડો વગેરે દસ્યો અદ્ભૂત હતાં. પર્વત ઉપર ધીમે ધીમે આવી પહોંચ્યા. અહીંનું વાતાવરણ પવિત્ર અને મધ્યમધતું લાગે છે. અહીં જગતની જંબળ ભૂતી જઈ હરેક મનુષ્ય આનંદ અને શાંતિ અનુભવે છે.

રામકુમાર તો ગિરનારનું બન્ય અને અદ્ભૂત દર્શન જોઈ મુખ થઈ ગયા. ભાવીશમા તીર્થાંકર શ્રી નેમીનાથલુના મંહિરની શોભા અપરંપાર છે. હાદાની મનમોહક મૂર્તિનું આકર્ષણ એવું થયું કે ત્યાં જ ધ્યાનમગ્ન જેસી ગયા. ધ્યાન પૂર્વ થયે મેરકવસી તથા સગરામ સોનીની દુંકના દર્શન કર્યાં. કુમારપાળ મહારાજા, વસ્તુપાળ તેજપાળ તથા સંપ્રતિ રાજાની દુંકના પણ ભાવપૂર્વક દર્શન કર્યાં.

કિલ્ડો છાડીને બહાર નીકલ્યા એટલે પ્રકાશ અને શાંતિનું

માતાપરણું મળ્યું. ગિરનાર ઉપરના એ વનો સહેસાવતા અને ભરત વન પણ ધૂમી વળ્યા. અહીં ગીય આડી અને ગુફાઓ જોઈ ધ્યાનની લાવના જગી ઉઠી પણ જેવાતું ધણું હતું તેથી આગળ ચાલ્યા. હતુમાન ધારા, લેરવાંપાથી આગળ ખીજ શિખરે અંબાળ માતાતું મંદીર આવે છે. આગળ જતાં ગોરખનાથનાં પગલાં આવે છે. ગિરનારતું પાંચમું શિખર ચઢવું એ જુદ્ગીની ઘરેખર મોજ છે. ઉચ્ચે આકાશ અને તેની વિશાળતા નીચે હળવો હીટ ડાડી ખીણુને શિખરતું ચઢાએ એ કુદ્રતની અદ્ભુતતાનો નમૂનો છે.

અહીં ગુરુદાત્તાત્રયના પગલાં છે. અહીંથી આપો ગિરનાર-જૂનાગઢના દશ્યો-હૃરદ્વરના પ્રહેણો બસ ! ગિરનારનો આનંદ, ગિરનારની શોભા અને ગિરનારની મધુરતા જે કહેણો તે આ શિખર ઉપરથી અનુભવવા મળે છે.

હુદે તો પાછાં જવું જોઈએ. યતિવર્ય તો થાડી જવાથી પાછા ગયા હતા પણ આપણા રામકુમારલું તો એકેએક કુંક કે ગુફાઓ જેતા ધરાતા નથી.

સાંજ પડવા આવી અને એક રમ્ય ગુફા પાસે તેમને શાંતિ લીધી અને ત્યાં બેસી ગયા. અંધારુ થવા આવ્યું હતું. ગુફામાંથી વૃદ્ધ યોગી બહાર નીકળીને જુઓ તો રામકુમારલું શાંતિથી ધ્યાનમન્દ હેખાયા.

‘યદ્યાં રાત્રિ રહેનેકા હુકમ નહિ ! તુમ કૌન હો !’

યોગી આગંક રામકુમારતું તેજસ્વી સુખ તથા યતિના કૃપદાં જોઈ અકિંત થયા.

રામકુમારજીએ જણાયું યાત્રાથે આવ્યો છું. અહીં મને શાંતિ લાધી અને યાત્રા કરી જરા થાક પણ લાગેલો. તેથી એસી ગયો. યોગીને આકર્ષણું થયું. રામકુમારજીને શુક્ષમાં લઈ ગયા. થોડું ખાવાનું આપ્યું.

‘એઠા કહાં જનેકા વિચાર હે ! યોગીએ પૂછ્યું.’


‘મહારાજ હું દ્વારાની યાત્રાએ જવા ઈચ્છું છું.’

‘અરે ! તુમ તો જૈનધરી હો ! શત્રુંજ્ય જૈન ધર્મની બાદા તીર્થ હે. તુમકો વહાં ઈચ્છા પ્રાપ્તિ હોણી !’

યોગીના વચન સાંભળી ગિરિરાજ શત્રુંજ્યની યાત્રાની ખાવના પ્રદિસ થઈ અને શત્રુંજ્ય જવા નિષ્ટય કર્યો.

અહીં ધર્મશાળામાં યતિશ્રી તેમની રાહ નોંધ રહ્યા હતા, યોગીની આજાથી તેમને નમસ્કાર કરી તેઓ મોડા મોડા પણ ધર્મશાળામાં આવ્યા. રામકુમારજીએ યોગીના આશીર્વાહની વાત કરી.

ખીને હિવસે શ્રી નેમનાથ પ્રભુના ભાવપૂર્વક ફર્શન કરી. શત્રુંજ્ય માટે નીકળ્યા. યતિશ્રીએ શત્રુંજ્યની યાત્રા ક્રી હોવાથી તેઓ જૂનાગઢથી પાછા ચોતાને ગામ ગયા. રામકુમારજીને શત્રુંજ્ય જવા માટે ટીકીટ કઢાવી આપી. એ ઝીપીઆ ખીન આપ્યા. રામકુમારજીએ યતિવર્યનો ખૂબ આભાર માન્યો. એકખીનને પ્રેમથી લેટી બન્નેએ વિહાય લીધી.



## શત્રુંજ્યનો ચમતકાર

( c )

જગતના તીર્થધામોમાં શત્રુંજ્ય અલૌકિક અને ચમતકારી છે. ચુગચુગથી એ આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને અત્મકલ્યાણનો દિંદ્ય સંદેશ આપી રહેલ છે.

તીર્થને વાચ્યા નથી હોતી પણ એ તીર્થધામો ખડાં ખડાં મૌનદારા હળરો ઉપહેણો જેવી જ પ્રાણપ્રેરક પ્રેરણા આપે છે. જગતની લુચનકથા અને આત્માની અમરકથા એ તીર્થો સંભળાવે છે.

રામકુમારજી પાલીતાણા આઠ્યા અને હૃરદસ્થી શત્રુંજ્યના શિખરો જેઠને હુહ્ય નાચી જિઠ્યું. હૃસ્થી જ ગિરિરાજને પ્રણિપાત કર્યો. એ મંહિરોના નગરસમા ગિરિનગરના દર્શન માટે તાલાવેલી લાગી. પાલીતાણામાં શ્રી ભરતરગચ્છના શ્રી ડેમચંદ્રજીના ઉપાશ્રયમાં ઉતારો કર્યો. ભરતરગચ્છના ધતિવર્યે રામકુમારજીને આવકાર આપ્યો.

રામકુમારણ તો યાત્રા માટે જવા તૈયાર થયા. ચિત્તિવિદ્યે સુખાકૃતીના થાકને કારણે તેમજ તડકો થઈ ગયો. હોવાથી આજનો દિવસ આરામ લઈ બીજે દિવસે પ્રાતઃકાળે જવા સૂર્યના કરી. તે દિવસે તળેટીના મંહિરોના દર્શાન કરી ધનવસી દુંક નેધિને સંતોષ માન્યો.

આજે તો પાંચ વાગ્યે જાગી ઉક્ખ્યા. યાત્રાથે વહેલા ચાલી નીકળ્યા.

જ્ય તળેટીની હેરીઓના દર્શાન કરી. ધનવસી દુંકમાં આહિંદેર દાદા તથા પુંડરિક ગણુધર અને દેરીઓના દર્શાન કરી બહાર નીકળી એક ધ્યાનથી ચઢના માંડયું. એક પછી એક વીસામા વટાવી છાલાકુંડ આવી પહોંચ્યા. અહીં શીતળ પવનની લહરીઓ આવે છે. છાલાકુંડથી પશ્ચિમ તરફ શ્રીપૂજાયની દહેરી અથવા લુનેન્દ્ર દુંક આવે છે તે લુણ્ણ છે છતાં તેમાં શ્રી પદ્માવતી દેવીના દર્શાન કરી હતુમાનધારા આવી પહોંચ્યા. અડીંથી વાધણુ પોળમાં શ્રી શાંતિનાથ દાદા તથા ચહેરીથી માતાના દર્શાન કરી આજુભાજુના મંહિરોના દર્શાન કરી દાદાની દુંકમાં આવી પહોંચ્યા. આહિંદેર દાદાની અતુપમ, ભાગ્ય, તેજ તેજ અંભાર અને અકૌદ્ધિક જ્યોતિર્મંથી ચમતકારી મૂર્તિના દર્શાન કરી આનંદ ઉદ્ઘાસથી હૃદય નાચી ઉડ્યું. આત્મા પ્રકુલ્પ બની ગયો. ભાવનાઓ જાગી ઉડી, પ્રભુના ચરણમાં લુધન અપંણુ કરવાની ઉર્મિઓ જાગી ઉડી. દર્શાન કરતાં કરતાં ધ્યાનમનું થઈ જવાયું. દાદાની ચમતકારી મૂર્તિ સામે ધ્યાન ધરીને આત્મશાંતિને અતુભવ મેળ્યો. બહારના મંહિરોના પણ દર્શાન કર્યાં. મંહિરાતું નગર, અકૌદ્ધિક મૂર્તિઓ,

કળામય મંહિરો, માનવસમુદ્ધાય, પવિત્ર-શાંત-મધ્યમધતુ' વાતા-વરણુ જોઈ જોઈને જીવન સાર્થક થતુ' લાગ્યુ'.

ખડાર નીકળીને ચોતરકુ-દૃષ્ટિ ફેરવતાં ઝેરી જગપ્રવાહુથી ભરીભરી શત્રુંજથી નહીં, તેનો વિશાળ પદ અને નાના નાના જેતરો જોઈ હથું થાય છે. સામે જ તાલ્લુકુજ-તળાજના ધ્વનિ મંહિરોની અતુપમ તોરણુમાળ રમ્ય દેખાય છે. સ્વર્ણ હવામાનમાં જોપનાથ અને મહુવાની ભૂમિને પખાળતી ઉછાગતા સમુરની લહેરો જોઈને મન પ્રકુલ્પ બને છે. પશ્ચિમ તરફ ગિર-નારના ક્ષયામ વર્ષના આકાશ સાથે વાતો કરતાં શિખરો દેખાય છે. ઉત્તર તરફ પ્રાચીન વલ્લભિપુરના અવશેષો અને શિહેરની આસપાસના પહોડા નજરે પડે છે. નીચે પાલીતાણાના રમણીય મકાનો ને વિધવિધરંગી પુણ્યાથી ખીલી ઉઠતા ખગીયાએ દૃષ્ટિને આનંદ ને આરામ આપે છે.

આજ યાત્રામાં ખૂબ આનંદ રહ્યો. હાઢાની પ્રતિમા તો મનમાં જડાઈ ગઈ હતી. મંહિરાતુ' નગર જગતનુ' અલૌકિક યાત્રા ધામ જોઈને તો મન સુગ્ધ બની ગયુ' હતુ'.

સવાર પડે ને યાત્રાએ નીકળી પડે. હંમેશાં જતા રામ-કુમારને પાલીતાણામાં ખીરાજતા પન્યાસળ દ્વારાવિમળળ મહારાજનો પરિચય થયો. પં. દ્વારાવિમળળ મહારાજની શાંત સુદ્રા, જીઈ મધુરી વાણી તથા પ્રેમભાવથી આકૃષ્ણીયા. સંવેગી જ્ઞાન સુનિવરોના ઉત્તમ આચારો અને ઉદ્દી છાપ રામકુમારના મન પર પડી. તેમની સંવેગી દીક્ષા માટેની તીવ્ર અલિકાધા જગૃત થઈ અને ચોતાની ભાવના પન્યાસશ્રી દ્વારાવિમળળ મહારાજને જણ્ણાવી.

‘તમે ખરતર ગચ્છના યતિ છો, તો તમારાજ ખરતર ગચ્છના ઉત્તમ કિયાપાત્ર, વચન સિદ્ધિવાળા, પરમ ચોગીસમા તથા જશનામ કર્મના ઉહ્યવાળા શ્રી મોહનલાલજી મહારાજ હાતમાં અતે યાત્રા-કરવા પધારેલા છે. તેમની પાસે જઈ તમારા મનોરથ સફુળ કરો.’ પન્થાસલુએ સાચી સલાહ આપી.

‘પોતાના જ ગચ્છના આવા ઉત્તમ સુનિરલ બિરાજે છે, તેમ જ અન્યગચ્છવાળા સુનિવરો પણ તેમની પ્રશંસા કરે છે. તો હું તેમની પાસે જરૂર હીક્ષા લઈશ.’ આમ વિચારી રામ-કુમારજી શ્રી મોહનલાલજી મહારાજના દર્શનાર્થે ગયા.

‘મધ્યેણુ વંહામિ,’ રામકુમારજીએ વંહણું કરી.

‘ધર્મલાલ ! કયાંથી આવો છો લાગ્યશાણી !’ શ્રી મોહનલાલજી મહારાજે પ્રશ્ન કર્યો.

‘સાહેબ ! હું ચૂદથી આવું છું. મારવાડ-રાજપૂતાના-આખુ-ગિરનારની યાત્રા કરી, શાત્રુજ્યની યાત્રાર્થે આવ્યો છું. આજે આપના દર્શનનો મને લાલ મળ્યો.’ રામકુમારે અધી હકીકત કુંકમાં જણ્ણાવી.

રામકુમાર ખરતર ગચ્છના યતિ છે. શાંત અને તેજસ્વી છે. તપક્ષીર્યા અને ધ્યાન તરફ લક્ષ છે તથા સંવેગી હીક્ષાની ભાવના જણી છે, તે જણી શ્રી મોહનલાલજી મહારાજે સિંચન કર્યું.

‘મહાતુલાલ ! તમારી ભાવના જણી અનંદ થયો. પણ સંવેગી સાધુતામાં જીવનની કસોટી છે. તમે તો જણો છો કે પાઠ વિહાર-ગોચરી-તપક્ષીર્યા-ત્યાગ અને કિયા વગેરે ઉપરાંત

આતમશુદ્ધિ અને આત્મકલયાણુ એજ અમારું અંતિમ ધૈર્ય છે. તમે યતિવેષ લીધો તો તેને ખરેખરો હીપાવવો હોય તો સંવેગી દીક્ષા લઈ તે મુનિવેષને પૂરેપૂરો સાર્થક કરો. લીધેલા વેષને યથાર્થ ભજવી ન શકાય તો અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ જેવી સ્થિતિ થાય. ત્યાગ બળને ભીબળી આત્મબળને ફેળવો અને આ ડાયાનું 'કલ્યાણ સાધી જગતનું કલ્યાણ સાધવા કટિખદ્ધ થાયો. અહીંને આત્મશાંતિ મળશે તે અવોભવના બંધનો કાપી અવિચણ એવા કલ્યાણધામ તરફ હોય જશે. મારા તમને અન્તરના મંગળ આશીર્વાદ છે.'

રામકુમારજી શુરૂવર્યની મીઠી-મધુરી વાણી તથા જીવન સાર્થકતા માટેનો વૈરાગ્ય ભાવનાભર્યો સહૃદિપહેશ અંતરમાં ઉત્તરી ગયો. આવા ખરતર ગંધના જશનામ કર્મવાળા અને વચન સિદ્ધિવાળા શુરૂ મળી ગયા તેથી ખૂબ શાંતિ અનુભવવા લાગ્યા.

'શુરૂહેવ ! અમ મોહે તારો ! હું આપની સેવા કરીશ. નૈનધર્મ અને શાસનનો ઉધોત કરીશ. તપક્ષયો અને ત્યાગથી મારું જીવન ધરીશ અને શુરૂહેવના નામનો જ્યયજ્યકાર કરીશ.'

રામકુમારના આવા પ્રિય અને મધુર શણ્ડો સાંભળી મહારાજશ્રી વિશેષ પ્રસંગ થયા. સારું સુહૂર્ત જોઈને સાં. ૧૯૪૮ ના અષાડ શુદ્ધ ૬ ના દિવસે ચતુર્વિંદ્ષ સંધની માનવ-મેહની વચ્ચે ઢાડમાઠપૂર્વક રામકુમારજીને દીક્ષા આપી. પોતાના વડીલ શિષ્ય શ્રી યशોમુનિલુના શિષ્ય તરીકે શ્રી 'કંદિમુનિ' નામ સ્થાપન કર્યું. આપણું ચરિત્રનાયકના આનંદની સીમા નહેંતી. હજારો શ્રી-પુરુષોના જ્યયજ્યકારથી વાતાવરણ શું લુ

ઉદ્ધું. નૂતનમુનિની સૌભ્ય, શાંત મુખાકૃતિ, વિશાળ લાલાટ, ગોડંવહન તથા સુદૃઢ શરીર અને તેજસ્વી ચક્ષુઓ તથા ભક્તિલાલ અને લઘુતા જોઈ બધાને ખૂબ સંતોષ થયો.

શ્રી ઋદ્ધિમુનિને આજે ઉપવાસનું પારણું હતું. નૂતન મુનિ હોવાથી પારણુંમાં શુરૂઆઠાએ હુધ-રાથડી શીરો વાપરવા આપી. બધાનો પ્રેમકારો લાલ જોઈને તો આનંદ થયો પણ સાધુલુલંબનમાં પણ શરીરની આટલી શુદ્ધામી! પોતે તો શરીરને જરૂરી ભાડું આપી ત્યાગભાવના ડેળવવા નિર્ભય કર્યો.

પ્રાતઃકાળ નિત્યકિયાથી પરવારી શુરૂદેવની આજા લઈ ચાત્રાર્થી ગયા.


શ્રી આદીશ્વર હાદાની મોટી દુંકમાં ફર્શન કરી ત્યાંથી ચન્હન તલાવડીએ આવ્યા. અહીં મોટી શિલા ઉપર એઠા એઠા કાઉંસંગ ધ્યાનમાં રહ્યા. ત્યાંથી લાડવાના દુંગર ઉપર જઈ ત્યાં આવેલી ફેરી પાસે અહુમની તપશ્ચર્યા લઈ ત્યાંજ રહ્યા.

સાધુપણું લીધું છે. શરૂંજ્ય જેવું ચેમતકારી તીર્થસ્થાન છે. તીર્થાધિપતિ શ્રી આદીશ્વર હાદા જેવા અલોકિક પતિત પાવન છે. લાડવાના દુંગરનું એકાન્ત સ્થાન છે. અહીં અહુમ કરી ધ્યાન કરીશ તો મારા આત્માનો સાક્ષાત્કાર થશે. આ જીવનનું એજ સાર્થક છે ને! આવા આવા મનોરથી કરતા અહુમની તપશ્ચર્યા લઈ ધ્યાનમણ રહેવા લાગ્યા. પોતે નૂતન મુનિ છે. શુરૂવર્યને કેટલી ચિંતા થશે! અહીં રાત્રિએ કાંઈ ઉપદ્રવ કહાય થાય! હિસંક-પ્રાણી પણ આસપાસ હોય જ. આ વિષે જરા પણ વિચાર કર્યા વિના ધ્યાનની ધૂનમાં રોકાધ રદ્ધા.

અહીં પાલીતાણુમાં યાત્રાર્થે ગચેલ નૂતનમુનિ ન આવ્યા તેથી ચિંતા થઈ પડી. બીજે હિસે જોડીએ નૂતન મુનિને ધ્યાનમળ જેયા અને નીચે તપાસ ચાલી રહી હતી ત્યાં જઈ જાણ્યું. તુરત જ ડોળી મોઢલાવી. નૂતન મુનિને નીચે આવવા વિનિતિ કરી. ઉપર રાત્રિના રહેવાની સરકારી મનાઈ છે. પેઢી તરફથી ડોળી મોઢલાવી છે. તમારા શુદ્ધેવ પણ તમારે માટે ચિંતાતુર છે. માટે નીચે પધારો. ચોતાને અહુમનો અભિગ્રહ હતો. પણ તે ડોળીમાં એઠા નહિ. ધીમે ધીમે ડોળી-વાળા સાથે નીચે આવી ગયા. બધાના જીવને શાંતિ થઈ. જ્યવહારકુશળ અને ગંભીર એવા શુદ્ધવર્ય શ્રી મોહનલાલજી મહારાજે કર્યો. ઠપકો ન આપ્યો. અકુમતું પારણું કરાયું.

પહેલાં જયારે જયારે ઉપવાસ આહિ તપશ્ચિર્યોમાં પારણું વખતે વારંવાર ડિલટી થતી પણ શ્રી શાનુંજ્ય ગિરિરાજની યાત્રા કથો પછી તેમજ લાડવાના ડુંગર ઉપર રહીને કરેલા અકુમ પછી પારણું પછીની તહલીક સદાને માટે શાંત થઈ ગઈ. આ પ્રતાપ પવિત્ર તિર્થાધિરાજનો તેઓ માનતા અને શ્રી શાનુંજ્યમાંજ પરોપકારી એવા શુદ્ધેવ મહિયા. સુનિપણુંની દીક્ષા લીધી, તેમજ ત્યાગ-તપશ્ચિર્યો અને ધ્યાનનો જે સંદેશ શાનુંજ્યમાંથી મળ્યો. તે દીર્ઘકાળના દીક્ષા પર્યાયમાં તેમણે જીવંત રાખ્યો.





## ગુરૂહેવની સેવા

( ૬ )

‘ ઋદ્ધ ! તારી તપક્રીયા, સેવાભાવના તથા ત્યાગભાવના જોઈને મને ખંતોષ થાય છે. તારો આત્મા પુણ્યશાળી છે. પણ હજુ તારી ઉમર નાની છે. તું નવીન સાધુ છો. ઉથ તપક્રીયા અને ત્યાગથી તુરત જ આત્મસિદ્ધ મેળવવી આ જમાનામાં ફુસ્કર છે. પ્રાતઃકાળમાં જ્યારે હું જેઓ છું ત્યારે તું ધ્યાનમાં લીન હોય છે તે સારી વાત છે. પણ હાલમાં તીર્થયાત્રા, અસ્યાસ, તપક્રીયા, સેવાભાવથી ધીમે ધીમે આત્મા ઉજવળ જનાવો તો આવતી કાલે તમારું ચારિત્ર-તપ અને યોગ બળ શાસનનું કલ્યાણ સાધી શકશે.’ એક હિંસ તક જોઈને ઋદ્ધભુનિને ગુરૂવર્ય શ્રી મોહનલાલજી મહારાજે પાસે બ્રેસાડી જરૂરી શીખામણુ આપી અને આશીર્વાંત આપ્યા.

શુરુહેવના ભમતા લયો મીઠા શર્ણહો તથા આ વ્યવહાર-  
દૃષ્ટિ નૂતન સુનિશ્ચી ઋદ્ધિસુનિના હૃદ્યમાં ઉતરી ગઈ અને ઉગ્ર  
તપક્ષીયો તેમજ ધ્યાનમાં મર્યાદા મૂકી દીધી.

આપણા ચરિત્રનાયક શ્રી ઋદ્ધિસુનિ શુરુહેવની શીખ માનીને  
અભ્યાસમાં લાગી ગયા. તપક્ષીયો તો ચાહુ હતી પણ શુરુહેવાનો  
રસ લાગ્યો. અને શુરુહેવની સેવા સુશ્રુષામાં મળ્યા રહેવા લાગ્યા.  
આવા પરમ ઉપકારી, સહૃદયાનુરાગી, પ્રલાવશાળી, વચનસિદ્ધિ  
પામેશા, વયોવૃદ્ધ, જ્ઞાનપ્રકા યુક્ત, તપસ્વી, સર્વમાન્ય શુરુવર્યની  
સેવા એ જીવનનો લંડાવો ગણ્યવા લાગ્યા. તેમની સેવાથી શ્રી  
ઋદ્ધિસુનિમાં સરળતા, સૌભ્યતા, શાંતિ, સેવાલાવના, નમૃતા  
તથા લઘુતા પ્રગટ્યાં, મન ઝૂલ આનંદમાં રહેવા લાગ્યું.  
ચિત્તમાં પ્રસન્નતા લાગવા લાગી અને શુરુહેવા એ પરમ કલ્યા-  
ણુકારી છે તેમ અનુભવ થવા લાગ્યો. પછી તો શુરુવર્યની  
સેવા એ ઋદ્ધિસુનિનું મહામૂલું કામ બની રહ્યું. શુરુહેવને  
આવા વિનીત, સેવાલાવથી ભરેકા, પ્રશાંત, શિષ્ય પર પુત્રપ્રેમ  
જેવો હાહીક પ્રેમ પ્રગટ્યો. શુરુશિષ્યની જોડી અનુપમ બની રહી.

ખીલ નાના મોટા શિષ્યો શુરુવર્યની સેવાભિત્ત માટે  
તલક્ષતા પણ આપણા ચરિત્રનાયક શ્રી ઋદ્ધિસુનિએ એવું  
મહામૂલું સ્થાન શુરુના હૃદ્યમાં ધારણુ કરેલું કે નાની મીઠી  
ખધી સેવા ઋદ્ધિસુનિ પાસેથી લેતા અને તેમાં ઋદ્ધિ સુનિ  
પોતાને લાગ્યશાળી માનતા.

ઋદ્ધિ સુનિ તરફ પૂર્વ જન્મનો એવો તો પ્રેમલાવ હતો  
કે છેવટની પણ સુધી શુરુહેવે આપણા ચરિત્રનાયકને ચોતાની  
પાસેજ રાગ્યા હતા અને તેમની નિર્મણ અને નિઃસીમ સેવા.

અકિતને લાલ લઈ શિખને ભૂરિભૂરિ અંતરના આશીર્વાંહ આપ્યા હતા.

કિયાપાત્ર, વચોવૃદ્ધ, જીનવૃદ્ધ, પરમપૂજ્ય, ચોગીવર, વચન-સિદ્ધ, હરેક ગચ્છ તથા સંઘેને માન્ય એવા જહાંગેવની સેવાના કૃણ સ્વરૂપ આપણા ચરિત્રનાયકને શુરૂ કૃપા મળી અને ધર્મ-સમાજ શાસના કલ્યાણના અનેક કાર્યો દીર્ઘ દીક્ષા-પદ્યાયમાં કર્યાં તે હવે પછીના પ્રકરણોમાં આપણે જોઇશું.

આપણા ચરિત્રનાયક શ્રી ઋદ્ધસુનિએ પહેલું સં. ૧૯૪૬નું ચાતુર્માસ પાલીતાણુમાં શુરૂવર્યની સાથેજ કર્યું. તેવીજ રીતે સં. ૧૯૫૦ નું ચાતુર્માસ સુરતમાં, ૧૯૫૧-૧૯૫૨ નું સુંબદીમાં. ૧૯૫૩ નું અમદાવાદમાં, ૧૯૫૪ નું પાટણમાં અને ૧૯૫૫ નું ચાતુર્માસ સુરતમાં શુરૂ મહારાજની સાથે અને તેમની સેવા-માંજ કર્યાં. સં. ૧૯૫૬ માં વલસાડના શ્રી સંધની વિનિતિથી પ્રતિષ્ઠા પ્રસંગે શુરૂમહારાજની આજાથી શ્રી ઋદ્ધસુનિ સુરતથી વિહાર કરી નવસારી થઈને વલસાડ પધાર્યો. વલસાડમાં શા. ડાયાભાઈ કેશુરણ તથા શા. મગનભાઈ રાયચંહ તરફથી જૈન મંહિરના ગોખલામાં પ્રલુબ પ્રતિમાની પ્રતિષ્ઠા અફ્રાઈ-મહેાત્સવ તથા શાન્તિસ્નાત્ર તથા આઠે હિવસના સંઘ જમણું બન્ને ગૃહસ્થો તરફથી બહુ આનંધપૂર્વક થયાં. નાની ડંમર હોવા છતાં આપણા ચરિત્રનાયકે શુરુહેવની કૃપાથી બધા ઉત્સવકાર્યો શાંતિપૂર્વક કરાયા અને સંઘને આનંદ આનંદ થઈ રહ્યો. ઉત્સવ બાદ પાછા શુરૂમહારાજની સેવામાં સુરત આવી પહેંચ્યા. વલસાડના ધર્મ ઉધોતના કાર્યોની સક્રાણતા જાહી શુરૂવયે પણ ધન્યવાદ અને પ્રેરણા આપ્યાં.

સં. ૧૬૫૬-૫૭ તું ૮ સું ૮ સું ચાતુર્માસ સુરતમાં  
શુરૂહેવની સાથે ૪ કયું. સં. ૧૬૫૮ તું ૧૦ સું ચાતુર્માસ  
શુરૂહેવની સાથે સુંબધમાં થયું.

આપણા અરિત્રનાયક રાતહિન શુરૂહેવની સેવા સુશ્રૂષામાં જ  
રહેતા. અલ્યાસમાંથી જેવો સમય અચે તે અધો સમય શુરૂ  
હેવની પાસે જ ગાળતા. શુરૂહેવના નાના મોટાં અધાં કાર્યો  
પોતે જ પતાવી લેતા. તેમના આહાર-પાણી તથા આરામની  
પણ તેચ્છા જ વ્યવસ્થા કરતા.

શુરૂહેવની પણ તેમના પર અમીદાદ રહેતી. 'મારો અદ્ધિ  
જેવો અનન્ય સેવક છે, તેવો જ મહાન યોગી થવા સર્જિયેલો છે.





## તीર्थ-यात्राच्या।

( १० )

ગુરુદેવ ! અમારા ગામ રોહિડામાં સુંહર મંહિર તૈયાર થયું છે. તેની પ્રતિક્ષાનું સુધૂતાં મહા શુદ્ધ પ આવે છે. કૃપા કરી આપશ્રી પદ્મારે. તો અમારાં ધન્યભાગ્ય ! ' રોહિડાના શેડ રાયચંદળ મૂથાચે પૂજય મોહનલાલાલ મહારાજશ્રીને વિનાંતિ કરી.

' ભાગ્યવાન ! મારાથી તો જદ્વારી પહેંચી શકાય તેમ નથી. ચાતુર્માસ પણી તખીયત પણું સારી રહેતી નથી. પણું મારા શિષ્ય શ્રી યશોમુનિ તથા શ્રી ઋદ્ધિમુનિને જરૂર મોઝલીશ. તમે ખુશીથી તૈયારી કરો. ' ગુરુમહારાજે સંમતિ આપી.

શુરૂહેવની આજાથી શ્રી યશોભુનિ તથા આપણા ચરિત્રનાયક તથા છ ખીલ મુનિઓએ સુંખદથી વિહાર કર્યો. સુરત-અમદાવાદને રસ્તે શ્રી તારંગા તીર્થી, કુંભારીયા તીર્થી તથા આખુ અચળગઢની યાત્રાએ કરી રોહિડામાં ધામધૂમથી પ્રવેશ કર્યો. રોહિડાના આખાતવૃદ્ધના આનંદનો પાર નહોટો. અકૂઈ-મહેત્સલ થયો. આઠ હિવસ સંધ-જમણ કરવામાં આવ્યા. જા. ૧૯૫૬ ના મહા શુહિ પંચમીના હિવસે શુલ સુહૂર્ટે શ્રી રોહિડાજીના જૈન મંહિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આપણા ચરિત્રનાયક શ્રી ઋદ્ધિસુનિએ શુરૂવર્ય શ્રી યશોભુનિજીની સાથે પ્રતિષ્ઠા કર્યાનો અનુભવ લીધો. શુરૂવર્યને શ્રી ઋદ્ધિસુનિના અલ્યાસ, તપશ્ચર્યા, સેવાભાવના, વિકાસ અને સૌભયતાથી વિશેષ આનંદ થયો.

રોહિડાથી વિહાર કરી શિરોહિ લુદ્ધાની નાણુા-નાંદીમા વગેરે પંચતીર્થીની યાત્રા કરી. આડોલી, પિંડવાડા, અંબલી, એડા થઈ ખીલપુરમાં શ્રી રાતા મહાવીરની યાત્રા કરી સેવાડી, લુદ્ધાના અને સાહી થઈ એનમૂત કળામય ભંય રાણુકપુરજી તીર્થની યાત્રા કરવા પદ્ધાયો. શ્રી રાણુકપુરના ૧૪૪૪ સ્તાંભ-વાળા અતૌકિક મંહિર તથા કોરણી જેઠ જેઠને પૂર્વપુરણે, આચાર્યપુરંગવો અને હાનવીરોની જ્વલંત ધર્મભાવના માટે મરતક નમી પડ્યું. ધન્ય કળા, ધન્ય તીર્થ, ધન્ય હાનવીરતાના શરૂહો નીકળી પડ્યા.

અહીંથી વિહાર કરી લાણુપુરા, સાયરા, ઢોલ અને મોટા જામ થઈ ઉદ્ઘયપુર પદ્ધાયો. ઉદ્ઘયપુરના જૈન મંહિરોના દર્શાન કરી સુમસિદ્ધ તીર્થ કેશરીયાજી આવ્યા. મહા પ્રભાવક કેશરીયા

દાદાની યાત્રા કરતાં આનંદ થયો. કેશરીયાજુને લૈનો જ માને છે તેમ નથી પણ જૈનેતરે. પણ માને છે અને બીજા-કોઈની ગણુંતી જાતિ પણ કેશરીયાખાબાને ખૂબ ખૂબ માને છે.

ઉદ્ઘાસુર થઈ ધાણેરાવની નાળ ઉતરી ધાણેરાવ, હેસુરી, નાડલાઈ, નાડોલ તથા વરકાણું પાચ્ચનાથની યાત્રા કરી રાણી-ગામ, ખીમેલ, ખુડાલા, શિવગંજ, પોસાલીયા, પાલડી થઈને જાવાલ પધાર્યા. મંહિરાના હર્ષનં કરી પાછા શિવગંજ આવ્યા. અહીં ગુરુદેવ શ્રી મોહનલાલજી મહારાજશ્રીને પત્ર આપ્યો કે ‘નેધ્યપુર જવાની આવશ્યકતા હેવાથી નેધ્યપુર તરફ વિહાર કરી ત્યાં ચાતુર્માસ કરશો.’ ગુરુદેવની આજા મળતાં શિવગંજથી વિહાર કરી શ્રી યશોમુનિલું તથા શ્રી ઋદ્ધિમુનિ, શ્રી પ્રતાપ-મુનિ, શ્રી મુક્તિમુનિ, શ્રી છગનમુનિ, શ્રી સિદ્ધિમુનિ આહિ નેધ્યપુર પધાર્યા. સં. ૧૬૫૮ તું અન્યારમું ચાતુર્માસ આહેરના ઠાકોરની હવેલીમાં કર્યું. નેધ્યપુરના ચોમાસા બાદ સુંખાઈથી ગુરુદેવની આજાથી શ્રી ઋદ્ધિમુનિ, શ્રી છગનમુનિ તથા શ્રી સિદ્ધિમુનિ સુંખાઈ તરફ વિહાર કરી ગયા. સં. ૧૬૬૦ તું ૧૨ સું ચાતુર્માસ ગુરુદેવની સેવામાં સુંખાઈ થયું. ચાતુર્માસ પછી આપણા ચરિત્રનાયકની ભાવના શ્રી અંતરીક્ષજી પાચ્ચનાથની યાત્રા માટે હેવાથી ગુરુદેવની આજા લઈ સુંખાઈથી વિહાર કરી થાણું, પનવેલ, લાનેલી, તલેગામ, ડલોડા, બાલા-ગામ, ઘોડનાની, અહમદનગર, ઔરંગાખાદ, જલના અને લૂણારમાં ખરોંપહેશ આપતા તથા ઢેવહર્ષનં કરતાં શ્રી અંતરીક્ષજી પાચ્ચનાથની યાત્રાએ સિદ્ધપુર પધાર્યા. કલિકાળમાં મહા પ્રભાવિક, અતૌકિક અને ચમતકારી શ્રી અંતરીક્ષ પાચ્ચનાથના હર્ષનં

કરી આતંક અનુભંગે. પ્રભુની તેજ પ્રલાથી હૃદય નાચી ઉડ્યું.  
જીક્ષિત અને ઉત્ત્સાહપૂર્વક દર્શાનતું પાન કરી બાદાપુર, ખામ-  
ગામ, મલકાપુર, જલગામ, અમલનેર, ધૂલીયા, કોડાબારી,  
દિસરવાડી, નવાપુર, સોનગઢ, વ્યારા, બાળપુરા અને બારડોલી  
વગેરે સ્થળોની યાત્રા કરતાં કરતાં તથા ગામેગામ ધર્મોપદેશ  
આપતાં આપતાં સુરત શહેરમાં પદ્ધાર્યો.





પ્રવીણ

## વચન-સિદ્ધિ

( ૧૧ )

‘ ભથ્યેણુ વંદામિ ! સાહેબ સુખશાતામાં ! ’ સુરતના શેઠશ્રી નગીનચંદ્રભાઈએ વંદણા કરી.

‘ ધર્મલાલ ! લાગ્યશાળી ’ તમે ખન્ને હાનવીરાએ શુરૂદેવના નામનો આ ઉપાશ્રય જહેર રસ્તા પર બહુજ સુંદર અને વિશાળ રાજમહેલ જેવો ખનાવરાવી સુકૃત લક્ષ્મીનો સાચો જ્ઞાનપ્રદીપાણ કર્યો છે. શ્રી ઋદ્ધિમુનિલુએ ધન્યવાદ આપ્યો.

‘ સાહેબ ! અમે સાંભળ્યું છે કે આપશ્રી વિહાર કરી અંકૃતેખર જવાના છેં. આપ શુરૂદેવ શ્રી મેહનતલાલજી મહારાજના પ્રશિષ્ય અને અમારો આ ઉપાશ્રય સુનો રહે ! સુરતને આપનો લાલ કેમ ન મળો ! ’ શેઠ કર્સુરચંદ્રભાઈએ વિનતિ કરી.

~

‘હયાળુ ! તમે આ ઉપાશ્રયને છોડીને જાઓ. તે કહી ન જને. અમને આપની વાણીને લાભ આપવાનો જ છે.’ શેઠ નગીનચંહભાઈએ પણ આચંહ કર્યો.

‘લાગ્યવાનો ! તમારી વાત તો સારી પણ હું તો હજુ અલ્યાસી છું. વ્યાખ્યાનનો બહુ અનુભવ પણ નહિ. તમારા સુરતમાં આચાર્ય મહારાજે શોલે. અંક્લેશ્વરના લાઈઓની ઘણું વખતથી વિનંતિ છે તેથી ત્યાં જવા લાવના છે.’

‘સાહેબ ! તમે અલ્યાસી છો તો અહીં સારા પંડિતની જોગવાઈ થઈ જશો. આપના વ્યાખ્યાન અમે સાંભળ્યા છે. આપ તો ચોતાને અલ્યાસી માનો છો પણ ગુરુદેવની કૃપાથી અહીં આનંદ આનંદ થશો. ગુરુદેવની આજા પણ અમે મંગાવી છે. અમે ડાઈપણું ઉપાયે આપને અહીંથી વિહાર કરવા હેવાના નથી.’ અન્નેએ કાવપૂર્વક આચંહ કર્યો.

મુનિ શ્રી ઋદ્ધિમુનિલુ સુરત આબ્યા અને શેઠ શ્રી નગીનચંહ કુપુરચંહ જવેરી તથા શેઠ કસ્તુરચંહ કુલ્યાણુચંહ જવેરીએ ગોપીપુરામાં ભાવ્ય રાજમહેલ જેવો. શ્રી મોહનલાલજી જૈન ઉપાશ્રય અંધાર્યો હતો. તે અન્નેએ શ્રી ઋદ્ધિમુનિને વિનંતિ કરી અને અંક્લેશ્વર જતા રોકીને સુરતમાં ચાતુર્માસ કરવા માટે ગુરુદેવની આજા મંગાવી. એ અરસામાં શ્રી ચતુરસુનિલુ ત્યાં આવી પહોંચ્યા. ગુરુ આજા પણ આવી ગઈ. તેથી સં. ૧૯૬૧-૧૯૬૨ ના (તેરમું તથા ચૌદમું) ચાતુર્માસ શ્રી સુરતમાં આનંદપૂર્વક થયાં. અહીં પંડિતની સારી જોગવાઈ હોવાથી અલ્યાસમાં પણ સારો વિકાસ થયો. પણું પણું પર્વમાં પણું

તપશ્ચયો-વરદોડા, સ્વાની એલી સ્વામીવાત્સલ્ય બહુ આનંદપૂર્વક થયાં.

‘ભાઈ! આ આમેરેન બંધ કરાવો. આવાં ગાયનો આપણે ત્યાં ન શોલે. આ તો મંહિર અને પ્રતિષ્ઠાનો મંડપ ગણ્યાય.’ શ્રી કદ્ધિમુનિએ શ્રૂંગારીક ગાયનો મંડપમાં ન વગાડવા સૂચના કરી.

‘સાહેબ! મારું તો કેછ માનતું નથી. મેં તો ધણું કહું કે બહાર લંઘ જઈને વગાડો. પણ માલીક ના પાડે છે અને સાથે કેટલાક જીવાનો પણ મળ્યા છે.’ ચેતા ભાઈએ ચોતાની લાચારી બતાવી.

મહારાજશ્રીને તો મંહિરલુના મંડપમાં લોકો અશ્વલીલ ગાયનો સાંભળવા ટોળે મળ્યા તેથી હુંખ થયું. વળી પ્રતિષ્ઠાના મંડપમાં તો વગાડી શકાય નહિ. ધર્મની હંસી થાય તે તો અસહી ગણ્યાય. મહારાજશ્રી સમસરી ગયા, તેમણે મૌન ધારણ કરી જે કરવાનું હતું તે કરી લીધું અને ચોતે ત્યાંથી ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. એક ગાયન પૂરું થયું અને થીલ રેકડ ચડાવી-ચાવી હીધી, થીન બદ્લાવી પણ આમેરેન ચાલે જ નહિ. જરા બગડી ગયું હશે એમ ધારી જોલીને કરી ચાવી હીધી પણ તે તો બંધ જે-બંધાને નવાઈ લાગી. હજુ તો હમણું જ ચાલું હતું અને આ શું થયું! વાળનો માલીક જણી ગયો કે આ બાબાલુએ કાંઈક જાહુ કર્યો—થીજું તો ઢીક પણ જોદું પડી જાય તો તો લારે નુકશાન થાય. હવે શું કરવું? બંધા લોકો પણ આ જનાનથી ચકિત થઈ ગયા. વાળવાળો દીનવહને મહારાજશ્રી પાસે ગયો ને પ્રાર્થના કરી.

‘મહારાજશ્રી મારા પર કૃપા કરો. હું તો મજૂર માણસ છે. પૈસા મળે તો ગુલરો ચાલે. આ વાળું પણ ભીજનું છે. મને માર્ગ કરો. મારી ભૂલ થઈ. આપ તો દ્વારું છો. ’

‘લાઇ! આ ધર્મસ્થાનમાં આવા એકસ ગાયનો ગવાય તેમાં આશાતના થાય અને અમારી હાંસી થાય, હવે તમે વાળું લઈ જાઓ. મંડપની બહાર ચાલુ કરો તો વાગથે પણ સારાં બોધવાળાં ગાયનો વગાડશો. તો જ ચાલશો.’ મહારાજશ્રીએ માર્ગ ફરીંદ્યો.

ચેલો વાળવાળો. તો તુરત વાળું લઈને મંડપની બહાર ગયો. ચાણી દીધી અને સારી રેકડ ચડાવી. તુરત જ ચામોકેન ચાલ્યું. લોકો તો ચકિત થઈ ગયા. મહારાજશ્રીના આ ચમત્કારની વાતો તો જામ આખામાં ફેલાઇ ગઈ.

સં. ૧૬૬૧ ના ચાતુર્ભાસ બાહુભારીના સંઘની આથહલરી વિનિતિ આવી. બુહારીના ફેરાસરની પ્રતિષ્ઠા હતી. આપણા ચરિત્રનાયક તથા શ્રી ચાતુર્ભુનિલુ બુહારી પધાર્યો. આઠ દિવસ અઙ્ગુધિમહેત્સુપ થયો. શાન્તિસ્નાત્ર થયું. આઠે દિવસ સંઘ જમણ થયાં. આનંદ આનંદ થઈ રહ્યો. અહીં પ્રતિષ્ઠાના દિવસેમાં આ નાનકડો ચમત્કાર થયો. આપણા ચરિત્રનાયકના ઉજવળ ચારિત્ર અને શેષાદ્ધિનો પ્રથમ પરિચય હતો.

સં. ૧૬૬૨ ના માગશર શુદ્ધ પ.ના મંગળ સુઝુતે બુહારીમાં શ્રી વાસુપૂર્ણ સ્વામીની પ્રતિષ્ઠા કરાવવામાં આવી. જૈન ધર્મની સારી પ્રલાવના થઈ. પ્રતિષ્ઠા ‘પ્રસંગના ફરેક કાર્યો નિર્વિદ્ધને સંપૂર્ણ’ થયાં.

આપણા ચરિત્રનાયકને વાળના પ્રસંગથી સુરત જીવ્યામાં અમતકારી મહારાજ તરીકે ઓળખના લાગ્યા. જૈનેતરેભાં પણ તેમની સારી પ્રસિદ્ધિ થઈ.

યુહારીથી વિહાર કરી સુરત પધાર્યા, શુરૂદેવ શ્રી મોહન-લાલજી મહારાજશ્રીએ સુંબદીથી સુરત તરફ વિહાર કર્યો. સુનિશ્ચી ઋદ્ધિમુનિ દહ્યાણુ સુધી સામા ગયા. મહારાજશ્રી સુરત પધાર્યા. સુરતમાં શુરૂદેવની તળીયત વધારે ભગડી. આપણા ચરિત્રનાયકે હિનરાત શુરૂદેવની અવિરત સેવા કરી. શુરૂદેવ સં. ૧૯૬૬ ના ચૈત્ર વહી ૧૨ ના રોજ અરિહંત-અરિહંતનો જાપ જ્યોતા શાંતિપૂર્વક સ્વર્ગે સીધાવ્યા. સુરતનો સંધ ગમણીન થઈ ગયો. હજારો ખી પુરુષો શુરૂમહારાજના દર્શાને ઉમરી આંદોલાંયા. શુરૂદેવની ભાંય સમશાન યાત્રા નીકળી.

શ્રી કાન્તિમુનિ, શ્રી કલ્યાણમુનિ તથા શ્રી ઋદ્ધિમુનિએ શ્રી સંધને શાંતિસ્તોત્ર સંભળાંયું. શુરૂદેવનો પ્રભાવ, વચનસિદ્ધિ, સર્વગર્ભ સમાનતા, શાંતસ્વભાવ, કલ્યાણ લાવના વગેરે યાં કરીને કૌચે શ્રદ્ધાંજલિ આપી.

શુરૂવયાંના સ્વર્ગવાસ પછી કઠોરના સંધના આગહુથી શ્રી કાન્તિમુનિ, શ્રી કલ્યાણમુનિ તથા શ્રી ઋદ્ધિમુનિ કઠોર પધાર્યા. સં. ૧૯૬૬ તું પંદરસુ ચાતુર્માસ કઠોરમાં થયું, અહીં શુજાત-મારવાડ સાથમાં પરસ્પર ક્લેશ ચાલતો હતો. તે ઘણી સમબળવટથી આપણા ચરિત્રનાયકે ફૂર કરાંયો. સંધમાં આનંદ આનંદ ઇલાઈ રહ્યો. આ એકસંપીની ઝુશાલીમાં સાયણુવાળા શેઠ પાનાચંદ નગીનહાસલાઈએ સંધ જમણુ કર્યું. શ્રી સંધે મનિહરના ચોકમાં આરસનો નકશીહાર ગોખલો કરાંયો અને

મહા પ્રભાવક શુદ્ધવર્ય શ્રી મોહનલાલજી મહારાજની ચરણ-  
પાદુકાની સ્થાપના કરી.

કઠોરના ભારવાડી સંઘે નૂતન જીનાવય તૈયાર કરાયું  
હતું. પણ પેસા ધરી પડવાથી કામ અટકયું હતું. ભારવાડી  
સમાજના આગેવાન શ્રી જ્યયચંડભાઈએ આપણું ચરિત્રનાયકને  
વિનિતિ કરી કે આપે અમારો કુચંખ મીટાયો. હવે આ  
અમારા મંહિર માટે કૃપા કરી કંઈ કરાવી આપો. મહારાજ  
શ્રીએ સાર્થક સુધૂર્ત કાઢી આપી બહાર જવા કહ્યું. અને  
(રૂ. ૧૦૦૦) ટીપમાં ન ભરાય ત્યાંસુધી કઠોરમાં પગ ન મૂકવો.  
તેમ પ્રતિજ્ઞા કરવા સૂચના કરી.

શ્રી જ્યયચંડભાઈ તથા શ્રી લીમાળએ શુદ્ધમહારાજની  
આજ્ઞા શિરોધાર્યે કરીને બહારગામ ગયા અને સૌના આંદ્રેં  
વચ્ચે એજ અઠવાડિયામાં (રૂ. ૧૦૦૦) વહિને પાછા આવ્યા.  
શ્રી ખંદ તથા બધા આ વચ્ચનસ્કિદ્ધ નેહિને ચકિત થયા.





## પાંચ પ્રતિષ્ઠા-મહેત્ત્સવો

( ૧૨ )

‘ સાહેબ ! આપશીની કૃપાદિથી પૈસા તો મળી ગયા અને મળી. રહેશે પણ અમારે પ્રતિષ્ઠા ઉત્સવ કરવો છે. તો પ્રતિમાળ માટે સારામાં સાડું સુહૃત્તું કાઢી આપો ’ એ આગેવાનોએ પ્રાર્થના કરી.

‘ પ્રતિમાળ માટે તો આજનું સુહૃત્તું બહુજ સુંહર છે. કારણુંકે આજે શાન્તિસ્નાત્ર અને સંઘ જમણું છે. તો તેનો લાભ લઈને આજેજ તમે પ્રતિમાળ માટે રવાના થાઓ તો પ્રભાવશાલી પ્રતિમાળ મળશે. ’ મહારાજશ્રીએ તો તાત્કાલિક સુહૃત્તું આપ્યું.

મહારાજશ્રીના વચનમાં વિશ્વાસ ડોવાથી ખીજું બધું કામ છોડીને તેજ હિવસે સંઘના આગેવાનો પ્રતિમાળ માટે રવાના થયા.

મારવાડમાં આવેલા ચોસીના તીર્થમા પાંચ જૈન મંહિરો છે. ત્યાંથી સંપ્રતિરાજના વખતના શ્રી શાંતિનાથભગવાન આહિની પ્રાચીન પ્રતિમાળાએ લઈને સંઘના ભાઈએ કઠોર આંદોલનથી પહોંચ્યા. રાજ્યમાન્ય નગરશેઠ શ્રી મોહનલાલ લક્ષ્મીયંદ દસ્તા-

હીઆના બંગલામાં પ્રતિમાળને પદ્ધરાવવામાં આવ્યા. આવા પ્રભાવિક પ્રાચીન પ્રતિમાળના હર્ષન માટે જૈન કેનેતરોના ટોળાં ઉમટી પડ્યાં. પ્રતિમાળ મનોહર અને ચમત્કારી હતાં. આવા મોટા પ્રતિમાળ કેમ ઉપડશે તેમ બધા વિચારતા હતા પણ પ્રતિમાળને ઉડાવતાં હળવા લાગ્યા અને સહેલાધથી ઉપડ્યા આથી લોડોને પ્રતિમાળ તરફ વિશેષ આડર્ખુ થયું.

સ' ૧૯૬૪ ના માગશર શુદ્ધ ઉના મંગળ સુહુતો પ્રતિષ્ઠા કરવામાં આવી. અહૃતીભેદતસ્વ, શાન્તિસનાત્ર તથા સંધજમણ વગેરે આનંદપૂર્વક થયા. ઉપજ પણ ઘણી સારી થઈ. જ્યારથી આપણું ચરિત્રનાયકે શ્રી શાન્તિનાથ પ્રલુની પ્રતિષ્ઠા કરાવી છે ત્યારથી કડોરના ભારવાડી સમાજની ઉત્તરોત્તર આભાદ્રી થઈ છે. ધર્મભાવના પણ વધી છે અને શાસન પ્રલાવનાના કાર્યો પણ થતાં રહ્યાં છે.

કડોરની પ્રતિષ્ઠા પ્રસંગે વચોવૃદ્ધ પ્રવર્તંક સુનિરાજશ્રી કાન્તિમુનિલુ, ત્યાગમૂર્તિ શ્રી દેવમુનિલુ, ભારવાડના મહેદુ ઉપકારી શ્રી કેશરમુનિલુ, કડોરમાંથી વીશાશ્રીમાળી જાતિમાંથી ભાત્યવયમાં દીક્ષિત થયેતા વિદ્યાવિદાસી શ્રી ક્ષમામુનિલુ આહિ શ્રી મોહનલાલલુ મહારાજના ઘણું શીષ્ય-પ્રશીષ્યો. કડોરમાં પધારેલા હતા. તે બધાએ વિચાર-વિનિમય કરી દદ સંકલ્પ કર્યો કે આપણું સસુદ્ધાયમાં પ'. શ્રી યશોમુનિલુ મહારાજને આચાર્યપદથી વિભૂષિત કરવા. આ માટે બધાએ હર્પુર્વક સંમતિ આપી અને એ સંમતિદર્શક પત્ર વચોવૃદ્ધ શર્દેય પ્રવર્તંક શ્રી કાન્તિમુનિલુને આપવામાં આવ્યો.

‘મથયેણુ વંદામિ !’ કડોરના આગેવાનોએ વંદણું કરી.

‘ધર્મલાભ ! ડેમ ભાગ્યશાળી ! શું કામે આવ્યા છે !’  
આપણા ચરિત્રનાયકે આગેવાનોને ધર્મલાભ આપી આવવાનું  
કારણ પૂછ્યું.

કૃપાળુ ! આપશ્રીએ કઠોરની પ્રતિક્ષાનું કાર્ય ખૂબ આનંદ  
પૂર્વક પૂર્ણ કર્યું. હવે કૃપા કરી અમારે ત્યાં પથાડો. તે  
અમારું પ્રતિક્ષાનું કાર્ય ધણ્ણા વખતથી બાકી છે તે આપશ્રીના  
પ્રભાવથી નિર્બિંદે પૂર્ણ થાય. ’કઠોરના આગેવાન શેઠ મોતી-  
ચંદ્રાંદ જગત્પાથજલાએ વિનતી કરી.

‘ મોતીચંદ્રાંદ ! તમારી વિનતિનો બરાબર છે પણ મેં  
સંભળ્યું છે કે તમારે ત્યાં સંઘમાં ધણ્ણા સમયથી કુસંપ છે.  
તેની શાન્તિ તો પહેલાં કરો પછી પ્રતિક્ષાની વાત કરો;’  
આપણા ચરિત્રનાયકે રૂપણ સંભળાયું.

‘ ગુરૂવર્ય ! આપની વાત તો સાચી છે પણ આપ જેવા  
તપદવી, વચનસિદ્ધ સુનિરતન પથારશો એટલે જરૂર શાંતિ  
થશે અને પ્રતિક્ષા આડિ શાસન પ્રભાવના થશે.’ ધીજા આગેવાન  
શ્રી મોતીચંદ્ર રાજલાએ પ્રાર્થના કરી.

‘ હ્યાણ ! મોતીચંદ્રાંદની વાત સાચી છે. આપશ્રી અમારે  
ત્યાં પગલાં કરશો એટલે કુસંપ તો ચાલ્યો જશે અને અમારું  
સંઘનું કલયાણ થશે. આપ આવવા મારે સંમતિ આપો  
એટલે જ અમે અહીંથી ઉઠવાના છીએ. અમારી વિનતિ સ્વીકારો.’  
શ્રી મોતીચંદ્ર જગત્પાથજલાએ વિશેષ આગ્રહપૂર્વક વિનતી કરી.

‘ જહાસુખમ ! વર્ત્માન જોગ. પણ પં. શ્રી હર્ષસુનિલના  
ઉપરોક્તાથી શેઠ નગીનચંદ કપૂરચંદ જવેરીએ સુરતથી છરીપા-  
ળતો. અધીયાતીર્થનો સંધ કાઢેલો છે. તેઓ અતે પથાર્યા છે.

તો સંધ્ય સાથે શ્રી અગડીયાળુ તીર્થની યાત્રા કરી હું કડોઢ આવું છું. તમે તૈયારી કરો' આપણુ ચરિત્રનાયકે સંમતિ આપી.

શ્રી મોતીચંહ જગત્તાથલુ તથા શ્રી મોતીચંહ રાજલુ મહારાજશ્રીની સંમતિથી હુંબિંત થયા.

શ્રી અગડીયાળુ તીર્થની યાત્રા કરી મહારાજશ્રી મંગરૌળ, તડકેશ્વર અને બહુધાન થઈને કડોઢમાં પદ્માર્થી. કડોઢમાં શ્રી સંધ્યે મહારાજશ્રીતું સાવલીનું સ્વાગત કર્યું. સંધના આખાલ વૃદ્ધમાં આનંદ આનંદ થઈ રહ્યો.

‘ભાગ્યવાનો ! હું વચન ગ્રમાણે યાત્રા કરી કડોઢ આવ્યો છું. તમારા શ્રી સંધનો આનંદ અનેરો છે. આપણે પ્રતિષ્ઠાનું મંગળકારી કાર્ય કરવું છે, પણ આવા મહાન ઉત્સવ માટે તો સંધમાં એકસ્પથી, એકવાક્યતા અને સંગઠન બેધાં, તમે તો જણો છો. કુસ્પથી છિન્નભિન્નતા થઈ છે. અધાના મનને ઉદ્ઘેગ રહે છે. વીતરાગ પરમાત્માનો મહા પાવનકારી મંગળકારી ધર્મ પામી આપણે તો સમતા-શાંતિ અને સમલાવ રાખવો બેધાં. તમે નાના નાના મત લેઢો ભૂલી જાઓ. એક બીજા પ્રત્યે પ્રેમ ભાવના પ્રગટાવો. કુસ્પર્દ્ધી અખિને અમૃતના છાંટણ્ણાથી ખુઝાવો અને સંધમાં શાંતિની લહેર લહેરાવો. આમેમિ સંવલ લુંબા, સંવલ લુંબા ખમંતુ મે. એ સૂત્રને યાદ કરી મૈત્રીભાવ ધારણુ કરો.’

ગુરુવર્યના ઉપદેશની બહુઈ અસર થઈ. સંધના ઘણ્યા ઘણ્યામાં આનંદ ઉભી ઉછળી રહી. ગુરુદેવના વચનામૃતોથી સંધમાં એકસ્પથી થઈ. અધારે ગુરુવર્યને પ્રતિષ્ઠાના કાર્યોરંસ

માટે વિનતિ કરી. કડોઠના વૃદ્ધોને તો આ ઐક્યતાનો અમતકાર લાગ્યો. હર્ષનાથથી ઉપાશ્રય ગુંજુ ઉઠ્યો.

સ'. ૧૯૬૪ ના મહા ભાસમાં મંગળ સુફુરો કડોઠ શહેરમાં શ્રી શાન્તિનાથ લગ્વાનની પ્રતિક્રિયા કરવામાં આવી. અહૃદાઈ મહોત્સવ થયો. સંધજમણુ કરવામાં આવ્યું. સંધમાં ઐક્યતા અને પ્રતિક્રિયા આનંદ આનંદ થઈ રહ્યો.

કડોર અને કડોઠની પ્રતિક્રિયા અને ઐક્યતાની વાતો આસપાસના શહેરોમાં પહેંચી અને આપણું ચરિત્રનાયકની ધર્મભાવના તથા વચનસિદ્ધિની ભૂરિ ભૂરિ પ્રશંસા થવા લાગી.

‘કૃપાનિધિ ! આપે કડોર અને કડોઠમાં તો પ્રતિક્રિયા આદિ કાયો કરી જૈન શાસનની પ્રભાવના કરી પણ અમારા ગામની પ્રતિક્રિયાનું કામ બાકી છે. આપણી પગલાં કરો તો જરૂર પ્રતિક્રિયાનું કાર્ય પાર પડે. કૃપા કરી વ્યારા પદ્ધારો અને અમારી ભાવના પૂર્ણ કરો.’ વ્યારાના સંધના અશ્રેષ્ટરોજે વિનંતિ કરી.

‘ભાગ્યવાનો ! અમાર્દ્દ સાધુનું કામ જ શાસન પ્રભાવનાની કરવાનું છે. જૈન ધર્મના અટકી પડેલાં કાયો અમારે ધર્મોપદેશથી પહેલી તકે કરવાં જોઈએ. હું અહીંનું થોડું ઘણું કાર્ય પૂર્ણ કરાવી વ્યારા આવું છું. તમે તૈયારીમાં રહેશો.’ મહારાજાની જન્મતિ આપી.

આગેવાનો મહારાજાનીની સરળતા તથા શાસન પ્રભાવનાની ધગશથી હર્ષિત થયા. વ્યારા જઈને પ્રતિક્રિયા માટે તૈયારી કરવાની વાત સંધમાં જણ્ણાવી. સંધમાં આનંદ આનંદ છખાઈ રહ્યો.

આપણા ચરિત્રનાથક કડોદથી વિહાર કરી વ્યારા પધાર્યાં.  
સંઘમાં ધણ્યા વખતથી મ્રમાદ અને થેડું મનહુઃખ હતાં તેનું  
પોતાની સુધાવાણીથી સમાધાન કરાયું. આગેવાનો આનંદ-  
પૂર્વક એકથીજાને સાથ આપી પ્રતિષ્ઠાની તૈયારી કરવા લાગ્યા.  
સં. ૧૯૬૪ ના વૈશાખ માસમાં વ્યારામાં આનંદ અને ઉત્સાહ-  
પૂર્વક શ્રી અળુતનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. અહુદી-  
મહેત્સવ, શાન્તિસ્નાત તથા આઠે હિવસના સંઘજમણે થયાં.  
આપણા ચરિત્રનાથેકની પ્રેરણાથી પ્રતિષ્ઠાની ઉપજ પણ ધલ્યી  
સારી થઈ.

હવે સરલોણ બાકી રહી જતું હતું. ત્યાંના આગેવાનો  
પણ મહારાજશ્રીને વિનિતિ કરવા આવ્યા અને આપણા ચરિત્ર-  
નાથક વ્યારાથી વિહાર કરી સરલોણ પધાર્યાં. સરલોણમાં પણ  
અહુદી-મહેત્સવ સંઘજમણું-શાન્તિસ્નાત તથા સં. ૧૯૬૪ ના  
જેઠમાં પ્રતિષ્ઠા મહેત્સવ આનંદપૂર્વક થયાં. સરલોણ જેવા  
નાના આમમાં પણ મહારાજશ્રીના પ્રભાવથી ધર્મ પ્રભાવના  
સારી થઈ. વૃદ્ધપુરુષો તો આવો અનુપમ ઉત્સવ જોઈને પોતાની  
ભતને ધન્ય આનવા લાગ્યા.

આપણા ચરિત્રનાથકને પગલે પગલે ધર્મપ્રભાવનાના  
દીવડા પ્રગટયા.

‘સાહેબ ! મારા પૂજય પિતાશ્રીના શ્રેયાથે’ અહુદી-મહેત્સવ  
કરવા કાવના છે. વળી નવાપુરાના જૈન મંહિના લોંયરામાં શ્રી  
શામળા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા આપના મંગળ ફર્સ્તે કરા-  
વાની અમારી સૌની ઈચ્છા છે તો હવે આપશ્રી સુરત પધારો.’  
સુરતના શેઠ શ્રી હલીચંહ વિરચંહ શોકે વિનાંતિ કરી.


‘ ભાગ્યશાળી ! તમે તો શુદ્ધેવના અનન્ય લક્ષ્ણ છો. તમારે ત્યાં આવ્યા સિવાય કંઈ ચાલશે ! તમે નિશ્ચિંત રહો. અમે થોડા રૈજમાં ત્યાં આવી પહોંચશુ’. ’ આપણા ચરિત્રનાયકે સંમતિ આપી.

મહારાજશ્રી સરલોખણી વિહાર કરી સુરત પદ્ધાર્યો. સુરતમાં આપણીતું સુંદર સામૈયું કરવામાં આવ્યું. શુદ્ધેવ શ્રી મોહન-લાલજી મહારાજશ્રીના પરમ લક્ષ્ણ શ્રી શેઠ હલીયંહલાઈએ તેમના પૂજય પિતાશ્રીના કલ્યાણ અર્થે આડ હિવસનો અફ્ટાઈ-મહોત્સવ કર્યો. સંઘજમણુપૂર્વક શ્રી શામળા પાર્વતીનાથ પ્રભુની પ્રતિષ્ઠા નવાપુરાના જૈન મંદિરના લોંઘરામાં ધામધૂમપૂર્વક કરવામાં આવી. જૈન શાસનનો જ્યાખ્યકાર થઈ રહ્યો.

મહારાજશ્રી જે ઉપાશ્રયમાં ઉત્ત્યા હતા તે લુણું થઈ ગયો હતો. તેથી મહારાજશ્રીએ તે ઉપાશ્રયને સગવડવાયો વિશાળ અનાવવા ઉપદેશ આપ્યો. અને નવાપુરાના શેઠ મગન-ભાઈ હેવચંહની ધર્મપત્ની શ્રીમતી સૂરજભાઈને ઝા. ૧૫૦૦૦) ખર્ચી જહેર રસ્તા ઉપર એ માળનો સુંદર ઉપાશ્રય કરાવ્યો.

મહારાજશ્રી સુરતથી વિહાર કરી રાંદેર થઈ એલયાડ પદ્ધાર્યો. અહીંતું મંદિર પણ લુણું થઈ ગયેલું હેવાથી તેનો પણ લુણોદ્વાર કરાવ્યો. અહીંથી વિહાર કરી મહારાજ શ્રી સુરત પદ્ધાર્યો. સુરત શેઠ હલીયંહ વીશચંહ તથા શેઠ કૃષ્ણાજી જેધાણ વગેરે આગેવાનોના આગ્રહીયી સં. ૧૬૬૪ તું સોળસું ચાતુર્માસ સુરતમાં નવાપુરાના ઉપાશ્રે કર્યું.

પાંચ પાંચ પ્રતિષ્ઠાએ કરાવીને આપા પ્રદેશમાં આપણા ચરિત્રનાયક વિરોધ પ્રસિદ્ધ થયા.



## શ્રીગોદ્ધંન તથા પન્યાસપદવી

( ૧૩ )

રતલામ શહેરથી રાવળાદુર થેઠ ચાંહમલજ કોટાવાળા. શુરૂદેવ પન્યાસલુ મહારાજ શ્રી બશોમુનિલુની પ્રેરણુથી શ્રી માંડવગઢ તીર્થને સંધ કાઢવાના છે તે સમાચાર મળવાથી આપણું અરિત્રનાયકની લાવના સ્થાવર તીર્થરૂપ શ્રી માંડવગઢ અને જંગમ તીર્થસ્વરૂપ શ્રી શુરૂદેવના હર્ષનની થઈ અને ચાતુર્માસ બાદ સુરતથી વિહાર કરી કઠોર, માંગરોળ, જગડીયા, ડ્રોધ, છોટાઉડેપુર, અલીરાજપુર, કુકસી, રાજગઢ, અને ધાર થઈની માંડવગઢ પદ્ધાયા. શુરૂદેવના હર્ષન અને મિત્રનથી અરસપરસ ખૂબ આનંદ થયો. માંડવગઢ તીર્થની બાત્રા કરી આત્મશાંતિ અને ઉલ્લાસ મળ્યાં.

સુરતના પ્રદેશમાં પાંચ પાંચ પ્રતિષ્ઠાનો કરાવી તથા આસપાસના પ્રદેશમાં ધર્મ પ્રભાવના કર્યાના સમાચાર જણ્ણી શુરૂર્થ શ્રી બશોમુનિલુને આપણું અરિત્રનાયક માટે ખૂબ સંતોષ થયો.

માંડવગઠ તીર્થમાં સાર્દ સુહૂતો લેછને શુલ્ગવર્યે પન્યાસલુ મહારાજશ્રી યશોમુનિલુએ શ્રી ઋદ્ધિમુનિ આહિ ૪ સુનિવરેને ઉત્તરાધ્યયન સૂત્રના યોગોક્ષણનો આરંભ કરાયો. માંડવગઠથી વિહાર કરી ઈન્હોર, દેવાસ, મકસીતીર્થ, ચારંગપુર, ખ્યાવરા થઈને ગૃષ્ણા પદ્માર્થ. ત્યાં શ્રી શુમાનમુનિલુ આવી મળ્યા. તેમને પણ યોગોક્ષણમાં પ્રવેશ કરાયો. ગૃષ્ણાથી વિહાર કરી શિવપુરી થઈને જ્વાલીયર, લશકર પદ્માર્થ અને સિંધીયા નરેશના અજનચી શેડ નથમલા શુદ્ધેચ્છાતા આચ-હથી પોતાના શુરૂમહારાજની છત્રછાયામાં આઠ સુનિરાબેના સમુદ્ધાય સાથે શ્રી ઋદ્ધિમુનિલુ મહારાજનું સં. ૧૯૬૫ તું સત્તરમું ચાતુર્માસ જ્વાલીયરમાં થયું. ચાતુર્માસ બાદ પાંચે સાધુએના ૪૫ આગમના યોગોક્ષણ પૂરા થવાથી સંવત ૧૯૬૬ ના માગશર શુદ્ધિ ત ના દિવસે પં. શ્રી યશોમુનિલુએ શ્રી શુમાનમુનિ, શ્રી ઋદ્ધિમુનિ તથા શ્રી કેશરમુનિને પન્યાસપહૃતી તથા શ્રી રત્નમુનિ અને શ્રી બાવમુનિને ગણી પહૃતી ધામધૂમપૂર્ક અર્પણ કરી. આ પ્રસંગે શેડ નથમલા શુદ્ધેચ્છાએ આઠ દિવસનો મહેતસ્વ કર્યો હતો.

પન્યાસ શ્રી ઋદ્ધિમુનિ જ્વાલીયરથી વિહાર કરી મોરેના, ધોળપુર, આચા થઈ જ્યપુર પદ્માર્થ. લક્તાજનોની વિનિતિથી સં. ૧૯૬૬ તું અદારમું ચાતુર્માસ જ્યપુરમાં કર્યું. પન્યાસલુ મહારાજશ્રીએ જ્યપુરમાં ૮૧ આચંબિલની દીર્ઘતપશ્ચયા કરી. સંધના આચાતવૃદ્ધ શુલ્ગવર્ય ઋદ્ધિમુનિલુ મહારાજશ્રીની ત્યાગ અને તપની જ્વલંત ભાવનાથી મુગ્ધ થયા. ૮૧ આચંબિલની તપશ્ચયા કર્યી છતાં પન્યાસલુ મહારાજને ખૂબ શાતા રહી

હતી. હમેંથાં ઉપરેશ આપતા તથા બેને કલાક ધ્યાનમાં એસતા.

પથુંખું પર્ણ પ્રસંગે આગરાથી શેડ તેજકરણું ચાંહમલાં અજમેરથી શેડ હૃતાચંદળું સંચેતી. સુંબધથી શેડ મહીલાલ ઉત્તા-મચંદ જવેરી તથા શ્રી શીવરાજનું જવેરી વગેરે ધણું આંધ્યા હતા. પથુંખુંપર્ણમાં દરેક ધાર્મિક કાર્યો પૂર્ણ ઉત્સાહપૂર્વક થયાં. તપશ્ચયી ધણી સારી થઈ. ઉપજ પણ ધણી સારી થઈ. સંધમાં આનંદ આનંદ થઈ રહ્યો. જૈન શાસનની શોલા વધી. હિગ્રાંબર ભાઈઓનો પંદર દિવસનો ઉત્સવ થયો. પછી શ્વેતાંધર સંધ તવહૃથી પણ પંદર દિવસનો મહોત્સવ થયો. આ પ્રસંગે ચૂરું શહેરથી આપણા ચરિત્રનાયકના યતિપણુના વડીલ શુરૂઆઈ યતિવર્ય શ્રી ઋદ્ધિકરણું પદ્ધાર્યો હતા. બન્ને શુરુભાઈ મિલન હૃદયસપર્શી હતું. યતિવર્ય શ્રી ઋદ્ધિકરણું પોતાના દીર્ઘિતપસ્વી-તેજસ્વી-પ્રભાવક શુરૂઆઈને ઉચ્ચયદ્ધા પામેલા નેઈને ખૂબ હસ્તિત થયાં. પન્યાસળું પોતાના પરમ પ્રેમી યતિવર્ય શ્રી ઋદ્ધિકરણુંનું ભાવલયું સ્વાગત કરાયું.

‘ભાહેણ ! આપતો આપના પ્યારા ચૂરું શહેરને ભૂતી જયા, તમારા વડીલખાંધું સમા શુરૂઆઈને ભૂતી જયા અને તમારા પ્રિય શ્રાવકોને પણ ભૂતી જયા ? હવે કૃપા કરીને તે તરફ પદ્ધારો.’ ચૂરુથી યતિવર્ય સાથે આવેલ ‘એસવાળ ભાઈઓએ વિનતિ કરી.

‘મહાતુભાનો ! હું ચૂરુને કેમ ભૂલું ! ત્યાં તો મેં યતિ-વર્યના રાજ્યમાં આનંદ માણ્યો છે. મારો અભ્યાસકાળ પણ

મેં ત્યાં જાઈયો. ભારત એકીકૃત શુક્રજાહિનો ભારત પ્રત્યેનો પ્રેમ-  
ભાવ તો બૂધ્યો બૂધાતો નથી. મેં તેમની ચાહ કાયમ રાખવા  
માર્દું નામ પણ ઝડિભુનિ રાખ્યું છે. તમારા જેવા પ્રેમી શ્રાવ-  
કેને પણ હું કેમ બૂધું ! શુક્રમહારાજની સેવા તથા અલ્યાસના  
કારણે હું ચૂરુ તરફ આવી શક્યો નથી.' આપણું ચરિત્રનાયકે  
ચૂરુની ચાહ તાળુ કરી.

‘હૃપાળુ ! ગુજરાત-સૌરાષ્ટ્રમાં તો સંવેગી સુનિવરો ગામે-  
ગામ વિચરે છે પણ આપણા સ્થળી પ્રદેશમાં તો ડોઈ આવતાજ  
નથી તેથી તેચાપંથી વગેરે આવી વિશેષ પ્રચાર કરે છે અને  
ઘણા ભાઈઓ ચલિત થતા જાય છે, તો હવે અતેથી સ્થળી  
પ્રદેશમાં પદ્ધારો અને આપની સુધાલરી વાણીનો અમને  
બાબ આપો.’

ચૂરુ શહેર પોતાની જૂતી વિદ્યાભૂમિ હોવાથી તથા ઘણા  
ભાઈઓનો અનન્યપ્રેમ હોવાથી પન્યાસળુ મહારાજે તે તરફ  
વિહાર કર્યો. ચૂરુના સંદે પન્યાસળુ મહારાજનું ભાવભીતું સુંદર  
સ્વાગત કર્યું. પન્યાસળુએ ધર્મઉપહેશ આપીને શ્રાવકેને  
સૈતાંબર મૂર્ત્તિપૂજક સંપ્રદાયમાં દઠ કર્યો. તેરાપંથી સાધુઓ  
આથે શાક્ષાર્થ કરી વિજયી થયા અને શાસનની પ્રભાવના થઈ.





## નાગોરમાં એકયતા

( ૧૪ )

‘સાહેબ ! આપ ધણુા સમયે આ તરફ પદ્ધાયો છે. અમારા શહેરને તો આપના જેવા ત્યાગી-તપસ્તી પુષ્ટાત્માનો લાલ ભળતો જ નથી. આપની મહુર દેશના અમારા હૃદયને પ્રકુલ્પ બનાવે છે. કૃપા કરો અને સ્થિરતા કરો.’ નાગોરના આગેવાનોએ સ્થિરતા માટે વિનિતિ કરી.

‘ભાગ્યશાળીઓ ! તમારા શહેરમાં તો કેમ રહી શકાય. હું જોઈ છું કે તમારામાં કુસંપનું સાઝાજ્ય છે. નાની બાળ-તોમાં મતમતાંતર ચાલે છે. જ્યાં કુસંપ હોય ત્યાં શાંતિ તો હોય જ નહિ. જ્યારે કુસંપથી ઠ્યનહારિક કાચો પણ અટકી પડ્યાં છે તો ધર્મકાચો તો થાય જ કયાંથી ! વરસાન તો વરસે પણ ભૂમિ જ ઉસર હોય ત્યાં શું અસર થાય ! આપણુા જૈન-સમાજનું કમનસીઅ છે કે આપણે આપણુા પોતાના ધરના અગડા ઉપાશ્રય અને મંહિરમાં લાવીએ છીએ. એમાંથી આપણું કોઈનું કહ્યાણ નથી. સંઘનો પણ અસ્કુદય આમાં કયાંથી થાય !

કુસંપવાળા શહેરમાં રહેવા કરતાં સંપત્તિ સુવાસવાળા ગામ-ડામાં રહેલું ધર્મઉદ્ઘોત કરનારું છે' આપણું ચરિત્રનાયકે રૂપણ જણ્ણાવી દીધું.

આ જાહુલરી વાણીની ચમત્કારિક અસર થઈ, બધાના હૃદય કુણું પડ્યાં. આપણે આ રીતે કુસંપથી વ્યવહાર-ધર્મ અધું જોઈ જેસીશું એમ વિચારી સંઘના આગેવાનેા શ્રી શૈઠ સુલતાનમલાલ, શ્રી જૂહારમલાલ, શ્રી ગોપીવાલાલ, શ્રી મીઠનલાલાલ, શ્રી અમોલખચંહાલ, શ્રી ઉહ્યચંહાલ જોથરા, શ્રી સુગનચંહાલ, શ્રી ચુલાલચંહાલ, સમહડીયા, વડીલ સજાનમલાલ, શ્રી મોહનલાલાલ ધર્મરાજાલ, શ્રી છગનમલાલ ચારડીયા, શ્રી અમરચંહાલ લાલચંહાલ, શ્રી હીરાચંહાલ તથા શ્રી ગોપીવાલાલ ખજનચી, શ્રી પનાલાલાલ ચાધરી, શ્રી જવેરીચંહાલ હુગડ તથા શ્રી મીઠનલાલાલ ભષ્ણશાળી વગેરે તમામ આગેવાનેાએ મહારાજશ્રીને નાગોર રોકાઈ જવા ગ્રાર્થના કરી અને આપના સુધા લર્યા પ્રાણુપ્રેરક પ્રવચનોથી શાંતિ થશે જ થશે તેમ ભાત્રી આપી.

આપણું ચરિત્રનાયક લાલ જાણીને થોડા દિવસ વિશેષ રોકાઈ ગયા. પ્રેરણુત્તમક ઉપદેશથી બધાને સમન્બલ્યા. બધાના મનનું ઝુણીથી સમાધાન કર્યું. નાગોરના શ્રીસંધમાં ધર્મ વર્ષોથી ચાલ્યો. આવતો કુસંપ ગયો. અને બધાના મન પ્રકુલ્પ થયાં. સંધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. બધાનેતો આ એક ચમત્કાર લાગ્યો.

આ સંપસમાધાનના આનંદમાં નાગોરમાં મહોત્સવ કરવામાં આંગ્યો. ધર્મ વર્ષે નાગોરમાં સંધતું જમણ થયું. આખાત-

વૃદ્ધ સાથે એસીને આનંદથી જગ્યા, શુરૂહેવના નામનો જયજય-  
કાર થાઈ રહ્યો, શાસનપ્રભાવના થાઈ. સુધાલાર્યી ઉપહેશતું આલું  
મધુરે ક્રૂળ જોઈને આસપાસના પ્રદેશમાં પણ આપણા ચરિત્ર.  
નાયકની થણોગાથા ગુંજુ છી.

નાગોરથી વિહાર કરી મેડતાદ્વોધી જઈ શ્રી પાર્શ્વનાથ  
અમૃતાનની યાત્રા કરી મહારાજશ્રી પાણા નાગોર પદ્માર્થી.  
ચોમાસા માટે નાગોરના સંઘે ખૂબ ભાવપૂર્વક વિનતિ કરી. પણ  
પાસેના કુચેરા ગામના લાઈઓ. વિનતિ કરવા આગ્યા, તેણેએ  
શુરૂમહારાજને પ્રાર્થના કરી કે આપે નાગોરમાં તો વર્ષોને  
કુસંખ શાંત કરી ચેતનાર કર્યો. અમારા કુચેરામાં આગ્યે જ  
સુનિરાજ પદ્મારે છે. નાગોરે ખૂબ સારો લાલ લીધો. હવે  
આપ અમારા કુચેરાને આપની અમૃતવાળીથી પાવન કરો.  
સ્થાનકવાસીના સાધુઓના આ તરફના વિહારથી ઘણ્ણાખરા  
સ્થાનકવાસી થવા લાગ્યા છે.

આપણા ચરિત્રનાયકે લાલલાલનો વિચાર કરી કુચેરાની  
વિનતિનો સ્વીકાર કરી નાગોરથી વિહાર કર્યો.

જેઠ મહિનાની સખત ગરમી, રેતાળ પ્રદેશ, રસ્તો વિકટ,  
આસપાસના ગામો હર હર, પાણી પણ ન મળે તો ગોચરીની  
તો વાત જ શી ! આપણા ચરિત્રનાયકને ઉચ્ચ ગરમીના કારણે  
તાપ આવી જયો. મૂંડવામા સ્થાનકવાસી થઈ જયેલા ધરો  
હોવાથી ઉત્તરવાની જગ્યા ન મળી, બીજે ઓસવાળોમાં તપાસ  
કરી પણ ગરમ પાણી ન મળ્યું.

આપણા ચરિત્રનાયકે આગળ વિહાર ચાલુ રાખ્યો. માર્ગમાં

આસવાળેની કુળહેવીનું મહિર આવે છે. ત્યાં ગયા પણ તે ગામમાં આસવાળનું એક પણ ધર હતું નહિ. કુચેરા પણ માઈલ દૂર હતું. મારવાડની ભૂમિ, લૂતો ચાલુ જ હતી. ગરમી કહે મારું કામ અને રેતીના ઠગ ઓળંગવાના. આપણું ચરિત્રનાયકને ખ્યાસ વિશેષ લાગી. પાસેના ટ્રાડના છાંયડે આરામ લેવા એસી ગયા. પણ ખ્યાસથી ગળું સુકવા લાગ્યું. મહારાજાનીને સુછી આવી ગઈ. બીજા સાધુ તેમને હવા કરવા લાગ્યા. હવે શું થાય! પન્થાસળું મહારાજે વીર ધંટાકરણને યાદ કર્યો અને તુરત જ ડાંટવાળા તે જ મારો નીકળ્યા. જૈનસાધુની આવી દશા જોઈને ડાંટવાળાએ તાખડતોણ કુચેરા જઈને ત્યાંના શ્રાવકોને વાત કરી. શ્રાવકો પણ તુરત જ પાણી વગેરે લઈને જઈ હોડી આવ્યા. મહારાજાનીને પાણી વહોરાંયું. પાણીથી ખૂબ શાંતિ થઈ. બધા અહુ પરતાવા માંડયાં. આપણે જ ભૂલ્યા, આપણો પ્રદેશ ઉજજડ, ગરમી એસુમાર, પાણી પણ મળે નહિ. સાથે એ-પાંચ જણાએ રહેલું જોઈતું હતું. આપણું પ્રદેશમાં સાધુ સુનિરાજે આવા કણ્ણેને લીધે નથી વિચરતા. પન્થાસળું મહારાજની પોતાની ભૂલ બહલ મારી માગી. પન્થાસળએ તો કણ્ણું કે એ તો સાધુમાર્ગની કસોટી છે.

થોડા સમય આરામ લઈ પન્થાસળ મહારાજે ત્યાંથી વિહાર કર્યો. કુચેરામાં આવી પહેંચયાં. ડાંટવાળાની વાતોથી કુચેરાના નાના-મોટા બધા ચિંતા કરતા હતા અને શુરૂમહારાજની કુશળતાની વાટ જોઈ રહ્યા હતા. શુરૂમહારાજને આવતા જોઈ બધાને હર્ષ થયો. બધા સામે ગયા. જૈનશાસનનો જયજ્યકાર ખોલાંયો. શુરૂમહારાજે બધાને માંગલિક ખંબળાંયું.



## ઉપકારોની પરંપરા

( ૧૫ )

‘કુપાસિંહુ ! આ સાલ વરસાઠ નહિ થાય તો અમારું તો ડીક પણ પશુ-પણભીઓનું, ગરીબ ખેડૂતોનું અને સામાન્ય વર્ગનું શું થશે !, કુચેરાના ભાઈઓએ ચિંતા વશોવી.

‘સાહેબ ! અન્ય દર્શાનીએ વરસાઠને લાવવા માટે લેરવળુના મંહિરમાં યજા-હોમ આહિ કરે છે. પણ વરસાઠ તો હેખાતો જ નથી !’ બીજા ગૃહસ્થે વાત કરી.

‘હ્યાણ ! ઢાકોરળુને શહેર અહાર તળાવ પર લઈ ગયા પણ પાણીનું બિંદુ પણ ન પડયું.’ બીજા ગૃહસ્થે પણ શહેર આખાની ચિંતા રણુ કરી.

‘તમારી વાત તો વિચારવા જેવી છે. વરસાઠ ન થાય તો તો મુશ્કેલીનો પાર ન રહે. પણ વરસાઠ તો થવો જેઠાંને. આપણે પરમ હિવસે શુભ મુહૂર્તે રથયાત્રાનો વરઘોડા ગોઠવો. તેજ હિવસે સ્નાત્રપૂજા જાણવો. હું તો વીર ધંટાકરણુનો જાપ કરું છું. વીર ધંટાકરણ તો હાજરા હજૂર છે. વરસાઠ આંદોલા જ કમનો.’ આપણા અરિત્રનાયકે ખૂબ સાંત્વન આપ્યું.

મહારાજશ્રીની બચનસિદ્ધિમાં બધાને વિશ્વાસ હતો. બધાને ખૂબ સંતોષ થયો. કુચેરાના શ્રી સંબે સ્નાત્ર બણ્યાની. રથયાત્રાને વરદોડા ખૂબ ઉત્સાહપૂર્વક કાઢી આપ્યા ગામમાં ફેરંયો. જ્યાં વરદોડા પાછો આંયો કે તુરત જ્યાં રેતીના ગોટે ગોટ હડી રદ્ધા હતા ત્યાં મૂશળધાર વરસાહ વરસ્યો, પાણીની રેલમહેલ થઈ રહી, તળાવોમાં પાણી ભરાયાં. કુચેરાના તમામ લોકોમાં આનંદ આનંદ થઈ રહ્યો. લોકો તો કહેવા લાગ્યા કે જૈનોના બગવાન હાજરાહંજૂર છે. આ મહાત્માએ તો અમતકાર કર્યો. વરસાહની આશા જ નહોંતી અને મૂશળધાર વરસાહ થવાથી લોકોને શાંતિ થઈ.

કુચેરામાં પન્યાસળુ મહારાજે એક પછી એક અનેક ઉપકારી કર્યો તે ચિરસ્તમરણીય રહેશે. કુચેરામાં ડ૦ ઘરો સ્થાનક્વાસી થઈ જયા હતા તે બધાને ઉપહેઠ આપી મૂર્તિપૂજઃ ધનાંયા અને ધર્મમાં દ્રદ ધનાંયા.


કુચેરામાં ઓચવાળોમાં એક રિવાજ એવો હતો કે જારા માઠા કેાઇપણુ પ્રસંગે જમણુવાર થાય તે રાત્રે જ થતો. જમણુ કરનારને તો રાત્રિના બંગે વાગ્યા સુધી હેરાન થવું પડતું. મહારાજશ્રીએ આ વિષે વારંવાર વ્યાખ્યાનમાં ટકેાર કરી. રાત્રિલોજનથી થતા ગેરલાલો જણ્યાંયા. તેમજ જૈનધર્મ પાળનારા આપણુથી કેાઇ પણ પ્રસંગે રાત્રે જમણુવાર રાખી જ ન શકાય. તેનાથી કેટલા હોષ લાગે? આ વાત બધાના હૃદયમાં ઉતરી અને તે હિવસથી જમણુવાર રાત્રિના રાખવાનું બંધ કરવામાં આંયું.

એક રિવાજ એવો પણ હતો કે કોઈના તરફથી સ્વામી-સત્ત્વાન્યથાય પણ તેમાં સ્વીએને જમવાતું નહિ. કેવળ પુરુષોને જ સ્વામીસત્ત્વમાં જમવાનો રિવાજ. આપણા ચરિત્રનાથકે આ વિષે પણ વ્યાખ્યાનોમાં ખૂબ ઉપદેશ આપ્યો. આવો રિવાજ તો કોઈ દેશમાં નથી. પુરુષોને જમવાનો અધિકાર અને સ્વીએને ડેમ નહિ! સાચું સ્વામીસત્ત્વથી તો એજ કે જેમાં સ્વી-પુરુષો, ખાળહો-આળિકાચો બધાં આતંકપૂર્વક જમે અને સાચી આશીશ આપે. આ ઉપદેશની પણ અસર થઈ અને સંધજમણમાં સ્વી-પુરુષો બધાને જમવાતું શરૂ કરાયું.

ઉપકારની પરંપરા ચાલી. આપણા ચરિત્રનાથકે એક ઉપકાર એ પણ કર્યો કે સ્થાનકવાસી સાધુઓના પરિચય અને ઉપદેશથી કેટલીએ બહેનો માસિક ધર્મ પાળતી નહોંતી. આ સાંભળને આપણા ચરિત્રનાથકને તો બહુ જ એવ થયો. તેમણે તો આ વિષે વ્યાખ્યાનમાં સ્થાનાંગસૂત્રનો તથા ફથાશુત સ્કંધનો પાઠ સંલગ્ની દર્શા પ્રકારની અશુદ્ધિ રાખવા માટે સમજાયું તેમજ માસિક ધર્મ તો આરોગ્ય દ્વારા, શુદ્ધિની દ્વારા, મંહિરો-ઉપાશ્રોત્તરી પવિત્રતાની દ્વારા, વ્યવહાર દ્વારા અત્યંત જરૂરી છે તે તો અવશ્ય પાળવો. જ નોંધાયે, તે નહિ પાળનાર ધર્મનો. કષ્ણો પણ જાણુતું નથી તેમ કષ્ણી શકાય. આ ઉપદેશની પણ ભારે અસર થઈ અને માસિકધર્મ પાળવાના બહેનોએ નિયમ લીધા.

પાંચમે સર્વશ્રેષ્ઠ ઉપકાર તો એ કર્યો કે લુંધાલિશમાં શ્રી શનુંજ્યતીર્થની યાત્રા નહોંતી કરી એવા ઢોઢોસો ભાઈ-બહેનોને તીર્થઘિરાજ શ્રી શનુંજ્યતીર્થનો અહિમા, આહીખરહાહા.

અને મહિદેલા નગર સમા મહા ચમત્કારી તીર્થની યાત્રા કરવા મહારાજશ્રીએ પ્રેરણા કરી અને કાતંકી પૂર્ણીમાએ શુરૂદેવના અષટ્ઠીંશી કુચેરાનો સંઘ યાત્રા કરવા સિદ્ધક્ષેત્ર પાલીતાણા આવ્યો. સંઘ શાનુંજય, ગિરનાર, લોયણી, અમહાવાઢ, તારંગા, આણુની યાત્રા આનંદપૂર્વક કરીને પાછા આવ્યો. પન્યાસળુ મહારાજશ્રીને તો અત્યંત આભાર માનવા લાગ્યા. પન્યાસશ્રીને પણ સૌ આનંદપૂર્વક યાત્રા કરી આવ્યા તેથી વિશેષ હથી થયો. કેટલાંક ગૃહસ્થોએ તો યાત્રાની ખુશાલીમાં સંબન્ધ જમણ્યો. કયો. મન્દિરમાં ઠાકમાઠી પૂજા લખુલ્લી, પ્રભાવનાઓ કરી, આંગારી રચાવી, ગરખાઓ જવરાંયા તથા જાત જાતના વાસણોની વહાણી કરી. કુચેરામાં પન્યાસળુ મહારાજના પ્રભાવથી જૈન શાસનનો ખૂબ ઉધોત થયો.



## નવાણુયાત્રા અને તપક્ષીયો

(૧૬)

‘મથ્યેણું વંદામિ !’ જયપુરના શેઠ હીરાચંદળ ટાંકે વંદણું કરી.

‘ધર્મલાભ !’ પન્યાસણાએ ધર્મલાભ આપ્યો.

‘ગુરૂદેવ ! મારી બાવના જયપુરમાં નવપદનું ઉદ્ઘાપન-ઉજવણું કરતું છે. આચય કૃપા કરી જયપુર પધારો’ શેઠ હીરાચંદળ ટાંકે આગ્રહપૂર્વક વિનતિ કરી.

પન્યાસણ કુચેરાથી ખજવાના થઈ કરી મેડતા કલોધીની બાગાએ આંદ્યા હતા. ત્યાં શેઠ હીરાચંદળ ટાંકની પ્રાથી નાથી મેડતા થઈ રીથાં, પુષ્કરરાજ, અજમેર અને કિસનગઢ થઈ જયપુર પધાર્યાં. શેઠ હીરાચંદળાએ ખૂબ ઉત્સાહ અને ઢાઠમાઠથી મહોત્સવ તથા નવપદાલુનું ઉજવણું કર્યું. જયપુરથી વિહાર કરી અજમેર, ઝાવર, સોજત, પાલી, શુંદોચ, ધીનેવા,

વરધાણા, નાંડોલ તथા નાંડવાઠની યાત્રા કરી મહારાજશ્રી દેસુરી પધાર્યાં. દેસુરીમાં ચારે બાઈઓને દીક્ષા દેવાના ભાવ થવાથી ચારે બહેનોને આનંદપૂર્વક દીક્ષા આપી. તેઓને સાધીશ્રી ઉત્તમશ્રીલુની શિષ્યા જાહેર કરી.

દેસુરીથી વિહાર કરી ઘાણેરાવ, ખાડી તથા રાણુકપુર તીર્થની યાત્રા કરી. ખાડી, શીરગંજ, શિરોહી થઈ આખુ તથા અચલગઢની યાત્રા કરી. પાલણુપુર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, એડા, માતર, સોલુત્રા, ખંભાત, જમસુર, આમોદ, ભર્યા, અંકલેશ્વર, થઈને મહારાજશ્રી સુરત પધાર્યાં. સુરત થોડા દિવસ સ્થિરતા કરી નવસારી, બીવીમારા, વલસાડ, અગવાડા, વાપી, ઘોલવડ, હણાણુ, પાલગઢ અગાસી, હોરીવલી, મલાડ, અંધેરી, માહિમ, હાદર, લાયખદા થઈને સુંખાઈ શ્રી લાલભાગ જૈન ઉપાશ્રય પધાર્યાં.

પન્થાસળ મહારાજ મારવાડ-ગુજરાતના હણદેંડ માઈ-કોનો વિહાર કરી ગામેગામ જૈન શાસનની પ્રલાવનાના કાર્યો કરતા કરતા સુંખાઈ પધાર્યાં. સુંખાઈના લક્ષ્ટાજનોની સંખ્યા વધવા લાગી. સં. ૧૯૬૮ અને સં. ૧૯૬૯ નું વીસ તથા એકીસસું ચાતુર્માસ સુંખાઈમાં આનંદપૂર્વક કર્યું.

તીર્થધિરાજ શનુંજ્યની દદ યાત્રાની ઘણું સમયથી ભાવના હતી. સિદ્ધાચળ શુરૂવર્યની દીક્ષા ભૂમિ હતી. શનુંજ્યનો સંદેશ તેમના હૂદ્યમાં હતો. સુંખાઈથી વિહાર કરી પન્થાસળ મહારાજ સુરત, ભર્યા, ખંભાત, ઘોલેરા, વળા થઈ પાલીતાણું પધાર્યાં. બાખુ પનાલાલલુની ધર્મશાળામાં ત્યાગમુર્તિં શ્રી હેન્સુની-લુની સાથે રહ્યા. અહીં સન્મિત્ર શ્રી કર્પુરાવવિજલુ મહારાજનો

પરિચય થયો. સનિમત્ર કર્પુરવિજયલુ આપણું ચરિત્રનાયકની ત્યાગભાવના, તપશ્ચર્યા તથા ચોગદાનિ જોઈની ખૂબ હવિંત થયા.

આપણું ચરિત્રનાયક. પન્યાસલુ ઝડ્પિસુનિએ ક્રાગણ્ય સુધી ૧ થી બગાતાર ૮૧ આચંભિકની દીધે તપશ્ચર્યા કરતાં કરતાં નવાણું યાત્રા પૂર્ણ કરી અને એવા નિયમપૂર્વક કે ધર્મશાળાથી નીકળ્યા બાદ ઓછામાં ઓછી એક યાત્રા કરીને ૫૦ ખાઢી નવકારવાળી જણ્યા પછી જ ધર્મશાળામાં પ્રવેશ કરવો.

નવાણું યાત્રા ઉથ તપશ્ચર્યાપૂર્વક પૂર્ણ કરી. સ. ૧૬૭૦ તું આવીસસું ચાતુર્માસ શ્રી સિદ્ધકોત્રમાં આનંદપૂર્વક કર્યો.

ચાતુર્માસ બાદ ચૈત્રી પુનમ સુધી સ્થિરતા કરી. વિશેષ યાત્રા કરતા રહ્યા. ત્યારણાં વિહાર કરી વળા, ઘોલેરા, આમદી-ભીપલી થઈ તડકેશ્વરનો આરો ઉતરી પન્યાસલુ મહારાજ ખંભાત પધાર્યો. ખંભાત શેડ અંભાલાવ પાનાચંહની ધર્મશાળામાં સ્થિરતા કરી. ખંભાતના શ્રી સંઘનો અક્ષિતભાવ હોવાથી સ. ૧૬૭૧ તું તેવીસસું ચાતુર્માસ શ્રી દેનસુનિ સાથે ખંભાતમાં કર્યો. અહીં આપણું ચરિત્રનાયકે પાઠશાળા તથા હુન્દરશાળા માટે ઉપહેશ આપ્યો. અને શ્રી મોહનલાલલુ જૈન પાઠશાળા તથા હુન્દરશાળા સ્થાપન કરવામાં આવી. આનો લાલ ખાળડે, બાળાચો અને હેરાંચો સારી રીતે લેવા લાગ્યા. ચાતુર્માસમાં સુંભાઈથી બાળુ રતનલાલલુ ચુન્નિલાલલુ મહારાજશ્રીને વંહન કરવા આવ્યા હતા. તેમણે પન્યાસલુના ઉપહેશથી રૂ. ૩૦૦૦) ઉપરોક્તા પાઠશાળામાં આપ્યા.

ચાતુર્માસ બાદ પન્યાસલુ મહારાજશ્રીએ વિહાર કર્યો.

ખંભાતની પૂજની ટોળીના બાઇઓ મહારાજશ્રીની સાથે આવ્યા. ખંભાતની આ પૂજની ટોળી મશાડૂર ગણ્યાતી તેમાં ખંભાતના નગરશૈઠ વેળ્ણીલાઈ દીપચંહ, માસ્તર દીપચંહ પાનાચંહ, ખંભાત સૈટના નાજર શૈઠ બડેરદાસ, શ્રી હવપતલાઈ નગીનિદાસ ફોટાવણા, શ્રી લોણીલાલ મગનલાલ નાણ્યાવટી, શ્રી ગાંડાલાઈ રતનચંહ, શ્રી રતનલાલ રણુષોડદાસ, શ્રી મણીલાલ લુલચંહ, શ્રી સાકરચંહ રાયચંહ અને પોરવાળની જાતિના શૈઠ શ્રી લોણીલાલભાઈ હતા. આ ઉપરાંત ૧૫૦ બાઇઓ પણ સાથે હતા. પન્યાસળુ મહારાજનો સાયમાનો ટોળી સાથેનો પ્રવેશ જેવા જેવો હતા. સાયમામાં પૂજની ટોળીએ મનોહર રીતે પૂજા લણ્ણાવી, હેર શુંઘ્યો, ડાંડીયારાસ દીધા અને નાના ગામમાં આનંહ ઉત્સવ કર્યો. સાયમાના બાઇઓએ અક્ષિતપૂર્વક બધાને જમાડયા. સાયમાંથી પન્યાસળુ મહારાજ ટોળી સાથે જણુસન ગયા. ત્યાં પણ સાયમાની માર્ક આનંહ ઉત્સવ પૂર્વ જમણુ થયાં. ધર્મજ પણ એ રીતે પ્રવેશ-પૂજા-ડાંડીયા-હેર શુંઘ્યો તથા જમણુ થયાં. મહારાજશ્રીના વ્યાખ્યાનોનો લાલ ખૂબ લેવાયો. ધર્મજથી ખંભાતની ટોળી મહારાજશ્રીના આશી-વોદ મેળવી ખંભાત ગઈ. આપણા ચરિત્રનાથક પેટલાં, જરૂર-સર, અરૂચ, સાયણુ થઈને સુરત પધાર્યો. સં. ૧૯૭૨ તું ચૌનીસમું ચાતુર્મોસ સુરતમાં શ્રી મોહનલાલનુ જૈન ઉપાશ્રયમાં આનંહપૂર્વક પૂર્ણ કર્યો.

ચાતુર્મોસ પૂર્ણ થયા પછી નવાપુરામાં શૈઠ મગનલાઈ દેવચંહ તરફથી તૈયાર થયેલા નવીન ઉપાશ્રયમાં શૈઠ હેવચંહ. બાઇની સુપુત્રી શ્રીમતી નેમકુંવર તરફથી ઉપધાન ફરાવ્યાં.

ઉપધાન સમાપ્ત થતાં અદ્દીએ મહોત્સવ, વરધાડો, સંઘજમણ  
વગેરે શાસનોનીતિના કાચો થયાં.

સુરતથી વિહાર કરી પન્નાસળ મહારાજ સુરત જુદ્ધાના  
ગામેનાં વિહાર કરતા કરતા હાહાણું તથા પાલગઢ થઈને  
સુંબદ્ધ પદ્ધાયો. શ્રી વાલભાગના જૈન ઉપાક્રમાં સં. ૧૬૭૩ નું  
પદ્ધાયીસમું ચાતુર્માસ પૂર્ણ કર્યું.

આસો માસમાં શેઠ બાધુભાઈ કલ્યાણચંદ જવેરી તથા  
શેઠ ભગવાનદાસ હીરાચંદ જવેરી તરફથી ઉપધાન વહન કરાયા.  
તથા વાલભાગમાં મહોત્સવ કરવામાં આવ્યો. જુહા જુહા પરામાં  
થાડો સમય સ્થિરતા કરી વાલકેશ્વર થઈને પાછા વાલભાગમાં  
પદ્ધાયી અને સં. ૧૬૭૪ નું છંનીસમું ચાતુર્માસ પણ સુંબદ્ધમાં કર્યું.

‘કાહેબ ! આપ તો તીર્થોધિરાજ શ્રી શનુંજ્યની નવાણું  
ચાત્રા દીધે તપક્ષયી સહિત કરી આયા. અમારો ધર્મા ભાવ  
હતો પણ તે સમયે કુદુંબ સહિત આવી શકાય તેમ નહોતું.  
હવે તો શું થાય !’ શુરૂબક્તા શેઠ ભગવાનદાસ હીરાચંદ જવે-  
રીએ ભાવના દર્શાવી.

‘ભાગ્યથાળી ! તીર્થોધિરાજ શનુંજ્ય જગતના તીર્થ-  
ધામેનાં અદૌકિક અમતકારી તીર્થ છે. તે યુગયુગથી આત્મ-  
શુદ્ધ, આત્મશાંતિ અને આત્મકલ્યાણને હિંય સંહેશ આપી  
રહ્યું છે. મને તે તીર્થભૂમિમાં જે પરમશાંતિ મળી છે તે કયાંથે  
મળે તેમ નથી. તમાસ ભાવ હોય તો જરૂર નવાણું ચાત્રા  
કરો. તમારે ગૃહસ્થીને તો સરળતા છે. આજે એડા ને ડાલે  
સિદ્ધચિરિમાં’ પન્નાસળ મહારાજે ભાવનાની મુણિ કરી.

‘કૃપાળુ ! આપશ્ચીના ઉપહેશામૃતથી કુદુંબ સહિત નવાલ્પાત્રાની ભાવના જાગી છે પણ આપશ્ચીની નિશ્ચામાં ૬૬ યાત્રા થાય તો તો અમારું પરમ કલ્યાણ થઈ જાય. એ કામના કેમ પૂરી થાય ? કયાં સુંબદ્ધ અને કયાં સિદ્ધક્ષેત્ર !’ શ્રી ભગવાના જેવેરીએ પોતાની ઈચ્છા ફરીઓ.

‘ભગવાનભાઈ ! વાત તો અરી. તમારે ગૃહસ્થીને તો બીજે દિવસે પહેંચાય પણ અમારે તો સમય લાગે. પણ તમારા કુદુંબની ભાવના હોય અને મારી જરૂર જણ્ણાતી હોય તો આવો હું પણ પાલીતાણું તરફ વિહાર કરું. તમે સુખેથી યાત્રાથે આવો અને તીર્થયાત્રાનો લાભ લઈએ. મને પણ ક્રી ક્રી હાહાની યાત્રાનો લાભ મળશે.’ પન્યાસળુએ પોતાની ભાવના પ્રગટ કરી.

ભગવાનભાઈ તો ખુશખુશ થઈ ગયા. મુંબદ્ધ-મોહમ્મદીમાંથી ગૃહસ્થીને નીકળાય નહિ. કાંઈને કાંઈ કામ-આવરણ આંયાજ કરે, વળી આવા ચારિત્રયાત્ર-દીર્ઘ તપસ્વી પન્યાસળ મહારાજ કૃપાદિષ્ટી પધારે તો તો બેડાપાર થઈ જાય. તેમણે પન્યાસળ પાસે તીર્થયાત્રા માટે પ્રતિજ્ઞા લીધી. પન્યાસળ ક્રી મુંબદ્ધથી વિહાર કરી વલસાડ, સુરત, અરૂચ, કાવી, અંભાત, ધોલેરા, વળા થઈને પાલીતાણું પધાયો. દરમ્યાન શેઠ ભગવાનહાસ જેવેરી પોતાના આખા કુદુંબને લઈને પાલીતાણું આવી ગયા હતા.

પન્યાસળ મહારાજની સાનિધ્યમાં આનંદ ઉત્સાહ અને આવપૂર્વક આખા કુદુંબએ શ્રી સિદ્ધગિરિની વિધિપૂર્વક નવાલ્પાત્રા યાત્રા પૂર્ણ કરી.

અગવાનદાસ પૈતાને આળી અમેલી તક અણાય માટે  
ભાગ્યશાળી માનવા લાગ્યા, શુરૂમહારાજની અસીમ હૃદા જોઈને  
અગવાનદાસ તો હિંબ થઈ ગયા.

ધન્યાલલુ ખલીતાણુમાં રહ્યા ત્યાં સુધી એકાંતરે ઉપવાસ  
અને પારણુમાં આયંબિલ એવી ઉચ્ચ તપશ્ચયો પૂર્વિકની યાત્રાનો  
સંસ્કુન વાસ લીધો.

ધન્ય તપશ્ચયો ! ધન્ય ત્યાગ !

ધન્ય યાત્રા ! ધન્ય તપસ્વી !





सेवामूर्ति पूज्यपाद  
मुनिश्री गुलाबमुनिल महाराज

मूण पाटीद्वार (गट) स्थानकवासी दीक्षा १८५७  
संवेगी दीक्षा श्री सिद्धगिरिमां सं. १८७५ वै. शु. ६





## સેવામૂર્તિ શિષ્યની પ્રાપ્તિ

( ૧૭ )

‘સાહેબ ! અમે આપની તપશ્ચિર્યા, શાંત પ્રકૃતિ, ત્યાગ-  
ક્રિયા તથા સૌભ્યતાથી આકર્ષણીને આપની પાસે રહેવાના  
ભાગી આવ્યા છીએ’ એ ગ્રંથ દીક્ષાર્થીઓએ પ્રાર્થના કરી.

‘ભાગ્યશાળીઓ ! શુ’ તમારી ભાવના દીક્ષા લેવાની છે !’  
આપણું ચરિત્રનાથકે પ્રશ્ન કર્યો.

‘કૃપા ! અમે તો એ નિર્ણય કરીને જ આવ્યા છીએ.  
આપ જેવા પરમ ત્યાગી ગુરૂવર્યની સેવા કર્યાંથી !’

‘જુઓ ! હું તો પરમપરૈપકારી, મહાપ્રભાવિક શ્રી મોહન-  
લાલજી મહારાજનો શિષ્ય છું. તપશ્ચિર્યા, તીર્થયાત્રાઓ,  
અમાનુશ્રામ વિહાર, ગુરુસેવા અને જૈનસમાજનું કલ્યાણ એ  
માર્દ ધ્યેય છે. આ સંવેગી દીક્ષા તો આંડાના ઐત છે. નોઈ  
વિચારીને-નિર્ણય કરજો.’

‘ સાહેબ ! અમારો મફ્ફલ નિધોર છે. અમે આપની સેવામાં જ રહેવાના છીએ. હવે અહીંથી પાછા જવાના નથી જ. ’ બન્ને દીક્ષાર્થીએ મફ્ફલતા દર્શાવી.

‘ ભાગ્યવાનો ! હું તમારી મનોકામના સમજયો છું. તમારી ભાવના ઉંચી છે. હું તમને જરૂર દીક્ષા આપીશ; પણ તમને હરકત ન હોય તો તમારો પૂર્વ કાર્યાલાય તો જણાવો. ’ પન્થાસળું શ્રી અદ્વિતીયને જ્ઞાસા દર્શાવી.

‘ સાહેબ ! અમારા પૂર્વજીવનની કથા લાંખી છે. અમે માર-વાડના સ્થાનકવાસી સંપ્રદાયના પૂજય શ્રી જયમલલાના સમુદ્ધાયના સુનિ શ્રી સૂર્યમલલાના શિષ્ય-પ્રશિષ્ય છીએ. સં. ૧૬૬૦ માં શુદ્ધસંવેગી ધર્મ અંગીકાર કરવા ભાવના જગ્યા. તીર્થયાત્રા કરતા કરતાં મારવાડથી આયુલની યાત્રા કરી પાલણુંપુર, લોયણી, સોનગઢ થઈને અહીં પાલીતાણુંમાં આવ્યા હતા. પણ સ્થાનકવાસી સાધુ એટલે કોઈ ધર્મશાળામાં જગ્યા ન મળી. એક ભાવસારની ફકાન હતી. તેણે અમને ઉતારાની વ્યવરસ્થા કરી આપી. તીર્થધિરાજની ભાવથી પાંચ યાત્રા કરી. આ વખતે સંવેગીપણ્યાની દીક્ષા લેવાની ઈચ્છા હતી, પણ કોઈ ઉદાર શાંત સુનિરાજ મળ્યા નહિ. પાલીતાણુંથી પછેગામ થઈ ખરવાળા ગયા. ત્યાં સ્થાનકવાસી વેષતું પરિવર્તન કર્યું અને મંહિરમાર્ગનો વેષ ધારણ કર્યો. શ્રી માહનલાલલા માહારાજ-શ્રીના સમુદ્ધાયના શ્રી પ્રભજસુનિલની પાસે ગ્રણ મહિના રહી સાધુની ફરેક કિયા શીખી લીધી. પછી સંવેગીપણ્યાની દીક્ષા લેવાની તો હતી, પણ હુદ્ધરના તીર્થોની યાત્રાની ભાવના થતાથી તુરતમાં સંવેગી દીક્ષા ન લીધી, અને પાદવિહાર



ગુરૂવાચ શ્રી ઇપમુનિલુ મહારાજ  
રથાનકવાસી દીક્ષા ૧૯૩૬  
સિદ્ધાચલ યાત્રા કરીને સર્વેગ પક્ષમાં ૧૯૬૧  
સ્વર્ગવાસ ૧૯૭૪



રેલ વિદ્ધાર કરી શ્રી સમેતશિખર, પાલાપુરી, રાજગૃહી, અંપા-  
પુરી, અલુમગંજ, ડલકટા વગેરેની યાત્રા કરી. ચાતુર્માસમાં  
જુહાજુહા શહેરમાં જઈને સ્થિરતા કરતા. સં. ૧૬૬૦ માં ઐરાળુ,  
૧૬૬૧ માં પાલથુપુર, ૧૬૬૨ માં શિરોધી, ૧૬૬૩ માં અલુ-  
મગંજ, ૧૬૬૪ માં માલેગામ, ૧૬૬૫ માં સાહી, ૧૬૬૬માં  
આડી, ૧૬૬૭ માં મેડાતા, ૧૬૬૮ માં કુચેરા, ૧૬૬૯ માં  
પાચેરા અને ૧૬૭૦ થી ૭૪ માં નાગોરમાં ચાતુર્માસ કર્યો.  
નાગોરમાં આમારામાના શ્રી ઇપચંદળ સં. ૧૬૭૪ ના શાવણુ  
શુહિ ૧૪ તું પાકિક પ્રતિકમણ કરી બૃહત્શાંતિ સાંભળતાં  
સાંભળતાં સમાધિપૂર્વક નાગોરમાં સ્વર્ગવાસ પામ્યા. અમે એ  
રહ્યા. છેને ગિરિજાજ શત્રુંભ્રણી યાત્રાની ભાવનાથી વિદ્ધાર  
કરી મેડના, સોજત, નાંડાલ, વરકાણા, શીવગંજ, પીંડવાડા,  
પાલનપુર, મેસાણા, અમદાવાદ, ધોળકા, ધ'ધુકા, વળા થઈને  
પાદીતાણા આવ્યા. અહીં આપશ્રીની પ્રસિદ્ધ સાંભળી આનંદ  
થયો. વળી આપશ્રી પૂજય મોહનલાલલ મહારાજશ્રીના પ્રશિષ્ય  
છો તેથી તો અત્યંત આનંદ થયો. હવે કૃપા કરી અમને  
તારો, આપના શિષ્યો બનાવો.' અન્ને દીક્ષાર્થીઓએ પોતાની  
પૂર્વકથા કહી સાંભળાવી.

'જહાસુખમ ! તમે સુખેથી અતે અમારી સાથે જ રહો.  
વૈશાખ શુહિ ૬ ના રોજ તમને દીક્ષા આપીશું.' આપણું  
ચરિત્રનાયકે વચન આપ્યું. અન્નેના હૃદય આનંદ ઉર્મિથી ઉભરાઈ  
આવ્યા. શુરૂવર્યના ચરણમાં પ્રણિપાત કરી, આનંદપૂર્વક રહેવા  
લાગ્યા. દીક્ષાના સુહૂતંની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા.  
તીર્થયાત્રાએ ફરી પોતાની જતને વિશેષ નિર્મણ બનાવવા લાગ્યા.

સ'. ૧૯૭૫ ના વૈશાખ સુદ ૬ ના મંગળ હિવસે બન્ને  
મારવાડી સુનિઓને પન્થાસળ મહારાજાઓએ દીક્ષા આપી.  
શ્રી શુલાખયંહળુને પોતાના શિષ્ય તરીકે બાહેર કરી શ્રી  
શુલાખમુનિ નામ સ્થાપન કર્યું. શ્રી જિરધારીલાલલુને શ્રી  
શુલાખમુનિના શિષ્ય તરીકે બાહેર કરી શ્રી જિરવિરમુનિ નામ  
સ્થાપન કર્યું, શ્રી શુલાખમુનિલું તે સેવામૂર્તિં બની ગયા.  
ગુરૂવર્યાના અનન્ય પરમ પ્રિય ભક્ત અને શિષ્ય તરીકે  
આચાર્યપ્રેર શ્રીમહુ જીનજાહિસ્કરીશ્વરલુના પ્રત્યેક શાસન  
ઉધોતના અને ધર્મપ્રકાવનાના કાર્યમાં જોડાનોડ રહ્યા. આચા-  
ર્યશ્રીની ઉચ્ચ તપક્ષિયો તથા માંદળીમાં પણ ગુરૂહેવની છાયા  
તરીકે પાસેને પાસે જ રહ્યાં. ગુરૂહેવના સ્વર્ગવાસ સમયે ગુરૂ-  
હેવ પરમ શાંતિપૂર્વક મહામૂહા આશીર્વાહ આપ્યા. આજે  
શાંતમૂર્તિં શ્રી શુલાખમુનિલું ગુરૂહેવને પગલે પગલે ગુરૂહેવનો  
સંદેશ જનતામાં પહોંચાડી રહ્યા છે. ગુરૂહેવના જીવનને ઉજવળ  
કરી રહ્યા છે.





## શ્રી મોહનલાલજી જૈન-જ્ઞાનમંહિર

[ ૧૮ ]

શ્રી ભરતરગચ્છ નલોમણિ, સુંબદી તથા સુરતના જૈન સમાજના મહદુદુ ઉપકારી, પરમ યોગી, વચ્ચનસિદ્ધિવાળા, પરમ પૂજ્ય શ્રી મોહનલાલજી મહારાજ ખાં ૧૯૬૩ માં સુરતમાં બિરાજતા હતા. તેમના પોતાના ધણા શાખના પુસ્તકો તથા જૈનધર્મ, જૈન ઈતિહાસ, જૈન કથા, જૈન સાહિત્ય, જૈન તત્ત્વ-જ્ઞાન, આગમ સાહિત્ય વગેરે હન્દારો અંથરતનો જુહી જુહી જગ્યાએ હતા. આવા અંથરતનોનો સંથડ એકજ જગ્યાએ હોય તો સાંધુ-સાધ્વી, જૈન વિદ્ધાનો તેનો વિશેષ લાભ લઈ શકે તેવો વિચાર મહારાજશ્રીને સર્કૂચો. તેમણે સુરતની આસ-પાસ જ્ઞાતિના અભેસર શેઠ નગીનયંદ કપુરથંડ જવેરીને ખોલાંયા અને ઉપરેશ આપ્યો.

‘આજ્યશાળી! પૂર્વપુષ્યના ઉદ્ઘે તમે હામ-હામ અને હામ ઉપરાંત વીતરાગ ધર્મ અને અદ્વિતીય અજ્ઞાના રૂપ શાંતા પાખ્યા છો. શાંતોની સંભાળ તો ફરેક જેને રાખવી

ઘટે. તે તો કહ્યતરું સમાન છે. તમને ધર્મની જીવી લાગણી છે. આપણા ખજના જેવાં અખુમોક રતનો વિભરાયેલાં જ્યાં ત્યાં પડયાં છે. લક્ષ્મીના સ્વામી તો અન્યા છે. પણ તે લક્ષ્મીને પટારામાં પૂરી રાખવા કે તેજૂરીએમાં ગોંધી રાખવા માટે તો નથી મળી ને? તે લક્ષ્મીનો જ્ઞાનપદ્યોગ કરેા. તેને વાવો અને તો જ તેમાંથી મિશ્ર ઇણો પામશો. મારી પોતાની પાસે હણરૈ અંથરતનો છે. જે તમે એક સુંદર શાનદાર અનાવો તો મારાં બધાં પુસ્તકો તેમાં આપી હઉં. વળી જીલાં જડુરી સાહિત્ય-તત્ત્વ-જ્ઞાનના અંથે પણ લાવવામાં આવશે. આવા અંથરતનોના સંગ્રહથી એક ભંધ જ્ઞાનદાર થશે. તમારી લક્ષ્મીને જ્ઞાન પ્રભાવનામાં ઉપયોગ થશે.’

શ્રી નગીનિદાસભાઈ તો સરળ પરિધ્યામી, અનન્ય શુરૂભક્તા તથા જ્ઞાનપ્રકાવનામાં પુષ્ટયોહ્ય માનવાવાળા હતા. તેમણે શુરૂ-મહારાજના ઉપદેશ વચનામૃતો જીવી લીધાં અને જ્ઞાનદાર માટે ચોતે નિર્ણય કર્યો.

‘કૃપાનિધાન! આપકી આપનાં પુસ્તકો જ્ઞાનદારને આપો છો તો હું પુસ્તકોની રક્ષા થઈ શકે તેવું પત્થરતું ભંધ માણ અંધાવીશ. આપકીના નામથી જ જ્ઞાનદાર થશે અને હરેક માણુસ તે જ્ઞાનદારનો લાલ લઈ શકે તેવી વ્યવસ્થા શ્રી સુરતનો સંધ કરશે’ શેઠ નગીનિયંહ કપૂરચંહે પન્યાસળુને વચન આપ્યું. મહારાજશ્રીએ પોતાનો હસ્તલિખીત તથા સુદ્રિત પુસ્તકોનો મોટો સંઘર્ષ શ્રી સુરત સંઘને અર્પણ કર્યો.

પણ ભાગ્ય ચોગે મહારાજશ્રી તો ત્યારપણી થાડા જ જમયમાં ઝૂરતમાં સ્વર્ગે સીધાંબ્યા. શ્રી શેઠ નગીનિયંહ કપૂરચંહે

ઉપાશ્રયની સમીપમાં બંધુ મહાન બંધાંયું અને શ્રી મોહન-  
લાલજી જૈન જ્ઞાનભંડાર બંધેર કર્યો.

બંડારની સ્થાપના તો થઈ ગઈ, પરંતુ તેના નિભાવ માટે  
તથા સુંધરસ્થા માટે કોઈપણ જતતું ઇંડ નહોતું. અંધવ-  
સ્થાને લીધે કેટલાંક હસ્તલિખીત મુસ્તકો ચોરાઈ પણ ગયાં.  
તેથી શ્રી નગીનદાસ કરુચંદ જવેરીના સરળ સ્વભાવી સુપુત્ર  
શ્રી રકીરચંદ નગીનચંદ જવેરીએ તે વખતે મારવાડમાં વિચ-  
રતા પન્યાસશ્રી હર્ષસુનિલુને બંડારની સુંધરસ્થા માટે સુરત  
પધારવા વિનાંતિ કરી. શુરૂઆતિમાં સાવધાન વિદ્યાપ્રેમી પન્યા-  
સણ શ્રી હર્ષસુનિલ ધણે લાંબો વિહાર કરીને પરમપૂજય  
શુરૂવર્યના જ્ઞાનભંડારની સુંધરસ્થા કરાવવા સુરત પધાર્યો.  
પન્યાસણુનો સુરતનો પ્રવેશ સમરણીય હતો. શ્રી મોહન-  
લાલજી જૈન જ્ઞાન બંડારના કાર્યવાહકોને શક્તા એડી કે પન્યા-  
સણ મહારાજની પ્રેરણુથી બંડારની વ્યવસ્થા સુંદર થશે.  
પણ કાળની ગતિ વિચિત્ર છે. માણુસ ધારે છે શું અને થાથ  
છે શું ! ન જણે જાનકી નાથ ! પ્રભાતે કિં લાવિષ્યતિ ' પન્યા-  
સણએ પ્રવેશ કર્યો તે જ હિવસે તેઓ એકાએક બિમાર થઈ ગયા.  
શ્રીસંધને ભારે ચિંતા થઈ પડી. માંદગીએ જોતજોતમાં બયંકરૂપ  
પકડયું. શ્રીસંધના આગેવાનોએ પ્રસિદ્ધ પ્રસિદ્ધ વૈદ્ય-ડાક્ટરેને  
લાવીને અનેક ઉપયારો કર્યા પણ 'તૂટીની ભૂટી નહિ' તેમ ચાર  
જ હિવસમાં પન્યાસણુનો સ્વર્ગવાસ થઈ ગયો. સૂરતના આખાત-  
વૃદ્ધ ભારે ગમગીત બની ગયા. જૈનધર્મની ઉત્તુતિના અનેક કાર્યો  
થવાની ધારણા નિષ્ઠળ ગઈ.

આ વખતે આપણું અરિત્ર નાયક પન્યાસણ મહારાજ શ્રી

કદ્દિસુનિલુ ખંભાતમાં હતા. ખધા આગેવાનેની દષ્ટિ તેમના તરફ ગઈ. તેઓ પરમપૂજય શુરૂવર્યના અનંત્ય લક્ષ્મા-તપસ્વી-ત્યાગી અને વચનસિદ્ધ ગણ્યાતા હતા. સુરતથી શેડ ક્રીરચંહ જીવેરીએ પોતાના સુનિમ શ્રી કુરુરચંહ સાકરચંહને ખંભાત મોકલ્યા. જાનસંડારની અન્યવસ્થાની વાત સાંભળી પન્યાસળુને હુંઘ થયું. હાદા શુરૂના જાનસંડારની સુન્યવસ્થા કરવી એ મારી પ્રથમ દૂરજ છે તેમ સમજુ પન્યાસળુએ ખંભાતથી વિહાર કર્યો.

પેટલાહમાં શેડ છગનભાઈનો અફુઠમહેતુલ્લખ હતો. તે માટે શેડ છગનભાઈની વિનતિથી પેટલાહમાં સ્થિરતા કરી અને શાંતિસ્નાત-મહેતુલ્લખ તથા સંધ જમણુ વગેરેની સ્થમાપિત ખાદ બોરસહ, પાહરા અને લાદ્ય થઈને સુરત પખાયો, સુરતમાં નવસારીવાળા શેડ અમરચંહલાઈએ વિનતિ કરી કે નવસારીમાં અમારા કુદુંબની એક બહેનને નવપહલુનું ઉજવાણું કરવાનું છે. આપ કૃપા કરી પખારો. તેમની વિનતિને સ્વીકારીને પન્યાસળ મહારાજ આદિ હાણું ૪ નવસારી પખાયો. નવસારીમાં પન્યાસળનું લાવલાયું સ્વાગત કર્યું. નવપહલુનું તથા જાનપંચમીનું ઉજવાણું, જળનગાનો વરદોડો, શાન્તિસ્નાત, સંધ જમણુ આદિ ધાર્મિક ઉત્સવ પન્યાસળ મહારાજની છન્નાચાચામાં આનંદપૂર્વક સમાપ્ત થયો. નવસારીમાં આ ઉત્સવ પ્રસંગે વલસાડથી શેડ ગાંડાભાઈ પ્રાગળ, જીવદ્યા મંડળના પ્રણેતા શેડ લલ્લુલાઈ શુલાખચંહ જીવેરી તથા શેડ મગનભાઈ સુળાચંહ, સુંબધથી શેડ દ્વીરીરચંહ કેશરીરચંહ, સુરતથી શેડ સુરચંહલાઈ બહામી જજ વગેરે બહારગામના આગેવાન બુહુસ્થો નવસારી આંધ્યા હતા.

આ ભડોતસવ પૂરો થયા પછી વક્ષાડની વિનિતિથી પન્યાસજુ વક્ષાડ પદ્ધાર્યો. અહી શેઠ નાથાલાલ ખૂખ્યંહ કોડારી તરફથી નવીન અંધાવેલ આલીશાન ઉપાશ્રય પાંચ દિવસને ઉત્સવ કરીને પન્યાસજુ શ્રી ઋદ્ધિમુનિજીના શુભ હસ્તે ખુલ્લો મુકાંધ્યો. વક્ષાડથી વિહાર કરી પન્યાસજુ પાછા સુરત પદ્ધાર્યો. સં. ૧૯૭૭ તું ઓગણુત્તીશમું ચાતુર્માસ ગોપીપુરામાં શ્રી મોહનલાલજુ જૈન ઉપાશ્રયમાં કર્યું.

‘મધ્યેણ વંદામિ !’ શેઠ ચુનિલાલ શુલ્કાખ્યંહ દાલીયાએ વંદણા કરી.

‘ધર્મલાલ ! હું તમને જ યાદ કરતો હતો. તમે તો પરમપૂજ્ય શુરૂહેવ શ્રી મોહનલાલજુ મહારાજના અનન્ય લક્ષ્ય છો. તમારે એક કામ કરવાનું છે, ’પન્યાસજુએ દાલીયાળને સૂચના કરી.

‘સાહેબ ! આજા ઝરમાવો. મારાથી શક્ય હશે તે જરૂર કરીશ.’

‘તમે તો લાગ્યશાળી છો. સરકારી જગતખાતાના ઇં (૧૧૦૦) ના માસિક પગારના ઉચ્ચય અધિકારી પરથી નિવૃત્ત થયા છો. તમારા જેવા સેવાભાવી શ્રદ્ધાળું આગેવાને તો સમાજને ઢારવણી આપ્યું સમાજનું કલ્યાણ કરવું જોઈએ. અમારા દાહા શરૂના નામનો આ આલીશાન જ્ઞાન બંડાર કેવો સુંદર છે ! તેના અંથરતનો અનુપમ છે. તે આપણો સાચો વારસો અને ઉત્તમ અજનો છે. તેની અંબ્યવસ્થા જોઈ મને પણ હુઃઅ થયું. તમારા જેવા એ પાંચ ભાઈઓ મન પર વધે તો સૂરતમાં તે જ્ઞાનની ગંગા વહેવડાવી ધેરધેર અને આખાલવૃદ્ધમાં જ્ઞાનના

હીવડા પ્રગટાવી શકે. મારો તો તમને અતુરોધ છે કે તમે આ કાર્યની જવાખારી હ્યો તો જરૂર આ જ્ઞાનકંડારનો ઉદ્ઘાર થશે જ થશે.' આપણું ચરિત્રનાયકે હાલીયાળુંને પ્રેરણું આપી.

'હ્યાણુ ! આપની વાત તો તદ્દન સાચી છે. પણ નિભાવ ઇંડ વિના આપણે શું કરી શકીએ. આપણી તે માટે પ્રયત્નશીલ છો. ને અમારા સદ્ગાર્યે નિભાવઇંડ સાર્ઝ થઈ જાય તો આપની આજા પ્રમાણે હું જરૂર ભંડારની સુંધરવસ્થા માટે સેવા આપીશ.' શ્રી ચુનિલાલ હાલીયાએ વચન આપ્યું.

જ્યારથી પન્થાસળું સૂરત પધાર્યો ત્યારથી આપણું પન્થાસળુંએ શ્રી ચોહનલાલજી જૈન જ્ઞાનકંડારને સુંધરવસ્થિત કરવા માટે પ્રયાસ આરંભ્યો. સૌથી પ્રથમ નવાપુરાવાળા શેઠ કૃષ્ણાજી જેધાળુંએ (દા. ૨૦૦) કખાટ માટે નોંધવ્યા અને પછી તો ધીમે ધીમે એક જ જલતના ૪૫ કખાટોની મહદ્વ મળી.

'જ્ઞાનેણ ! અમારી જીવના આપણીની નિશ્ચામાં ઉપધાન વહન કરાવવાની છે.' શેઠ લાલુભાઈ હેમચંદ તથા શેઠ હીરાચંદ જુવણુંએ વિનિતિ કરી.

'જ્ઞાનેણ ! ઉપધાન વહન કરાવવાની તમારી જીવના ઉત્તમ છે. તે માટે મારે વિદ્વદ્ધય્ય શ્રી માણેકમુનિલુંની સાથે થાડી વિચારણા કરવાની છે તે પછી તમને જણાવીશ.' પન્થાસળુંએ ખુલાસો કર્યો.

'કૃપાણ ! આપ તેમને જરૂર જણાવશો પણ અમને તો તે માટે મંજુરી આપો. અમે અમારી તૈયારી આજથી શરૂ કરીએ.' બન્નેએ મંજુરી માળી.

‘આપણું પરમ પૂજય શુરૂવર્ય શ્રીમહુ મોહનતાલજી મહારાજાનીના આ જાનભાડારને માટે મારી થોડી જવાખદારી છે. તે માટે હું જાનભાડારના દ્રસ્તી તથા શ્રી સંઘની સાથે વાટાવાટ કરીને તમને જણ્ણાવીશ.’

‘શુરૂવર્ય! આપ જેમ કહેશો એમ અમારે તો મંજુર છે.’

‘હવે હું આ પચુંધણુપર્વમાં સમય મેળવી વાતચીત કરી લઈશ. આપણું વિજ્યાહશમીનો પ્રવેશ રાખીશું. તમે નિશ્ચિંત રહેશો.’

શુરૂમહારાજની મંજુરી મળવાથી અજ્ઞેને ઘૂણ ઘૂણ આનંદ થયો. આપણું ચરિત્રનાયકે સુનિ રત્નશ્રી માણેકમુનિજીની સલાહ લીધી તથા ભાડારના કાર્યવાહકો સાથે પણ વિચારણા કરી. એવો વિચાર કર્યો કે શ્રી મોહનતાલજી જાનભાડારના મહાનમાં ઉપધાનની કિયાઓ કરાવવી અને માળ વગેરેની ઉપધાન અંગેની એલીની જે ઉપજ આવે તે ભાડારના નિભાવ આતામાં લઈ જવી.

પચુંધણુ પર્વમાં આ વિષે ગોપીપુરાના ઉપાશ્રયમાં શ્રી સંઘ સમક્ષ જાહેર કરવામાં આઠ્યું કે આવતી વિજ્યાહશમીનું હિવસે ગોપીપુરામાં આવેલા શ્રી મોહનતાલજી જૈન જાન ભાડારના મહાનમાં ઉપધાનતપ શાડુ કરવામાં આવશે, અને તે ઉપધાનમાં માળ વગેરેની જે ઉપજ આવશે તે જાનભાડારના નિભાવ ફંડ આતે લઈ જવામાં આવશે. તે પ્રસ્તાવ શેઠ લાલુબાઈ હેમચંદ બરદીવાળા તથા શેઠ હીરાચંદ જીવણજીઓ ઉભા થધને શ્રી સંઘને જણ્ણાઠ્યું કે ઉપરોક્ત રીતે અમારે ઉપધાન કરાવવાની અમારી લાવના છે તો શ્રી સંઘ કૃપા કરી અમને રજ આપે, તે જ વખતે સંઘ તરફથી શ્રી મોહન-

લાલલુ જ્ઞાન ભંડારના કાર્યવાહક શેઠ દ્વારા ચંદ્ર નગીનચંદ્ર જવેરીએ ઉલા થઈને બનને ભાગ્યશાળીએને ચાંદ્રોએ કરી ઉપધાન વહન કરાવવાનો આદેશ આપ્યો.

જિજનગરદિક્ષિસૂરિના હિસે શ્રી મોહનલાલલુ જૈન જ્ઞાન-ભંડારના મફાનમાં ઉપધાન શરૂ કરવામાં આવ્યા. તે જ હિસે ૮૦ માણુસોએ ઉપધાનમાં પ્રવેશ કર્યો.

ઉપધાન વહન ખૂબ સુંદર રીતે થયાં. તપસીઓએ શાંતિ-પૂર્વક હિયાએ કરી. માળનો લભ્ય વરદોડા નીકળ્યો. માળા-રોપણુનો ઉત્સવ આનંદપૂર્વક થયો. ઉપજ પણ ઘણી સારી થઈ ઉપધાનમાં થયેલી ઉપજના ઉપયોગ વિષે ઘણ્ણો. ઉણાયોહ થયો. તે માટે ચર્ચાઓ પણ થઈ. કોઈકાઈએ દેખભાવથી કલેશના બીજ વાયાં પણ આપણા ચરિત્રનાયકની મફકમતા-ઉપધાનના વિવસ્થાપકેનો નિર્ણય તથા શેઠ દ્વારા ચંદ્ર નગીનચંદ્ર તથા શેઠ કેશરી-ચંદ્ર આહિના પ્રયાસોથી પહેલા શ્રી સંધ સમર્પત કરેલ નિર્ણયજ છાયમ રહ્યો.

આ ઉપજ લગભગ રૂ. ૧૧૦૦૦) લગભગ થઈ હતી. પન્થાસલુ મહારાજશ્રીના વરદ હસ્તે માળ પહેરાવવાની કિયા કરાવવામાં આવી હતી. ઉપરાંત જ્ઞાનભંડારની રૂ. ૩૫૦૦) ની સ્પીલક હતી. રૂ. ૫૦૦૦) શેઠ દ્વારા ચંદ્ર નગીનચંદ્ર જવેરીએ તથા તેમના ભાઇશ્શી જવેરચંદ્ર તરફથી રૂ. ૧૦૦૦) બીજુ પદ્ધતુરણ આવક મળી રૂ. ૩૦૦૦૦) ત્રીજી હલાર શ્રી મોહનલાલલુ જૈન જ્ઞાનભંડાર ખાતે જમે થયા. પન્થાસલુ મહારાજશ્રીના પ્રેરણા અને પ્રાણુપ્રેરક પ્રેતસાહનથી શ્રી જ્ઞાન ભંડારના નવસર્જન માટે નાણી મારી બીજુ પણ મહં મળી અને આરસ

જડાવવા માટે હા. ૨૦૦૦) રંગ રોગાનમાં હા. ૧૫૦૦) કખાટોમાં (હા. ૭૦૦૦) વગેરે ખર્ચાંયા અને શ્રી મોહનલાલજી નૈન શાન બંડાર સર્વાગ સુંદર શાન મંહિર થયું. આજે પણ એ શાન બંડારનો લાલ સાધુ-સાધી, વિક્રાનો, અલ્યાસીએ ખૂબ સારી રીતે લઈ રહ્યા છે.

શાન બંડારની સુંધરસ્થા થઈ ગયા પછી સાધુ સાધીના અલ્યાસ માટે પંડિતની વ્યવસ્થા આપણું ચરિત્રનાયકના ઉપ-દેશથી કરવામાં આવી. આ ઉપરાંત બાળક બાળિકાએના અલ્યાસ માટે ધામીંક શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવી. આ રીતે શ્રી મોહનલાલજી નૈન પાઠ્યાળાની સ્થાપના પણ કરવામાં આવી.

સુરતથી વિહાર કરી પન્યાસલુ મહારાજ વલસાડ પધારો. વલસાડના સંઘના આચહથી સં. ૧૬૭૮ તું 'ત્રીસસુ' ચાતુર્માસ વલસાડમાં કર્યો. ચાતુર્માસ બાદ વિહાર કરી બીલીમોરા, જમાલપુર, સુરત, લાદ્યા, જમણુસર, કાવી થઈને પન્યાસલુ મહારાજ શ્રી ઋદ્ધિમુનિજીએ સં. ૧૬૭૯ તું 'એકત્રીશસુ' ચાતુર્માસ ખંભાતમાં કર્યો. ચાતુર્માસ બાદ વિહાર કરી ઓરસઢ, વાસઢ, વડોદરા, મીયાગામ, જગડીયા, માંગરોળ, તડકેશ્વર, અહુધાન થઈને પન્યાસલુ મહારાજ કડોદ પધારો. સંવત ૧૬૮૦ તું 'ખત્રીશસુ' ચાતુર્માસ કડોદમાં કર્યો. પન્યાસલુ મહારાજના ઉપદેશથી આસો માસમાં કડોદમાં ઉપધાન શરૂ થયાં. ઉપધાન સમાપ્તિના સમયે અકૃત્ય મહોત્સ્વ, શાતિસનાત્ર તથા સંઘર્ષમણ વિગેરે આનંદપૂર્વક થયાં.



## ધર્મ-ઉદ્ઘોત

( ૧૯ )

ભાગ્યવાનો ! તમે બધા ભાઈઓ-ભણેનો બાળકો, વૃષ્ટો, હુધપાક-પુરીનું જમણુ જમો અને તમારા જૈનધર્મ પાળનારા વીતરાગ ભગવાનને માનનારા, પ્રતિકમણુ-સામાયિક, પૂજા આદિ કરનારા તમારા ભાઈઓ લાડવાશ્રીમાણી તમારી સાથે એસી ન શકે ! તે કોઈ રીતે ધિષ નથી. ‘ખીછે સે ચલી આતી હૈ’ એ હવે ક્ષયાં સુધી ચાલશે. તમે તો શાણું છો. આપણે સમય પ્રમાણે સંગઠન અને સંયાની દિશિએ જડરી ઇરઝાર કરવા જોઈએ. આમાં તો ભાગ કહાયછ છે. નવકાર જાણુનાર કોઈપણ જૈન-સ્વામી ભાઈને નવકારશી કે સંધ જમણુમાં અટ-કાવી શકાય નહિ, તો તે જમણુને તમે નવકારશી ન જ કહી શકો. કોઈ કાળે કોઈ મતલેહના કારણે તેમ બન્યું હશે પણ આજે તો એવા નાળજા મતલેહો ભૂતી જઇ બધાએ એકૃયતા સાધી તમારાજ લાડવાશ્રીમાણી ભાઈએને તમારી સાથે જમાડના જ જોઈએ. તેમાં શ્રીસંધની શ્રોભા-ઉકારતા છે.’ પન્થાસળ મહારાજે સચોટ ઉપદેશ આપ્યો.

આ ઉપદેશ વચ્ચેનોની જાહુઈ અસર થઈ, આગેવાનો સંમત થયા અને વધોથી જુગા થયેલા લાડવાશ્રીમાણી

ભાઈઓ સંધ જમણુમાં સાથે જમવા લાગ્યા. આ કાર્ય કડો-  
હના ઈતિહાસમાં સમરણીય ગણાયું. શ્રી લાડવાશ્રીમાળી  
ભાઈએ તો આ મંગળ પ્રસંગથી પન્યાસળુના આળુવન ઝણી  
અન્યા, સંધના નાના-મોટા કાર્યમાં લાડવાશ્રીમાળી ભાઈએ  
ઉદ્સાહથી ભાગ લેવા લાગ્યા.

કડોહથી વિહાર કરી પન્યાસળ મહારાજ હરમણ પદ્ધાર્યો.  
હરમણુમાં હાડાણું, ખગવાડા, વાપી અને વલસાડના આગેવાન-  
ભાઈએ ચોતાના ગામમા ચોમસું કરવા માટે વિનતિ કરવા આવ્યા.  
વલસાડવાળા શેઠ ગાંડાભાઈ પ્રાગળુભાઈ તથા લુષ્ણદ્વારા કામમાં  
ધણ્ણો જ પ્રશંસનીય પ્રયાસ કરનાર શેઠ લલ્દુભાઈ શુલાખચંહ-  
ભાઈ જવેરીનો વિશેષ આગ્રહ હોવાથી તથા ધર્મ ઉદ્ઘોતના  
વિશેષ કાર્યો થવાની સંભાવનાથી પન્યાસળ મહારાજશ્રીએ  
વલસાડની વિનતિ સ્વીકારી.

થામાનુથામ વિચરતા પન્યાસળએ ધામધૂમપૂર્વક વલ-  
સાડમાં પ્રવેશ કર્યો. સં. ૧૯૮૧ નું તેત્રીશમું થાતુર્માસ  
મહારાજશ્રીએ વલસાડમાં કર્યું.

વલસાડના થાતુર્માસમાં આપણું ચરિત્રનાયકે એક એક  
પારણુને આંતરે અંકુમ જેવી કહિન તપદ્ધયાં ચાર માસ સુધી  
કરી, આત્મિક આનંદનો અનુભવ કરી અનેક પ્રકારની આત્મ-  
શક્તિ ખીલવી આત્મહથંન મેળંયું.

પદ્યુષણુની આરાધના આનંદ પૂર્વક થઈ. આસપાસના  
ગામેના ઘણું ભાઈ-ખડેનોએ પદ્યુષણુનો લાલ લીધો. ઇણુસવાળા  
શેઠ મેધરાજશ્રીના બહેન શ્રી સૂરજળણેને ૧૦ ઉપવાસની તપદ્ધયો  
કરી હતી, અને પંદર દિવસ તેમના તરફથી સાધમીં ભાઈઓની

અકિત કરવામાં આવી હતી. ઉપરાંત પરીયાવાળા શેડ છોટા-  
લાલભાઈ, અંબાયાવાળા શેડ તારાચંહ જેતાળ અને શેડ કેસ-  
રીમલાળ જેઠાળ કંકરીયા તરફથી પણ જુહાજુહા રસોડા ચાલતાં  
હતાં. આખા હિંદુસ્તાનમાં અને પરદેશમાં પણ જુવફા મંડળી  
મારફત તન મન અને ધનથી જુવફાતું અત્યુત્તમ કાર્ય કરતાર  
શેડ લલુભાઈ ગુલાખચંહ જવેરીએ આખા ચોમાસામાં મહારાજ  
સાહેબને વાંઢવા માટે બહારગામથી આવનાર ભાવિકોની અકિતનો  
લાલ લીધો હતો.

શેડ લલુભાઈ જવેરીની ઉપધાનની ભાવના થઈ અને શેડ  
લલુભાઈ ગુલાખચંહ જવેરીની તથા શેડ નગીનદાસ જવેરી તરફથી  
ઉપધાન વહન કરાવવામાં આવ્યા. ઉપધાનમાં ધણું જામોના  
ભાઈ-ખણેનાએ પ્રવેશ કર્યો. ઉપધાન આનંદથી સમાપ્ત થયાં.

માળારોપણ આહિ ઉત્સવો થયા. ધર્મનો સારો ઉદ્ઘોત  
થયો. આ પ્રસ'ગે શ્રી જુવફા ખાતે ૩ ૩૦૦૦) ની ઉપજ  
થઈ હતી.

‘મથથેખુવંદામિ !’ જયચંહભાઈએ વંદણા કરી.

‘ધર્મલાભ !’ મહારાજશ્રીએ ધર્મલાભ આપ્યો.

‘સાહેબ ! મારી વૃદ્ધાવસ્થા છે. મારી ભાવના ઉત્સવ કર-  
વાની છે. અમારા નાનકડા ગામમાં તો સુનિરાજ ભાગ્યે જ  
પધારે છે. આપ સાહેબ મારા તરફ કૃપા કરી મારે ગામ ઉંટડી  
પધારો. મારી ભાવના પૂર્ણ કરો, શેડ જયચંહભાઈએ વિનિતિ કરી.

‘ભાગ્યશાળી ! તમારી ભાવના તો ધણી સારી છે. તમારા  
હાથે કરેલી કમાણીનો વૃદ્ધાવસ્થામાં સદ્ગુણ્યોગ કર્યો જેઠાએ.

તમારા નાના ગામમાં અનેક આત્માઓને વીતરાગ પરમાત્માના ઉત્તમધર્મનો એધ થશે. તમારું કદ્યાખુ થશે.' પન્યાસળુએ સંભતિ આપી.

'કૃપાગુ ! હું મારા રનેહીસંબંધીને નિમંત્રણ મોક્લું છું. આપકી વહેલાસર પધારશો.'

'ડુંગરીના ભાઈઓની પણ વિનતિ છે, પણ હું પહેલાં ઉંટડી થઈને ડુંગરી જઈશ. તમે સુધેથી તૈયારી કરો.'

શેઠ જયચંદ્રભાઈની ભાવના આ રીતે પૂર્ણ થઈ તેથી તેમને આનંદ થયો. જયચંદ્રભાઈ વલસાડ, ધીલીમારા વગેરે નજદિકના ગામોમાં જાતે જઈને પોતાના રનેહીસંબંધી વર્ગને નિમંત્રણ કરી આવ્યા. હીર્દેંતપસ્વી, ધર્મ ઉદ્ઘોતકારી પન્યાસળ મહારાજની નિશામાં ઉંટડી જેવા ગામમાં ઉત્સવ થવાનો છે તે સાંભળી ધણુા લાઈઓને તેમાં ભાગ લેવાની ભાવના જગ્યા અને ઉંટડીમાં અફૂધ મહેલસવ, વિવિધપૂજા, સ્વામીવાત્સલ્ય ધણુા ઉમંગથી થયાં. શ્રી જયચંદ્રભાઈએ પોતાની સ્વ કમાઈનો આ રીતે ધર્મ ઉદ્ઘોતમાં સદ્ગુપ્યોગ કર્યો. આસપાસના ગામોના ભાઈ-ભહેનોને ધર્મનો એધ મજયો. પન્યાસળ મહારાજના પ્રાણપ્રેરક પ્રવયનોથી ધણુા ભાવિકોના ભાવો ધર્મમય અન્યા.

ડુંગરીના ભાઈઓની પણ વિનતિ હતી. પન્યાસળ મહારાજ ઉંટડીથી ડુંગરી પધાર્યા. ડુંગરીમાં સ્વામીવાત્સલ્ય વગેરે થયું.

ડુંગરીથી વિહાર કરી ધીલીમારા, નવસારી અને મરોદી થઈને પન્યાસળ મહારાજ સુરત પધાર્યા.

‘કૃપાસિધુ ! આપ સાહેબ શ્રી સમેતશિખરલુની યાત્રાએ પથારો તો અમારી પણ ભાવના શિખરલુની યાત્રાની છે. સમેતશિખરની યાત્રા માટે આપને કશી તકદીક નહિ રહે ૮-૧૦ બાઈ અહેનો. આપની સાથે જ રહેવાની ઠચ્છા રાખે છે. તે બધાનો જરૂરી ખર્ચ હું આપીશ. સંઘ કાઢવાની તો મારી શક્તિ નથી પણ આપશ્રીની સેવાલક્ષીત અને યાત્રાનો નાનો સૂનો લાલ નથી. ધણ્ણા વધોથી આ મહાન તીર્થની યાત્રાનો લાલ હું લઈ શક્યો નથી. આપશ્રી પથારશો તો અમને પણ તે લાલ મળશે.’ શ્રી છાદુભાઈ લગ્નવાનહાસ જવેરીએ વિનિતિ કરી.

‘ભાગ્યશાળી ! તમારી ભાવના તો ધણ્ણી સુંદર છે. મારી ઠચ્છા પણ સમેતશિખરલુની યાત્રાની છે પણ સમેતશિખરલુની યાત્રા સહેલી નથી. હું વે તમારો અત્યંત આગ્રહ છે તો હું વિચારીને જણ્ણાવીશ.’

‘સાહેબ ! જયારે પણ આપશ્રી તે તરફ વિહાર કરો ત્યારે મને તુરત જણ્ણાપણો હું’ તે માટે શક્ય બધી વ્યવસ્થા કરીશ.

સમેતશિખરલુ તીર્થની યાત્રાની ભાવનાથી સુરતથી વિહાર કર્યો. આપણા ચરિત્રાયક ભારડોલી, કડોઢ થણ્ણને માંડવી પધાર્યો. માંડવીમાં શેડ મેતીયંકાઈએ અકુઝમહેતુલ, શાન્તિસ્નામ તથા સંઘજમણ કરી લાલ લીધો. માંડવીથી વિહાર કરી વ્યારા, સોનગઢ, નવાપુરા, ચિંચપાડા અને ખાંડારા થઈને નંદરાર પધાર્યો.

વ્યારાથી નંદરારનો રસ્તો ધણ્ણો જ ખરાબ હોવાથી પન્યાસાજુ મહારાજને વિહારમાં ભારે તકદીક થઈ. પરિશ્રમ

પણ ધર્મે પડ્યો. પગે સોજ આવી ગયા. નંદભારમાં શેઠ ડાદ્યાભાઈ મંછારામના જુનમાં પદ્ધાર્યો. તાવ પણ આવી ગયો. ચાત્રાના પ્રારંભમાં જ વિધન આવ્યું. કોઈ જૈન મુનિ મહારાજ પોનાના જુનમાં ઘર આંગળે પદ્ધાર્યો છે તેમ સંભળી શેઠ ડાદ્યાભાઈ મહારાજશ્રીના હર્ષને આવ્યા.

પન્થાસળ મહારાજને જેઠને તેઓ તો ખૂબ હર્ષિત થયા. પોતાને જૈન ધર્મના ઉત્તમ સિદ્ધાંતોની ઓળખાણ કરાવી પોતાને તથા પોતાના આખા કુંદુંખને સન્માર્ગે ચઢાવનાર, પોતાના પરોપકારી શુરૂમહારાજ પન્થાસળ શ્રી ઋદ્ધિમુનિલુને જેઠને ખૂબ પ્રસન્ન થયા. ઔપધની તુરત બ્યવસ્થા કરવામાં આવી, સેવાઅંકિતનો પણ લાભ લીધો અને પોતાને આંગળે પોતાના જ ધર્મશુરૂ એકએક આવી મળ્યા તે પોતાના અહો ભાગ્ય છે તેમ માનવા લાગ્યા.

‘સાહેણ ! આપની તથીયત સારી નથી. તાવ તો નથી પણ હજુ અશક્તિ ધર્ણી છે. વળી આ દર માઈબના વિહારથી નંદરખારના વિહારમાં ડેવી કડીનતા આવી ? તો સમેતશિખર તો હજુ દૂર રહ્યું. આપની ચાત્રાની લાવના તો ઉત્તમ છે. છોડુભાઈ જેવેરી પણ લાગ્યવાન છે, પણ આપની તથીયત ખરાખર સારી ન થાય ત્યાંસુધી તો હું આપને વિહાર કરવા નહિ હડી. સમેતશિખર માટે જે કે સામની જેઠ શે તે માટે સેવક હરથડી તૈયાર છે. આપ તો મારા પરમ ઉપકારી છે. મારામાં ધર્મ પ્રાણુ પ્રેરક છેા.’ શેઠ ડાદ્યાભાઈ મંછારામે તથીયત સંભળવા આગ્રહ કર્યો.

‘ભાગ્યશાળી ! તમારી લક્ષ્ણ તો પ્રશાંસનીય છે. તમે તો મારા સ્વાસ્થ્ય માટે અને સુખશાતા માટે ધણું ધણું કરો છો, પણ મારા મનમાં હણું કે શેઠ છોટુંબાઈની લાવના પણ ચાત્રાણી છે તો આવા મહાન તીર્થની ચાત્રાનો લાલ લઈ દેયો. પણ આ પ્રદેશનો વિચાર તો ધણો જ કષ્ટદાયી નીવડયો. શ્રી છોટુંબાઈએ તો બધી વ્યવસ્થા કરી છે, પણ શરીર કથળે ત્યાં શું થાય ! હવે હમણું તો આગળ વધી શકાય તેમ નથી.’ આપણા ચરિત્રનાથકે ખુલાસો કર્યો.

‘હુયાળુ ! મારી વિનિતિને માન આપી આપે શ્રી સમેત-શિખરની ચાત્રાનો વિચાર સુલ્લતવી રાજ્યો તે જાણી આનંદ થયો. આ અમારા નન્દરખારના આગેવાનો પણ આવી પહેંચ્યાં.’

‘મધ્યદેશુ વંદામિ !’ આગેવાનોએ વંદણા કરી.

‘ધર્મલાલ !’ પન્થાસલુએ ધર્મલાલ આપ્યો.

‘મહારાજશ્રીએ મારી વિનિતિને માન આપી શ્રી સમેત-શિખરની ચાત્રાનો વિચાર સુલ્લતવી રાજ્યો છે.’ ડાદ્યાલાઈએ ખુલાસો કર્યો.

‘કૃપાળુ ! આ સમાચારથી તો ખહુ જ આનંદ થયો. પણ કૃપા કરી હવે હમણું અતે જ સ્થિરતા કરો અને આપના સુધા વચ્ચેનોથી અમારામાં ધર્મલાવના પ્રગટાવો.’ આગેવાનોએ વિનિતિ કરી.

‘ભાગ્યવાનો ! મારા સ્વાસ્થ્ય માટે તો હું હમણું અહીં છું પણ મારી એક લાવના છે.’

‘ સાહેબ ! કરમાવો. આપની આજા શિરોધાર્ય છે. ’

‘ નનદરભાર તો વેપારનું મથક છે. સાહુ સાધીને માટે વિહારનું આશ્રય સ્થાન છે. તમારા ગામમાં ઉપાશ્રય ન હોય તે બરાબર નથી. તમે ધર્ષણા ખરા બહારથી આવી વસ્ત્યા છો. પરમાત્માની કૃપાથી તમે સુખી થયા. લક્ષ્મી કમાયા પણ ધર્મ લક્ષ્મી વિના બધું નકારું. તમે ધારો તો ઉપાશ્રય થતાં વાર રહી ! ’

‘ સાહેબ ! ઉપાશ્રય માટે અમારી ભાવના તો ધર્ષણા સમયથી છે પણ તે માટેના પ્રયાસો થયા નથી. ’

આપણા ચરિત્રનાયકના ઉપરેશાની જહુઈ અસર થઈ. તેજ વખતે રૂ. ૫૦૦૦) લખાઈ ગયા. બીજી પણ રૂ. ૧૦૦૦૦) થયા અને ઉપાશ્રયનું ખાતસુહૂર્ત (પણ થયું. કામ પણ તાખડું તોબ શરૂ થયું અને મનોહર ઉપાશ્રય તૈયાર થઈ ગયો.

પ્રતિષ્ઠાનો દિવસ નક્કી થયો. અષ્ટોત્તરી સ્નાત્ર ભણ્યાવવાનો નિર્ણય થયો. આચપાસના ગામોમાં નિમંત્રણ પત્રો મોકલવામાં આવ્યા.

શેઠ ડાદ્યાભાઈ મંધારામ મહારાજાની પરમ ભક્તા હતા. તેમણે મહારાજાની વિનતિ કરી કે આ પ્રતિષ્ઠાના મહોત્સવમાં તેર દિવસની નવકારશી તથા અષ્ટોત્તરી સ્નાત્ર વળેરેનો લાલ મને મળવો જોઈએ. મારાં અહોભાગ્ય કે મારી લક્ષ્મીનો આવાં ધર્મ-ઉદ્વોતના કાર્યોમાં સદ્ગુરૂપદેશ થયો. ડાદ્યાભાઈની ભાવના તો ધર્ષણી જ ઉંચી હતી પણ બીજી લાઈઓને પણ લાલ મળવો જોઈએ તે દ્રષ્ટિએ શ્રીસંદે શ્રી ડાદ્યાભાઈને નજુ

નવકારશીની રબ આપી. થીજુ હશે નવકારશી થીળ લાઇએ તરફથી વખાઇ ગઈ.

મહેતસવનું કાર્ય ખૂબ આનંદપૂર્વક શરૂ થયું. અણોસરી રનાર કરવામાં આંથું આસપાસના હણરે લાઇબહેનોએ પ્રતિષ્ઠા-ઉત્સવનો લાભ લીધો. સં. ૧૯૮૨ ના જેઠ શુહિ દ ના હિસે પન્યાસળું મહારાજશી ઋદ્ધસુનિલુના મંગળ હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રી ડાદ્યાભાઇએ દ્રોય પરથી મમતા ઉતારી ઉહારતાથી લક્ષ્મીનો સંહિતપ્રેરણ કર્યો. લગ્નવાનને ગાડીએ એસાઉવાનો, ધ્વનાંડ તથા કળશ ચઢાવવાનો આડેશ લીધો. પ્રતિષ્ઠા મહેતસવ ખૂબ આનંદપૂર્વક થયો. શ્રી ડાદ્યાભાઇએ આ પ્રસંગે રૂ. ૫૦૦૦૦) જેટલી મોટી રકમ ખરચી જીવન ખન્ય અનાંથું, નન્હરાણા લાઇબહેનોનો ઉત્સાહ અનેરે હતો. હણરે માણુસો પ્રભુલુના હર્ષન માટે ઉમરી આંથા હતા. નૈનશાસનનો જય જ્યકાર થઈ રહ્યો હતો.

આપણું ચશ્મિત્રાયકના પ્રેરક વચ્ચેનોથી નન્હરાણા જેવા અનાર્ય પ્રહેશમાં પણ કારે ધર્મઉદ્ઘોષ થયો. પ્રતિષ્ઠા પ્રસંગે રૂપીઆ એક લાખની તો ઉપજ થઈ. પ્રતિષ્ઠાનું કાર્ય નિર્બિંદે પૂર્ણ થયું.

પ્રતિષ્ઠા કંમણે આવેલ વ્યારાના સુરત લુલ્લામાં પ્રસિદ્ધ શેઠ ચીમનાલું મેધાલું તથા થીળ વ્યારાના આગેવાનોએ વ્યારાના ચાતુર્માંસ માટે વિનતિ કરી. લાભાલાલની દૃષ્ટિ પ્રતિષ્ઠા પછી પન્યાસળું મહારાજે વિહાર કર્યો વ્યારાના સંગ્રહ ધાર્યા જ ઉત્સાહ અને ડાઠમાઠથી પ્રવેશ કરાયો. સં. ૧૯૮૨ તું ચાતુર્માંસ પન્યાસળુએ વ્યારામાં કર્યો.

વ્યારામાં પદુંપણું પર્વ કરવા માટે બહારગામના ભાઈ બહેનો પણ આંધ્રા હતા. ૧૮ અફ્રાઇ ઉપરાંત તપશ્ચયોએ ઘણી સારી થઈ-તપસ્વીઓની લક્ષ્ણ પણ સારી થઈ. લગભગ મહિનો હિવસ તો ઉત્સવ ચાલ્યો.

પન્થાસળુના ઉપરેશથી વાદોડવાળા શેઠ મોતીલુ રાજલુ તથા ખુહારીવાળા શેઠ ઉત્તમચંદ વીરચંદ તરફથી આસો સુદી ૧૦ થી ઉપરાન શરૂ થયાં. આસપાસના ગામોના ઘણું બહેન ભાઈઓ પણ ઉપરાનમાં એડા. ઉપરાન આનંદપૂર્વક સમાસ થયાં.

માળારોપણુના ઉત્સવ પ્રકંગે જેન શાંકોના નિષણુાત તથા અસ્થાસી વિદ્ધાન શ્રી શેઠ કેશરીચંદ કલ્યાણચંદ જવેરીએ ઉપરાનની તપશ્ચયો કરનાર ભાઈ બહેનોને મંગળ આશીર્વાહ આપતાં જણ્ણાંયું કે વ્યારાના શ્રાવક ભાઈઓને ધર્મેત્સાહ પ્રશંસનીય છે. તમે ભાગ્યવંત છો કે જગત પૂજય શ્રી મોહનલાલજી મહારાજના અનન્ય સેવાભાવી, દીર્ઘ તપસ્વી પ્રશિદ્ધ પન્થાસ શ્રી ઋદ્ધ સુનિલ મહારાજની નિશામાં આવો ધર્મ ઉદ્ઘોત થઈ રહ્યો છે. તપસ્વી ભાઈ બહેનોને ધન્ય છે કે આવું ઉજમાળ તપ સંપૂર્ણ કરી આજે તેઓ માળ પહેરવા ભાગ્યશાળી બન્યા છે. શ્રી કેશરીચંદભાઈએ એક એક શ્રીકૃષ્ણ તથા એક ઇપીયાની પ્રભાવના કરી.





## आभार्दार

( २० )

‘मथेणु वंहामि !’ शेठ कानाळु राजलुचे वंहणु करी.

‘धर्मलाभ’ पन्यासलुचे धर्मलाभ आण्यो.

‘साहेब ! हु श्रीमती लाडुअडेन तथा श्रीमती सूरज-  
अडेन तथा मारा भाऊनी धर्मपत्नीने माण पडेराववा माटे  
टांकेलथी आण्यो. कुं-माणनो उत्सव तो अडुज लांय थयो.’  
शेठ कानाळुचे आनंद प्रहरिंत कयो.

‘लाग्यशाणी ! भोटा शडेरमां उत्सवो तो हरहंसेश थता  
रडे छे. पछु नाना नाना गामेना लोगालवां, लावलयो.  
धर्म श्रद्धावाणा भाई बडेनोने प्रतिषेध आपी धर्मप्रेमी  
भनाववा ते अत्यंत आवश्यक छे. मने तो आभातुआमनो  
विहार अने धर्मज्ञवोत माटेना उत्सवो भाटे विशेष प्रेम छे.’

‘હ્યાળુ ! આપે વ્યારામાં અને આસપાસના પ્રદેશમાં તો જૈનશાસનની સારી પ્રકાવના કરી પણ અમારા ટાંકેવ ગામના ભાગ્ય ક્યારે જગથે !’ શેઠ કાનાળ રાનજુએ વિનતિ કરી.

‘સાહેબ ! અમારા ગામમાં ૪૦ લગ્ભગ શ્રાવકોના ઘર છે. ધર્મશ્રદ્ધ પણ સારી છે પણ સાધુ સુનિરાજની જેગવાઈ વિના અમે ધર્મથી વિસુખ બનતા જઈએ છીએ. સંસારમાં મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટેનો સરોતમ મનુષ્યભવ હારી જવા જેવી સ્થિતિ અમારી છે. કૃપા કરી આપ પધારો અને અમને ધર્મનો ઓધ આપી કૃતાર્થ કરો.’ બીજા આગેવાનોએ વિનતિ કરી.

‘હ્યાળુ ! આપ પધારો તો મારી ભાવના ઉપાશ્રય માટેની થાય છે.’ લાડુભણે પોતાની ભાવના હશોવી.

‘લાડુભણ ! પહેલાં તો હેરાસર થલું જોઈએ પછી ઉપાશ્રય પણ થઈ જ રહેશે. વળી ટાંકેવ જેવા ગામમાં તો નાનકડું સુંહર હેરાસર અને નાનકડો ઉપાશ્રય થાય તો બધાને ઉપયોગી થઈ પડે. તમે તો ભાગ્યશાળી છો. તમે જ એ લાલ હ્યો. એવી મારી હચ્છા છે.’ પન્યાસળુએ સૂચના કરી.

‘શુરૂદેવ ! આપની આજા મારે શિરોધાર્ય છે. આપ અમારે ત્યાં પધારો, હેરાસર અને ઉપાશ્રય મારા તરફથી થશે.’ લાડુભણે પોતાની ભાવના હશોવી.

વ્યારાથી વિહાર કરીને પન્યાસળ મહારાજ માંડવી, કડોહ કડોર, સાચણુ, સુરત અને નવસારી તથા રીસોહરા થધને ટાંકેવ પધાર્યો.

ટાંકેલ જેવા નાના ગામમાં પન્યાસળુ પધાર્યો હેવાથી ગામના આખાતવૃદ્ધને આનંદ થયો. પન્યાસળના ઉપહેશથી શ્રી કાડુભહેને હહેરાસર તથા ઉપાશ્રય માટે તેમના દૂસ્તી શ્રી કાનાળ રાજાનુ મારકૃત જૈન હહેરાસર તથા જૈન ઉપાશ્રય કરાંયાં. ધર્મનો ઉદ્ઘોત થયો.

ટાંકેલથી વિહાર કરી ગણુદેવી, ખાપરીયા, થીલ્લીમેરા અને વલસાડ, થઈને પન્યાસળ મહારાજ પારડી પધાર્યો.

‘કૃપાળુ ! અમારા બગવાડા પ્રગણામાં તો અમે નામના જ નૈનો છીએ. અમારા નાના ગામડાચોમાં સુનિરાને ઓછા વિચરે છે. કોઈ સ્થિરતા તો કરતું નથી. જૈનધર્મ અને તેનું સ્વરૂપ તથા ડિયાકાંડ વિષે અમને પણ ખાસ કાંઈ જાન નથી તો અમારા બાળકેને ધર્મના સંસ્કાર કર્યાંથી હોય !’ અંધા-ચના શેઠ તારાચંદ જેતાળુએ પરિસ્થિતિ હર્ષાવી.

‘હ્યાસિંધુ ! આપ અમારા બગવાડા પ્રહેશમાં પધારો અને અમારા ગામડાચોમાં રહેતા કાઈભહેનોને ધર્મનો ઓધ આપી ધર્મમાર્ગમાં જોડો.’ શા કસ્તુરચંદ પ્રેમચંદ વિનિતિ કરી.

‘સાહેબ મોટા શહેરોમાં તો સુનિરાનેનો જોગ હોય છે અને ત્યાંના શ્રાવકોને તો વ્યાખ્યાનવાણીનો લાભ મળ્યા જ કરે છે પણ અમારા ગામડાચોમાં તો જલો વેપાર અને જાંસું ધર. તપ-જપ-નિયમ, સમાયિક કશું જ થતું નથી. ઉપહેશના સિંચન વિના ધર્મસંસ્કાર કર્યાંથી આવે !’ શા નેમચંદલાઈએ ગામઢાચોની હશા ગણુાવી.

‘ભાગ્યશાળી ! તમે જણો છો કે હું તો આમતુઓમ વિહાર કરી ગામડાયોના ભાઈ-ગ્રહેનોને ધર્મનો એાધ આપી જૈનધર્મમાં સ્થિર કરવાના વિચારનો હું અને જ્યાં જ્યાં હું જાઉં હું ત્યાં ત્યાં આમ પ્રજ્ઞામાં ધર્મના સંસ્કાર રેઝું હું. તમારા ગામમાં પણ આવવાનું થયે. બગવાડા મહેશમાં તો ધરણાં કારોં કરાવવાની ભાવના છે.’ પન્થાસળ મહારાજે પોતાની ભાવના વ્યકૃત કરી.

પારદીથી વિહાર કરી પન્થાસળ મહારાજ પરીયા, અંભાય, કેાપરલી, ડેહગામ, રાંતા વગેરે નાના નાના ગામોમાં થોડા થોડા દિવસોની સ્થિરતા કરીને ખચોટ ધરોપહેશ આપ્યો. આમ-વાસીઓને ધર્મ રસ્તે ચઢાવ્યા. તથ-જ્યા-મત-નિયમ હર્ષિન-પૂજા-સામાચિક વગેરે ધર્મકરણીનું સ્વરૂપ સમજાવી કિયામાં રસ દેતા કર્યા. ગામેગામ પન્થાસળનો ભાવથરો સત્કાર થવા લાગ્યો, પૂજા-જમણુવાર-યાખ્યાનો થવાં લાગ્યાં. જૈનધર્મનો જયજયકાર થઈ રહ્યો. ગામડાના લોળા-ભવા ભાઈ ગ્રહેનો પન્થાસળના હર્ષિન માટે ટોળેટોળાં આવવા લાગ્યાં. તેઓશ્રીના અમૃત વચ્ચેનો સાંકણી પોતાની જતને ધન્ય માનવા લાગ્યાં. વૃદ્ધ સ્વી-પુરુષો તો પોતાને અંગણે પ્રભુ પધાર્યો ‘એમ માની હસ્તિ થયા.

આમતુઓમ વિહાર કરતાં કરતાં પન્થાસળ મહારાજ વાપી પદ્માયો. વાપી જેવું નાનકડું પણ કેન્દ્રસ્થ ગામ, સો ધરણી વસ્તી, બધા શ્રદ્ધાળું અને ધર્મભાવવાળા પણ ધર્મના એાધ વિના સંસ્કાર નહિ તેથી પન્થાસળએ વાપીમાં સ્થિરતા કરી. ડેવપૂજા, સામાચિક, મતિકમણ જેવી રોજની કિયાથી વંચિત એવા બધાને

ધર્મનો ઉપહેશ આપી ધર્મકરણીમાં જોડ્યા. વાપી જેવું સુંખ-  
ઈના રસ્તા ઉપરનું ગામ ધર્મસંકારી હથે તો અગવાડા પ્રહે-  
શમાં ધર્મની સુવાસ ફેલાયે, તે દૃષ્ટિએ વાપીમાં વિશેષ સ્થિરતા  
કરી ધર્મભાવના ફેલાવી ધરણાં કુંદુંબાને ધર્મમાં દઢ કર્યો.

અગવાડા અગણુના આગેવાન દેહગામવાળા ધર્મચુસ્ત શેઠ  
માતીલુ પહેલાના મહાનમાં ચાર મહિના સ્થિરતા કરી  
સચોટ ધર્મોપહેશ આપી, આજ્ઞા ગામને ધર્મમાં જોડીને સમસ્ત  
અગવાડા પ્રહેશમાં વાપીને ધર્મભય બનાવી દીધું. અગવાડા પ્રહે-  
શના બધા શ્રાવકો આપણું ચરિત્રનાયકના ધરણા ભક્તિવંત થયા.

‘સાહેબ ! મારે ત્યાં અમારાં બહેનનો લઘોત્સવ છે. મારી  
ભાવના તે પ્રસંગે ધાર્મિક ઉત્સવ પણ કરવાની છે. અચછારી  
ગામમાં આપના પગલાંથી ધર્મ પ્રલાવના થશે. અમને આપના  
અમૃતવચનોનો લાલ મળશે.’ શેઠ રાયચંહ શુલાખયને  
વિનિતિ કરી.

‘રાયચંહભાઈ ! તમે તો ધર્મશ્રદ્ધાળુ, સાધુ સેવાબિલાખી અને  
ધ્યબહારહક્ષ છો. તમારા અચછારી ગામમાં તમારી સુવાસ તો  
છે પણ આસપાસના પ્રહેશમાં પણ તમારી પ્રતિકા ધર્મી સારી  
સાંભળી છે. તમારા ધર્મકાર્યમાં તો આંયા સિવાય ચાલશે !’

‘કૃપાળુ ! હું તો સંધનો હાસ છું. ધર્મકાર્યો અને સમાજ-  
કલ્યાણના કાર્યો તરફ મને રસ છે. મારી ભાવના તો શિક્ષણ.  
પ્રવાસની છે. જ્યારે સંભેગો આવશે ત્યારે તેમાં આપના  
આર્થીબોદ જોઈશે.’ રાયચંહભાઈએ પોતાની ભાવના પ્રદર્શિત કરી.

અચછારી જીવાની તૈયારી ચાલતી હતી. ત્યાં અગવાડા

પહેશના ૩૦૦ માણુસો પન્યાસળુને વંડન કરવા આવ્યા. તેઓ પન્યાસળ મહારાજાની અચછારી પધારે છે તે જાણી હખિંત થયા.

અચછારીનોં પ્રવેશ લાવલયો હતો. શેઠ રાયચંહાઈએ લગ્નો-ત્સવની સાથે અહૃદિમહેતસવ-પૂના-સંધજમણુ વગેરે આનંદ-પૂર્વક કર્યો. અચછારીના ભાઈબહેનોને ધર્મપહેશ આપી ધર્મભદ્રાળુ અનાવ્યા. શેઠ રાયચંહલાલાંએ ખૂબ લક્ષિત કરી લાલ લીધી.

‘ સાહેબ ! આપણી અમારા આમપહેશમાં ડીકડીક ધર્મ-પ્રલાવના કરાવી રહ્યા છે. અમારા સામટા ગામમાં પધારી અમને આપણી સુધાલરી વાણીનો લાલ આપો. ’ શેઠ ચુલાખ-ચંદળુએ વિનિતિ કરી.

‘ કૃપાળુ ! અમે હણેરાસર તૈયાર કર્યું છે. અમારા ભાઈએનો સંપ પણ સારો છે. પ્રતિષ્ઠા કરાવવાની છે. આપ સામટા પધારા તો પ્રતિષ્ઠાનો ઉત્સવ આપણીની નિશ્ચામાં થાય. વળી પ્રતિષ્ઠાના ઉત્સવ માટે અમે અનણું ધીએ તો આપના માર્ગફર્શન પ્રમાણે બધી કિયાએ થાય તેમ અમારી ભાવના છે. ’ શેઠ ચુનિલાલાલાંએ સંધની ભાવના રજુ કરી.

‘ ભાગ્યશાળી ! તમે સામટા જેવા ગામમાં હણેરાસર કરવા ને ઉત્સાહ બતાવ્યો છે તે પ્રશંસનીય છે. પ્રતિષ્ઠા વૈશાખમાં આવે છે તો હું બોરડી, ઘોલવડ થઈને સામટા આવવાની દિચ્છા રાખું છું. ’ પન્યાસળુએ સંમતિ હશોવી.

સામટાના ભાઈએની વિનિતિને માન આપી પન્યાસળ મહારાજ અચછારીથી વિહાર કરી બોરડી, ઘોલવડ, હાહાણુ વગેરે ગામોમાં ઉપહેશ આપતા આપતા સામટા પધાર્યો.

પ્રતિષ્ઠાના કાર્ય સંખ્યે ત્યાંના શ્રાવકોને માર્ગદર્શિન આપ્યું  
થિયે જતની તૈયારી કરાવી. સં. ૧૬૮૮ ના વૈશાખમાં મંગળ  
સુદ્ધુતે પન્યાસલુ મહારાજશ્રીના વરદ હસ્તે ધામધૂમપૂર્વક  
પ્રતિષ્ઠા કરાવવામાં આવી. સામટાના ભાઈ-ખણેનોમાં આનંદ  
આનંદ છનાદ રહ્યો.

પ્રતિષ્ઠા સમયે એક ચમત્કાર થયો. શેડ કેશરીમલના ધર્મ-  
પત્ની સ્થાનકવાસી ધર્મ પાળતા હતા. કોઈ કોઈ વખત આપણા  
ચરિત્રનાયકના દર્શાને જતા. ફણેરાસર જવામાં તો તે પાણ માનતા  
હતા, એક હિંદુ તેઓ. વંદન કરવા આવ્યા. પન્યાસલુ મહા-  
રાજશ્રીએ વીતરાગ ભગવાનનું સ્વરૂપ, મૂર્તિસૂલના લાલ,  
ભગવાનની મનોહર મૂર્તિના દર્શાનથી આત્માની લગૃતિ, પ્રાચીન  
સંમયમાં પણ મૂર્તિઓનું વિધાન વગેરે એવી તો સચોટ શૈલીમાં  
ઉપદેશ આપ્યો. કે શેડ કેશરીમલના ધર્મપત્નીને અંતર  
આત્મા જગી ઉઠ્યો. ધર્મકાવના પ્રગતી ને એવી તો પ્રથમ  
ચિનગારી જગી કે નૂતનશ્રાવિકા તરીકે પન્યાસલુ મહારાજશ્રી  
પાસે પૂલનું વૃત લીધું એટલું જ નહિ પણ પ્રતિમાલને  
પદ્ધરાવવામાં, શાંતિસનાત્રમાં અને સંઘર્ષમણ વગેરે કાયોમાં  
(ા. ૩૦૦૦) આશરે વાપર્યો. સામટાના ભાઈ-ખણેનોને તો આ  
ચમત્કાર જાગ્યો.

પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ કરી પન્યાસલુ મહારાજે સામટેથી  
વિહાર કરી પાલગઢ થિંને અગાસી, યોરીવલી, મલાડ, અંધેરી,  
શાંતાકુજ, હાદર, ભાયઅલા થિં સુંભિં લાલખાગના ઉપા-  
શ્રયમાં પખાયો. સં. ૧૬૮૮ તથા ૧૬૮૯ નાં પાંચીસ છત્રીસમાં  
આતુમોસ સુંભિંમાં કર્યો.

ચાતુર્માસ પછી ફરી વિહાર કર્ણી, હાઈર વગેર થઈ લાઈ-  
ર, અગાસી, ફંડાણું થઈને વોલવડ પધાર્યાં.

વોલવડમાં જૈન મંહિર તથા ઉપાક્રમયની જોઇએ તેવી સગ-  
વડ ન હોવાથી આગેવાનોને ઉપદેશ આપીને બજે ધર્મસ્થાનો  
સગવડવાળાં કરાવ્યા. વોલવડથી વિહાર કરી અચારી, વાપી,  
ભગવાડા થઈ વલસાડ પધાર્યા. વલસાડના સંઘનો આગહ  
હોવાથી ત્યાં થોડીવાર સ્થિરતા કરી, વલસાડથી નવસારી  
થઈને સુરત પધાર્યાં, સં. ૧૯૮૫ નું સાડત્રીશસું ચાતુર્માસ  
સુરતમાં કર્યું.

ચાતુર્માસ પછી આમોદ્ધારની દ્રષ્ટિથી સુરત લુદ્ધાના ગામ-  
ડાઓમાં ફરતા ફરતા કઠોર પધાર્યાં, શ્રી સંઘના આગહથી  
સં. ૧૯૮૬ નું આડત્રીશસું ચાતુર્માસ પન્યાસળ મહારાજે કઠો-  
રમાં કર્યું. આ ચાતુર્માસમાં પન્યાસળ મહારાજ હોવાથી  
આસપાસના ધણ્ણા ભાઈ બહેનો પણુંપણું કરવા આવ્યા હતા.  
પણુંપણું બહુ આનંદપૂર્વક થયાં. ઉપજ પણ ધણી સારી થઈ.  
પન્યાસળ મહારાજે ચાર ચાર અને પાંચ પાંચ ઉપવાસ એક  
એક પારણુંને અંતરે ત્રણ માસ સુધી કરીને તપશ્રયાની  
જવલંત ભાવના પ્રદર્શિત કરી.





## ધર્મ-ચર્ચા

( ૨૧ )

‘સાહેબ ! આજે મુનિશ્રી ન્યાયવિજ્યલુ અતે પધારે છે.’  
એક ગૃહદર્શે સુમારા આખ્યા.

‘અહું આનંદની વાત ! તેઓ તો શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય  
શ્રી વિજય ધર્મસૂરીલુના વિદ્ધાન શિષ્યરત્ન છે. સંસ્કૃતભાષાના  
પ્રભર પાડિત છે. તેમની કવિત્વ શક્તિ પણ અનેડ છે. તેઓએ  
જૈન હર્થેના પણ ધર્ષાં સુંદર પુસ્તકો લગ્યાં છે. તેઓ તો  
ન્યાયવિશારદ અને ન્યાયતીર્થ છે. તેમના પરિચયથી મને તો  
આનંદ થશે. ધર્મચર્ચાને આનંદ આવશે.’ પન્યાસળુએ  
આનંદ ઠયકત કર્યો.

‘પધારે ! વિદ્ધાન મુનિરત્ન ન્યાયતીર્થલુ ! તમારા આગ-  
મનથી ધણ્ણો આનંદ યશે.’ પન્યાસળુએ લાવકયો આવકાર  
આપ્યો.

‘મથ્યેષુ વંદામિ ! પન્યાસળ મહારાજ મને આપના  
પરિચયથી લાલ થશે. જ્ઞાનગોચિ થશે. તમારા અતુલબેનો અને  
આમીદારની દ્રષ્ટિનો લાલ મળશે.’ મુનિ ન્યાયવિજ્યલુએ  
વિનય ફશોંયો.

ચાતુમોસ બાઢ કડેલથી વિહાર કરી પન્યાસળ મહારાજ સાયણુ પધાર્યાં. સુરતથી મુનિરલ શ્રી ન્યાયવિજયલુ પણ સાયણુ આંદ્યા. પન્યાસળ મહારાજ શાસ્ત્રવિશારદ જૈનાચાર્યો શ્રી વિજયધર્મસૂરીલુના ધર્મપ્રભાવના તથા સાહિત્ય પ્રચારના કાર્યથી વાકેક હતા. તેમના શિષ્યોની વિદ્વતાથી પણ પરિચિત હતા. ન્યાયતીર્થ મુનિરલ શ્રી ન્યાયવિજયલુના પુસ્તકો તથા વિચારોથી વિશેષ જાણુકાર હતા. સાયણુમાં ખજેનુ' મિલન અનુપમ હતું. ખજેના હૃદયમાં એક ખીળ પ્રત્યે ઉચ્ચં ભાવના અને ભમતા હતી.

આને પન્યાસળ મહારાજને ખીલે ઉપવાસ હતો. પન્યાસળ મહારાજની દીર્ઘ તપક્રીયો વિષે જાણુને ન્યાયવિજયલુ મહારાજને ખૂબ ભાવ થયો. કુરસદનો વખત મેળવી તેઓ પન્યાસળ મહારાજ પાસે આવતા અને અનેક વાતોલાખ કરીને ખજે સમયનો સદ્ગુપ્તયોગ કરતા.

પન્યાસળએ અહમતુ' પારણુ' કહ્યું. મુનિશ્રી ન્યાયવિજય પણ કુરસદ લઈને આંદ્યા.

'સદ્ગુલાંયે આપણે નાના એવાગામમાં મળ્યા છીએ. અહીં શહેર જેટલી ધમાત કે ખીલુ પ્રવૃત્તિ નથી. તમે છો ન્યાયતીર્થું, ન્યાય વિશારદ અને વિદ્વાન. આપણે થોડી ધર્મચર્ચા કરીએ. તેમાંથી ધણું જાણવાનું મળશે.' પન્યાસળએ વાતની શરૂઆત કરી.

'મહારાજશ્રી! હું ન્યાયતીર્થ છું, પણ તમારા જેટલો અનુભવ મને કયાં છે! આપ તો પૂજ્યપાદ મોહનલાલલુ મહારાજના ગાઢ સંપર્કમાં આંદ્યા છે. તેમનો પુણ્ય પ્રભાવ પ્રસિદ્ધ

છે. તમે પણ શાખના બાણુકાર છો. છતાં વિચાર વિનિમય કરવાથી લાભ જ થશે.' ન્યાયવિજ્ઞયળુએ સંમતિ દર્શાવી.

ખેડી તો હસ હિવસ સુધી જ્ઞાનગોધિ ચાલી. સાચું સ્વામી-વાત્સલ્ય માત્ર જમણુવારોમાં નહિ પણ સ્વામી લાઈએને પોતાના જ આપ્તજ્ઞનો જાણી તેઓને ઉદ્ઘોગ ધંધે લગાડવા જોઈએ. હાનમાં સુપાત્રહાન અને કુપાત્રહાનની પણ ચર્ચા થઈ. ઉપધાન પ્રવૃત્તિ હિતકારી છે પણ તેમાં શાંતિપૂર્વક કિયા થની જોઈએ. ઉપધાનતું રહસ્ય સમજનવલું જોઈએ અને તેની પાછળ ઓછામાં ઓછા. અર્ય થવો જોઈએ જેથી સામાન્ય સ્થિતિનો ભાવિક ભાષુસ પણ ઉપધાન તપોના લાલ લઈ શકે. આસ્તિક નાસ્તિક વિષે પણ રસપ્રહ ચર્ચા થઈ અને જૈન સમાજની પરિસ્થિતિ તથા નાના નાના મતલેહોમાંથી ઉલ્લાસ થતા વિખ્વાહો વિષે પણ ચર્ચાઓ થઈ. આ બાબતમાં બન્ને સુનિરાનેએ તરસ્થ દૃષ્ટિ એવો વિચાર દર્શાવ્યો કે જ્યારે કોઈ પણ પ્રકારનો મતલેહ ઉલ્લો થાય ત્યારે પરસ્પર મળી એક-બીજાની દૃષ્ટિ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો સંતોષકારક નીવેડો આવે અને કુસંપના બીજ ન વવાય. કોઈ પણ બાબતમાં સમાધાનવૃત્તિ સુખ્ય રહેવી જોઈએ, પણ સમાજના કમનસીએ હમણા હમણા મતલેહો વધતા લાય છે એટલું જ નહિ પણ એક બીજને ઉતારી પાડવાની પ્રવૃત્તિ થાય છે તે કોઈ પણ રીતે ઈષ નથી. જૈન સમાજના શાષ્ટ્રા અને ડાદ્યા અશ્રેષ્ટરોએ આ બાબતમાં બદ્ધે પણોતું સમાધાન કરાવતું જ જોઈએ. જૈન સમાજને આ શોલે નહિ. આ અને આવા બીજા અનેક વિચારો બજે સુનિવરોએ કર્યા અને હસ હિવસ સુધી ધર્મચર્ચામાં રસપૂર્વક

ભાગ લઈ અનેક દિલ્લિ બિંહામોથી વિચારણા કરી. હેવદ્રાવ્ય-સ્વર્પનની ઓલીનું દ્રોય તથા ઉપધાનમાં માળ વગેરેનું દ્રોય વગેરે કિંબે પણ સ્પષ્ટતાથી ચચોમો થઈ અને તેમાં સુનિ રત્નશ્રી ન્યાયવિજ્યયજીએ નવી જ વિચારસરણી રજુ કરી. આ ધર્મચર્ચા આપણું ચરિત્રનાયકને તો ધાર્ણી ઉપયોગી થઈ પડી.

આજ પચચીસ વર્ષે પણ જૈન સમાજની એ જ ઇથા જોઈને ખેડ થાય છે. પ્રમાણિક મતલેઢો તો ડાય પણ મતલેઢોને કુકેલ થવો જોઈએ. તેમાંથી ડાદ્યા પુરુષોએ સમાધાનનો માર્ગ શોધવો જ જોઈએ. જૈન સમાજ જેવો શિક્ષ અને પ્રતિષ્ઠિત સમાજ તો કેવો. પ્રગતિશીલ અને સમુજ્ઞત ડાય આપણું ધર્મના ઝગડાએએ આપણું સમાજને છિન્ન બિન્ન કરી નાખ્યો છે. સમાજના પુનર્વિધાન કે નવસર્જન માટે તો હોઈને વિચાર સરળો નથી તે આપણું કમનસીણી છે.





## કદ્વાણુકારી કામો

( ૨૨ )

‘મથેણું વંદામિ !’ શુલાખચંહ લદ્વાભાઇ લેસ્તાનવાળાએ  
વંદણું કરી.

‘ધર્મલાલ ! તમારી સાધુ મુનિરાજે પ્રત્યેની અનન્ય  
અકિત વિષે જણ્ણીને અત્યાંત આનંદ થાય છે. શું સમાચાર  
છે, પન્થાસણાએ પ્રશ્ન કર્યો.

‘સાહેબ ! અમારા ગામમાં સુરતના ભાવિક ગૃહસ્થોએ  
ઉપાક્રમ તો બંધાવી આપ્યો પણ હેખરેખની ખાનીને લીધે  
કામ કાચુ રહ્યું છે અને દીવાલોમાં ફાટ પડી છે. તેને હમણુંના  
સુધારી લેવામાં આવે તો તો ટીક છે, નહિ તો ચોમાસામાં  
મુશ્કેલી રહેશે. સાધુ મુનિરાજને પણ ઉતારી નહિ શકાય.’  
ગુલાખચંહસાઇએ પરિસ્થિતિ જણ્ણાવી.

‘તમારી વાત સારી છે. પણ તેમાં ખર્ચ કેટલો છે !’

‘ગુરુહેવ ! ચોમાસા પહેલાં તેને સુધારી લેવામાં આવે તો  
તો તો ૧૦૦૦ રૂપીયામાં કામ થઈ જશે પણ જે ચોમાસું જવા  
હેવામાં આવશે તો તો પછી પાંચેક હન્દર જોઈશે.’

‘મથેણું વંદ્દામિ !’ જવેરભાઈ નગરીનહાસે વંદ્દથ્યા કરી.

‘ધર્મલાલ ! કઠોરમાં તો બધા સુખશાંતિમાં છે ને !’

‘ગુરુહેવ ! આપની કૃપાથી સુખશાંતિ છે. આપના પ્રતાપે  
આનંદમંગળ છે. આપશ્રીના પુષ્ટય પ્રલાવને અમે બધા ચાંડ  
કરીએ છીએ. કઠોરના એ હિવસો તો ભારે આનંદ અને ઉત્સ-  
વના હતા. મારા સરખું કામકાજ ફરમાવો.’ કઠોરભાળા જવેર-  
ભાઈએ વિનિતિ કરી.

‘જવેરભાઈ તમે તો ભાગ્યશાળી છો. તથ, જ્ય અને  
ધર્મદિલ્લિયામાં તમે શ્રદ્ધાવાન છો. તમારી કમાઈનો તમે તો  
પ્રસંગે પ્રસંગે સહૃદિષ્ટ્યોગ કરો છો. તમે હીક સમયસર  
આવી પહોંચ્યા છો.’

‘ગુરુહેવ ! આજા ફરમાવો. મારી લક્ષ્મીનો સહૃદિષ્ટ્યોગ  
ધર્માકાર્યમાં થાય એવાં મારા ભાગ્ય કયાંથી ?’

‘જવેરભાઈ ! આ ગુલાખયંડભાઈ લેસ્તાનના ધર્મનિષ્ઠ  
આગેવાન છે. તેમના લેસ્તાન ગામમાં ઉપાશ્રય તો સુરતના  
કાઈઓએ કરાવી આપ્યો છે પણ પૂરી હેખરેખ ન રહેવાથી  
દીવાલોમાં ચીરાડો પડી છે. જે ચોમાસા પહેલાં તેને સુધારી  
હેવામાં આવે તો ઓછા ઝર્યામાં થાય અને ચોમાસામાં સાંધુ  
સુનિરાજ પણ રહી શકે.’ પન્થાસજુએ પ્રેરણ્યા કરી.

‘સાહેબ ! તે માટે મારા તરફથી રૂ. ૧૦૦૦ આપીશા. ખસો પાંચસો વધારે જેઠશે તો પણ આપીશા.’

‘ધન્ય છે તમારી ભાવના ! હમણાં તો રૂ. ૧૦૦૦ થી કામ બની જશે પણ જરૂર હશે તો તમને શુલ્કાખ્યાંહસાઈ જણાવશો. તમે હવે જઈને ઉપાક્રય સુધારવાની તૈયારી કરો. અથાતુખાં આતું નામ. તમારું આવણું અને શ્રી જવેરભાઈની લક્ષ્મીનો અદ્ભુતયોગ થબો તે કેવો જેગાનલેગ થયો. કંદેવાય ? ધર્મ ઉધોતના કામો આ રીતે થતાં જ રહે છે.’’ પન્થાસ-લુચે સંતોષ પ્રગટ કર્યો.

“સાહેબ ! આપ સાહેબના પુણ્ય પ્રકાવથી જ આ ખધાં કાર્યો થાય છે. આપણી જ્યાં જ્યાં પધારો છો. ત્યાં ત્યાં આખાલવૃદ્ધમાં ધર્મભાવના પ્રગટે છે અને ગામેગામ મંહિરો, ઉપાક્રયો, ઉત્સવો થઈ રહ્યા છે. આસપાસના ખધાં ગામેગામાં નૈનધર્મની કેવી પ્રકાવના થઈ રહી છે !’’ બન્નેએ કદ્વાણુકારી કામો વિશે હક્કીકત હશોવી.

‘કાગ્યશાળી ! તમે તો જણો છો. ગામડાઓની લોણી-ભાળી પ્રજામાં ધર્મ શર્દીના બીજ વવાશે તો નૈનધર્મનો જ્યાખયકાર થશે. શર્દી કરતાં આમ પ્રહેણોમાં વિચરવામાં મને આનંદ આવે છે. તમારા જેવા કાગ્યશાળીઓના આત્મામાં ધર્મનો પ્રકાશ થાય તો અમારે બીજું શું જેઠાં !’’ પન્થાસ-લુચે આમપ્રહેણોમાં કાર્ય કરવાના લાભ હર્થાંયા.

શ્રી જવેરભાઈની જહોયતાથી કેસ્તાનો ઉપાક્રય સુધારીને મજબૂત ફરવામાં આવ્યો. સુરતથી વિહાર કરી ખરોલી, નવ-

સારી, અમલસાડ, પીવલીમોરા, ગણુહેવી, વલસાડ, પારડી, અગવાડા, વાપી, ઉમરગામ અને દોલવડ થઈને પન્યાસળું મહારાજ હાહાણું પધાર્યાં. હાહાણુના શ્રીસંઘે ભાવલીનું સ્વાગત કર્યું. ચં. ૧૯૮૭ તું ઓગણચાલીસમું ચાતુર્માસ પન્યાસળુએ હાહાણુમાં કર્યું.

હાહાણુના એ કુરિવાને વિષે પન્યાસળુએ ખૂબ સંબંધયું હતું. આજે અષ્ટમી હતી. વ્યાખ્યાનમાં હાહાણુના બધા આગેવાનો ઉપરાંત આસપાસના ધણા ભાઈ-ખણેનો પર્યુષણું કરવા આવ્યા હતા. મહારાજશ્રીએ ચેરસી ભણ્ણાવી, ખણેનોએ પન્યાસળુની વાણીનો લાલ લેવા તથા પર્વાધિરાજ પર્યુષણું પર્યાં રૂઢી રીતે ઉજવવાની ગરૂંલી સંભળાવી. પરચખાણો આપ્યાં અને પછી જણ્ણાંયું.

‘ભાગ્યશાળીએ, હાહાણુની હિન-પ્રતિહિન ઉજ્જ્વિત જેવામાં આવે છે, પુષ્ટેદ્વયથી તથા ધર્મ શક્ષાથી તમે બધા સુખી છો, પણ તમારામાં જે એ કુરિવાને છે તે નાયૂફ થવા જેઠાએ. લગ્ન પ્રસંગે હંજરોની પહેરામણી આપવાનો રિવાજ તો કોઈ રીતે ઈષ નથી. હરેકની સ્થિતિ સરખી નથી હોતી. શ્રીમંતોને લાઘે ખીજ સાધારણ સ્થિતિના માણસોને ધણું સહન કરવું પડે છે. દીકરી-જમાઈને તો આપવું હોય તેટલું જેમે ત્યારે આપી શકાય છે, પણ લગ્ન પ્રસંગે આપવાનો રિવાજ બંધ થવો જેઠાએ નેથી સ્વામીભાઈ સુખેથી રોટલો રળી શકે અને ધર્મ સાધનમાં તૈયાર રહે, વળી યુવાનો પણ પૈસાના મોહમાં તણું ધને માત્ર લક્ષ્મી મેળવવાની લાલસા રાખે તે કોઈ રીતે ઈચ્છિવા જોગ નથી. ખીલુ જોટી પ્રથા મરણ પાછળ દી ખીચડીનો રિવાજ

નિંદનીય છે. શ્રીમંત તો ગમે તે ખર્ચ કરે પણ સાધારણ વર્ગની શું સ્થિતિ ! એક તો ધરતું માણુસ જય અને ખીલુ તરફ પ્રણુ-ત્રણુ ૪-૫ મહિના સુધી રહેમાને દી ખીચડી અવરાવવી પડે તેમાં મધ્યમવર્ગને ધાણું જ સહેવું પડે છે. તમે તો જણો છો. મધ્યમવર્ગના ભાઈઓને ચોતાની ઝીના હાગીના વેચીને કે ધર ગિરવી મૂકીને મરણું પાછળ જમણું કરવું પડે છે. આ બંને પ્રથા મધ્યમવર્ગ માટે અત્યંત હાનીકર છે. તે સહંતર બંધ થવી જ જેઠાં તેમાં તમારું-તમારા સ્વામી ભાઈઓનું, તમારા હાહાણું અને સૌતું કલ્યાણ છે.'

આ પ્રવચનની જાહેર અસર થઈ. તેજ વખતે પંદર વીસ ગામના આગેવાનોએ બંનેમાં સુધારો કરવા વચન આપ્યાં. આ તો એક ચમત્કાર થયો. આખાલવૃદ્ધમાં આનંદ આનંદ ફેલાઈ રહ્યો.

પણ પણ ખર્ચમાં હાહાણુના શ્રી સંદે કુમકુમ પત્રિકા કાઢી ને આસપાસના જૈન ભાઈઓને નિમંત્રણ મોકલ્યાં અને પન્નાસ-ળની જ્યાખ્યાન વાણીનો લાભ લેવાની દ્ધિએ આસપાસના ધણ્ણા ડુંડુંએ. પણ પણ કરવા હાહાણુ આંદ્યા હતા. હાહાણુના સંઘ તરફથી મોદું રસોડું એલવામાં આંદ્યું અને પંદર દિવસ સુધી હળર હળર માણુસોની સ્વામીભક્તિ હાહાણુના શ્રી સંદે આનંદપૂર્વક કરી હતી. આ સેવા કાર્યમાં શેઠ ધન-રાજણ દેવરચંદળ, પુનમચંદળ ચુનિલાલણ, છગનમલણ, મીશ્રીમલણ, નગરશેઠ મીશ્રીમલણ એથરા, ફેજમલણ મોટાણ, ચુકાખચંદળ એથરા અને શેઠ તારાચંદળ વગેરે આગેવાનોએ સારો એવો લાભ લીધો હતો. કાર્ત્તકી પુનમે હાહાણુ શહેરથી

વિહાર કરી પન્થાસળ મહારાજ હાહાણુ દેશન પદ્ધાર્યો. ત્યાં સામટા બંહરવાળા ધર્મનૃષ્ઠ શેડ હરખચંદળ લક્ષ્મીચંદળ તરફથી માટે મંડપ તૈયાર કરાવી તેમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય તીર્થને નવીન સુંદર પહું બાંધવામાં આવ્યો. હાહાણુમાં પહું બાંધવાનો રિવાજ હતો નહિ, પણ પન્થાસળ મહારાજશ્રીની પ્રેરણુથી પહુંના દર્શનની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી. આસપાસના ગામોના ઘણા ભાઈઓ-ખણેનો પહુંના દર્શને આવ્યા હતા. પૂજા તથા સ્વામીવાત્સલ્ય પણ કરવામાં આવ્યા હતાં. હાહાણુથી વિહાર કરી વોલવડથી બોારડી પદ્ધાર્યો. બોારડીમાં ઉપાશ્રયનું કામ અટકી પડ્યું હતું. પન્થાસળ મહારાજે ઉપદેશ આપી. (દા. ૨૦૦૦) કેગા કરાવ્યા અને ઉપાશ્રયનું કામ પૂર્ણ કરાવ્યું. બોારડીથી વિહાર કરી ઝણુસાવાળા શેડ અમરચંદળ મૂલચંદળ છાંઝેડના નવા બંગલામાં પૂજા ભણ્યાવીને સ્વામીવાત્સલ્ય થયું. ઝણુસા પદ્ધાર્યો. ઝણુસામાં બર દહેરાસર શેડ ગંલીરમલલ છાંઝેડના મકાનમાં હતું પણ ઉપાશ્રયની વ્યવસ્થા નહોંતી. પન્થાસળએ ઉપાશ્રય માટે પ્રેરણું કરી. અમરચંદળ છાંઝેડ વિનિતિ કરી કે—

‘ શુરૂહેવ ! ઉપાશ્રયનો લાભ શ્રીસંઘ મને આપે. હું ઉપાશ્રય અને દહેરાસર બન્ને કરાવી આપીશ. મારી ભાવના પૂર્ણ કરો. ’

શ્રી સંઘ ધન્યવાહ સાથે અમરચંદળ છાંઝેડની વિનિતિ સ્વીકારી, અને એ માળનું મકાન તૈયાર કરવામાં આવ્યું. ઝણુસાથી વિહાર કરી પન્થાસળ વાપી પદ્ધાર્યો. નાપીના શ્રીસંઘે ભાવલીનું સ્વાગત કર્યું. પન્થાસળ મહારાજ હાહાણુ હતા

ત્યારે વાપીમાં શ્રી મગનીરામ વંદ્નાયો ગયેત્તા. તેમની તખીયત નરમ રહેતી હતી. તેમણે મહારાજાશ્રીને પૂછ્યું કે મને કોઈ એવી તપશ્ચર્યા બતાવો કે મને મારા તન-મનની શાંતિ મળે. પન્યાસળુ તો હીર્દતપસ્વી. તેમણે તો ૮૧ આયંબિલની હીર્દતપશ્ચર્યાની વાત શેઠ મગનીરામજીને કહી અને જણાયું કે મને તો આયંબિલની તપશ્ચર્યામાં સંપૂર્ણ શ્રદ્ધા છે. તમે પણ શ્રદ્ધા રાખો અને આયંબિલની તપશ્ચર્યા કરી જુઓ. તમને તનની ને મનની તો શાંતિ રહેયો. પણ અધિષ્ટાયક દેવની કૃપા અને નવપદજીના પ્રભાવથી ધનની પણ વૃદ્ધિ થશે. પન્યાસળુ જેવા હીર્દતપસ્વી, પુષ્યપ્રભાવક તથા વચનસિદ્ધ શુરૂવર્યના વચનમાં શ્રદ્ધા તો હતી જ અને શરીરની શક્તિ નહેતી છતાં શ્રદ્ધાપૂર્વક ૮૧ આયંબિલનો નિર્ણય કરો અને ઉચ્ચ તપશ્ચર્યા શરૂ કરી. પન્યાસળુ વાપીમાં પદ્માર્થી ત્યારે તપશ્ચર્યા ચાલતી હતી તે જોઈને પન્યાસળુને આતંક થશે. પન્યાસળુ મહારાજને તપશ્ચર્યાના પારણું સુધી વાપીમાં સ્થિરતા કરવા અને શુરૂદેવના મંગળ હસ્તે પારણું કરવા શેઠ મગનીરામે અભિગ્રહ લીધો. પન્યાસળુએ વાપીમાં સ્થિરતા કરી.

શેઠ મગનરામજીની ૮૧ આયંબિલની તપશ્ચર્યા પૂર્ણ થઈ, તપશ્ચર્યામાં હમેશાં પન્યાસળુના વંદ્નાયો શેઠ મગનરામજી જતા, પૂજા ભાવપૂર્વક કરતા, બ્યાખ્યાન સાંભળતા અને શાંતિપૂર્વક ઘેર નોકારવાળી ગણ્યતા. પન્યાસળુના મંગળ આશીર્વાદથી નિર્વિધને તપશ્ચર્યા પૂરી થઈ. પારણાનો દિવસ આવી પહોંચયો. પન્યાસળુ મહારાજને ભાવપૂર્વક ઘેર પગલાં કરાયા. આહારપાણી પોતે જતે વહોરાયા. કૃપાં તથા કામળ પણ આગ્રહપૂર્વક

વહેઠારાંથાં, આનંદિદ્વાસથી પારણું કર્યું. રોગ તો શરીરમાંથી નિમૂળ થઈ ગયો. મન પણ શાંત, સંયમી અને પ્રકૃષ્ટ રહેવા લાગ્યું. અધિકાર્યની કૃપાથી વ્યાપારમાં પણ લાભ થયો. અચોરના બારવતની પૂજા ઠાડમાઠથી અણુવવામાં આવી. પન્યાસળુના આશીર્વાહ ઇણ્યા. વાપી અને આસપાસના આમપ્રહેશમાં આ હીધે તપશ્ચયો અને પન્યાસળુના પુણ્યપ્રલાવની પ્રશંસા થવા લાગી.

વાપીથી વિહાર કરી ફરેગામ થઈ પન્યાસળાંદારા પદ્ધાર્યાં. શોઠ નેમીચન્દળ તથા શોઠાંકુલયાંદળ તરફથી પૂજા અણુવવામાં આવી તથા સ્વામીવિત્તસદો થયા. પન્યાસળુના વ્યાખ્યાનમાં જૈનો તેમજ જૈનેતરો પણ આવતા હતા. એક હિવસ ઝીરંગી લેડેના ધર્મશુરુ ચોતાના સમુદ્ધાય સાથે ધર્મચર્ચા માટે પન્યાસળ પાસે આવ્યા. એક કલાક સુધી છશ્વર, કર્મ, પુણ્યપાપ, મૂર્તિપૂજા, સ્વર્ગ, તીર્થાંકરો તથા નવતર્ત્વો અને જીવવિચાર વિષે રસપ્રદ ચર્ચા થઈ. પન્યાસળએ સરળતાથી જૈન તત્ત્વજ્ઞાન સમજાંદ્યું. ઝીરંગીના ધર્મશુરુને ખૂબ આનંદ થયો. જૈનધર્મના સિદ્ધાંતોથી તેમને ધાર્યું ધાર્યું જાણુવાનું મળ્યું.





## દાદાસાહેણોની દેરીએનો જગ્યોદ્ધાર

( ૨૩ )

‘મથ્યેશુંદામિ ! અંલેટીના શેડ ચીમનલાલ નાનયંદં  
તથા શેડ કેશવલાલભાઈ અને મરોડીવાળા શેડ ચીમનાલ  
વગેરેએ વંદણા કરી.’

‘ધર્મલાલ !’ પન્યાસલુએ ધર્મલાલ આપ્યો.

‘સાહેબ ! આપે તો આ ત્રામ પ્રહેણોમાં ધણાં ધણાં  
કલ્યાણ કામો કર્યાં. જૈનશાસનની પ્રકાવના ધણી થઈ. શેડ  
મગનીરામલુની ૮૧ આયંભિલની તપક્ષીયો અને તેની પૂર્ણા-  
હૂતી અને ઉત્સવ વગેરે વિષે જાણીને તો બધાને આશ્વર્ય થયું.’  
કેશવલાલ ભાઈએ ત્રામ પ્રહેણોના કલ્યાણ કામો વિષે પ્રશંસા કરી.

‘ભાઈ ! હું તો નિમિત્ત માત્ર છું. ધર્મના કાર્યો થાસન-  
ફુવતી કૃપાથી નિવિધને થતાં જ રહે છે. તમે તો જણ્ણું છો મને

આમગૃહેશોમાં વિચરવાનો અને ગામડાના લોળા ભાવા ભાઈ-ખણેનોમાં ધર્મનો હીપ પ્રગટાવી તેમનામાં શ્રદ્ધા અને ધર્મ-સંસ્કાર દ્રઢ કરવા તરફ વિશેષ પ્રેમ છે. તપશ્ચર્થી તો તન-મન-ધનના કલ્યાણ માટેનું મહાત્મત છે.' પન્યાસળુએ તપશ્ચર્થીનો મહિમા દર્શાવ્યે.

'ગુરુહેવ ! કૃપા કરી મરોલી પધારો. મરોલી તો આપે જેયું છે. કેવું મળનું નાનકડું ગામ છે ! શ્રદ્ધા પણ સારી છે. મંહિર તો છે, પણ ઘર ફરેરાસર માત્ર છે. અમારી ભાવના સ્ટેશન ઉપર સુંદર જૈન મંહિર અને ઉપાશ્રય કરવાની છે. આપણી પધારો તો અમારી ભાવના મૂર્ત્તિમંત થાય ?' મરોલીના શેઠ ચીમનાળુએ વિનંતિ કરી.

'ભાગ્યશાળી ! મરોલી જેવા નાનકડા ઝ્યાળા ગામમાં જૈન મંહિર તો જેઠિયે. સાધુ સાધીના વિહારનું તે સ્થળ છે. તમારી ભાવના જરૂર ઝળશે, હું અગવાડા, વલસાડ, ધીહી-મોરા, નવસારી થઈ મરોલી આવીશ. તમે પ્રાથમિક વિચારણા કરી રાખશો.' પન્યાસળુએ સંમતિ આપી.

પન્યાસળ હાદરાથી વિહાર કરી વાપી, અગવાડા, વલસાડ વગેરે થઈ મરોલી પધાર્યી મરોલીમાં સંદે ભાવભીનું સ્વાગત કર્યું. સંઘના આભાલવુદ્ધમાં આનંદ આનંદ છિંબાઈ રહ્યો. પન્યાસળુએ વ્યાખ્યાનમાં જૈનમન્હિર તથા ઉપાશ્રય માટે પ્રેરણા કરી અને તુરત જ વાળીનું જાહુ થયું. અંલેટીવાળા શુરૂબકડા શેઠ ચીમનદાલે પોતાના જીનની જગ્યામાંથી થોડી જગ્યા મજૂત કાઢી આપી. દીપ પણ સારી ભરાઈ ગઈ. એ માળનું મનોહર

મહાન તૈયાર થયું. નીચેના ભાગમાં ઉપાશ્રય રાખવામાં આવ્યો. ઉપાશ્રય માટે નડોહવાળા શેડ પાનાચંહ ઐતાળુએ ઉદ્ઘારતાથી રૂ. ૬૦૦૦ આપ્યા. માળ પર મંહિર રાખવામાં આવ્યું. જૈનમન્દિર અને ઉપાશ્રય થવાથી મરોલીની શોલા પણ વધી. સાંધુ સાંદીઓ માટે સુહર વિશ્રામ સ્થાન બન્યું. મરોલીમાં જૈનકુદુંઓ વધ્યાં. હુકાનો પણ ૬૦-૬૫ થઈ. બધા કુદુંઓ ધર્મ પ્રતાપે સુખી છે.

‘કૃપાસિંહુ ! આપશ્રીના પુણ્ય પ્રકાવથી અને પ્રેરણથી રૂ. ૩૦૦૦૦, ત્રીસ હજારનું જે ઇંડ હાદાસાહેબોની દેરીએના લુણોદ્વાર માટે થયું હતું. તે પ્રમાણે અંભાતની લુણુંશીંહ થયેલી હાદાવાડી તથા હાદાસાહેબોની દેરીએનો લુણોદ્વાર થઈ ગયો છે.’ અંભાતના બોણીલાલ મગનતાવે પન્યાસળુને હકીકત કહી.

‘બોણીલાલભાઈ ! હું વિચાર જ કરતો હતો. કે અહીંથી અંભાત થઈને પછી આગળ જવું. મને હાદાસાહેબની દેરીએની ચિંતા હતી જ. લુણોદ્વાર શરૂ થવાની વાત જાણી હતી, પણ કામ ક્યાંસુધી પહોંચ્યું તેનો જ્યાદ નહોતો. હવે તમારી વાતથી જંતોષ થયો.’ પન્યાસળુએ સંતોષ બ્યક્ત કર્યો.

‘સાહેબ ! મને મન સાક્ષી. આપે અંભાત યાદ કર્યું અને હું આવી પહોંચ્યો. હાદાવાડી તથા ત્રણે હાદાસાહેબોની દેરીએ ઘણ્ણી મનોહર થઈ તૈયાર છે. આપશ્રી અંભાત પધારો અને પ્રતિષ્ઠા કરવો તો હાદાશુરાંબોનો જયજયકાર થઈ જય.’ શેડ બોણીલાલભાઈએ વિનિતિ કરી.

સૂરતથી ખંબાત તરફ વિહાર કર્યો. ભર્યા, સમની, જરૂરસર, કાવી તીર્થ થઈ સારેછને આરે થઈ પન્યાસળ મહારાજ રાતજ પધાર્યો. ખંબાતની પાંચે જ્ઞાતિનો સમૃદ્ધાય ત્યાં આવી પહોંચ્યો. શેઠ લોગીલાલભાઈ તરફથી પૂજા અણુવવામાં આવી તથા સ્વામીવાતસદ્ય કરવામાં આવ્યું. એને હિસે શક્રપુરામાં ચીંતામણી પાર્શ્વનાથના હર્ષન કરીને શહેરમાં પધાર્યો. શ્રીસંગ્રામભૂતિનું સ્વાગત કર્યું. ખંબાતની પાંચે જ્ઞાતિના આગેવાનોની હાજરીથી સામૈયું ઘણું જ દીપી રહ્યું. શ્રી ચિન્તામણી પાર્શ્વનાથના હર્ષન કરી માણેકચોકના ઉપાશ્રયે પન્યાસળ મહારાજ પધાર્યો. માંગલિક સંલગ્નાંયા બાંડ શુરૂકર્ત શેઠ લોગીલાલભાઈએ પ્રભાવના કરી. ખંબાતના આભાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.

પ્રતિષ્ઠાની તૈયારી થવા વાગી. શેઠ છોટાલાલભાઈ મગનલાલ નાણુબટીએ સં. ૧૯૮૮ નાં જેઠ શુદ્ધી ૧ થી અદ્ભુતમહોત્સવ શરૂ કર્યો. જળ જત્રા વગેરે વરધીડા ડાઢમાઠથી કાઢવામાં આવ્યા. હમેશાં વિધ વિધ પ્રકારની પૂજા અણુવવામાં આવતી. રાત્રે ભાવનાચ્ચામાં સંગીત વિશારદોનો એવો તો જીવસો જમતો કે તે સંલગ્નવા માનવ મેહની ઉમટી પડતી. મહોત્સવને છેલ્લે હિસે દાદાવાડીમાં જગત વિખ્યાત કલિકાલ કદ્વપતૃ જગતી જ્યોત સમા, ભક્તજ્ઞનોના પ્યારા, હાજરાહુભૂર વડા દાદાશ્રી યુગપ્રધાન શ્રી લુનહસ્તસૂરિ, મણિધારી શ્રી લુનચંદ્રસૂરિ, પુષ્ય પ્રભાવક શ્રી લુનકુશલસૂરિ આહિ દાદા શુરૂએની ચરણુપાહુકા-ઓની પ્રતિષ્ઠા ધામધૂમપૂર્ણક કરવામાં આવી. આ પ્રતિષ્ઠા ઉત્સવ જોવા માટે ખંબાતના ફળરો ભાઈ-ભણેનો ઉમટી આવ્યા હતા.

પન્થાસળ મહારાજે આનંદ ઉત્કાસપૂર્વક પ્રતિષ્ઠા કરાવી, હાંશુરાંયોનો જ્યોતિરાચાર થઈ રહ્યો.

મહેતસ્પને છેલ્લે હિસે નાણુાવટીભાઇએ તરફથી સંઘ જમણુ કરવામાં આંદ્રું. શ્રી સંઘના આગ્રહથી પન્થાસળ મહારાજનું સં. ૧૯૮૮ નું ચાલીશમું ચાતુર્મોસ અંભાતમાં માણ્યેકચેાકના ઉપાશ્રયમાં થયું.





## શ્રી માણીભદ્રવીરની દેરીનો જગ્યોદ્ધાર

( ૨૪ )

‘ગુડહેવ ! માતર તીર્થના સાચાહેવ શ્રી સુમત્રિનાથ બગાનના ખાવન જીનાલયની યાત્રાએ જવા અમારી ભાવના છે. આપણી પધારો તો યાત્રાનો આનંદ આવે.’ કેટલાક ભાઈઓએ વિનિતિ કરી.

‘ભાઈ ! ભારી પણ ભાવના ઘણા સમયથી સાચાહેવની યાત્રા કરવાની છે. તમે અધાર આવતા હો તો વિશેષ આનંદકારી. કરો તૈયારી.’ પન્યાસળુંએ સંમતિ હશ્યોવી.

‘સાહેબ ! માતર પાસે સોળુત્રામાં એક ઉપાશ્રયમાં પૂર્વીભાર્યના હસ્તે ખાવન વીરમાં સુખ્ય ગણ્યાતા શાખનરક્ષક શ્રી માણીભદ્રવીરની સ્થાપના થયેલી છે. તે ચમત્કારી છે.’ એક ગૃહરથે વીરમાણીભદ્ર વિષે વાત કરી,

‘માતર સાચાહેવની યાત્રા કરી આપણે જરૂર સોલુના  
જરૂર શાસનરક્ષક વીર માણીભદ્રના હર્થન કરીશુ’.’ પન્થાસળાએ  
લુણાસા હશોવી.

ચાતુર્માસ આહ આવક શ્રાવિકાના બહેણા સમુદ્દરાય સાથે  
પન્થાસળ માતર પદ્ધાયો. માતરમાં સાચાહેવ શ્રી સુમતિનાથ  
ભગવાનની અલૌકિક મૂર્તિના હર્થન કરી આનંદ અનુભંગ્યો.  
આવન લુનાલુયના મનોહર હહેરાસરલુ માતર જેવા નાનકડા  
ગામમાં જોઈને પ્રાચીન ‘નભરની ઝાંખી થઈ. સાચાહેવને જૈનો  
ઉપરાંત હિંદુ સુસ્થલમાન બધા માને છે અને મેળા પ્રસંગે  
તો અઠારે આલમ સાચાહેવના હર્થન કરી પાવન થાય છે.  
આખા સંઘે માતરમાં ખૂબ આનંદ અનુભંગ્યો—પૂજા લાણુવામાં  
આવી, સંઘ જમણુ થયું અને આનંદ આનંદ થઇ રહ્યો.

માતરથી કેટલાક કાઈએઓ પન્થાસળ સાથે સોલુના  
માણીભદ્રવીરના હર્થને ગયા. પન્થાસળ તો પ્રવીચાર્યના  
હસ્તે પ્રતિષ્ઠિત થયેલી, બાવનવીરમાં પ્રમુખ શાસન રક્ષક  
શ્રી માણીભદ્રવીરની ચમતકારી પ્રતિમાના હર્થન કરી સુંગ થયા.  
લેએ તો ત્યાં ધ્યાનમાં એસી ગયા. શ્રી માણીભદ્રવીરનું ધ્યાન  
ધરવા લાગ્યા. ઉપાશ્રયમાં અજ્ઞાન શાંતિ હતી. પન્થાસળનું  
ધ્યાનમાં લીન હતા. ધ્યાનમાં જ જોખી અવાજ સંભળાયો.  
‘અહીંથી અંભાત પદ્ધારો, ત્યાં માણુક્યોફના ઉપાશ્રયમાં ચમ-  
તકારી માણીભદ્રવીરની ફેરીનો લુણોઢાર કરો.’ આ અવાજ  
સાંભળી પન્થાસળ આશ્રમ્ય ચકિત થઈ ગયા. માણુક્યોફના  
ઉપાશ્રયમાં તો ચેતે ચાતુર્માસ કરેલું પણ તે વખતે કશો વિચાર  
આ લુણું ફેરી માટે આવ્યો. નહિ અને આ પ્રાચીન મૂર્તિએ

પન્થાસળુને સંહેશ આપ્યો. તે જાળીને પન્થાસળુનો આત્મા ખૂબ પ્રસન્ન થયો. ધ્યાનમાંથી જ્યારે તેઓ ઉક્ખા ત્યારે શ્રી માણી-ભદ્રની મૂર્તિં તેજસ્વી જગ્યાવા લાગી. પોતાના અંતરમાં પણ પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો. આવી ચમતકારી પ્રાચીન મૂર્તિંથી પન્થાસળુના આત્મામાં આનંદની લહેરો લહેરાણી. પન્થાસ-ળનું સુખાવિંદ તેજથી જળહળવા લાગ્યું.

પન્થાસળ સોલુત્રાથી વિહાર કરી અંભાત પધાર્યો. માણી-કચોકના ઉપાશ્રયમાં પધાર્યો. અંભાતનો આ માણીકચોકનો ઉપાશ્રય કલિકાળ સર્વંશ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સમયમાં અનેલો ધંઢો પ્રાચીન છે. વૃદ્ધ પુરુષો કહે છે કે આ ઉપાશ્રયમાં એક લોંઘરં છે-તેનું ખીંચુ દ્વારા કાવી ગામના બળરમાં પડે છે. એ ઉપાશ્રયમાં પાચ્ચંચન્દ ગરછીય શ્રી બાતૃચંદ્રસૂરિલુના ત્રણ ચાર ચાતુર્મીસ થયાં હતાં. આ પ્રાચીન ઉપાશ્રયમાં શ્રી જૈન શૈતાંખર સંઘના રક્ષક, ધર્મનિષ્ઠ શ્રદ્ધાળું પુરુષોના સંકટ હરનાર, શાસનોભાતિના હરેક કાયોમાં સહાયક થનાર અને બાવન વીરમાં શિરોમણી, વડવીરતું બિદ્રહધારક જગતિ જ્યોતસમા શ્રી માણી-ભદ્રવીરની આદહાદકારક મનોહર દર્શનીય મૂર્તિની સ્થાપના આ ઉપાશ્રયની મધ્યમાં પૂર્વાચાર્યના હાથે થયેદી છે.

પન્થાસળ મહારાજે પોતાને મળેલ જેણી સંહેશની વાત શ્રી સંઘના આગેવાનોને પોતાની રીતે સમબન્ધી.

“ લાગ્યશાળીઓ ! આ પ્રાચીન ઉપાશ્રય છે. કલિકાલ સર્વંશ શ્રી હેમચંદ્રાચાર્યના વખતનો ગણ્યાય છે. અહીં આપણા અનેક સંતો-મહાતો પૂર્વ પુરુષો અને જ્યોતિર્ધરા આવીને ધર્મ બાવના પ્રગટાવી ગયા છે. સાથે જ શાસન રક્ષક વીર માણીભદ્રલુની-

ચમત્કારી મૂર્તિં તમારા કલ્યાણ માટે બિરાજમાન છે. તે હાજરા હજૂર છે, અને જગતી જર્યોત છે. આવા પ્રાચીન ઉપશ્રયનો લણોદ્ધાર જરૂરી છે. તમારી લક્ષ્મીનો આવા ધર્મકાર્યમાં ઉપયોગ થાય તે તમારા અહોકાળ્ય ગણ્યાય."

પન્યાસળુની વાણીની ચમત્કારી અસર થઈ અને તુરત જ લણોદ્ધાર માટે ખંભાતના નગરશેઠ શ્રી ચંદુલાલ બાણુલાલ, અચ્છારીવાળા શ્રીયુત શેઠ રાયચંદ શુલ્લાભચંદ, સુરતના જવેરી શ્રીયુત કુસુમચંદ લલુભાઈ તથા ખજવાના મારવાડના શ્રીયુત શેઠ કિસનચંદ પુનમચંદ અને ફણસાના શેઠ અમરચંદ ભૂળચંદ વગેરેએ પોતાની રકમે લખાવી. લણોદ્ધારનું કાર્ય શરૂ થયું. નગરશેઠ ચંદુલાલ બાપુલાલબાઈની દેખરેખથી ઉપાશ્રય તૈયાર થઈ ગયો. શાસન રસીક માણીબદ્રવીરની મૂર્તિની દરીનો લણોદ્ધાર ૧૯૮૯ ના ફાગણ શુદ્ધ ૧ ને શનિવારના પૂર્ણ થયો.

લણોદ્ધારનું કાર્ય ચાલતું હતું. તેનો હિસાબ વગેરે દેખ. રેખનું કાર્ય સેવાબાવે હાહાણું પ્રગણાના હૃવીયર ગામના લૂંકડ ગોત્રીય વીસાએસવાળ શ્રી માનમહલ પન્યાસળ મહારાજના વિશેષ પરિચયમાં આંદ્યા. પન્યાસળુની પવિત્ર તપોમય લુધનપ્રભા તથા અમૃતવાળીથી પ્રભાવિત થઈને દીક્ષા માટે ઉત્સુક ફન્યા. માનમહલની પ્રમાણિકતા, સરળતા તથા ધર્મદ્રષ્ટિ જોઈને પન્યાસળમહારાજે તેમને દીક્ષાની સંમતિ આપી. સં ૧૯૮૯ ના કાર્તાક શુદ્ધ ૧૫ ના દિવસે ખંભાતમાં શ્રીસંધ સમસ્ત પોતાના વરદ હસ્તે દીક્ષા આપી. શ્રી શુલ્લાભમુનિના શિષ્ય તરીકે જહેર કર્યાં. શ્રી મહોદ્યમુનિ નામ સ્થાપન કર્યું".

ખંભાતથી વિહાર કરી મહારાજશ્રી સાયમા પદ્ધાર્યો. પન્થાસળુના દર્શન કરવા ખંભાતની પાંચે ઝાતિના આગેવાનો ઉપરાંત ખંભાતના નવાખ સાહેભના મામા તથા મસીઆઈ લાઈ પણ પોતાના જનાના સાથે મહારાજશ્રીના દર્શનાથે પદ્ધાર્યો. મહારાજશ્રીના ધર્મપ્રવચનોના અમૃતવચનો સાંભળી ખધા મુગધ થયા. જનતાની સેવા અને પ્રાણી માત્ર તરફ હયા દ્રોષ્ટિ એ સાચ્યા ધર્મ છે તે સમજાયું. ખંભાતના શુરૂકાઢત શેઠ લોણીલાલ નાણુાવટી તરફથી સ્વામીવત્સલ કરવામાં આયું.

તારાપુર, સોલુના, ડાસોઈ થઈ માતરની ફરી બાંના કરી પન્થાસળ એડા પદ્ધાર્યો.





## એ પ્રતિષ્ઠાયો।

( ૨૫ )

‘સાહેબ ! પૂર્વપુષ્ટયના ઉહ્યે શેડને ભાવના જગી અને પરામાં નહીને કિનારે નૈન મંહિરની પાસે સુંદર ધર્મશાળા અને ઉપાશ્રય કરાવ્યા છે. આપક્ષી ત્યાં પગલાં કરેા અને આપના વચનામૃતોનો લાભ આપો. ’ શ્રી હામોદરદાસ વિઠુલ-હાસના ધર્મપત્ની શ્રી મહુણહેને વિનિતિ કરી.

‘ મહુણહેન ! તમારી તો મેં સારી પ્રશંસા સાંભળી છે. તમે શ્રીમંત છો. છતાં ધર્મપ્રેમી છો અને શેડને તમેજ પ્રેરણું કરીને ધર્મશાળા તથા ઉપાશ્રય કરાવ્યાં છો. તમે તો સાધુ-સાધ્વીનું ચાતુર્માસ કરાવી જાતિભાઇઓને ધર્મમાર્ગેં જોડો છો અને આ તો મહાન પુષ્ટ ઉપાજનનું કાર્ય કરેા છો. ’ પન્થાસલુએ ધર્મનીષ મહુણહેનને ધન્યવાહ આપ્યા.

‘કુપાળુ ! અમારા ઐડામાં તો બધી જતની સામચી છે. ધર્મશાળા-લાઈફ્રેરી-પાઠશાળા-ઉપાશ્રય બધું છે. પણ સાહેબ જોઈએ તેવો સંપ નથી.’

‘તમારી વાત તો સાચી છે. તમારા જેવા શહેરમાં તો ધર્મને જ્યાખયકાર હોવો જોઈએ. પરમાત્માની કુપાથી રડા વાના થઈ રહેશે’ પન્થાસળ મહારાજ ઐડામાં શ્રી મણીધંદેનના ઉપાશ્રયમાં રહ્યા અને વ્યાપ્તિનવાણી સંભળાની ઐડામાં ધર્મનીયતિ લાંયા અને કુલંપને દૂર કરી શાસનની ઉજ્ઞતિ કરવા પ્રેરણું કરી.

ઐડાથી વિહાર કરી વટવા જૈનાશ્રમમાં એ હિવસ સ્થિરતા કરી અમહાવાહ પદ્ધાર્યાં. કોઠારી ચોળમાં આવેલા વખતશાહની હવેલીના નામથી મશદૂર ખરતરગચ્છીય જૈન ઉપાશ્રયમાં સ્થિરતા કરી. ઐતરયાળની ચોળની કન્યાપાઠશાળાની બહેનો અને કન્યાઓની પરીક્ષા લીધી. કન્યાઓને ધનિામેં આપવામાં આવ્યાં.

‘કુપાસિંધુ ! અમારા તરફથી ખંભાતના લુણું થઈ ગયેલા શ્રી કંસારી પાર્શ્વનાથના જૈન મંહિરનો લુણોદ્ધાર થઈ ગયો છે. આપ ખંભાત પદ્ધારો. પ્રતિક્ષા આપના મંગળ હસ્તે કરાવવા શ્રીસંધના આગેવાનોની ભાવના છે.’ શેઠ વાડીલાલ છોટાલાલે વિનિતિ કરી.

‘તમે તો લુણોદ્ધારનું કાર્ય જલ્દી પૂર્ણ કર્યું. હું ખંભાત ગયે વખે હતો, ત્યારે તો હજુ વાતચીત ચાહતી હતી.’ પન્થાસળએ આશ્રય હશોંયું.

‘સાહેખ ! આગેવાનોની હેખરેખ સારી, વળી કારીગરો પણ સારા મળી ગયા. કામ પણ સારું થયું છે. આપ પધારો તો ખાસ કરીને મને તો વિશેષ આનંદ થશે. આપની પ્રેરણાથી જ મેં કામ ઉપાડેલું અને હવે ખૂં થયું છે તો પ્રતિકાતું કામ પણ પતી જય તો આનંદ આનંદ.’ શ્રી વાડીભાઈએ પોતાની મનોકામના હથીવી.

‘ભાગ્યશાળી ! હજુ તો ગયે વરો ખંભાત ચાતુર્મોસ કયું’ ત્યાં પછી કરી તે તરફ આવવાતું શી રીતે અને ! આ અમારા નૂતન પ્રશિષ્ય શ્રી મહોદ્યમુનિના ગામમાં પણ પ્રતિકા કાર્ય છે. ત્યાંના ભાઈએ પણ રાહ લેઈ રહ્યા છે.’ પન્યાસળુએ મુર્કેલી રજુ કરી.

‘આ પ્રતિકા તો આપના હસ્તેજ કરાવવાની છે. પછી હું વિશેષ રેઝું તો કહેલે પણ આ વખતે તો ખંભાત આંધ્યા વિના ચાલશેજ નહિ. પછી ખુશીથી આપ બીજુ પ્રતિકા માટે પધારો.’ શ્રી વાડીભાઈએ વિશેષ આગ્રહ કર્યો.

આવી આગ્રહ ભરી વિનતિના કારણે પન્યાસળુએ અમહાવાહથી વિહાર કર્યો. સામટા પધારતાં ખંભાતની પાંચે જાતિનાં ધણાં ભાઈ-ભણેના મહારાજશ્રીને વાંદવા આંધ્યા. તે ભધાની સ્વામી-કુંડિત ખંભાતના શૈઠ વાડીલાલ છોટાલાલે સ્વામિવાતસદ્યદારા કરી. થાંજે હિવસે પન્યાસળનો નગર પ્રવેશ ભાવભીનો થયો. માણ્ણેકચોકના જૈનઉપાશ્રયમાં પધાર્યો. શ્રી સંઘના આખાવવુદ્ધને આનંદ આનંદ થઈ રહ્યો. પ્રતિકાના કાર્યની શરૂઆત મંગળ સુહૃતો કરવામાં આવી. ખંભાતની ઓસવાળજાતિના આગેવાન શૈઠ શ્રી વાડીલાલ છોટાલાલે લગ્નવાનને આહીએ એસાડવાનો

આહેશ મેળવી પ્રતિકાળે દિવસે પોતે શ્રી કંસારી પાર્વતાથને ગાહિએ બિરાજમાન કર્યો. શાન્તિસ્નાત્ર લણુવવામાં આવ્યું. તથા તેમના તરફથી સ્વામીવાત્સદ્વય કરવામાં આવ્યું. પ્રતિકાળું કાર્ય પન્યાસલુના મંગળહસ્તે આનંદપૂર્વક થવાથી શ્રી વાડી-લાવલાઈને ખૂબ આનંદ થયો. પન્યાસલુ મહારાજને વિશેષ સ્થિરતા કરવા પ્રાર્થના કરી પણ પન્યાસલુને માતરની યાત્રાની ભાવના હોવાથી પાંચે જ્ઞાતિના ભાઈ-ખણેનો ભાવભરી વિહાય આપી. પન્યાસલુ ખંભાતથી વિહાર કરી સાયમા, તારાપુર, સોલુગ્રા ડલોઈ, ખાંધલી થઈ માતર પધાર્યાં. માતરમાં સાચા-હેવના દ્વારાં કરી વિહારની તૈયારી કરતા હતા ત્યાં શરદીએ એકાએક આકમણ કર્યું. તાવ અને પછી ન્યુમોનીયાનો હુમલો થયો. માંદગીએ ઉત્ત્રસ્વરૂપ લીધું.

માતરના નગરશેઠ શ્રી ગોપાળલભાઈ વગેરેને ચિંતા થઈ પડી. નગરશેઠ શ્રી ગોપાળલભાઈ વૈષ્ણવ હોવા છતાં પન્યાસલુ મહારાજના સંપર્કથી સુસંકારવાળા અને અતુરાગી થયા હતા. તેમણે તથા જૈન સંધના આગેવાનો રાત દિવસ સેવાસુશ્રૂષા કરી. સરકારી હવાખાનાના ડોકટરે પણ ખૂબ કાળજીથી સેવા કરી. એકવીસ દિવસની લાંઘી માંદગી પછી સતત સેવાસુશ્રૂષાથી પન્યાસલુને આરામ થયો. આ વખતે અમહાવાહનો ૨૦૦૦ માણુસનો સંધ તથા વડવા આશ્રમથી આવેલો કવિ રાજ્યદ્રના અતુયાયીએનો ૧૦૦૦ માણુસોનો સંધ પણ એક જ દિવસે માતરમાં આવી પહોંચ્યો. માતરની ધર્મશાળા તો ચિકાર ભરાઈ ગઈ. આ વખતે આચાર્યશ્રી વિજ્યલભિધસૂરી અઢારેક હાણુએ સાથે આવી પહોંચ્યા. જગ્યા તો હતી જ નહિ પણ

આચાર્યશ્રી પન્થાસળુ મહારાજ હતા. ત્યાં આજ્યા ત્યારે પન્થાસળુએ ભાવપૂર્વક આવકાર આપ્યો. ‘સાંકડા મોકડે આપણે સાથે રહીશું. આપ બધા અતે જ આવી જાયો. તીર્થસ્થાનમાં જગ્યા ન હોય તો મારી ઝરાજ છે કે મારે મુનિવરો માટે જનતી વ્યવસ્થા કરી આપવી.’ પન્થાસળુની આ ઉદ્ધાર અને ભમતાભરી નીતિથી આચાર્યશ્રી નિજયતાધિસુરિને ભારે આનંદ થયો. પોતાની તથીયત બરાબર નહોંતી છતાં ચાતે જતે ઉભા થઈને આવકાર આપ્યો અને બધાને માટે સગવડ કરી આપી. અપોરના સુરિલુએ પન્થાસળ સાથે અનેક પ્રકારને વાતોલાપ કર્યો. હિંલ જોવીને વાતો કરી અને પરસ્પર આનંદ અનુભંગ્યો.

તથીયત બરાબર થવાથી ઐડા, મહેમહાવાહ, તથા વટવા થઈને અમહાવાહમાં જવેરીવાડામાં ભરતરગર્ભીય ઉપાશ્રેયે પદ્ધાર્યા.

અમહાવાહમાં અશાડ શુદ્ધ ૧૧ ના હિંસે મોટા દાઢા તરીકે પ્રસિદ્ધ શ્રી લુનદતસ્તૂરીલુની જ્યંતી પન્થાસળ મહારાજશ્રીના અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવી, શ્રીકૃણની પ્રભાવના થઈ. જૈનશાળાની બાળાઓને પુસ્તકોની લાણી આપવામાં આવી.

આ ચાતુર્માસમાં પન્થાસળુએ એક એક પારણુને આંતરે અહુમ-અહુમની ઉથ તપશ્ચયો ચાર મહિના સુધી કરી. ધન્ય તપશ્ચયો! ધન્ય ત્યાગ.

દાહાસાહેભની પોળમાં પ્રાચીન પૂર્વોચાર્યશ્રી લુનદતસ્તૂરીશ્વરાજ, શ્રી લુનકુશળસ્તૂરિલુ તથા શ્રી લુનચન્દ્રસ્તૂરિલુ તથા શ્રી લુનલાલસ્તૂરીલુ અને પુણ્ય પ્રભાવક મુનિશ્રી મોહનલાલલુ

મહારાજની ચરણું પાહુકાઓ તથા હાહાસાહેખના મન્હિરના નામથી પ્રચિન્હ પામેલા મંહિરને પન્યાસળ મહારાજની પ્રેરણુથી રંગ દોગાન કરાવી મંહિરને મનોહર બનાવી હીધું. મન્હિરની આપી રોનક બહુલાઈ ગઈ. સ'. ૧૯૮૬ તું એકતાલીસસું ચાતુર્માસ અમહાવાહમાં થયું.

અમહાવાહથી ઐડા, માતર થઈ ખાંધલી પધાર્યા. ખાંધલીથી તારાપુર, મોરજ થઈને ઈસરવાડે પધાર્યા. અહીં સાધુ-સાધીને ઉત્તરવાની ધર્ષી મુશ્કેલી હૃતી. પન્યાસળ મહારાજશ્રીની પ્રેરણુથી ઉપાશ્ર૟યની ટીપ કરાવવામાં આવી અને ઉપાશ્ર૟યનું કામ શરૂ કરવામાં આવ્યું. ઈસરવાડેથી ખંભાત, રાલજ, કાવી, જમ્બુસર, આમોદ, સમની, ભર્દ્ય, અંક્લેશર અને સાયણુ વગેરે ગામોભાં ઉપહેશ આપતા આપતા સુરત થઈ લેસ્તાન પધાર્યા. લેસ્તાનમાં શેડ શુલાખચંદ્રાઈએ આથહપૂર્વક રોક્યા. લેસ્તાનના જૈન જૈનેતર લાઈએને ખાસ નિમંત્રણ આપીને પન્યાસળનો ઉપહેશ સંભળાયો. ગામના લાઘા માણુસો પન્યાસળની વાણી સંભળી સુંગ થઈ ગયા. ધણું જૈનેતર બહેન લાઈએ રાત્રિલોજન, માંસ, મહિરા વગેરેના નિયમ લીધા. લેસ્તાનથી મરોલી, નવસારી, કાલીયાવાડી, સીસોહરા અને અણુહેવી થઈને ટાંકેલ પધાર્યા.

‘મથ્યેણ વંદામિ !’ હવીયરના શેડ પૃથ્વીરાજલુ તથા શેડ છગનહાલલ અને શેડ નવલમહલાએ વંદણા કરી.

‘ધર્મદ્વાર ! ભાગ્યશાળી ત્રિપુરી શું પધાર્યો છો !’ પન્યાસળએ પ્રશ્ન કર્યો.

‘સાડેબ ! આપના પ્રશ્નિષ્ય શ્રી મહોદ્યમુનિએ હીક્ષા પહેલાં ચોતાતું ઘર તથા જમીન જૈન મન્દિર અને ઉપાશ્રય માટે સંધને અપણું કરેલ તે ઉપર અમારા શ્રી સંદે નવીન મંહિર બંધાવી તૈયાર કરાયું છે તો પધારો.’ શેડ પૃથ્વી-રાજલુએ વિનિતિ કરી.

‘તમારે પ્રતિમાળ માટે સુશકેલી હતી ને ?’

‘કૃપાણ ! પ્રતિમાળ માટે તો ખડુ તફલીઝ રહી. અમારે શ્રી વિમલનાથલુની પ્રતિમાળની જરૂર હતી. ધણી ધણી તપાસ કરી પણ મળેજ નહિ. છેવટે અમદાવાહમાં તપાસ કરતાં ત્યાં અમારે જોઈતા શ્રી વિમલનાથલુ હતા. ત્યાં શેડ આણુંદળુ કલ્યાણલુની ચેઢીના કાર્યવાહકો શેડ અગુભાઈ સુતરીયા તથા ત્યાં બિરાજતા આચાર્ય શ્રી વિજયવલલસસૂરીશ્વરલુ તેમજ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરલુની પ્રેરણુથી શેડ આણુંદળુ કલ્યાણલુની ચેઢી હસ્તકના. શ્રી અળુતનાથલુના મંહિરમાંથી આચીન જન્ય પ્રતિમાળ મળ્યાં. તેનો પ્રવેશ વૈશાખ શુદ્ધ દ નો છે. પ્રવેશ આપના વરદહસ્તે કરાવવાની અમારા શ્રી સંધની કાવના છે તો તે સ્વીકારો અને શિશ્રી તે તરફ પધારો.’ શેડ નવદમતલુએ ખુલાસો કર્યો.

‘ભાગ્યશાળી ! તમારી વિનિતિ તો છે. પણ પંથ લાંબો ને હિવસો થોડા. મારાથી પહેંચી નહિ શકાય.’

‘હૃદાણ ! અમારે તો આપના મંગળ હસ્તે જ પ્રતિષ્ઠા કરાવવી છે. આપ હમણાં નહિ પધારો તો આ સુહૂતું જવા હુદ્ધશું. જયારે આપ પગલાં કરશો ત્યારે જ પ્રવેશ થશો. આપના

સિવાય પ્રવેશ થવાનો નથી.' શેઠ છગનલાલજીએ સંધની અવના રજુ હરી.

'તમે તો જખરા નીકળ્યા. લાંબો પંથ તેથી જ વિચાર કરતો હતો. પણ તમારી વ્યેરહાર વિનતિને માન્ય રાખ્યા સિવાય બાદે તેમ નથી. કરો તૈયારી. પન્યાસલુએ સંમતિ આપી.'

બધા ઝુઅ હળવિંત થયા. પન્યાસલુને વિહાર કરાવીને પછી જ ગયા.


ટાંકેતથી જદ્દી જદ્દી વિહાર કરતા કરતા બીજીમોરા, વલસાડ, પારડી, અગવાડા, વાપી અને સંભાળુ થઈ ઉમરગામ. પધારો. તેજ દિવસે પ્રતિમાળ પણ ત્યાં આવી ગયા હોવાથી ત્યાં નવપદજીની પૂજા લણુવામાં આવી.

બીજે દિવસે હીથર, ઘોલવડ અને હાહાળુંના આગેવાનો ઉપરાંત અમણાયના શેઠ તારાચંદ જેતાળુ તથા શ્રી મહેશ્ય સુનિઝીના સંસારી અવસ્થાના મસીઆઈભાઈ અચ્છારીવાળા શેઠ રાયચંદજીબાઈ, ઇણુસાના શેઠ મેધરાજજી અને સોલસમણાના શેઠ શુલાભચંદજી સંચેતી તથા શેઠ મોહનલાલ પોપટલાલ બાઈ વગેરે ધણુા ઉમરગામ પહેંચી ગયા. શ્રી વિમલનાથ-જીના પ્રતિમાળને સંભલાયી પાલખીમાં પદ્ધરાવી ઠાઠમાઠથી વરધાડો કાઠવામાં આવ્યો. પન્યાસલુ મહારાજ પણ સાથે જ હતા. હીથર ગામનો પ્રતિમા પ્રવેશ બંધ હતો. હરેક કોમના માણુસો પ્રતિમાળના દર્શાન માટે ઉમરી આવ્યા, બહેનોએ ભગવાનને વધાર્યા અને આખા ગામમાં અતંદ-આતંદ છવાઈ રહ્યો. સં. ૧૯૬૦ ના વેશાખ શુહિ ૬ ના શુલ મુહૂર્તે

માચારીવાળા થોડ રાયચંહ ગુલાબચંહે ૪૦ મણુ ધીની બોલીથી  
આદેશ લઈને પ્રતિમાળનો મંહિરમાં પ્રવેશ કરાયો. સંધ.  
જમણુ કરવામાં આયું.

સ'. ૧૯૯૦ સુ' બેતાલીસમુ' ચાતુમોસ પન્યાસળુએ ઘોલ-  
વડમા છયું. આ પદ્યંખણુમાં પંદર હિવસ સુધી દાહાણુ' તથા  
બગવાડા પ્રગણુના જેન કાઢાયો. તથા બહેનોએ ઘોલવડમાં  
શ્હીને ફેરેક ધર્મકાયોમાં સુંદર લાલ લીધો હતો. આ ચાતુ-  
મોસમાં શ્રી મહોદ્યમુનિ તથા દાહાણુ સ્ટેશનવાળા શા તત્ક-  
ચંહલુ લેરાળુના માતુશ્રીએ માસકુમણુની તપદ્ધ્યા કરી હતી.  
નાના ગામમાં આવી ઉચ્ચ તપદ્ધ્યાથી બધાને ભારે આદ્યં થયું.  
પન્યાસળ મહારાજના મંગળ આશીરોહથી અજેને ખૂબ શાતા  
શ્હી. પારણુા આનંદથી થયા. જેન ધર્મનો જયજ્યકાર થઈ  
શક્યો.





## જૈન વિદ્યાર્થીગૃહ

( ૨૬ )

‘આજનો હિવસ પવિત્ર હિવસ છે. પર્યુષણું પછીના જીવેં લુચો સાથે ક્ષમાપના કરવાનો અને પારણુનો હિવસ પવિત્ર અને મંગલકારી છે. આજે તમે આસપાસના પ્રદેશના લગભગ ખધા આગેવાનો હાજર છો. તમારા પ્રદેશમાં ધર્મભાવના તો ટીક ટીક વધી છે. હંદેરાસરો ને ઉપાશ્રેણી પણ જગ્યાએ જગ્યાએ થયા છે. તમે ટીક ટીક સુખી છો અને તમારી પ્રતિષ્ઠા પણ સારી વધી રહી છે. તમારામાં ધર્મા બાળ્યવાનો હાનનો મહિમા જણો છો અને થથાશક્તિ હાન કરો છો. પણ તમારા પ્રદેશમાં એક પણ વિદ્યાર્થીગૃહ નથી. તમારા મધ્યમવર્ગના કુદુંબોની પરિસ્થિતિ તો તમે જણો છો. જાનહાન ઉત્તમ હાન છે. આજના ભાગડો આવતી કાલના જૈનક્ષમાજના સાચા વારસહારો છે. શિક્ષણ તો સરકારી શાળામાં અપાય છે પણ તેમાં ધાર્મિક

શિક્ષણ કે ધર્મસંસ્કાર તો અપાતા નથી. મારી લાવના છે કે આ પ્રદેશમાં એક સુંહર જ્ઞાનના પરખસમુ' વિદ્યાર્થીનું થાય તો હજારો વિદ્યાર્થીઓના જીવન ઉનળી શકાય. મધ્યમવર્ગને રાહત મળે. આ વિદ્યાર્થીઓમાંથી જે રતનો નીકળશે તે તમને લાખ લાખ આશીર્વાદ આપશે.'

પન્થાસળ મહારાજે પચુંબણું પછી ભાહરવા સુધી ૫ ની ૨૦૦૦ ઉપરાંત માણુસોની મોટી સભામાં જૈન વિદ્યાર્થીનું માટે જેરહાર પ્રેરણું કરી અને આસપાસના પ્રદેશના આગેવાનો પન્થાસળનો જ્ઞાનનો સંદેશ સાંબળી વિચારમાં પડ્યા.

'ગુરુવાયે ! આપની પ્રેરણું વખતસરની છે. હાણું પ્રગ-  
ણ્ણામાં એક પણ શિક્ષણ સંસ્થા નથી. મધ્યમવર્ગના ખાળકો  
માટે ધર્મસંસ્કાર અને ધર્મશિક્ષણ મળે તેવા લૈન વિદ્યાર્થી-  
ગૃહની જરૂર ધણી છે. આપણું ઉપરેશથી મને વિદ્યાર્થીનું  
માટે ભાવના જાળી છે. આ બધા આગેવાનો પોતપોતાની શક્તિ  
અનુસાર ફાળો આપે અને ચોતાના થામપ્રદેશોમાંથી અપાવા  
પ્રયાસ કરે તો મારા સ્વર્ગસ્થ પૂજન્ય પિતાશ્રીનું નામ જોડવાની  
શરતે રૂ. ૨૧૦૦૦ આપવા હશ્યું છું. આપણે ધીન રૂ. ૪૦૦૦૦  
થી વિશેષ એકઢા કરવાના રહેશો.

ધર્મનિધિ, વિદ્યાપ્રેમી શેઠ શ્રી રાયચંદ્રબાઈની ઉદાર સખા-  
વતથી બધાને ચય્યાંત આનંદ થયો. દોલવડ, હાણું તથા સામ-  
ટાના આગેવાનોએ ઉલા થઈને શ્રી રાયચંદ્રબાઈની ઉદારતાને  
બધાવી લઈ તેમનું બહુમાન કર્યું અને સૌચે યથાશક્તિ ફાળો.  
આપવા સંમતિ હશ્યો.

હબરો બાઈ-ખણેને આ મંગળમય શરૂઆતથી આનંદ થયો. એરડીમાં જૈન વિદ્યાર્થીંગૃહ શરૂ કરવા કમીટી નક્કી કરવામાં આવી. પન્ચાસળ મહારાજશ્રીની ભાવના ફળી. પન્ચાસળએ પણ આ પ્રદેશમાં ગામેગામ વિહાર કરી જૈન વિદ્યાર્થીંગૃહ માટેના ફળા માટે ઉપદેશ આપ્યો અને થોડા સમયમાં રૂ. ૪૦૦૦૦ ) નો ફરાળો થઈ ગયો. પન્ચાસળ મહારાજ વાપીમાં હતા તે વખતે મુંબઈથી શ્રી મહાવીરસ્વામી જૈન મંહિરના કાર્યવાહક શ્રી મૂળયંહાઈ હીરાચંહ ભગત વિનતિ કરવા આંદ્રા. મુંબઈમાં શ્રી મોહનલાલલ જૈન સેન્ટ્રલ લાઈફ્ટેરીના વિકાસ માટે વિચારણા કરવાની હેવાથી શ્રી મૂળયંહમાઈએ મુંબઈ પદ્ધારવા વિનતિ કરી. શ્રી રાયચંહાઈએ જૈન વિદ્યાર્થીંગૃહના ઉદ્ઘાટન માટે પણ વિનતિ કરી.

‘ ભાગ્યશાળી ! તમારી ભાવના તો ફળી. રૂ. ૪૦૦૦૦ ) તું હુંડ થઈ ગયું. આ પ્રદેશમાં વિચરીને મેં યથાશક્ય પ્રયાસો કર્યો. રસોઈ તો તૈયાર થઈ ગઈ. હવે તમે આનંદથી તેનો ઉપલોગ કરો. મુંબઈમાં ગુરુઠેવના નામની સેન્ટ્રલ લાઈફ્ટેરી માટે ટ્રસ્ટીએ સાથે પરામર્શ કરવાનો છે. તે અગત્યનું કામ છે તો તમે સુખેથી રજી આપો. ’ પન્ચાસળએ મુંબઈ તરફ જવાની કૃચ્છા કર્શીવી.

‘ સાહેબ ! આપશ્રીની પ્રેરણુથી જ આ જૈન વિદ્યાર્થીંગૃહ થવા પામ્યું છે. વળી આપે તો ગામેગામ વિહાર કરી-આગે વાનેને સમલની મોટી રક્મ પણ કરાવી આપી, હવે ખરેખરા

અંસ્થાના ઉદ્ઘાટન વખતે આપની હાજરી તો જરૂરી છે. કો  
કૃપાકરી ઉદ્ઘાટન સુધી સ્થિરતા ઠરે તો વિશેષ આનંદ થશે.'  
શ્રી રાયચંહાલએ ખૂબ આશ્રમપૂર્વક વિનિતિ ઠરી.

'રાયચંહાલ ! તમારી વાત સાચી છે. પણ મારું કામ  
પૂરું થયું. સુંઅધિતું' જરૂરી કામ ન હોત તો હું જરૂર સ્થિરતા  
કરત. મારા તમને મંગળ આશીર્વાદ છે. તમારી અંસ્થા ખૂબ  
કૂલેક્ષણ અને આ પ્રદેશમાં જાનની ગંગા વહેતી રહેતેમ મારી  
અંતરની અભિવાધા છે.





## ગુરૂદેવનો ભીય જ્યાંતિ-ઉત્સવ

( ૨૭ )

‘સાહેબ ! થૈત્ર વહી ૧૨ નો પુષ્ય હિવસ આવે છે. શુરૂવર્યનો ઉપકાર મુખ્ય શહેર ઉપર ધણ્ણા ધણ્ણા છે. પ્રસંગે સમાજ કલ્યાણ વાંચુ પંજાખેશરી આચાર્યશ્રી વિજય વલ્લભસૂરીલુ પણ અતે બિરાજમાન છે. ગુરૂદેવનો જ્યાંતિ ઉત્સવ ભીય રીતે ઉજવવાની અમારી ભાવના છે.’ શ્રી મૂળચંહબાઇએ જ્યાંતી ઉત્સવ માટે ચેતાની ભાવના ફર્ખાવી.

‘લાગ્યશાળી ! ગુરૂદેવ તો પરમ ઉપકારી અને પુષ્ય-પ્રભાવી હતા. આ વખતે તો જોગ સારો છે. જ્યાંતિ ઉત્સવ આતંહપૂર્વક ઉજવવા મારી સંમતિ છે. તમારી દ્રસ્તીએ અને લક્ષાજોની ભાવના પ્રમાણે જે ચોણ્ય લાગે તેની વ્યવસ્થા કરો. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિલુ તો ગુરૂવર્યના પ્રેમી છે. જૈનશાસનના ઉદ્ઘોતમાં આચાર્યશ્રીનો ઝાણો સંવિશેષ છે.’ પન્થાસળુએ સંમતિ આપી.

શૈખ વહી ૧૩ નો પુષ્ટય હિવસ આવી પહેંચ્યો. સવારના ૮ વાગે તો મુંબદ્ધના લક્તાજ્ઞનો, બહેનો અને લાઈઓ, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ, સ્વયંસેવકો અને યુવાનો ઉમટી આવ્યા. રથયાત્રાનો વરદોડો ધામધૂમથી નીકળ્યો. શાળા, પાઠશાળા અને એાડીંગના ૨૦૦ બાળક બાળિકાઓ હર્ષનાદ અને સંગીત ગાતાં ગાતાં રથયાત્રામાં મોખરે હતા. જૈનસ્વયંસેવક મંડળ તથા માંગરોળ જૈન યુવક મંડળનાં ઐન્ડ ગાળ રહ્યાં હતાં. જૈનધ્રમાજના ધર્ણા આગેવાનો પણ રથયાત્રામાં આવ્યા હતા. મુનિ-મંડળ પણ શોલી રહ્યું હતું. રથયાત્રામાં લક્તાજ્ઞનોના જ્યદ્યાષ શુંલુ રહ્યા હતા.

રથયાત્રા શહેરના મધ્ય મધ્ય ભાગમાં ઝરીને આહી-શરળની ધર્મશાળામાં આવી પહેંચ્યો. આજ ધર્મશાળાનો હોલ નાનો પડ્યો. ક્રી પુરુષોના ટેલેટોળાં આની પહેંચ્યા. પગ મૂક્ખાની પણ જગ્યા નહોંતી. કેટલાક લાઈઓને તો હાદરામાં ઉલ્લંઘન પડ્યું. કેટલાક તો બહારના ભાગમાં ઉલારહ્યા. પંલબકેશરી આચાર્યશ્રી પ્રમુખસ્થાને ધીરાજ્યા. ભાજુમાં પન્યાસળ મહારાજ શ્રી ઋદ્ધિમુનિલુ ધીરાજ્યા. પન્યાસળએ આચાર્યશ્રીને મંગલિક સંભળાવવા વિનિતિ કરી. મંગલાચરણ પછી બહેનોએ ગુરુવર્યાની શુરૂસ્તુતિ ગાઈ સંભળાવી. ગુરુવર્યના જીવનકાર્ય અને પ્રલાવિકતા વિષે જુદ્ધાજુદ્ધ વક્તાએએ વિવેચનો કર્યો. પન્યાસળ મહારાજને પરમપૂજ્ય ગુરુવર્ય શ્રી મોહનલાલજી મહારાજના કેટલાક જીવનપ્રસંગો દર્શાવ્યા તથા તેમની સેવા અક્રિતિથી ચોતાને જે ચમત્કારી અતુલવો થયેલા તેમજ

ગુરૂદેવ પાસેથી ચોતે જે લુખન-દર્શન મેળાંયું તે એ શાળ્હોમાં દર્શાંયું હતું.

શ્રી માવળ હામળ શાહે ગુરૂવર્યાના જયંતી ઉત્સવ પ્રસંગે ચોતે રચેલી ગુરૂસ્તુતિ સંભળાવી ને જણાંયું કે પૂજય મોહનલાલલ મહારાજ એવા પ્રભાવશાળી અને પુષ્યરાશી હતા કે સુંબદીના જૈનસમાજની દુકાને દુકાને અને ઘેરેઘેર એ મહાપુરુષના ફોટોઓ નજરે પડે છે અને પ્રાતઃકાળે તેમના દર્શન મંગળકારી મનાય છે. સુનિશ્ચી ચરણુંબિજ્યળુંએ પૂજયપાદ આત્મારામળ મહારાજ તથા સુનિરતન શ્રી મોહનલાલલ મહારાજનો પરસ્પરનો કેવો પ્રેમભાવ હતો. તે દર્શાવતા જણાંયું કે ચિકાગો વિશ્વધર્મ પરિષદમાં પ્રતિનિધિ તરીકે જઈ આવેલા મહુવાના વીરનર શ્રી વીરચંદ રાઘવળ ગાંધી એરીસ્ટર અમેરિકામાં જૈન દર્શનનો. જય-જયકાર એવાવી સુંબદ આંયા ત્યારે તેમને વિદેશગમન માટે સંઘખહાર મૂકુવાની હિલચાલ થતી હતી ત્યારે સુંબદના શ્રી સંદે શ્રીમદ મોહનલાલલ મહારાજની સલાહ માણી પણ શ્રી મોહનલાલલ મહારાજે પૂજયપાદ આત્મારામળ મહારાજની સલાહ કેવા સૂચના કરી. સંદે તે માટે પંચાંશ પૂજયપાદ આત્મારામળ મહારાજશ્રીને પૂછાંયું પણ એ સમયના જણુકાર એ મહાપુરુષે શ્રીમદ મોહનલાલલ મહારાજતું માર્ગદર્શન મેળાવી તેમની આજા પ્રમાણે કરવા સૂચાંયું. આ પ્રસંગ નાનોસ્કુનો નહોતો. જૈન જગત માટે એ પ્રશ્ન ધોણો જટિલ હતો. પણ દૂરદૂરના પ્રદેશોમાં હેઠા છતાં બજે મહાપુરુષોનો અંતરનો પ્રેમભાવ અનુપમ હતો. તે આ ઉપરથી આપણે સમળ શકીએ છીએ. આવો પ્રેમભાવ આપણા સુનિરાજોમાં જાગે તો જૈનશાસનનો કેવો

ઉધોત થાય ! આપણા જ્યાંતીનાથકે પણુ પ્રશ્નનો ઉકેલ બહુજ સુંહર રીતે કર્યો હતો. શ્રી વીરચંહભાઈને સ્નાતપૂળ ભણાવી તીથોધિરાજ શનુંજ્યની યાત્રા કરવા જણ્ણાંયુ અને એ રીતે જૈન સંઘમાં શાંતિ થઈ.

ઉપસંહાર કરતાં આચાર્યશ્રીએ ખુલંદ અવાને શ્રીમદ્ મોહનલાલજ મહારાજનાં લુવનકાર્ય વિષે જણ્ણાંયુ કે સુંબદ્ધના દ્વાર સાધુ સુનિરાલે માટે ખુલ્લા મૂકનાર પ્રથમ સુનિરલન શ્રીમદ્ મોહનલાલજ મહારાજ હતા. તે પ્રસંગે જૈન જનતાના આનંદની સીમા નહોતી. સુંબદ્ધ શહેર અને પરાના હલરે બહેન લાઈએ સુનિરલના સ્વાગત અને દર્શાન માટે ઉમટી આંદ્યા હતા. ભારતના વાઈસરેચ લોડ રિપનને મોતીના તોરણુથી જે આવકાર મળ્યો હતો. તેથી વિશિષ્ટ ભાવથીનું સ્વાગત શ્રીમદ્ મોહનલાલજ મહારાજનું જૈન જગતે કર્યું હતું. આજસુધીમાં બીજા કોઈપણ સુનિરાજને એટલું માન મળ્યુ જાણુમાં નથી. તમે જુઓ છો કે જે ઉલ્લાસથી આને આ મહાપુરુષની જ્યાંતી ઉજવાય છે તેવી મેં તો કોઈપણ મહાપુરુષની ઉજવેલી જોઈ નથી. શ્રીમદ્ મોહનલાલજ મહારાજની ગ્રેરણુથી સુંબદ્ધ જેવા સોટા શહેરમાં બાયુ પદ્માલાલ જૈન હાઈસ્કૂલ સ્થપાઈ છે. તે હલરે બાળકો માટે જાનનું મહામૂલું પરબ છે. પણ મારી તો ભાવના છે કે બાયુ સાહેબ જૈન ક્લાવેજ કરે તો આપણા હલરે બાળકોને ઉંચા પ્રકારનું જાન મળે અને જૈન દર્શાનના અસ્થ્યાસ માટે પણ તક મળે. જૈનસુમારાજના ઉત્થાત વિના જૈનશાસનનો ઉધોત નથી. સુંબદ્ધ જેવા

શહેરમાં શિક્ષણ સાહિત્ય અને સમાજ માટે શ્રીમંતોએ હાનનાં  
અરણ્યાં વહેવરાની જૈનશાસનનો ઉદ્ઘોત કરવો જેઠાં.

શ્રીમદ્ મોહનલાલજી મહારાજના જ્યંત્યકારથી ધર્મશાળા  
શુંલુ ઉઠી.

જ્યંતી ઉત્સવ નિમિત્તે શ્રી મહાવીર સ્વામીના મંહિર  
પૂજા ભણ્યાવવામાં આવી, અંગી રચવામાં આવી તથા રાત્રે ભાવના  
એસાડવામાં આવી.



## સાચી લક્ષ્ણ તો સ્વામીભાઈએની

( ૨૮ )

‘સાહેબ ! આ વખતતું ચાતુર્માસ અમારી વાડીમાં કરવા માટે અમારા સસુહાયની વિનતિ છે. આપના પધારવાથી જરૂર ધર્માલગ્રતિ આવશે. નવીન ધર્માકારો પણ થશે.’ કંચ્ચિ વીશા ઓસવાળ સસુહાયના આગેવાનોએ વિનતિ કરી.

‘ભાગ્યશાળી ! અહીં પાયધુની ઉપરના શ્રી મહાવીર સ્વામીના હલેરાસ્કરના ઉપાશ્રય માટે બ્યવરસ્થા થઈ શકે તો હું જરૂર તમારી વાડીમાં ચાતુર્માસ કરીશ. અહીં પણ કોઈ તો જોઈએ ને.’ પન્થાસળએ સુશકેલી દર્શાવી.

‘પન્થાસળ ! આપ સુખેથી કંચ્ચિ વીસા ઓસવાળ ભાઈ-એની વિનતિ સ્વીકારો. અમે તણે ઠાણ્યા અતે પાયધુની સંભાળીશું. પન્થાસળ કેસરસુનિલએ રસ્તો કાઢયો.

‘આપ પાયધુની સંભાળો તો અમે પાલાગલી જઈશું.’  
 ‘ભાગ્યવાનો અમે તમારી વાડીમાં ચાતુર્માસ કરીશું પણ ખ્યાલ રાખશો કે ધર્મકારો થવાં જોઈએ અને તમારે બધા આગેવા નોંધે મને સહકાર આપવો જોઈશો.’ પન્નાસલુએ શરત કરી.

‘હ્યાણ ! આપની મધુરી વાણીથી જરૂર ધર્મકારો થશે.  
 અમારો તો આપને હાદિંક સહકાર છે જ. આપ સુખેથી અમારે ત્યાં પધારો.’ એક આગેવાને વચ્ચન આપ્યું.

‘કૃપાણ ! અમારી ભાવના તો એવી છે કે આપના પુનિત પગલાંથી અને આપના સુધાસર્યાં ઉપદેશથી દર્શા-વીસામાં જે ગોડા ઘણો લેહલાવ છે તે મીટાવવો છે.’ જીજા આગેવાને સ્વીક્યાના કરી.

‘ભાઈ ! મારી પણ એ જ ઈચ્છા છે. તમે દર્શા-વીસાને શા માટે જરા પણ લેહલાવ ડોય. હું પણ એ જ ભાવનાથી ત્યાં આવું છું. તમે તો સમુદ્દ્રાયના સંપરમાં માનો છો. દર્શા ભાઈએના આગેવાનોને સમજની લઈશ.’ પન્નાસલુએ ચોતાની ભાવના દર્શાવી.

પન્નાસલુ કેસરમુનિજી આહિંકાણું ત ને શ્રી મહાવીર નૈન મન્દિરના ઉપાશ્રેષ્ઠ રાખી પન્નાસલુ આદિ સુનિરાણે કર્યાશી વીશા ઓસવાળ સમુદ્રાયના આગેવાનોની વિનતિથી ભાંડવી ઉપર પાલાગલીમાં આવેલી તેઓની વાડીમાં પધાયો.

આ વખતતું ચાતુર્માસ ચાદગાર બની ગયું. પન્નાસલુના ઉપદેશથી આ ચાતુર્માસમાં શેડ હંસરાજભાઈ કુંવરલુએ ચોતાની ઉદ્ઘારતાથી શ્રી વર્ધ્માનતપ આયંબિલ ખાતું ત્રણ વર્ષ જાતે

ચલાવી રૂ. ૧૦૦૦૦) હસ હળવની મહદ આપી, કંઈછી વીસા ચોસવાળ મહાજનને સોંપી દીધું. આ આયંબિલ ખાતાનો લાલ કંઈછીભાઈએ ઉપરાંત મારવાડી અને ગુજરાતી ભાધાએ પણ લઈ રહ્યા છે.

પર્યુષણ પર્વ પણ આનંદપૂર્વક થયાં. આઠે દ્વિસના ચોસઠ પહેલારના પૌષ્ઠ ધણુા લાઈ-બહેનોએ કર્યો હતા. આ પર્યુષણ પર્વ માટે બહાર ગામથી આવેલ લાઈ બહેનો માટે લોજન આદિ દરેક પ્રકારની અકિલ શા. લધાભાઈ માવળુ, શા. પુનશ્ચ મોણુશી તથા તેમના લાગીદાર શા. જેઠાભાઈ અને શા. ગાંગળભાઈ વગેરેએ ઉત્તમ પ્રકારે ઠરી હતી.

પર્યુષણ પર્વ ચાલતા હતા. વ્યાખ્યાનનો હોલ ચિકાર હતો. પન્થાસળુએ તક જોઈને પ્રશ્ન કર્યો.

‘ભાગ્યવાનો ! કેવાં મંગળમય પર્યુષણ પર્વો તમે ઉજવી રહ્યા છો ! તપદ્રોયો પણ ખૂબ થઈ. ચોસઠ પહેલારી પૌષ્ઠદ્વા પણ ધણુા થયા. ત્વમની ઉપજ પણ આ વખતે ધણી સારી થઈ. તમારો બધાનો આનંદ ઉલ્લાસ પણ ધણુા જ હેખાય છે. પણ એક વાત આ વખતે થાવી જોઈએ. તમે દશા-વીસા કંઈ જુદ્દા છો ! એક જ પિતા ભગવાન મહાવીરના પુત્રો અને ભક્તો છો. બધા એક અને અવિલક્ત છો. તો પછી રથયાત્રાનો વરદ્ઘાડો જુદ્દો જુદ્દો શા માટે ? બધા સાથે મળી જાય રથયાત્રા શા માટે ન કાઢો ! તેથી તો તમારી-તમારા સંઘની, તમારા સમુદ્ધાયની, તમારા આગેવાનોની, જૈન શાસનની અને જૈન ધર્મની શોભા અને પ્રતિષ્ઠા છે. રથયાત્રા તો સાથે જ નીકળવી જોઈએ. અને તે તો નીકળશે પણ હું તો તમારા બધા

સમુહાયને એક સાથે જમવા માટે પણ આગેંહ કરી રહ્યો છું.  
બન્ને લાઈએ સાથે જમે—તો તેથી આભાલવુદ્ધને કેટલો  
આનંદ થાય ? અને જૈનશાસનનો ફેલો જ્યજ્યકાર થાય તે  
વિચારશો. મને તમે ભાવપૂર્વક લાંઘા છો. તમે ભક્તિ પણ  
ભાવપૂર્વક કરો છો. પણ સાચી ભક્તિ તો સ્વામીભાઈઓની છે. ’

આ સુધાભયો મધુર વચ્ચનોથી બધાના હિંદુ પીગળ્યા.  
આગેવાનોએ મંત્રણા કરી અને રથયાત્રા તથા જમણ એક  
સાથે કરવા નિર્ણય કર્યો. સંઘમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.  
પ્રેમકાવ અને એકતાની લહેર લહેરાણી. ભગવાન મહાવીર-  
સ્વામી અને પન્થાસળ મહારાજના જ્યનાદોથી ઉપાશ્રય ગુંજ  
ઉઠ્યો. છેલ્લા ૧૭ વર્ષથી દર વર્ષે રથયાત્રાનો વરધોડો અને  
જમણ સાથે જ થાય છે. સં. ૧૯૬૧ ની સાલનું તેંતાલીસસું  
ચાતુર્માસ મુંબદ્ધ-માંડળીમાં આવેલી કંઈ વીસા ઓસવાળની  
વાડીમાં આનંદપૂર્વક થયું હતું.

ચાતુર્માસ પૂર્ણ થયા પછી કાર્ત્તકી પૂર્ણિમાએ કંઈ વીસા  
ઓસવાળની વાડીએથી શ્રી શત્રુંજ્ય તીર્થનો પટ મોટરમાં  
પધરાવી અનેક સાંભેદાએં તથા ઐન્ડવાળ સાથે વરધોડો કાઢ-  
વામાં આવ્યો. ગિરિજાજ શ્રી શત્રુંજ્ય ઉપર લંબ કળામય  
મંહિરાથી સુશોલિત મોતીશાની દુંક બંધાવનાર, લાકખાગમાં  
જૈન ઉપાશ્રયની વિશાળ જગ્યા અર્પણ કરનાર, કોટ તથા પાય-  
ધૂની પર મંહિર બંધાવનાર, અનેક જગ્યાએ ધર્મશાળાએ  
બંધાવનાર તેમજ ભાયખાલામાં મોતી વિશાળ જગ્યા તથા  
આલીશાન મંહિરનું મોંદું દ્રસ્ત કરનાર મહા પુષ્પયશાળી સુગ-  
રિદ્ધ મોતીશા શેડના ભાયખાલાના મંહિરે હર્ષિન કરવા બધા

ગયા હતા. ત્યાં બહારના મંડપમાં ખાંધેવા તીર્થોધિરાજ શત્રુ-  
જ્યના પદની ચાત્રા કરી. પન્નાસલુ મહારાજ તથા પન્ના-  
સલુ કેશર સુનીણુ આહિ પાછા કચ્છી વીસા એચવાળની વાડીએ  
પધાર્યો હતા. કાત્ક વહી ર ને હિવસે શ્રી મહાવીર સ્વામીના  
મંહિરે પધાર્યો હતા અને માગશર શુદ્ધ ઉના પુષ્ટ હિવસે  
પોતાના પરમપૂજય ગુરૂવર્ય શ્રી જીન યથઃસૂરિણી જ્યંતિ  
ઢાકમાઠથી ઉજવી હતી.

‘સાહેબ! શેઠ મેધળુભાઈ સોજપાળે વંદ્યા કંડેવરાંયા  
છે. અને આપ સાહેબ કૃપા કરી આવતું ચાતુમૌસ લાલવાડીમાં  
કરો તેમ વિનંતિ કરી છે.’ લાલવાડીના સુનીમે વિનંતિ કરી.

‘હું લાલવાડી થઈને જ દાદર થઈ કુરલા આવ્યો. હાલ  
ઘાટકોપર જવાની ભાવના છે. શેઠ મેધળુભાઈને અમારા ધર્મ-  
લાલ સાથે કહેશો કે તમારી ભાવનાનો જરૂર વિચાર થશે.’  
પન્નાસલુએ આશા દર્શાવી.

ધાર્ટકોપરમાં કચ્છી-ગુજરાતી ભાષાએ. વ્યાજયાન આહિનો  
સારો લાલ દેતા હતા પણ શેઠ મેધળુભાઈના આથડને માન  
આપી પન્નાસલુ લાલવાડી પધાર્યો. શેઠ મેધળુભાઈને અત્યંત  
આનંદ થયો. સં. ૧૯૬૨ તું ચુમ્માલીસમું ચાતુમૌસ પન્ના-  
સલુ મહારાજે લાલવાડીમાં કર્યું.

લાલવાડીના ઉપાશ્રયમાં અશાડ શુદ્ધ ૧૧ ના પુષ્ટ હિવસે  
દાદા સાહેબ શ્રી જીનદત્તસૂરીધરણી જ્યંતિ ઉજવામાં  
આવી. આ પ્રસંગે મહારાજશીના વૈક્ષવ કાકા શેઠ મહાદેવજી  
ચોહાર તરફથી માદકની પ્રભાવના કરવામાં આવી.

આ ચાતુર્માસમાં એ લાદરવા હોવાથી પન્યાસળુએ પોતાની પરંપરા અનુસાર ચેતે ખરતરગચ્છ અને અંચલગચ્છવાળાં એની સાથે પહેલા લાદરવામાં પર્યુષણું પર્વનું આરાધન કર્યું. તપાગચ્છના પર્યુષણુંની આરાધના કરવા માટે હાદરના આગેવાનોની વિનિતિથી ચોતાની તથીયત નરમ હોવાને કારણે પોતાના શિષ્ય શ્રી ગુલાભમુનિલુને હાદર મોકલ્યા. તેમણે હાદરમાં ખાર હિવસ રોકાઈને ત્યાંના લાઈઓને શાન્તિપૂર્વક પર્યુષણું પર્વની આરાધના કરાવી, તેમાં માહીમ-માટુંગા વગેરે આસપાસના બીજા લાઈઓએ પણ સારો લાલ દીધો હતો. શ્રી ગુલાભમુનિના હાદર ગયા પછી લાલવાડીના તપગચ્છના ભાઈઓએ પન્યાસળુને વિનતી કરી કે અમને પર્યુષણુંની આરાધના આપશ્રી કરાવો તો કેવું સારું ! ચોતાની તથીયત નરમ હોવા છતાં પન્યાસળુએ તપગચ્છના ભાઈઓને પર્યુષણુપર્વના વ્યાખ્યાનો સંભળાયા અને ચોતાની ઉદ્ઘારતા અને પ્રેમભાવ દર્શાવ્યો.

આ ચાતુર્માસમાં પન્યાસળ મહારાજની તથીયત નરમ જ રહી. શેઠ મેધળુભાઈએ પન્યાસળની ખૂબ સેવા ભક્તિ કરી. તેઓની જ્વલંત ધર્મપ્રવૃત્તિ જેઠને પન્યાસળુને ખૂબ આનંદ થયો. બીજા કુદ્ધી લાઈઓ પણ ધર્મપ્રવૃત્તિમાં જેણાયા.

ચાતુર્માસ પૂર્ણ થવા આંધું. કાર્ત્તક શુદ્ધ ૬ ને હિવસ હતો. પન્યાસળને ચોવિહારો છકુ હતો. એકાએક સુંખર્થી ટેલીફોન આંધો, કે પન્યાસળ કેશરમુનિલુન જ્ઞાનપંચમીના ઉપચાસના પારણે તથીયત અકળાવાથી આજ બપોરના એ વાગે કાળધર્મ પાર્યા, સમાચાર સંભળી પન્યાસળુને આધાત થયો.

સુંખદિની પાસે જ હેવા છતાં પન્યાસળુનો વિશેષ રહ્યો. તેએં પાયધુની જવા તવપાપડ થઈ રહ્યા. પણ સુંખદિમાં કોઝી હુક્કુકની આગ ભલૂકી રહી હતી અને લીડી બનારતથા મહા-મહાબી રોડ પણ કોઈની પણ સહીસલામતી નહોતી. મારા-મારી ને કાપાકાપી ચાલી રહી હતી, પાયધુની પહેંચવાની ઉત્સુકતા વિશેષ હતી. લક્તાજનો પન્યાસળુને જવા હેવા તૈયાર નહોતા. તપસ્વી અને અશાક્ત શરીરે હુર જવા બધાની અનિયથા છતાં અધિષ્ઠાયક અને વીર ઘંટાકરણુને યાહ કરી પન્યાસળ ચાલી નીકળ્યા. સહૃદાયે ચોલીસોની સહાયતા મળી ગઈ. પન્યાસળ પાયધુની પહેંચી ગયા. શુરૂભન્ધુ પન્યાસળ કેશર-સુનિ પાછળ કરવા ચોણ્ય કાચો પન્યાસળએ અશ્રેસર થઈને કરાયા તથા તેમના શિષ્યો. શ્રી બુદ્ધિસુનિલુ આહિને આશ્રા-સન આપ્યું.

પન્યાસળના ઉપરેશથી (રૂ. ૧૦૦૦) કુરાડાવાળા શેઠ અતાળ ખુમાળ તરફથી જીવદ્યા મંદળને આપવામાં આવ્યા, પાયધુની શ્રી મહાવીર સ્વામીના હેરાસરમાં અહુએ-મહોત્સવ, શાન્તિસનાત્ર વગેરે થયાં.

જ્યુરનિવાસી ભાઈ નથમલલુની દીક્ષાની ભાવના થવાથી પન્યાસળએ શ્રી આદીશરની ધર્મશાળામાં ધામધૂમપૂર્વક દીક્ષા આપી. શ્રી બુદ્ધિસુનિના શિષ્ય તરીકે નન્દનસુનિ નામ રાખવામાં આયું હતું.





## પરાયોમાં ધર્મ-જગૃતિ

( ૨૬ )

‘સાહેબ ! આપના ઉપરેશથી મારા આખા કુટુંબમાં ધર્મ-ભાવના વધી છે. મારી તો ભાવના છે કે આપશ્રી અત્રે વિશેષ સ્થિરતા કરો તો ઘણું ધર્મકાર્યો થવાની સંભાવના છે. બીજું તો કાંઈ નહિ પણ મારવાડી લાઇઓએ મન્હિર તૈયાર કરાયું છે પણ પ્રતિક્રિયાનો જોગ આવતો નથી. આ કામ આપની પ્રેરણુથી થઈ જાય તો હાદરમાં આનંદ મંગળ થાય. ’ ધર્મ-પ્રેમી શેડ રવળુભાઇએ વિનિતિ કરી.

‘ભાગ્યશાળી ! તમે તો ધર્મપ્રેમી છો, સેવાપ્રિય અને સંપત્તિ-શાળી છો. હાદર તો સુંભાઇનું’ કેન્દ્ર સ્થાન છે. હાદરમાં ફેરા-સરની પ્રતિક્રિયા કરવા તમારા જેવા આગેવાનોએ માર્ગ કાઢવો જોઈએ. બીજું અમારા જેવા માટે ઉત્તરવાની જગ્યાની પણ વ્યવસ્થા કર્યાં છે ! જુઓને શેડ પાલણુભાઇની ચાલીમાં શુલરો

ચાલે છે. પણ હાદર તો સાંખુ સુનિરાનેના વિહારને આરામતું સુખ્ય સ્થાન છે?’ પન્થાસળુએ મુશ્કેલી ફર્શાવી.

‘કૃપાનુ! આથ સ્થિરતા કરવા વચન: આપેં તો હું માતું હું આપને માટે સ્થાન અને વ્યાખ્યાન માટેના હોલની સગંવડ પણ થઈ રહેશે. પ્રતિષ્ઠા. માટે પણ આપની સાથે અમે પણ પ્રયાસ કરીશું.’ શેઠ રવળુભાઈએ ખાત્રી આપી.

‘તો પછી હું ચાતુર્માસ માટે આવવા વિચાર કરીશ. તમે તમારા પ્રયત્નમાં ઉદ્ઘમવંત રહેશો. તમારી આઆ કુદુંઅની ધર્મભાવનાની સૌરસ હાદરમાં પ્રસરે તો હાદર મોકષમાર્ગનો હાદર બની લય. સમાજના હંજરો સ્વી-પુરુષોનું આત્મકલ્યાણ થાય.’ પન્થાસળુએ મંગળભાવના ફર્શાવી.

પન્થાસળ હાદરથી વિહાર કરી માહીમ થઈને સાન્તાકુઝ પખાયો. સાન્તાકુઝમાં ભાવનગરના સુપ્રસિદ્ધ આગેવાન શેઠ અમરચંદ જસરાજના સુપુત્રો શ્રી અનિતલાલભાઈ તથા શ્રી ભાતુચન્દ્રભાઈના આગ્રહથી તેમને બંગલે ઐ હિવસ રોકાઈને રાધનપુરવાળા શેઠ ગીરખરવાલ ત્રીકમલાલને બંગલે પખાયો.

આને રવિવારને હિવસ હતો. સાન્તાકુઝના ભાઈ બહેનો મોટી સંખ્યામાં વ્યાખ્યાનનો વાલ લેવા આંધ્યા હતા. પન્થાસળુએ તક જોઈને વાતની રણુઆત કરી.

‘ભાગ્યશાળીએ! તમે મોટી સંખ્યામાં સુંભદ્રથી હૂર શાન્ત એવા આ સાન્તાકુઝના પરામાં વર્ષોથી વસવાટ કરે. તમારી ધર્મભાવના પણ સારી છે. શેઠ નરોતમદાસ ભાણુલુએ તો ધર ફેરાસર કર્યું હતું. વળી પૂર્વપુષ્યના ઉદ્યથી લક્ષ્મી

પ્રાપ્ત કરી તમે પોતાના નિવાસો બંધાવો છો. તમે સુખી અને ભાગ્યવાન છો. હવે ધર્મભાવનાની વૃદ્ધિ માટે અને બાળકેના સંસ્કારો ધર્મભય બનાવવા શ્રી જૈન-મંહિર તથા ધર્મના કિયાંકંડ સામાચિક-પ્રતિકમણુ-પૌષ્ઠ વિગેરે શાંતિપૂર્વક કરવા માટે અને સાધુ-સાધ્વીઓની સ્થિરતા માટે એક ઉપાશ્રયની અત્યંત જરૂર છે. એક જ ભાગ્યશાળી ધારે તો એક એક કામ કરી શકે પણ તમે બધા ભાગ્યવાનો મળીને આ ધર્મ-ઉદ્ઘોતના એ સ્થાનો. કરી શકો તેવા શક્તિશાળી છો. તમારામાંના ૧૦ બાઈઓ આ જવાબદારી ઉપાડે તો એ વર્ષમાં સાન્તાકુઝમાં મનોહર મંહિર અને ઉપાશ્રય લોઈ શકાય. મેં સાંભળ્યું છે કે તમે તે માટે પ્રયત્નશીલ છો. ટીપનું કામ પણ શરૂ કર્યું છે. તેમાં કોઈ કારણે દીલાશ આવી છે, તો હવે કરી તે કામ ઉપાડો અને ઉત્સાહથી ટીપ પૂરી કરી કામ શરૂ કરો. ધર્મપસાયે તમારા બધા કુદુંભોનું કલ્યાણ થશે અને જૈન-શાસનનો જ્યલ્યક્ષણકાર થશે.'

પન્યાસળ મહારાજની પ્રેમકારી વાણીની સારી અસર થઈ. ટીપનું કામ શરૂ થયું અને આજે સાન્તાકુઝમાં મનોહર મંહિર અને સુંદર ઉપાશ્રય છે. સાન્તાકુઝ હિવસે હિવસે ખૂબ વધી રહ્યું છે.

સાન્તાકુઝથી વિહાર કરી પન્યાસળ મહારાજ વિલેપારલે શેડ ઘેલાબાઈ કરમયંડે બંધાવેલા સેનેટોરીયમમાં ઉત્ત્યો.

વીલેપારલેથી વિહાર કરી પન્યાસળ મહારાજ અંધેરી પધાર્યો. અંધેરીમાં સુંબદ્ધ શહેરના મહોપકારી ગુરુવ્યં શ્રી

મોહનલાલજી મહારાજ સાહેણના ઉપરેશથી ઘણુા સમયથી જૈન-મહિર તથા ઉપાશ્રયની સગવડ થયેલી છે. અંધેરીમાં કુચ્છી ભાઈઓમાં તેમ જ મારવાડી ભાઈઓમાં ઘણુા સમયથી મત-લેદ અને કુસંપ હતો. પન્યાસજી મહારાજે તે માટે ભારે પરિશ્રમ કર્યો. વ્યાખ્યાનમાં પણ સંપર્થી ડેવાં ધર્મ ઉદ્ઘોત અને સમાજ કલ્યાણના કામ થાય છે તથા નાના મોટા મતલેદોથી આપણુા સમાજમાં કેવું કુસંપનું વાતાવરણ સર્જાંયું છે તેમ જ આપણુા સમાજના ડેવાં ડેવાં કામો બગડે છે! સમાજની ઉત્ત્રાતિમાં ધર્મની ઉત્ત્રતિ છે. શાસ્ત્રની શોભા જીંપ અને સંગ-ઠનમાં છે. આ સુધારસરી વાણીની ધીમે ધીમે સારી અસર થઈ. કુચ્છી ભાઈઓના આગેવાન શેઠ લાલજીભાઈ તથા શેઠ હેવ-રાજભાઈએ પોતાના કુચ્છી સમાજને એકત્ર કરી મહારાજશ્રીના અમૃતવયનો કહી સંભળાંયા.

આપણુા સંગઠન માટે જે ધગશથી મહારાજ પ્રેરણુા આ ચે છે તે આપણે જીલવી જોઈએ. આપણે એકથીજની નાની મોટી ભૂલેા દરશુજર કરવી જોઈએ. ઉપરાંત અમે અને તે ભૂલેા માટે સમાજ વતી કહો તે ગ્રાયશ્રિત કરવા તૈયાર છીએ. હવે ગમે તે લોગે સંપુર્ણ થયો જ જોઈએ.

આ નમ્ર વચ્ચેનોની પણ જાહેર અસર થઈ. બધાના દ્વિતી સારુ થઈ ગયાં. સંપત્તું વાતાવરણ દેલાઈ ગયું. આપા કુચ્છી અમૃહાયમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. કુચ્છી સમાજમાં સંપની લહેર લહેરણી હતી ત્યાં મારવાડી સાથના મન પણ પૂર્ગળ્યાં. શુરૂવત્યે પન્યાસજી મહારાજે તેઓના આગેવાનોને ભોલાંયા અને ખૂબ ભારપૂર્વક સંપુર્ણ અને સંગઠન માટે

પ્રેરણું આપી. તેમના આગેવાન શેડ વનેચનહાળ સુકાદમ, શેડ સાગરમલાળ તથા શેડ શુવતાનમલાળના પ્રયાસથી મારવાડી સમાજમાં પણ જંપતુ' આંડોલન ફેલાયું. મારવાડી સમાજમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.

પન્થાસળની વિહારની ભાવના હતી પણ અંધેરીના સવેં ભાઈઓએ ચૈત્ર મહિનાની શાશ્વતી ઓળિ કરાવવા આથંબારી વિનતિ કરી અને પન્થાસળની નિશ્ચામાં ઓળિ પર્વની આરાધના કરવા નિશ્ચય થયો. મારવાડી સાથમાંથી શેડ સાગરમલાળ ફેલાજમલાળની ધર્મપત્ની શ્રીમતી પેટીયાંદી તરફથી નવમહાળની ઓળિમાં આયંગિત વગેરેની જ્યવસ્થા ઉત્તમ પ્રકારની હતી. નવે દિવસ જુદા જુદા ગૃહસ્થો તરફથી વિવિધ પ્રકારની પૂજાઓ ભણુવવામાં આવતી હતી. ચૈત્ર શુદ્ધ ૧૩ ના મંગળ દિવસે આસનોપકારી ચરમ તીર્થીકર શ્રી મહાવીર પ્રભુની જ્યંતી ઉજવવામાં આવી હતી. ચૈત્ર શુદ્ધ પૂર્ણિમાને દિવસે મુંબાઈથી પરાનો સંધ એક લાગ્યવાને કાઢયો હતો. તેમાં ૨૫૦૦ ખલેન ભાઈઓ આંદ્યાં હતાં. અંધેરીમાં નવાળું પ્રકારની પૂજા ભણુાપી હતી તથા સંધ જમણું કર્યું હતું.

પન્થાસળ મહારાજ વિહાર કરી મલાડ પધાર્યો. મલાડમાં પણ શુરૂર્ય શ્રી મોહનલાલાલ મહારાજના ઉપદેશથી નૈન મંહિર અને ઉપાશ્રય શેડ શ્રી હેવકરણ સુળાલુએ કરાંદ્યાં હતાં.

મલાડમાં શ્રી મોહનલાલાલ મહારાજની જ્યંતી આનંદ પૂર્ક ઉજવવામાં આવી. મલાડથી વિહાર કરી ગોરેગામ થઇ પાછા વળતાં અંધેરી, પારલા થઈને હાદર પધાર્યો. હાદરમાં ચાતુર્માસ માટે ધર્મનિઃઠ શેડ શ્રી રવલાલાઈ સોજપાળના સુપુત્ર

શેડ રામલુભાઈએ વિનતિ કરી કે આખુથી મારા પિતાજીનો પત્ર છે અને આપણીને ચાતુર્માસ માટે આગ્રહકરી વિનતિ કરવા જરૂરી છે.

હાદરમાં ચાતુર્માસ થવાથી લાભ થવાની સંભાવના હોવાથી પન્યાસળ મહારાજની લાવના હાદરમાં ચાતુર્માસ માટે હતી પણ થાડે વખત પાયધુની જવાની ઈચ્છા થવાથી પન્યાસળ પાયધુની શ્રી મહાવીર સ્વામીના ઉપાશ્રેણે પદ્ધાર્યો, અહીંના દ્વારીઓએ મહારાજનોને ચાતુર્માસ પાયધુની કરવા વિનતિ કરી પણ હાદરથી શેડ રામલુભાઈ આવ્યા અને આગ્રહકરી વિનતિ કરી કે મારા પિતાજી શેડ રખલુભાઈનો તાર છે, આપણીને હાદરમાં ચાતુર્માસ કરવા આગ્રહકરી વિનતિ કરે છે અને ચેતે પાદીતાણુથી આવી પહેંચવા જરૂરી છે. શેડ રામલુભાઈએ હાદરની પ્રતિષ્ઠા અને કૃષ્ણી ભાઈઓના સંગડન માટેની ઘણી સંભાવના હોવાથી આગ્રહકરી વિનતિ કરી. પન્યાસળ પણ લાભાલાભની દ્રષ્ટિએ હાદર પદ્ધાર્યો. હાદરમાં અખાડ શુદ્ધ ૧૫ ના રોજ પન્યાસળની પ્રેરણુથી હાદરના સંઘ તરફથી શ્રી વર્ધમાન-તપ આયંણીલ ખાતુ ખોલવામાં આવ્યું. તે હિનપ્રતિહિન વધતું જય છે. ઉપરાંત પન્યાસળના ઉપદેશથી શ્રી હાદર જૈન મિત્રમંડળની સ્થાપના કરવામાં આવી. જૈન મિત્રમંડળના પ્રયાસથી હાદરમાં જૈન ભાગિકાઓને ધાર્મિક શિક્ષણ મળે તે દૃષ્ટિએ વિજ્યા દર્શાવી હશે કે શેડ રખલુભાઈના શુભહસ્તે જૈન પાઠશાળા ખુલ્લી સુક્રવામાં આવી. સં ૧૯૬૮ તનું પીરતાલીસમું ચાતુર્માસ હાદરમાં ખૂબ આનંદથી પૂર્ણ થયું. પૂર્ણખણુમાં તપ-શ્રીયી પણ ઘણી સારી થઈ. આસપાસના પરાઓના ભાઈઓએ સારો લાલ લીધે.



## પ્રતિષ્ઠા માટે પ્રયાસ

( ૩૦ )

‘હ્યાળુ ! આગાર તડના આગેવાનો હાદરના જૈનમન્હિરની પ્રતિષ્ઠા કરાવવા ઉત્સુક છે. આપ સાહેબના માર્ગદર્શિન અને પ્રેરણુંની આવશ્યકતા છે. કૃપા કરી આપશ્શી હાદર પખારો અને પ્રતિષ્ઠાનું કાર્ય સરળ કરાવી આપો ’ થાણુના ઉત્સાહી કાર્યુંકર અને હાદરમંહિરના વ્યવસ્થાપક શ્રી મંગળહાસ ત્રીકમહાસ જવે-  
રીએ વિનતિ કરી.

‘ભાઈ ! પ્રતિષ્ઠાનું સુહૂત્તં જોવરાંધું છે કે કેમ ? ’ પન્થા-  
સજી મહારાજે પ્રશ્ન કર્યો.

‘ સાહેબ ! આપ સાહેબ પખારશો એટલે તુરત સુહૂત્તં  
પણ આપ સમક્ષ નષ્ટી થશો. ’

‘ મંગળહાસભાઈ ! પ્રતિષ્ઠાનું કામ કરવુંજ હોય તો તેમાં  
દીલાશ ન ચાલે. કામ તો વ્યવસ્થિત અને ચોજનાપૂર્વક ઉપાડવું  
નેધિએ, બધા ભાઈઓનો તેમાં સહકાર નેધિએ. ’

‘કૃપાળુ ! આપશ્રીની પ્રેરણુથી જરૂર અમારું કામ વેગપૂર્વક થયે જ. આપના મંગળહસ્તે અને આપશ્રીના માર્ગદર્શન પ્રમાણે પ્રતિષ્ઠા કરવી છે તેનો આગેવાનોએ નિષ્ણય કર્યો છે. કૃપા કરી દાદર પધારો’ અવેરીએ વિશેષ આશ્રહલરી વિનંતી કરી.

પન્યાસળુ મહારાજ ભાયખલા અને લાલવાડી સુકામ કરીને દાદર પધાર્યો. આગેવાનોએ લેગા થઈને પન્યાસળુ મહારાજને શુભ સુહૂર્તાં જેવરાવી આપવા વિનંતિ કરી. સારા જ્યોતિષીને બોલાવીને સા. ૧૯૬૪ ના વૈશાખ સુદી ૬ તું સુહૂર્તાં કઢાવી આપ્યું. શેઠશી રવાજુભાઈ સોજપાટ જેભી તથા મેઘાજુભાઈ સોજ-પાલભાઈની હાજરીમાં આગરતડના આગેવાનોએ આ સુહૂર્તાં વધાવી લીધું.

સુહૂર્તાંનો નિષ્ણય થયા પછી પન્યાસળુએ આગર તડના આગેવાનોને બોલાવ્યા.

‘તમે મોટી જવાબદારીતું કામ ઉપાડયું છે. પ્રતિષ્ઠાતું કામ સહેતું નથી. તેમાં તમામ ઉત્સાહી ભાઈએઓ સાથ આપવો જેઈશે. સૌથી પહેલાં તો પ્રતિષ્ઠાના ખર્ચ માટે પ્રબંધ કરવો જેઈએ. તે સુખ્ય જરૂરી કાર્ય છે. ભીજાં કાર્યો તો તે પછી થશે અને તેમાં તો તમારો અધાનો ઉત્સાહ છેજ. પ્રતિષ્ઠા જેવો મંગળઅવસર ભાગયેજ મળે છે. પ્રતિષ્ઠાના કાર્યોમાં તમારી લક્ષ્મીનો સદઉપયોગ કરી આત્મકલ્યાણનો લહાવો લેવાનો છે. સૌથી શક્તિ પ્રમાણે લાલ લેવો જેઈએ. તેમાં તો ચોતાની ભાવના અને ખાસ કરીને શક્તિ પ્રમાણે લાલ વ્યો. તો ખર્ચનો પ્રક્રિ તો વહેલો ઉક્લી જાય. આ કાર્યોમાં મોટા-નાતાનો વિચાર

કરવા કરતાં જે જે ભાગ્યશાળી કાઈ અહેનને જે જે લાક્ષ દેવો હોય તે ચોતાની ભાવના જણું વે અને તેની નોંધ થઈ નાય. ’

પન્થાસળ મહારાજે તો ટીપ માટે ભાસ પ્રેરણું કરી. પણ આગરતાના આગેવાનો હમેશાં મીરીંગો મેળવતા હતા અને ઉનાગરા કરતા હતા છતાં કંઈ સંગીન કામ કરી શક્યા નહિં.

પન્થાસળને આ જાહીને જેહ થયો. તેમણે આગેવાનોને એલાવાની સૂચના કરી કે મીરીંગો રાત્રે કરવાને બહ્લે હવે હિવસે મારી સમક્ષ કરો અને એક એક વાતનો સ્પષ્ટ નિકાલ કરો નહિંતો પ્રતિષ્ઠાનું કામ લાભાશે અને આવાં ચોકખાં સુહૃત્તો વારંવાર આવતાં નથી.

હવે આગેવાનોની મીરીંગો હિવસે થવા લાગી. પન્થાસળ મહારાજ તેમાં પ્રસંગે પ્રસંગે હાજરી આપવા લાગ્યા.

‘આજે તમારે આંગણે પ્રતિષ્ઠા જેવો માટામાં મોટો સુઅવસર આવ્યો છે. પ્રતિષ્ઠા ઉત્સવ તો એક વાર જ આવે. તમારા હાહરની પ્રસિદ્ધિ સારી છે. તમે બધા શક્તિશાળી અને ભાવનાશાળી છો. ધર્મની વૃદ્ધિ અને શક્તાનું સિંચન મંહિરકારા આખાતવૃદ્ધમાં થશે. આપણું પરમપૂજય મુનિવર્યો અને હનારો સ્વામીભાઈઓ દર્શન-પૂજન કરી આત્મકલયાણ સાધશે. આ તો મહા પુણ્યકાર્ય છે. આ અવસર તમે બધા સુઅશાંતિ અને જીવાહ સંપર્યી એક ધીજાના સહકારથી તન-મન ધનથી ભાવપૂર્વક ઉજવશો તો તમારી શોભા વધશે. હવે વિલંખ ન કરો. જે જે ભાગ્યશાળીના જે જે ભાવ હોય તે મારી સમક્ષ જણું વે અને ટીપનું મંગળ સુહૃત્તો શરૂ કરો. ’

પન્યાસળુ મહારાજના ઉપદેશની જાહેર અસર થઈ, તેજ પ્રસંગે હા. ૬૦૦૦) અડધા કલાંકમાં ભરાઈ ગયા અને ધીમે ધીમે તેમાં હા. ૧૩૦૦૦) થઈ ગયા. હાદરના ભાઈઓ આ જોઈને અકિંત થયા. બધા આ મંગળ શરૂઆતથી હવિંત થયા, આનંદ આનંદ છવાઈ રહ્યો.

પ્રતિષ્ઠાનું ફેંડ ચાલુ રાખવા પન્યાસળુએ પ્રેરણા કરી. પછી પ્રતિષ્ઠાના જુહા જુહા કાર્યો માટે જુહી જુહી કમીઠી નક્કી કરવામાં આવી અને પ્રતિષ્ઠાની તૈયાર થવા લાગી.

પ્રતિષ્ઠાના દિવસને થોડી વાર હતી તેથી પન્યાસળુએ ઘાટકોપર-થાણું જઈ આવવાનો વિચાર હશોંયો. અને હાદરથી વિહાર કરી કુરલા થઈ ચેમણુર પદ્ધાર્યો. ચેમણુરના હવાપાણી સારાં અને ત્યાં સંધ તરફ અકિંતલાલ હશોંવનાર ણીહાલાવાળા ડાક્ટર રતનશીલાઈનો. ભાવલાર્યો આથડ હતો. તેથી થોડા દિવસ સ્થિરતા કરી. ચેમણુરથી વિહાર કરી પન્યાસળુ ઘાટકોપર પદ્ધાર્યો. ઘાટકોપરમાં પન્યાસળના વ્યાખ્યાનમાં લોકો સારો રસ લેવા લાગ્યા. કાશીવાળા વિક્રાન યતિ શ્રી હીરાચન્દ્રલુ ઘાટકોપર આંધ્રા હતા. પન્યાસળની આજાથી યતિ શ્રી હીરાચન્દ્રલુએ ઘાટકોપરમાં મનનીય વ્યાખ્યાન આપ્યું. ઘાટકોપરથી વિહાર કરી ભાંડુપ થઈ સુલુંડ પદ્ધાર્યો. સુલુંડ પણ દિવસે દિવસે ઢીક વધતું જય છે. ત્યાં શ્રી અમરચંદ વેતાલાઈ અને શ્રી હર-ગોવિંદભાઈ રામજી જેવા વિક્રાન અને ધર્મનિષ્ઠ આગેવાનો છે. સુલુંડમાં મંહિર તથા ઉપાશ્રય માટે સારી એવી જગ્યા છે મહારાજશીંગે તે જગ્યામાં મોદું જાંય મંહિર તથા વિશાળ ઉપાશ્રય માટે આગેવાનોને એ સમયે સૂચના કરેલી અને આજે

આપણે સુલુંડમાં ભંય જીનાલય અને ઉપાશ્રય જોઈએ છીએ.  
 શ્રી હરગોવિંદભાઈ રામજીભાઈ તો સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી,  
 બંગાળી અને મરાಠીના સારા અભ્યાસી છે. જ્યોતિષ શાસ્ત્રમાં  
 પ્રવીણ છે અને જીનાનના રસિયા છે. તેમની પાસે ઉત્તમોત્તમ  
 પુસ્તકેનો સારો સંશોધ છે. સુલુંડના વિકાસમાં તેઓ તથા  
 શ્રી શેઠ મહીલાલ ચત્રભૂજભાઈ તથા શા. મૈધળ હીરળ  
 ખુક્સેલ્લરની લાણેજ રાણુભાઈ જે જૈન તત્ત્વના સારા અભ્યાસી છે.  
 તથા જૈન જૈનેતર બહેનોમાં સારા સંસ્કારો સુલુંડમાં રેડાયા છે.  
 વગેરેનો સારો એવો ક્ષાળો છે.





## થાણુની પ્રાચીનતા

( ૩૧ )

‘મહારાજ ! આપ આપની સુશીલ, ઇપકુમારી ચંદ્રાનના પુત્રી મહનમંજરી માટે ચિંતા કરો છો. પણ તે મહાબાળયશાળી છે. તેને મહાપ્રભાવશાળી, રિદ્ધિ-સિદ્ધિવાળો રાજકુમાર મળશે.’ રાજલેખીએ વસુ રાજને ભવિષ્યની આગાહી કહી.

‘લેખી મહારાજ ! તમારી વાત સાચી હશે પણ પુત્રી મહનમંજરી હવે ઉંમર લાયક થઈ છે, તેથી તેની માતાને વિશેષ ચિંતા થાય છે. રાજકુમાર મળશે પણ કયારે ! કેવી રીતે મળશે !’ રાજલેખી ચિંતા હર્થાવી.

‘આપ કશી ચિંતા ન કરો. પૂર્વભવની લેણુદેણુના થોડો આવતી પૂર્ણભાના પ્રભાતે સમુદ્ર કિનારે ચમ્પક વૃક્ષની છાયામાં આરામથી નિદ્રાધીન રાજકુમાર મળશે. તેના પુણ્યપ્રભાવથી વૃક્ષની છાયા જેમની તેમ તેમના ઉપર સ્થિર થઈને રહેશે. એ નિશાની છે.’ રાજલેખીએ સ્પષ્ટતા કરી.

‘ જેણી મહારાજ ! તે સમુદ્ર કિનારે કેવી રીતે આવશે ! આપણે તેમનો કેવી રીતે સતકાર કરવો ?’ રાણલુણે પ્રશ્ન કર્યો.

તે એક વિચિત્ર પ્રસંગ છે. તે કથા તે ચેતે જ સંબળાવશે. આપ તો એક ઉત્તમ અધ્યરત્નને તેમની પાસે મોકલશો તથા તેમનો રૂડી રીતે નગરપ્રવેશ કરાવશો.

રાજનેધી પાસેથી મહનમંજરીના ભાવિપતિના આગમનની વાત સાંભળી રાણને કૌતક થયું. પૂર્ણિમાના પ્રભાતે સુલટોને અધ્યરત્ન સમુદ્ર કિનારે લઈ જવા આજા કરી. ચમ્પકવૃક્ષની છાયામાં કોઈ તેજસ્વી ચુવાનને લોઈ આશ્ર્ય થયું. ચમ્પકવૃક્ષની છાયા અરાબર રાજકુમાર ઉપર જ સ્થિર હતી અને સુસાઇરનું મુખાનિંદ નિદ્રામાં પણ મહાપ્રભાવશાળી અને હાસ્ય અરતું તેજસ્વી હતું. સૂર્યના લાલ કિરણો વધવા લાગ્યા અને કુમાર જાગી ઓઠ્યા. હું કયાં આવ્યો છું ! આ સુલટો કેણું હશે ! આ અધ્યરત્ન ડેઝ આવ્યો હશે ! વગેરે વિચારો રાજકુમારના મનમાં થવા લાગ્યા.

‘ કુમાર ! અમારા શહેરના મહારાજ વસુદેવે આ અધ્યરત્ન આપને માટે મોકદ્યો છે. આપ અમારા રાણલુણા માનવંતા ભહેમાન છો. આપ સુણે પધારો અમારી નગરી પાવન કરો. આપનો યોગ્ય સતકાર થશે.’

હું સમુద્રમાંથી કયાં આવી ચકડો ! કયાં પેલા ધ્વનશૈઠ ! કયાં એ વહાણુ, કયાં પેતાના હાસ-હાસી, કયાં પેતાના શાંકો, કયાં લક્ષ્મી અને કયાં આ સમુદ્ર કિનારો, આ અવનવી નગરી, કયાં આ સુલટો અને કયાં આ અધ્યરત્ન ! આ તો કોઈ પરી-

કથા જેવી વાત થઈ. આમ વિચારતંડ્રામાં હતો. ત્યાં સુલાટોના મીઠાં-મધુરાં વચ્ચનો સાંખળી શાંતિ થઈ. પોતે અસ્થારૂઢ થયો અને નગરપ્રવેશ કર્યો. અસ્થરતન પર આરૂઢ થગેલા પુષ્ટ્ય-પ્રભાવક તેજસ્વી કુમારને જોવા શરેરના નગરજનો ઉમટયા. બણરો અને હવેલીઓ સ્વી-પુરુષોથી છવાઈ ગઈ. કુમાર નગર-જનોનું સંનાન સ્વીકારતો રાજમહેલમાં આવી પહોંચ્યો. રાજ વસુદેવે કુમારનું હર્ષથી સ્વાગત કર્યું. બન્ને બાવપૂર્વક લેટયા. આનંદ આનંદ છવાઈ રહ્યો.

કુમારનું રૂપવાવણ્ય, પ્રતિભાશાલી ચહેરો, ચમકતી આંખ-ડીઓ, તેજસ્વી લક્ષાટ, હસ્તું વહન, ગૌરવર્ણ અને સુદૃઢ શરીર વગેરેથી રાજ વસુદેવને હર્ષ થયો. રાણીઓ અને રાજ-કુળને આ મોંદેરા મહેમાનને જોઇની ભારે આનંદ થયો. મહનમંજરીને તો કુમારને જોઇને પૂર્વભવની પ્રીત યાદ આવી અને તે મીઠી પડી.

કુમાર પ્રાતઃકિયાથી પરવારી સનાનાહિક કરીને અંતઃપુરમાં પદ્ધાર્યો, હાસ-હાસીઓ. હાજર થઈ ગયા. પટરાણીએ મંગળ વચ્ચનોથી સ્વાગત કર્યું. સુખાસને ઐસાડી ફર્હી-સાક્ર ચખાડી મીઠાઈ, હુધ અને વિવિધ વાનીઓથી તેમને શાંત કર્યો. કુમાર પણ આવા પ્રેમલાર્યો સ્વાગતથી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા.

આનંદ ભવનમાં રાજલુ તેમની રાહ જોતા હતા. અંતઃપુરમાંથી વિદ્યાય લઈને રાજલુ પાસે આવ્યા. રાજલુએ મધુર વચ્ચનોથી સ્વાગત કર્યું. બન્ને શાંતિપૂર્વક સુખાસનોમાં એઠા.

‘લાગ્યશાળી કુમાર! તમને જોઈને કોઈ સ્વજનને મહિયા જેટલો આનંદ થાય છે. તમે આ મારી નગરીમાં પગલાં કર્યાં તેથી અમને બધાને ભારે હથું થયો છે. તમારા જેવા પુષ્ટ્ય-પ્રભાવક નરરત્ન મારે ત્યાં કયાંથી! પણ કુમાર! તમે તમારો પરિચય આપશો તો વિશેષ આનંદ થશો.’ રાજ વસુદેવે જિઝાસા દર્શાવી.

‘મહારાજ! એ કુથા મોટી છે. આપની જિઝાસા સંતોષવા મારે આપને અથડીતિ વાત કહેવી પડશે. શાંતિથી સંબંધો.’ કુમારે રૂપણતા કરી.

‘મારું નામ શ્રીપાળ છે. હું રતનકીયનો રાજકુમાર છું. રતનકીયથી વહાણુમાં અમે નીકળ્યા સાથે એક ધ્વલ શેઠ નામના શેઠ હતા. મારી વધતી જતી ઋદ્ધિ-સિદ્ધિની એ ધ્વલ શેઠને ઈધ્યા થધ. તે લાગ જેવા લાગ્યા. એક હિવસ મને મીઠા વચ્ચનોથી પોતાના સ્થાને બોલાવી મીઠી મીઠી વાતો કરી મને લોળ્યો. લાગ જોઈને મને સસુદ્રમાં ધકેલી હોયો. હું તો નવપદજીનો આરાધક હોવાથી મેં નવપદજીનું સમરણ કર્યું. ધર્મ અને નવપદજીની પસારે જલતરણી વિદ્યાના ચોગે મોટા મગરમન્ધની પીડ મને મળી આવી, હું તરતો તરતો નવપદજીનું ધ્યાન ધરતો ધીમે ધીમે સસુદ્ર કિનારે આવી પહોંચ્યો. પરિશ્રમથી હું ખૂબ શ્રમિત થયો હતો. વળી આરામની મને જરૂર હતી તેથી આ ચંપડ વૃક્ષની શીતળ છાંયામાં હું સૂઈ ગયો અને મને મીઠી નિદ્રા આવી ગઈ. હું એક હિવસ અને એક રાત્રિ ખૂબ સૂતો અને આજ પ્રભાતે મારી પાસે સુલટો અને અધરરત્ન જોઈને મને આશ્રમં થયું. આપનો મારા પ્રત્યેનો

પ્રેમલાવ જોઈ મને આનંદ થયો. હું મારી જાતને ધન્ય માનવા લાગ્યો. 'કુમારે પોતાની વીતક કથા કહી સંભળાવી.

રાજણ આ વાત સાંભળી અકિત થયા. નવપદળ આરા-ધનાનો ધર્મ પ્રલાવ જોઈને રાજણ પણ પ્રલાવિત થયા. પોતાની પુત્રી મહનમંજરીને આ ભાગ્યશાળી કુમારને આપવા નિર્ણય કર્યો.

શ્રીપાળકુમાર અને મહનમંજરીના લગ્નોત્સવ ખૂબ ધામ-ધૂમથી કરવામાં આવ્યો. નગર આણામાં આનંદ ઉત્સવ થઇ રહ્યો. ભાગ્યશાળી શ્રીપાળકુમારને જોઈ બધા ધન્ય ધન્ય કહેવા લાગ્યા.

રાજ વસુહેવે શ્રીપાળકુમારને પોતાના રાજ્યમાં 'રક્ષ-પાળ' બનાવ્યા અને આનંદ પ્રમોદથી રહેવા લાગ્યા.

થોડા સમય પછી પેદો ધ્વલશેઠ પણ પોતાના વહાણો લઈને થાણું બંદરે આવી પહોંચ્યો. કેટણું લઈને રાજ-દરખારમાં આવ્યો. શ્રીપાળને રાજણની પાસે એઠેલો જોઈને અકિત થયો. શ્રીપાળે પણ ધ્વળશેઠને ઓળખી લીધા. રાજની કુંવરી સાથે શ્રીપાળ પરણ્યો. છે તે વાત સાંભળીને ધ્વળશેઠનો ઈધ્યોગ્રિ વિશેષ સંગ્રહ્યો. રાજણને દરી મળ્યો. અને આ તો દૂસરાંતિનો છે તેમ ઠસાંયું. દૂસરાંતિના કેટલાક લોકોને લાક્ય આપી શ્રીપાળ અમારો સંબંધી છે તેમ કહેવરાંયું. રાજ પણ આ જાણીને જાત-જાત પૂછ્યા વિના પોતાની પુત્રીને આપવા માટે અક્ષેસાસ કરવા લાગ્યા. પણ પુત્રી મહનમંજરીએ કહ્યું, શ્રીપાળકુમાર તો રતનદીપના રાજકુમાર.

છ. આ ધવળશેઠ કૃષ્ણાંગજિંશી આ બધું તરકટ કરે છે તેમ જણુંયું. રાજને ધવળને પકડાવી કારાગૃહમાં પૂરો પણ શ્રીપાણને દ્વારા આવવાથી તેને છાડાયો.

શ્રીપાણ અને ધવળશેઠ સાથે રહેવા લાગ્યા આનંદ વિનોદની વાતો. કરવા લાગ્યા પણ ધવળશેઠને તો કૃષ્ણાંગ હતી જે તે શ્રીપાણને ઘાટ ઘડજાની પેરવીમાં હુતો. એક હિક્સ લાગે જેઠને શ્રીપાણના મહેલ ઉપર ચઢી તેની હત્યા કરવા નિયાર કર્યો. પાટલાંગાના આધારે કટારી લઈને ચડવા લાગ્યો. ધવળશેઠના પાપોનો પરિપાક થઈ ગયો હતો. કટારીથી તે નિર્દોષ એવા શ્રીપાણની હત્યા માટે જતો હતો પણ પાટલાંગાના ધૂઢી જવાથી તે પડ્યો. અને તે જે કટારી તેના કાળજામાં ચેસી ગઈ અને તે પાપોનો હિસાબ આપવા ત્યાંને ત્યાં જ મરણું પાડ્યો.

જે પ્રાચીન સ્થાન થાણુા નગરીમાં શ્રીપાણ મહારાજ નવપદજીની આરાધનાથી સમુદ્ર તરીને ચમ્પકવૃક્ષની છાયામાં શાંતિ પામ્યા અને રાજ વસુદેવ તરફથી સન્માન પામી રાજકુંવરી મહનમંજરી સાથે લખચંથીથી જોડાયા અને સુખ વૈલન પામ્યા. એ પ્રાચીન થાણુા નગરી સુપ્રસિદ્ધ છે. સુંભઈ નગરી તો થોડા જ વર્ષોમાં સમૃદ્ધ બની તે પહેલાની થાણુા નગરી પ્રાચીન ગણ્યાય છે.

આ પ્રાચીન થાણુનગરીમાં પહેલાં થોડાં જૈન કુદુંએ હતા પણ ધીમે ધીમે વસતી વધવા લાગી. આને તો થાણુા તીર્થ સ્થાન અની ગણું છે.

સં. ૧૯૪૨ માં પરમહિંદુકારી પરમપૂજય શ્રી મોહનલાલજી મહારાજ પવાર્યી હતા. આ મહાપુરુષના મંગળ હસ્તે થાણ્યાના જૈન મંહિરમાં શ્રી આદીશર ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સં. ૧૯૬૨ માં પણ એને માળ શ્રી કેશરીયાનાથજીની પ્રતિષ્ઠા પણ પરમપૂજય શ્રી મોહનલાલજી મહારાજના વરદ હસ્તે ખામધૂમપૂર્વક કરવામાં આવી હતી. ત્યારથી થાણ્યાના જૈન સુંધરી હરેક પ્રકારે ઉજ્જ્વલિ થઈ રહી છે.





## આર આર વર્ષના કલેશનું સમાધાન

( ૩૨ )

‘કૃપાસિંહુ ! આપની મીડી મધુરી વાળી સાંભળી અને તે સુધ્ય થયા છીએ. અમારા થાણું સંધના અહોભાગ્ય કે આપશ્રી પદ્માર્થી અને અમારામાં ધર્મ લાવનાની જ્યોતિ જગાવી.’ થાણુના આગેવાને પન્ચાસજી મહારાજને ચોતાનો આનંદ વ્યક્ત કર્યો.

‘ભાગ્યશાળી ! થાણું તો પ્રાચીન નગરી છે. પરમ પવિત્ર નવપહણના મહાન આરાધક શ્રીપાળ મહારાજની આ ધર્મ ભૂમિ અને કર્મ ભૂમિ છે. તમારા આત્મકલ્યાણ માટે ઉપદેશ આપવો એ તો અમારું સાધુઓનું કર્તૃંય છે. લોગેવાન મહા-વીરના સાધુઓએ તો વિદ્યના કલ્યાણ માટે છે.’ પન્ચાસજીએ સાધુઓનું કર્તૃંય હશોંયું.

સાહેબ ! આપ તો જાણો છો વીસમી સહીના જગ્યેતિ-  
ધ્ર્ય, પંબા દેશોદ્વારક, ન્યાયાંકોનિધિ જૈનાચાર્ય શ્રી વિજયા-  
નંદસૂરીશ્વરજીના શિષ્ય ન્યાયરત્ન શ્રી શાન્તિવિજયજીએ બાર  
વર્ષ સુધી થાણુમાં સ્થિરતા કરીને નવપદજી તથા શ્રીપાળ  
મહારાજના જીવન પ્રસંગોને દર્શાવતું નૂતન જીવનમંહિર તૈયાર  
કરાવવાં લગ્નિરથ પ્રયાસ કર્યો છે. જમીન પણ લેવાઈ ગઈ છે  
અને કળામય મંહિરનો પ્રારંભ પણ થઈ ગયો છે, પીળ  
આગેવાને વીજત જણ્ણાટી.

‘પણ તો પછી કામ કેમ અટકયું છે ! થાણુા જેવા પ્રાચીન  
સ્થાનમાં નવપદજીના મંડળ વાળું અને શ્રીપાળ મહારાજના  
જીવન દૃશ્યોથી કંડારેલ કળામય મંહિર થાય તો થાણુા તીર્થ-  
સ્થાન થઈ જાય, અને સુંખાઈના લાઘો જૈન ભાઈ-અહેનોનું  
પ્રેરણુા ધામ બની રહે.’ પન્યાસજીએ ઉચ્ચ જાવના દર્શાવી.

‘હ્યાણુ ! શું કહેલું ! અમારા કમનસીએ થાણુા સંઘમાં  
મતલેદ ઉભો થયો છે તેથી આ નવા મંહિરનું કામ અટકયું  
છે. એ મન હુંખતું કોઈ આજ સુધી નિવારણ કરી શકયું  
નથી. આપ કૃપા કરી થાડી સ્થિરતા કરો તો બાર વર્ષના  
કલેશનો અંત આવે અને કળામય મંહિરનું કામ પૂર્ણ થાય.’  
એક આગેવાને આથડી ભરી વિનાંતી કરી.

૧૯૬૪ ના મહા મહિનામાં પન્યાસજી શ્રી ઋદ્ધિ સુનિલ  
સુંખાઈથી વિહૃત કરી નાસિક જવા માટે થાણુા પધાર્યા. થાણુામાં  
ધ્યાનયાન આદિથી ત્યાંના સંધને આનંદ થયો. થાડા દિવસ  
પછી મહારાજશ્રીએ નાસિક જવાનો વિચાર દર્શાવ્યો. આગે-  
વાનોએ થાણુાના બાર બાર વર્ષના કલેશની વાત રંજુ કરી.

મંહિરતું કામ અટકયું છે તે જાણી મહારાજશ્રીને પણ તે માટે પ્રયાસ કરવા આવના થઈ. સંઘની વિનિતિને માન આપી પન્યાસળુએ થોડી વિશેષ સ્થિરતા કરી. વ્યાખ્યાનમાં પણ હુમેશાં સંઘની એકતા, થાણુાની પ્રાચીનતા, કળામય મંહિરથી થાણુા કેલું રમ્ય તીર્થધામ બની રહેશે? થાણુના શ્રી સંઘની વધતી જાહેરજાતી, કુસંપના કડવા ઝળ, વગેરે પ્રેરણુત્તમક ઉપદેશ આપતા રહ્યા.

તડતું કારણ જાણી લઈ બન્ને તડના આગેવાનોને જુહા જુહા એવાવી મતલેહ હું કરવા અને સંપ-સમાધાન કરવા તનતોડ પ્રયાસ કર્યા, ધીરે ધીરે બજે તરફના આગેવાનોના હિલ સાંક થવા લાગ્યા. એક વખત તો બન્ને પણ્ણો લેગા થઈ સમાધાન માટે વાટાધાટો કરવા લાગ્યા. હવે સમયનો પરિપાક થયો જાણી પન્યાસળુએ બન્નેને મધુરવાણીમાં કલેશને જડમૂળથી ઉઝેડી ઝેંકી હઈ સંપ-સુલેહ કરવા આગ્રહ કર્યો.

જ્યારે થાણુના સંઘના સંપ-સમાધાન માટે વાટાધાટો ચાલતી હતી તે સમયે હાદરના સંઘના આગેવાનો પન્યાસળ શ્રી ઋદ્ધિમુનિનું હાદરના જૈન મનિદરની પ્રતિષ્ઠા ઉપર પધારવાની વિનિતિ કરવા થાણુા આવી પહેંચ્યા. આ હાદરના આગેવાન જાઈએની હાજરીથી લથા પન્યાસળ મહારાજના અવિરત ઉપદેશથી થાણુના આગેવાનોના મન ખૂબ નરમ થયાં અને બન્ને તડના અગેવાનોએ વ્યાખ્યાનમાં જ જાહેર કર્યું કે, વર્ષોથી જમી ગયેત કુસંપને કાઢવાની અત્યંત જરૂર છે. થાણુા સંઘનું વષેનું કાર્ય અટકી રહ્યું છે. કળામય મંહિરતું કામ પણ અધૂરું છે. મનહુઃખ વધ્યા કરે છે. સંઘની જ્ઞનતિને બદલે છિન્નમિન્નતા।

દેખાય છે, પન્થાસળ મહારાજશ્રીએ અમારી ઉપર કૃપા કરી કુસંપને દેશવટો આપવા માટે જહેમત ઉઠા વીને બન્ને તડોના કાઈઓને સમબાળી સમાધાનને માર્ગે વાળ્યાં છે. સુલાંગે આપશ્રી હાદરના આગેવાનો પદ્ધાર્યાં છે. સમાધાન માટે ત્રીજ નિષ્પક્ષ વર્ગની ખાસ જરૂર હોય છે. તો આપ શ્રીમાનોને અમારી આચહુ ભરી વિનતિ છે કે આપશ્રી આ સમાધાનને માર્ગંદર્શન આપો અને અમારા બજે તડમાં સુખશાંતિ સ્થાપો. ’

પન્થાસળ મહારાજે પણ આ સુદાની વાતને પુછિ આપી અને થોડી વિચારણા પછી હાદરના પંચ તરફથી શા ઝૈજમતળ તથા શા વીરચંદળુએ જણ્ણાંયું કે ‘હાદરના આગેવાનો જે નિર્ણય કરે તે બજે તડવાળાને માન્ય છે’ તેમ બન્ને તડવાળા લખી આપે તો અમે જવાબહારી લેવા તૈયાર છીએ. બન્ને તડવાળા આગેવાનોએ તે પ્રમાણે લખી આપ્યું.

લવાહ તરીકે ની માયેવા શા ઝૈજમતળ તથા શા વીરચંદળુએ સમાધાન માટે ખૂબખૂબ પ્રયાસ કર્યો. બન્ને પક્ષની તકરારે સાંલળી. બન્નેના મતલેઢોના સુદાએ વિચાર્યાં અને નિર્ણય ઉપર પણ આવ્યા. છેવટનો સુસદો તૈયાર કર્યો પણ પાછળથી થાણ્ણાના આગેવાનોને શંકા થઈ અને હાદરના આગેવાનો પોતાનો નિર્ણય બહાર પાડી શક્યા નહિ. તેએ પન્થાસળની રણ લઈ હાદર ચાલ્યા ગયા. થાણ્ણામાં પણ આશા નિરાશાના રૂપમાં ઝૈરવાઈ ગઈ અને બધા ઉદાસ બની ગયા. પન્થાસળ મહારાજશ્રીને પણ હુઃખ થયું. થાણ્ણાના ઉત્કર્ષ માટેની બધી જહેમત નકામી થઈ પડી.

પન્થાસળ મહારાજને ત્રીજે ઉપવાસ હતો. પાંચ ઉપવાસ કરવાના હતા. ત્રીજે ઉપવાસે તેઓ સુલુંદ વિહાર કરી ગયા. પન્થાસળના વિહારના સમાચાર પવન વેગે થાણુભાં પ્રસંગી ગયા. સ્વી-પુરુષો-વૃદ્ધો તથા ચુંબકો બધાં સમસમી ઉઠ્યા. થાણુના જૈનેતર આગેવાનોને પણ ભારે હુંઅ થયું. તેઓએ જૈન સંઘના આગેવાનોને ઠપકો પણ આપ્યો. ચિંતામણી રતન સમાન શુરૂવર્ય મહિયા અને તેઓએ તમારાજ સંઘના કલ્યાણ માટે રાત-દિવસ ચિંતા કરી સમાધાન માટે માર્ગદર્શન આપી ભારે પ્રયાસ સેવ્યો પણ કમનસીએ સમાધાન થઈ શક્યું નહિ. વાતાવરણ ગમળીન બની ગયું. બધા આગેવાનો એકઠા થયા. પન્થાસળ તપશ્ચિયોમાં વિહાર કરી ગયા તે માટે બધાને અત્યંત હુંઅ થયું છે. છેવટે ફરી વાટાધાટ થવા લાગી, અને પરસ્પર સલાહ કરી તેજ રાતે ૭૫ બાઈઓ સુલુંદ પન્થાસળ મહારાજ પાસે પહોંચી ગયા.

‘શુરૂવર્ય ! આપ તપશ્ચી છો. હજુ તો ત્રીજે ઉપવાસ ચાલે છો. પાંચ ઉપવાસનું’ પારણું થાણુભાં જ થલું જોઈએ. અમારા શ્રી સંઘની વિનતિ સ્વીકારી આપ થાણું પધારો. પારણું કરી આપ સુખેથી પધારશો. અમારા મનને ભારે હુંઅ થયું. ઘણું બહેન બાઈઓ તો ઉદ્ઘાસ બની ગયા છે, આગેવાનોએ પાર્થના કરી.

‘બાળ્યશાળીઓ ! અમારે સાધુને તો જ્યાં શાંતિ હોય, જ્યાં સંપ હોય, જ્યાં પ્રેમ-ભાવના હોય, જ્યાં સમાજનો ઉત્કર્ષ સધાતો હોય. જ્યાં ધર્મ-ભાવના ચોપાતી હોય, જ્યાં દેવ-શુરૂ અને ધર્મનું બહુ માત થતું હોય, જ્યાં સાધુ-સાધી

ની વેદાવચ્ચય થતી હોય ત્યાં રહેવાનો—જવાનો—સ્થિરતા કરવાનો અમારો પ્રથમ ધર્મ છે. તમારા ઉત્કર્ષ માટે, તમારા કલ્યાણ માટે, તમારા સંપ-સમાધાન માટે, તમારા શહેરની પ્રાચીન જહોજવાળીને વિશેષ ઉજવણ કરવા માટે, તમારા શહેરના કળામય મંહિરને પૂર્ણ કરાવવા માટે મેં તો બથાશક્તિ પ્રથાસો કર્યા, દાહરના આગેવાનોએ તો ખૂબ જહેરત ઉકાવી પણ સમયનો પરિપાક નહિ હોય' કેવો ભાવીભાવ, 'પન્યાસલુએ રૂપણ સાંભળાવી દીધું.

'કૃપાળુ ! બીજું કાંઈ નહિ પણ આપ તપસ્વી છો અને પારણું કર્યો વિના થાણું છોડી સુલુંદ આવી ગયા તેમાં અમારી પ્રતિશા અને અમારી શુરૂલક્ષિતનો પ્રશ્ન છે.' એક આગેવાને સુંકેલી હશોંવી.

'આઈ ! વાત તો સાચી પણ મેં તો નિર્ણય કર્યો છે, કે થાણુભાં સમાધાન વિના પગ મૂકવો નહી. જ્ઞાની મહારાજે જે ધાર્યું હશે તે જ થશે પણ હવે હું તો અહીં જ પારણું કરીશ. તમારું શ્રીસંધ્યનું હું તો કલ્યાણ જ ઈચ્છિશ.' પન્યાસલુએ પોતાનો નિર્ણય દર્શાવ્યો. પન્યાસલુની પ્રતિશાથી બધા ભાઈઓને વિચાર થઈ પડ્યો. વાટાધાટ થવા લાગી. પણ કેટલાક સુખ્ય આગેવાનો થાણું હોવાથી બધાં થાણું ગયા. ત્યાંને ત્યાં રાત્રે સંધની સભા એવાલાવી. મહારાજશ્રીની પ્રતિશા અને તેમની તપશ્ચયોએ બધાના મન પીગળાવી દીધા. પન્યાસલુ મહારાજની આજા શિરોધાર્ય કરવા નિર્ણય થયો.

સુવારના આગેવાનો સુલુંદ આંબા. પન્યાસલુ મહારાજને સુભાની બધી માહીતી આપી. આપશ્રી જે આજા કરશો તે

અમને બધાને શિરેધાર્ય છે અને આપણી થાણા પધારો અને ત્યાં જ પાંચમા ઉપવાસનું પારણું કરવાનું છે. વગેરે જણ્ણાંયું.

પન્યાસળ સમાધાનની વાત સાંભળી હવિંત થયા પણ પન્યાસળ તો ખૂબ વ્યહાર કુશળ હતા તેથી રૂપણ જણ્ણાંયું.

‘જુઓ તમે છેલ્દો નિર્ણય કરીને આવ્યા છો. સમાધાન તો હવે થઢજ ગયું સમનો. ત્યારે અહીં તમે બજે તડવાળા ભાઈઓ આજેજ સાથે એસીને જમો. અને સમાધાનના શી ગણેશ શરૂ કરો.’

આ નવીજ હરખાસ્તથી બધાનાં મન પ્રકૃતલ થયાં. સુલુંદ્વાળા ભાઈઓએ થાણાના આગેવાનોનું ખૂબ સુંહર સ્વાગત કર્યું. બધા આનંદપૂર્વક સાથે એસીને જમ્યા. વર્ષોના વિલેગ સ્નેહના મંગળ-મિત્રનમાં પરિષ્ણિત્યા. આનંદની લહરીઓ લહેરાણી.

પન્યાસળએ સુલુંદ્થી વિહાર કર્યો. થાણાનો પ્રવેશ અનુપમ હતો. પાંચ ઉપવાસનું પારણું આનંદપૂર્વક થયું. સંઘ આખામાં સંપના મોળાં ઉછળી રહ્યાં. આનંદ આનંદ છવાઈ રહ્યો. આખાત વૃદ્ધ બધાં પોતાને ધન્ય ધન્ય માનવા લાગ્યાં. થાણા શરેરનું વાતા-વરણ પરંમ પવિત્ર, સુખશાંતિમય અને આનંદપૂર્વ મધમદી રહ્યું.

પન્યાસળની આજા પ્રમાણે બન્ને તડોએ સમાધાનની શરતો સ્વીકારી લીધી. બાર બાર વર્ષના કલેશનો અંત આવ્યો. પન્યાસળના પ્રયાસો કર્યા. દાહરના અગ્નિવાનો શેઠ ફૈજમલલુ તથા શેઠ વીરચંહલુએ ભારે પરિશ્રમ કરી આખીરાતનો ઉલાગરે કરી ફૈંસલો તૈયાર કર્યો. પન્યાસળ મહારાજે તે ફૈંસલો સાંભળ્યો.

તેઓ તે સાંલળી હબિંત થયા. સવારમાં થાણુના શ્રી-પુરુષોથી ઉપાશ્રય ચિકાર બશાઈ ગયો. પન્યાસળુ મહારાજના જ્યનાહોથી ઉપાશ્રય ગુંલુ ઉઠ્યો. પન્યાસળુએ કેંસલો સંભળાવ્યો. ન્યાયપૂર્વું કેંસલો સાંલળી બધાના હૃદય આનંદથી નાચી ઉઠ્યા. આખા ઉપાશ્રયમાં આનંદની લહેર લહેરાણી. થાણુના બન્ને તડેના બાઈએ. પરસ્પર પ્રેમપૂર્વક લેટ્યા. આગેવાનોએ હાદરના આગેવાનો, સુલુંદના આગેવાનો, પન્યાસળુ મહારાજ વગેરેનો ખૂબ હૃદયપૂર્વક આલાર માન્યો. શ્રીકૃણની પ્રલાવના કુરવામાં આવી. જ્યનાહોથી કરી ઉપાશ્રય ગુંલુ ઉઠ્યો. થાણુનગરની સમુજ્ઞતિ ‘અને સમુત્કર્ષનો પાચો નંખાયો. થાણુ તીર્થધામ બનવા સર્જું’.





## દાહરનો ભવ્ય પ્રતિષ્ઠા-મહેંતસવ

( ૩૩ )

હાહરના પ્રતિષ્ઠા-ઉત્સવ માટે થાણુથી વિહાર કરી પન્ચાસળ હાહર પધાર્યો. થાણુના આખાળવુદ્ધના હુદ્ધયમાં મહારાજની સૌન્ધર્ય, શાંતા, તપસ્વી સુર્તિ ડેતરાઈ ગઈ હતી. હર્ષ અને આનંદની લાગણ્ણીઓથી થાણુની વિહાય ચિરસ્મરણીય હતી. તેણું જ હાહરના શ્રી સંધુંબાલયું સ્વાગત હતું. શ્રી શાંતિનાથ પ્રલુના જયદોષથી ઉપાશ્રય શુંજુ રહ્યો હતો. પન્ચાસળના જયનાહોથી સ્વી પુરુષોએ હાહરની બજારો ગણવી મૂકી હતી. હાહરના શ્રી સંધુંબાલના આનંદની સીમા નહોંતી. પન્ચાસળની તમન્ના, હાહરના, આગેવાનોની જહેમત, થાણુના નૂતનકળામય જીનાલયની નવરચના, હાહરની પ્રતિષ્ઠાની આવી પહોંચેલી મંગળ ઘડી વગેરે પ્રસંગો બધાના હુદ્ધયમાં તાબા થયા હતા. હાહર આજે હબારો સ્વી પુરુષોથી ઉભારાઈ રહ્યું હતું. ઝાગણ સુહ ૧૨ ના રોજ મંગળપ્રલાતે પન્ચાસળએ હાહરમાં ધામધૂમપૂર્વક પ્રવેશ કર્યો.

ચૈત્ર શુક્ર ૧૩ ના રોજ હાહરના જૈન મિત્રમંડળ તરફથી પન્થાસળ મહારાજની અદ્યક્ષતામાં શ્રી મહાવીર જ્યંતી ઉજવવામાં આવી. જૈન પાઠશાળાના ખાળેકોએ લગવાન મહાવીર સ્વામીની સ્તુતિ ગાઈ સંભળાવી હતી. આ પ્રસંગે કાશી નિવાસી પ્રસિદ્ધ વક્તા વિદ્યાબંકાર યતિવર્થશ્રી હૃતાચંદ્રલુએ શ્રી મહાવીરસ્વામીની લુખનપ્રલા ઉપર મનનીય વિવેચન કર્યું હતું. જૈન સંસ્થાઓના ઘડવૈચા, જૈન-સાહિત્યરત્ન વિક્રાન સોલીસીટર શ્રી મોતીચંદ કાપડીયાએ શ્રી મહાવીર સ્વામી અને ગૌતમસ્વામીનું દણ્ણાંત આપી જૈનોની વિશાળ ભાવના અને જૈનધર્મ એ વિશ્વધર્મ બની રહેવાનો સમય આવી લાગ્યો છે. જૈનસમાજે સંગઠિત થઈ સમાજનો ઉત્કર્ષ સાધવાની જરૂર છે, સંકુચિત ભાવનાથી જૈનશાસનનું કદવાણું નથી. લગવાન મહાવીર જગતના કદવાણુદાતા હતા. આપણા પૂજય આચાર્યો, સુનિરતનો અને સાધ્વીઓએ જૈનસમાજ અને જગતના કદવાણું માટે સેવાભાવથી કાર્ય કરવું જોઈએ. વગેરે વિવેચન કર્યું હતું.

શિશ્રુતિશ્રી લોગીલાલભાઈએ ‘મહાવીર’ નામનું રહસ્ય કહ્વિતામાં ગાઈ બતાવી સલાને સુંગધ કરી હતી. છેવટે પ્રમુખ શ્રી પન્થાસળ મહારાજે લગવાન મહાવીરના ઉપસર્ગો, મહાવીરના ગણુધરોની દિંય ખુદ્ધિપ્રલા તથા લગવાનના શાસનનો ઉદ્ઘોત કરી જનારા પૂર્વના મહાન જ્યોતિર્ધર્દો વગેરેતું વિવેચન કરી હાહરમાં શ્રી સંધને આંગણે આવી પહેંચેલા પ્રતિધા મહેતસવને માટે બધાને સાથે મળી આનંદ અને શાંતિપૂર્વક કાર્ય કરવા પ્રેરણું આપી હતી. શ્રી મંગળહાસ અવેરીએ પ્રતિધા સંબંધી તૈયારી વિષે કેટલીક હકીકત રજુ કર્યો પછી

ભગવાન મહાવીર સ્વામીના જ્યનાડોથી ઉપાશ્રય શુંજ ઉઠ્યો હતો.

ધન્યાસજુ મહારાજના અત્યન્ત પરિશ્રમ અને ઉપદેશથી દાહરના શ્રી સંઘે પ્રતિષ્ઠાની લારે સુંદર તૈયારી કરી. દાહર સ્ટેશનથી પાંચ મિનિટના રસ્તા ઉપર સુંદર બનાર અને વિશાળ ચોગાન સંસુખ આવેલા શિખર બંધ નૈન મંહિરમાં ચૈત્ર વઢી ૧૩ થી પ્રતિષ્ઠા મહેત્સવની મંગળ શરૂઆત કરવામાં આવી. પ્રતિષ્ઠા માટે વિવિધ સુશોભાન તથા વીજળીક રેશનીથી જગા મગતો ભંધ મંડપ તૈયાર થઈ ગયો. પ્રતિષ્ઠા પ્રસંગે ચાર આકર્ષક જગાયાત્રા વગેરેના વરધોડા, સોના-ચાંદીના રથો સહિતના ધામધૂમપૂર્વક કાઢવામાં આંદ્રા. દાહરમાં હજારો ભાઈ બહેનો પ્રતિષ્ઠા મહેત્સવ માટે ઉમ્મી આંદ્રા હતા. અગર તડના સંધ તરફથી એ સંધજમણું તથા લાડારાવાળા શેઠ કુઓણ ભીખાળ છત્રીવાળા તરફથી એક એમ ત્રણ સંધજમણું કરવામાં આંદ્રા. પ્રતિષ્ઠાને હિવસે આકાશમાં વિમાન દ્વારા પુણ્યવૃષ્ટિ જોઇને દાહરના નગરજનો હિંગ થઈ ગયા. અષોતશી સનાત આનંદપૂર્વક ભણ્યાવવામાં આંદ્રા.

પ્રતિષ્ઠામાં પ્રભુજી પધરાવવા વગેરેને લાલ ધર્મપ્રેમી ભાઈ બહેનોએ આનંદપૂર્વક લીધ્યો અને યથાશક્તિ સારી રકમ ખર્ચની આનંદ અનુભંગ્યો.

આ પ્રતિષ્ઠા પ્રસંગે સુખ્ય ઉપજ નીચે પ્રમાણે થઈ હતી.

૨૫૦૧) મૂલનાથક શ્રી શાંતિનાથે પ્રભુને ચાદીપર બિરાજ-માન કરવાના શેઠ નેમમતલુ જરૂરી પરેતવાળા

- ૧૬૦૧) માળ ઉપરના ગલારામાં મૂળનાયક શાન્તિનાથ  
પ્રલુને ગાહી પર બિરાજમાન કરવાના શેડ રવળ-  
બાઈ સોજપાળ જે. પી. તથા શેડ પાલણુભાઈ  
સોજપાળ હાદર.
- ૧૫૦૧) શ્રી શાન્તિનાથ પ્રલુના શિખર ઉપર ઈંડું ચઠાવવાના  
શેડ શુલાચંદળ કેસરીમલલુ હાદર.
- ૨૮૫૧) શ્રી શાન્તિનાથ પ્રલુના શિખર ઉપર ધળ ચઠાવવાના  
શેડ અગાળુ રામાળ નાયગામવાળા.
- ૧૧૭૫) શ્રી શાન્તિનાથ પ્રલુના શિખર ઉપર હંડ ચઠાવવાના  
શેડ ઝૈજમલલુ કસ્તુરચંદળ પરેવવાળા.
- ૧૮૦૧) ડાખી બાળુના શિખર ઉપર ધળ ચઠાવવાના શેડ  
મોહનલાલલુ હેમરાજલુ હાદરવાળા.
- ૧૧૦૧) જમણી બાળુના શિખર ઉપર ધળ ચઠાવવાના શેડ  
જવરાજલુ ઉહેરાજલુ પોયખાવડીવાળા.
- ૭૭૫) મૂલ ગલારામાં શ્રી શામળા પાર્થનાથ પ્રલુને ગાહી  
પર બિરાજમાન કરવાના શેડ માદાળ જીતાળ  
પોયખાવડીવાલા।
- ૬૫૧) મૂલ ગલારામાં શ્રી પાર્થનાથ પ્રલુને ગાહી પર  
બિરાજમાન કરવાના શેડ તારાચંદ તિલોકચંદળ  
લોયવાડીવાળા.
- ૬૫૧) ડાખી બાળુના શિખર ઉપર હંડ ચઠાવવાના શેડ અગ-  
વાનલુ થાનાળુ લોયવાડીવાળા.

૬૫૧) જમણી બાળુના શિખર ઉપર હંડ ચઢાવવાના શેડ ચાંદમલણ ધુકાળ પોયખાવડીવાળા.

૬૫૨) ડાખી બાળુના શિખર ઉપર ઈંડું ચઢાવવાના શેડ પુનમચંદળ હંજરીમલણ પોયખાવડીવાળા.

પ્રતિષ્ઠાનું કાર્ય નિવિદને પૂર્ણ થયું. આજ તો દાહર સોનાનો દાહર, ધર્મનો દાહર અને આનંદનો દાહર બની રહ્યો છે. દાહરસ્થી વિહાર કરી પન્થાસળ મહારાજ રાવ સાહેબ શેડ શ્રી રવલુભાઈ સોજપાળના અત્યારેથી માટુંગા શેડશ્રીના શાન્તિ નિકેતનમાં પદ્ધાર્યો. શેડ શ્રી રવલુભાઈની ધર્મ ભાવના, સમાજ સેવાની ધગશ, વિદ્યા પ્રેમ, સાધુ સાધીની વૈયાવર્ય ભાવના, સૌરયતાની સૌરલ માટુંગામાં પ્રસરેલી છે પણ થાણુથી સુંખુર્ય સુધીમાં પણ તેની સૌરલ સંભળાય છે.

પન્થાસળ મહારાજે શ્રી રવલુભાઈને માટુંગા માટે ટકોર કરી કે આપના પુર્વ પુન્યથી તમારા હાથે તમોએ લક્ષ્મી પેહા કરી છે અને હેવ ગુરુ ધર્મની તમારી ઉત્સ્વ ભાવના છે, તે ભાવના આખા કુંભમાં ટકી રહે તેને માટે તમારા શાન્તિ નિકેતનમાં ધર હેરાસરની ખાસ જરૂર છે. આવા પ્રેમ કથ્યો વચ્ચે પુન્ય પન્થાસળ મહારાજના સંભળી તેજ વખતે શેડ શ્રી રવલુભાઈએ ધાતુના પંચતિર્થી ઉત્સવ પુર્વક પુજ્ય પન્થાસળની હાજરીમાં પધરાવીને દરેક ભાઈ-ખલેનોને ઉત્તમ સગવડતા કરી આપી.

સુરતવાળા બાળુભાઈ અવેરીની વિનંતીથી તેમના મલાડના નૂતન નિવાસ ગૃહમાં કરાવેલ ગૃહ મંહિરમાં ધાતુના પ્રતિમાણ પધરાવવાના હોવાથી પન્થાસળ મલાડ પદ્ધાર્યો. શેડ બાળુ-


ભાઈએ વૈશાખ વહી ૬ ને દ્વિસે શુભ મૂર્કૃતો પ્રભુ પ્રતિમાણનો પ્રવેશ કરાવ્યો. અપોરના નવાણું પ્રકારની પૂજા લાણા વચામાં આવી. સુપ્રસિદ્ધ ગવૈયા ગ્રાણુસુખભાઈએ પૂજામાં રંગ જમાવી દીધ્યો.

સાંજના શેઠ આખુભાઈએ સંઘ જમણુ કરી સ્વામી ભાઈઓની લક્ષ્ણ કરી.

પન્થાસળ મહારાજ મહાદથી માટુંગા પધાર્યો. શેઠ રવણુભાઈએ માટુંગામાં પોતાના શાન્તિ નિકેતનમાં ચાતુર્માસ રહેવા માટે આગ્રહ ભરી વિનંતિ કરી







શ્રી લૈન શ્વેતાંબર કળામય નૂતન મનીદર : થાણુા  
( ઇટો : કસુમચંદ ગુણાખચંદ ઝવેરી )



## નૈનમૂન કલામય મંહિર

( ૩૪ )

‘ મધ્યેણ વંદામિ ! ’ થાણુના આગેવાળોએ વંદણા કરી.

‘ ધર્મલાલ ! ’ પન્યાસળુએ ધર્મલાલ આપ્યા.

‘ સાહેબ ! આપે ભારે પરિશ્રમ સેવીને અમારા થાણુના સંઘનો બાર બાર વર્ષનો કલેશ મટાડી અમારા થાણુ ઉપર મહેદ ઉપકાર કર્યો છે તે માટે થાણુના આખાતવૃદ્ધ આપક્રીના ઝાણી છીએ.’ એક આગેવાને પન્યાસળનો આભાર માન્યો.

‘ ભાગ્યશાળી ! તમારું થાણુ તો તીર્થધામ છે. શ્રીપાળ મહારાજની ધર્મલક્ષ્મીનું એ પ્રાચીન શહેર છે. થાણુના સંઘમાં કલેશ હોય તેથી તો સુંભાઈના સંઘને પણ શાંતિ ન હોય. અમારું સાધુઓનું તો પ્રથમ કર્તાંય છે કે જ્યાં જ્યાં કુસંપ-કલેશ મનહુંઅ હોય ત્યાં શાંતિ રથાપણી જોઈએ. તેમાં જ નૈનશાસનનું કદ્વાલુ છે. તેમાંજ નૈન સમાજનો સાચો ઉત્કર્ષ છે.’ પન્યાસળુએ સાધુઓનું કર્તાંય હર્થાંયું.

‘કૃપાળુ ! આપણી થાણું પધારો. જેવી રીતે સંપુર્ણ કરાવી આખા સંધમાં આનંદ આનંદ ક્લાવાવી હીથે. તેવી રીતે બાર ખાર વર્ષથી અધૂરું રહેલું શ્રી મંહિરલું’ કામ પ્રેરણું આપી થાણું કરાવી આપો તો થાણુનો સંધ આપનો ચિરભણી રહેશે.’ એક આગેવાને વિનંતિ કરી.

‘હ્યાળુ ! અમારા શ્રી સંધની ભાવના થાણુને ખરેખર તીર્થધામ બનાવવાની જ છે. આ મંહિર ક્લામય કરાવવું છે. જગ્યા પણ વિશાળ છે. વળી કોઈપણ જગ્યાએ ન હોય તેથું ઐન્ભૂત ડોતરાણીવાળું બનાવવા ચોજના કરી છે. મંહિરલુના રંગમંડપમાં શ્રીપાણ મહારાજ અને દેવી મયણાસુંદરીના જીવન પ્રસંગોના દર્શયો. ડોતરાવાની વિચારણું કરી છે ઉપરાંત આપણું મહાન તીર્થધામોના પણ્ઠો પણ્ઠો ડોતરવાનાં છે.’ ધીજ આગેવાને સંધની ભાવના રજુ કરી.

‘સાહેબ ! આ મંહિરમાં નવપદજી મહારાજનું’ વિશાળ અતુપમ નવપદ-મંડળ પણ ડોતરાવાનું છે અને ધીજ પણ્ઠો જૈન સંસ્કૃતિના ક્લામય દર્શયો. હુંઘડું રજુ કરાવાની ભાવના છે.’ ધીજ આગેવાને ક્લામય દર્શયો. વિષે રજુઆત કરી.

‘કૃપાસિંહ ! આ બધાં કામોમાં આપ સાહેબની પ્રેરણુની અમને ખાસ જરૂર છે. આપ થાણું પધારશો તો અમારાં બધાં કામો યશસ્વી રીતે પાર પડશો.’ બધા આગેવાનોએ સાથે આગ્રહકરી વિનતિ કરી.

‘ભાગ્યવાનો ! તમારી ભાવના તો આદર્શ અને અત્યુત્તમ છે. થાણુની પ્રાચીનતાને ચોગ્ય ઐન્ભૂત ક્લામય મંહિરની

થાણા પણ સુખંગત છે. તો તો થાણા આદર્શ તીર્થધામ બનશે. હનરો ચાન્તિકો થાણાના હર્ષને અંવશે અને સુંબદ્ર નગરી અને પરાંઘોના હનરો ભાઈ ખડેનોનું રમરણીય અને હર્ષનીય સ્થાન બની રહેશે.' પન્થાસળાએ ભવિષ્ય બાણ્યું

'સાહેબ! અમારી શ્રી સંધની લાવના તો ઉજવળ છે પણ આવા એનમૂન કલામય મંહિર માટે લાખો ડ્રીપીઓ લેધશે ને! થાણા પાસે તો મંહિરને પૂર્ણ કરવાની પણ મૂડી નથી.' એક આગેવાને સુશકેલી હર્ષાવી.

'લાણશાળી! જૈનશાસન જ્યવંતુ છે. જૈન સમાજ હાનશર છે. પૂર્ણપુરુષોએ લાખો અને કરોડાના હાન કરી શત્રુંજ્ય, ગિરનાર, આયુ, રાણુકપુરના કળામય મંહિરો બંધાંયાં છે. કામ કરનાર નિષ્ઠાવાળા અને સેવાલાણી હશે તો પેસાનો તો વરસાહ વરસશે. થાણા તીર્થધામ બની રહેશે.' પન્થાસળાએ આશા આપી.

'સાહેબ! હવે કૃપા કરી થાણા પધારવાની અમારી વિનતિનો સ્વીકાર કરો તો અમારી લાવના ફેણે. મંહિરનું અધૂરું કામ પૂરું કરવા પ્રેરણું મળે.' આગેવાનોએ છેવટની વિનતિ કરી.

'લાઈઓ! તમારી લાવના તો સારી છે. પણ મારી એક સુશકેલી છે. મેં તો માટુંગામાં ચાતુર્મોસ રહેવાની ધર્મનિષ્ઠ શેઠશ્રી રવળુભાઈની વિનતિ સ્વીકારી લીધી છે. હવે તો તમે બધી હકીકત શેઠ રવળુભાઈને સમજાયો. તેઓ તથા તેમના ધર્મપત્ની કંકુણેન બન્નેને તમારી લાવનાની હલીક ગળે ઉત્તરશે અને તેઓ જરૂર આવા ડડા કામ માટે સહકાર આપશે.' પન્થાસળાએ પોતાની સુશકેલી હર્ષાવી,

ખાંડા લાંધાએ, પન્યાસળુની વાત સાંખળી શેડ રવળભાઈ પાસે ગયા.

‘શેડ સાહેબ ! અમારા થાણાની પરિસ્થિતિ આપ જણો. છો.ભાર ભાર વર્ષનો કલેશ શાંત કરનાર પન્યાસળ મહારાજની પૂરી પ્રેરણું હશે તોજ અધ્યુરું રહેલું મંહિરળું’ કામ પૂર્ણ થશે. વળી આપતો અમારા કામમાં ખૂબ રસ લ્યો છો. આપે પણ આવા ધર્મઉદ્ઘોતના કામમાં સહિય સહકાર આપવાનો છે. આપ માટું જામાં જ્યારે ખારણો ત્યારે પન્યાસળને લાવી શકશો. આ સાચ બીજા ડોઈ મુનિરાજનો લાભ મેળવી શકશો. આ વિનતિ અમે શેઠાણી શ્રી કંકુણને પણ કરીએ છીએ. પન્યાસળ મહારાજના થાણા પર અનહંહ ઉપકારો છે, અમે તેઓશ્રીના ચિરનાની રહીશું. પણ ને ધગશ પન્યાસળને થાણા માટે છે તે દણિએ પન્યાસળ ચાતુર્માસ કરે તોજ અમારું કામ આગળ વધે તેમ છે. કામ શરૂ થઈ ગયા પછી તો બધો પ્રભાધ થઈ રહેશે. અમારી વિનતિ સ્વીકારો અને પન્યાસળને થાણા ચાતુર્માસ લઈ જવા અનુમતિ આપો.’ આગેવાનોએ શ્રી રવળભાઈને આથડપૂર્વુંક વિનતિ કરી.

‘તમારી વાત તો સાચી છે પણ જમવાનો સમય થઈ ગયો. છે રસોઈ પણ તૈયાર છે. પહેલાં આપ બધાં લાંધાએ. જમી લ્યો. પછી તમારી વાત ઉપર આપણે વિચાર કરીશું.’ શેડ રવળભાઈએ જમવા માટે આથડ કર્યો.

‘શેડ સાહેબ ! જમવાની ના તો કેમ પડાય ! આપના આથડને માન આપવું જ પડશે પણ અમારી મોટી ભૂખ તો શાંત કરે. ને અમૃતની વર્ષાની જરૂર છે તે તૃપ્ત કરે. જયાંસુધી

અમારા મન શાંત ન થાય ત્યાંસુધી અમે આપના જમણુનો સ્વીકાર કેમ કરી શકીએ? પહેલાં પન્ચાસળુ મહારાજના ચાતુર્માસ માટે અતુમતિ આપી અમને કાયમી જમણુનો લાલ આપો. પછી અમે આપને ત્યાં જમવાના જ છીએ. આપનો પ્રેમભાવ અમને જરૂયા સિવાય કર્યાં જવા હે તેમ છે! 'આગેવાનોએ લાગણીપૂર્વક પોતાની લાવના હર્ષાની.

'ભાગ્યવાનો! પન્ચાસળુ મહારાજના ઉપરેશ વચ્ચેનોનો આ વખતે અમારે સૌને સહદુંદુંબ લાલ હેવો હતો. માદુંગાના ભાઈઓની પણ જે જ લાવના છે પણ તમારા થાણુના લાલાલાનો વિચાર કરતાં પન્ચાસળુ થાણું પધારશે. તમે નિશ્ચિંત રહો. હેવે આનંદપૂર્વક આપ સૌ જમી હ્યો અને પછી સુઝેથી પધારો.'

થાણુના આગેવાનોના હૃદયમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. પન્ચાસળુ મહારાજના જયદોષથી શાંતિનગર ગાળ રહ્યું શેડ રવળુભાઈએ થાણુના બધા ભાઈઓને પ્રેમપૂર્વક લોજન કરાવી વિહાય આપી. પન્ચાસળુ મહારાજે માદુંગાને પણ લાલ મળે તે દસ્તિએ શ્રી શુલાભમુનિ આહિ એ ઠાણુને માદુંગા ચાતુર્માસ રહેવા આજા આપી. બીજા સુનિરાજેની સાથે પન્ચાસળુ મહારાજે થાણું તરફ વિહાર કર્યો.

થાણુનો પ્રવેશ ભાવભયો હતો. થાણુના બણેન-ભાઈઓના આનંદનો પાર નહોતો. થાણુનો સાચો ઉત્કર્ષ સાધનાર પન્ચાસળુ ચાતુર્માસ માટે પધાર્યા હોવાથી આભાલવુદ્ધના હૃદયો હષંથી ઉછળી રહ્યાં હતાં.

પન્થાસળુ મહારાજના ઉપરેશથી થાણુમાં શુભ કાર્યની શરૂઆત થવા માંડી. અશાડ શુદ્ધ ૧૧ ના હિવસે શ્રી જીન-દાસૂરીજીની જ્યન્તી ઉજવવામાં આવી હતી. પન્થાસળએ થાણુમાં વર્ધમાન આયંબિલતપ આતા માટે ઉપરેશ આપ્યો અને તે પેલવામાં આવ્યું. તે આજ સુધી ચાલુ છે. અને તેનો લાલ ઘણું ભાઈ-ખણેનો લઈ રહ્યા છે.

આજ ચતુર્દશીનો હિવસ હતો. વ્યાખ્યાનમાં બધા આગે-વાનો ઉપરાંત કંચી-મારવાડી-ગુજરાતી ભાઈઓ હાજર હતા. સુંભરથી કેટલાક લક્તો મહારાજશ્રીના વંદનાથેં આવ્યા હતા. પ્રસ્તંગ જોઈને પન્થાસળએ ચીમકી આપી.

‘ભાગ્યશાળીએ થાણુના સહ્બાધે હિવસે હિવસે થાણુના સંધની ઉત્તેજિ થતી જાય છે. થાણુ તીર્થભૂમિ જનરો તેમાં શાંકા નથી. આ કણામય મંહિર થશે એટલે હંજરો ભાઈઓ થાણુ આવશે અને થાણુની જહોજલાલી વધશે. પણ સંધ-જમણુમાં મારવાડી ભાઈઓ તથા કંચી ભાઈઓ એક સાથે એસી જમે નહિ તે સારું કહેવાય? નવકાર ગણુનાર, જૈન ધર્મ પાળનાર, પૂજા-સામાયિક-પ્રતિકમણુ કરનાર, આયંબિલ કરનાર, પ્રલાવના કરનાર અને લેનાર, એક શુરૂને માનનાર જમવામાં જુદા શા માટે? જૈનધર્મ પાળનાર સ્વામી લાઈએ તો બધા સાથે એસીને જમે તેમાં જ શાસનની શોભા છે. આનંદ ઉત્સવ અને પ્રેમલાવ રહેલો છે. જુદા જુદા શહેર અને ગામથી આવેલ તમે બધા થાણુ સંધના સ્વામીભાઈઓ સાધમી છો અને બધાએ સાથે જમવામાં કશો હોષ નથી. ઉલ્લંઘણે ન જમવામાં મોટાઈ અને પ્રેમનો અલાવ છે. મારી

લાવના છે કે તમે બધા એકજ થાણુા સંઘના ભાઈ બહેનો કુચ્છી-મારવાડી-ગુજરાતી એકજ સાથે એસી જમેા અને સાચું સ્વામીવત્સલ ઉજવો. સંઘની સાચી એકતા તેમાં જ છે. ”

પન્યાસળુની સુધા લરી વાણીની અમતકારી અસર થઈ. બન્ને પદ્ધોએ સાથે એસી જમવાનું કૃષ્ણલ કર્યું. તેનો અમત કરવા પાલીનીવાસી શેઠ વનેચંદળ ખીમાળુએ પોતાના તરફથી સ્વામીવાત્સલ્યનું જમણું કર્યું, અને થાણુામાં વર્ષો પછી બધા કુચ્છી-ગુજરાતી-મારવાડી ભાઈ બહેનો સાથે એસીને જમ્યા, ત્યારથી થાણુાના સંઘમાં કુચ્છી ભાઈએ દરેક કાર્યમાં ઉત્સાહથી ભાગ લેતા રહ્યા છે. થાણુાના સંઘમાં આ સંઘજમણુથી એકયતા, પ્રેમભાવ, સમાનતા તથા હમહર્ફી વધવાં લાગ્યાં.

હવે જૈન મંદિરનું અટકી પડેલું કાર્ય વેગપૂર્વક ચાલુ કરવા માટે થાણુાના ઉત્સાહી આગેવાનો શ્રીયુત શેઠ એંગારાલ હીરાળ, શેઠ પદ્માલાતાલ નવતાળ, શેઠ નરસિંગાળ મનરૂપાળ, શેઠ ચન્દ્નમલાળ મૂલચંદળ, શેઠ ઇપચંદળ હળરીમલાળ, શેઠ ઉમેદમલાળ ચત્રલુજાળ, શેઠ સરહારમલાળ મગનાળ, શેઠ મેતીલાલાળ તારાચંદળ, શેઠ અનરાજાળ તપસ્વી, શેઠ વનેચંદળ ખીમાળ, શેઠ કપુરચંદળ લુતાળ, શેઠ હલીચંદળ અનરાજાળ, શેઠ પુનમચંદળ ધમાળ, શેઠ મૂળચંદળ ઉમાળ, શેઠ તારાચંદળ વનેચંદળ, શેઠ દીપચંદળ સિન્દૃવાળા, શેઠ રાવતમલાળ, શેઠ જેઠાભાઈ ગોધરભાઈ, શેઠ આણંદળભાઈ ચાંપશીભાઈ, શેઠ ખીમળભાઈ પુનરીભાઈ, શેઠ સવળભાઈ તથા શેઠ મેધળભાઈ વગેરે બધા ભાઈઓને ઉપહેશ આપીને ટીપ શરૂ કરાવી. બધા પાસે સારી રકમ ભરાવી, આ ઉપરાંત ખીળ,

સુંબદ્રિ, માદુંગા, ઘાટકોપર આહિના લાઈચો પાસેથી પણ સારી રકમો લરાવવામાં આવી. આશરે રૂ. ૨૫૦૦૦) થઈ ગયા અને પન્થાસળુંની પ્રેરણુથી તેમજ જીજા આચાર્યપ્રવરો ને સુનિવરોના ઉપહેશથી આજ સુધી કળામહિર માટે હાન મળ્યા કરે છે.

સં. ૧૬૬૪ ના ભાદ્રવા શુદ્ધ પુણ્યમાના મંગળ દિવસે કુચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિના અશ્રેષ્ટ, ધર્મપ્રેમી, ઉદ્ધાર ચરિત, દ્વાનવીર, રાવસાહેબ શેઠ રવળુભાઈ સોજ્યાળ જે. પી. તથા વીસ સ્થાનકણી અને નવપદળુંની ઓળિ પૂર્ણ કરી છન્નુ જિનની ઓળિની તપદ્ધિયો. કરનાર તેમના ધર્મપત્ની શ્રીમતી કંકુબહેનના શુભ હસ્તે નવા મનિહરતું ખાતમુહૂર્ત કરાવવામાં આંધું. થાણુના આખાતવૃદ્ધમાં અનેરો આનંદ છવાઈ રહ્યો. નૂતન કલામય મનિહરતું કામકાજ ધર્મધોકાર ચાલવા લાગ્યું.


આ નૂતન મનિહરને ડેટલાઠ શ્રીપાળ મનિહર કહે છે, પણ તે સુનિસુવત સ્વામીતું મનિહર છે. મૂલનાયક તરીકે વીસમા તીર્થુંકર શ્રી સુનિસુવતસ્વામીની જંય પ્રતિમા જીરાજમાન છે. રંગ મંડપના મધ્યભાગમાં આરસતું સુંદર અનુપમ નવપદળતું મંડળ પધરાવવામાં આંધું છે. ઉપરાંત હળવરો વર્ષ પહેલાં થાણુના ઈતિહાસમાં જૈનધર્મની ગૌરવતા હર્ષાવનાર શ્રીપાળ મહારાજના ઈતિહાસિક દ્રશ્યોના સુંદર આરસના કલામય દ્રશ્યોના પટોને આકર્ષણી રીતે ફોતરવામાં આંધ્યા છે.

સં. ૧૬૬૪ તું ૪૬ સું ચાતુર્મોસ આનંદપૂર્વક થાણુનાં થયું હતું.

આતુમોસ પૂર્ણ કરી પન્યાસળુ મહારાજ સુલુંંહ પદ્ધાયો. પન્યાસળુની સાથે ૨૦૦ ભાઈઓ પણ સુલુંંહ આવ્યા. બધાની સેવાભક્તિ સુલુંંના શ્રી મણીલાલ ચતુરભુજ તરફથી કરવામાં આવી હતી. બીજે હિવસે ભાડુંપ થઈને ધાટકોપર પદ્ધાયો. ધાટકોપરમાં ૨૧ હિવસની સ્થિરતા કરી, ચેમ્બુર, માડુંગા, દાહર, ભાયખલા થઈને પન્યાસળુ મહારાજ પાયધુની પદ્ધાયો. પાયધુની ૧૫ હિવસ રહીને કચ્છી વીસા એશાવાળની વાડીએ થઈને દાહર પદ્ધાયો. દાહરથી થાણું તરફ વિહાર કરવાના હતા પણ દાહરમાં ઓચિંતા શ્રી મહેાદ્યમુનિ બીમાર પરી ગયા તેથી તેમની સેવામાં રોકાઈ ગયા. શ્રી મહેાદ્યમુનિ માટે કટરોએ ચાંપતા ઉપાયો લીધા. શેઠ વલ્લભજીભાઈ, શેઠ ડા. વિઠુલભાઈ અને શેઠ કાનલુભાઈ વગેરે ભાઈઓએ સેવાભક્તિ ઘૂંઘ કરી. શ્રી મહેાદ્યમુનિની બિમારીના સમાચાર સંભળી ધાટકોપરથી સુનિ હેમસાગરલુ તથા સુનિશ્રી ત્રિલોકચંદ્રલુ દાહર આવી પહેંચ્યા અને સેવા સુશ્રૂષા કરી પણ તૂટીની ખૂટી નહિ તેમ ચાર હિવસની બિમારી બોગની શ્રી મહેાદ્યમુનિના. ૧૯૬૫ ના ચોખ વર્ષી ૪ ના રોજ અરિહંત પ્રભુનો જાપ જપતા જપતા સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. સમાચાર મળતાં જ થાણું તથા સુંખદિથી ભાઈઓ આવી પહેંચ્યા. સમશાન યાત્રામાં દાહરના તમામ ભાઈઓ જોડાયા. સુનિ શ્રી મહેાદ્ય મુનિના આત્માની શાન્તિ નિમિત્તે નવપદલુની પૂજા ભણુંવામાં આવી. કેટલાંક ભાઈ-ખાંડેનોએ મળીને ૮૧ આયંબિલની તપસ્યા કરી હતી. દાહરથી વિહાર કરી પન્યાસળુ થાણું પદ્ધાયો.

સુંખદીમાં માંડવી બંદર પર શેઠ નરશી નાથા સ્ત્રીએમાં આવેલા  
ઓ અનંતનાથણુ જૈનમહિરના ટ્રસ્ટી શેઠ રતનશીલાઈ તથા  
કચ્છી હશા ઓશવાળ મહારાજના માનદ સેકેટરી શ્રીયુત જેઠાલાઈ  
નાગડા વગેરે થાણ્ણા આંદ્રા અને પન્ચાસણુ મહારાજને વિનિતિ  
કરી કે શ્રી અનંતનાથણુ જૈનમહિરની શાખા તરીકે લાંડુપમાં  
નહું શિખરબંધ હાઇરાસર ઇ. ૭૫૦૦૦) ના અર્યો તૈયાર થઈ  
ગયું છે. તે મહિરમાં બિમણ પ્રવેશનું સુધૂતો ૧૯૬૫ ના મહા  
વદી ૧૩ નું છે તો આપશ્રી લાંડુપ પથારો અને બિમણ પ્રવેશ  
આપના વરદ હસ્તો કરાવો તો અમને અત્યંત આનંદ થશે.  
આવા ઇડા કાર્ય માટે પન્ચાસણુએ વિનિતિનો સ્વીકાર કર્યો  
અને તુરતજ લાંડુપ તરફ વિહાર કર્યો. મહા વદી ૧૩ ના  
મંગળ હિવસે ધામધૂમ પૂર્વક પન્ચાસણના મંગળ હસ્તો લાંડુપ  
જૈનહાઇરાસરમાં બિમણપ્રવેશ કરાયો. સંઘમાં આનંદ આનંદ  
થઈ રહ્યો. વાતાવરણ મધુર મધુર બની રહ્યું. આણાલવૃદ્ધમાં  
હુર્ખની ઉર્ભિઓ ઉછળી રહી. જૈન શાસનના જયજ્યકારના  
નાડોથી મહિર શુંણ ઉદ્ઘૂં.





## આચાર્યપહવી સમારંભ

( ૩૫ )

‘ શેડ સાહેબ ! અમારા થાણુના સંઘ ઉપર તો પન્થાસળુ મહારાજે મહાન ઉપકાર કર્યો છે. બાર બાર વર્ષના કલેશનો અંત આવ્યો એતો એક ચમત્કાર થયો છે. વળી કલામય બેનમૂન મંહિરનું કામ પણ તેઓશ્રીની પ્રેરણુથી ધરે છે. અમારી થાણુા સંઘના આખાતવૃદ્ધની લાવના તો ધળીએ છે કે પન્થાસળુ મહારાજશ્રીને આચાર્યપહવીથી અલંકૃત કરી કૃતકૃત્ય થઈએ પણ આપ તો જણ્ણો છો. પન્થાસળુ તે વાતજ ઉડાવી દરે છે. તેઓ તો કહે છે કે સાધુપદ ક્યાં ઓછું જવા-અહારીવાળું છે !’ થાણુના આગેવાન શેડ રૂપચંહલુએ શેડ રવળુભાઈ સોજાળને વસ્તુસ્થિતિ સમનવી.

‘ રૂપચંહશા ! તમારી વાત તો સાચી પણ પન્થાસળુ મહારાજ આચાર્યપહવી માટે સુચોણ્ય છે. તેઓ મહા પ્રલાવિક, હિયાપાત્ર, વચનસિદ્ધ, દીર્ઘતપસ્તી અને શ્રેદ્ધેય છે. તમારા થાણુના સંઘની લાવના હોય તો તેઓશ્રીને જરૂર ગ્રાર્થના કરો જ કરો. હું તો માતું છું કે સંઘની વિનિતિની અવગણુના નહિ થાય. આપણે આપણી ઝરજ ખજાવવી જ રહી. મારો

તેમાં હાંડિંક સહકાર છે. હું પણ પન્યાસળુને તમારી વતી જરૂર વિનિતિ કરીશ.' શેઠ રવળભાઈએ સલાહ આપી.

થાણુના સંધના આગેવાનો ઘણુા સુમયથી પન્યાસળ મહારાજશ્રીને આચાર્યપહવી આપવા માટે વિચાર કરતા હતા પણ પન્યાસળ તેવી કોઈપણ વાત સંખળતા જ નહિ. થાણુના અનેક ઉપકારો જેતાં થાણુના ભાઈઓનું એ કર્તાંય હતું કે પન્યાસળ મહારાજનું બહુમાન કરવું. મહારાજશ્રીના અનન્ય ભક્તા શ્રી રવળભાઈ સોજપાળની તેમાં સંમતિ મળી એટલું જ નહિ પણ તેમણે તો તે માટે આથડભયો અનુરોધ કર્યો. થાણુના આગેવાન શેઠ ઝ્યપચંદલુને થાણુના સંધ તરફથી આચાર્યપહવી માટે પ્રયાસ કરવા સમલંઘ.

આજ ચતુરથિનો દિવસ હતો. વ્યાખ્યાનમાં થાણુના આગેવાનો, થાણુના ઘણુાખરા ભાઈ-ખણેનો ઉપરાંત શેઠ શ્રી રવળભાઈ તથા બીજી મુંખદિના આગેવાનો પણ હાજર હતા. ચારસીનો સમય થયો, ખણેનોએ ગહુંલીમાં જ પન્યાસળ મહારાજના થાણુના ઉપકારો અને નૂતન કલામય મંહિરનો ઉલ્લેખ કરી આવા ચારિત્રપાત્ર, દીર્ઘતપસ્વી, મહાપ્રભાવશાળી, શાંતમૂર્તિં પન્યાસળુને આચાર્યપહવી આપવાના સંધના મનો-રથ પુરુણોને તેમ પણ ભાવપૂર્વક ખણેનોએ ગાયું. આ તકનો કાલ લઈ થાણુના આગેવાન શેઠ ઝ્યપચંદલ ઉભા થયા અને સુકળ સંધને વિનિતિ કરી.

'જગત્પૂજય મહાત્મા શ્રી મૈહનત્વાલલ મહારાજ સાહે-બના ભરતરગચ્છીય સંવિગ્ન થાણુના પ્રથમ નૈનાચાર્ય શ્રી જીનયશઃસ્તૂરીશ્વરલુના પદ્ધતિ બાલપ્રકાશચારી અનુયોગાચાર્ય'

પન્થાસળ મહારાજ શ્રી ઋદ્ધિમુનિજીએ આપણા સંઘમાં ખાસ ખાર વર્ષથી ચાલતા કુસંપનો સંપ કરાવી થાણુના શ્રી સંઘ ઉપર ભારે ઉપકાર કર્યો છે. ઉપરાંત થાણુમાં નવપદજી મંડળચુક્તા શ્રીપાળ મહારાજના જીવન પ્રસંગોને કળામથ રીતે દર્શાવનાર શ્રી મુનિસુવતસ્વામીના મન્દિરના અટકી પડેલા કામને પ્રેરણા આપી પ્રારંભ કરાવીને આ થાણા નગરીને પ્રાચીન તીર્થભૂમિ તરીકે જાહેરજીવાલીમાં લાવવા માટે સતત પ્રયાસ સેવી રહ્યા છે. ઉપરાંત ધર્મનિષ્ઠ શ્રદ્ધેય શ્રી શેઠ રવળુભાઈ તથા તેમના સુપુત્ર શ્રી રામજીભાઈની નવા મન્દિરના બાંધકામ માટે હરેક પ્રકારની સહાઈ-સૂચના આપાવી રહ્યા છે. આવા આપણા પરમ ઉપકારી પન્થાસળ મહારાજને આપણા થાણુના શ્રી સંઘ તરફથી આચાર્યપદવીથી અલંકૃત કરવામાં આવે તો તે ધણું જ સુચોણ્ય છે. હું આશા રાખું છું કે આપ શ્રી સંઘ મારી આ હરખાસ્ત વધાવી દેશો. ’

‘ભાઈઓ ! શ્રી ઇપચંહળુભાઈની આ હરખાસ્ત બહું જ ચોણ્ય છે. તેને સુંબદ્ધના અત્રે આવેલા બધાં ભાઈઓ તરફથી હાર્દિક અતુમોદન છે. પન્થાસળ મહારાજ આચાર્યપદને બધી રીતે ચોણ્ય છે. આવા ચારિત્રયાત્ર હીર્દિતપસ્તી સમાજ ઉધોત માટે પ્રેરણા આપનાર પન્થાસળને આચાર્યપદવીથી વિભૂષિત કરવા એ આપણું પ્રથમ કર્ત્તવ્ય છે.’ શેઠ રવળુભાઈએ અતુમોદન આપ્યું.

‘ભાઈઓ ! પંચપરમેષ્ઠીમાં તૃતીય પહે ગણુઠા આચાર્યપદજી જવાખારી બહુ મોટી છે. અને તે જવાખારી ઉઠાવવાની મારી ચોણ્યતા નથી. સુનિપણુના કર્ત્તવ્ય અતુસાર મી’

તો મારી કુલજ બળવી છે. ધર્માપહેશ આપી શાસનને ઉદ્ઘોત કરવો, જ્યાં જ્યા કુસંપ હોય ત્યાં સંપ કરાવવો, જૈનધર્મના માર્ગ તરફ હણરો લુચેને વાળવા અને મન્દિરો—પાઠશાળાએ વિદ્યાલયો—પુસ્તકાલયો વધારી જૈનધર્મ અને સમાજનો ઉદ્ઘોત કરવો એ તો અમારું પ્રથમ કર્તાં છે. હું સુનિયદ અને વળી પન્યાસપદ એ જવાબદારી કયો પદને સંભાળી ધર્મઉદ્ઘોત કરી રહ્યો છું. આચાર્યની જવાબદારી મહાન છે. મને તે ન શોલે.’ પન્યાસલુચે ચોતાની લધુતા દૃશ્યાંવી.

પન્યાસલુ મહારાજ તો ચોતાની લધુતા દૃશ્યાંવે તે બરાખર છે. પણ સંધ આખાની ભાવનાને માન આપવું જેઠાંએ. એ પણ પન્યાસલુએ વિચારવાનું છે. છેવટે શ્રીયુત શ્રેષ્ઠ રવળભાઈની વિનિતિને પન્યાસલુએ માન આપવું પડ્યું. થાણું સંધના આખાલવૃદ્ધના હૃદયો. આનંદથી નાચવા લાગ્યાં. પન્યાસલુ મહારાજના જ્યનાહોથી ઉપાશ્રય ગુંજું ઉઠ્યો. આનંદની ઉર્મિએ ઉછળી રહી.

તિલકચોકમાં આવેલા જૈન મંહિરની સામે નવા બંધાતા જૈન મંહિરના વિશાળ ચોકમાં સુંદર મંડપ બાંધવામાં આવ્યો હતો. ક્રાગણ્ય શુદ્ધ પાંચમના દિવસે થાણુનાં જૈન સંધના તમામ ભાઈ-ખણેનો, થાણુના અયૈસરો, અધિકારી વર્ગ, સુંખાઈ, માંદુંગા વગેરેથી આવેલ આગેવાનો તથા જનતાથી મંડપ ઘીચીઓખીય ભરાઈ ગયો હતો. મંડપની બહાર પણ દૂર દૂર સુધી ઘણ્યા ભાઈઓ ઉભા હતા. આચાર્યાંપહવીની કિયા શરૂ થઈ, બધા શાંતિથી સાંભળવા લાગ્યા. પ્રેક્ષકો પણ વધવા લાગ્યા. એ કલાક કિયા ચાલી. શ્રી ગુલાભમુનિએ સ્વેં સલાજનો.

સમક્ષ ખરતરગચ્છીય જગતપૂજય મુનિપુંગવ શ્રી મોહન-  
લાલજી મહારાજના પદ્ધતિ શ્રી જિનયશસ્તુરિલુના પદ્ધતિ  
પન્યાસળ મહારાજ શ્રી જનજિસુનિને જૈનાચાર્ય બદ્ધારક શ્રી  
જુનજિસ્તુરિલુ તરીકે જહેર કર્યા. આ પ્રસંગે મુંબઈથી  
વિહાર કરી પધારેલ વયોવૃદ્ધ મુનિશ્રી હેમસાગરજી, મુનિશ્રી  
શુલાભમુનિ તથા મુનિશ્રી ત્રિલોકચંદ્રલાલે અતુક્કમે વાસ્ક્રેચ  
નાખ્યો હતો. (ઝ. ૧૫૧) ની એલીથી રાવસાહેબ શેઠ રવલુલાઠિના  
સુપુત્ર શેઠ રામલુલાઠિએ વાસ્ક્રેચ નાખ્યો. શેઠ ગીરધરલાલ  
ત્રીકમલાલના ધર્મપત્ની શ્રીમતી ચંદ્રન બહેને (ઝ. ૧૫૧) ની  
એલીથી વાસ્ક્રેચ નાખ્યો હતો. થાણાના શેઠ હેવીચંદલ  
હેમાલાલે (ઝ. ૧૪૧) ની એલીથી આચાર્યપદની ચાદર ઓઢાડી  
હતી. સકળ સંઘે નૂતન આચાર્યશ્રી જુનજિસ્તુરિને લાવપૂર્વક  
વહંન કર્યો હતું. મંડપમાં જયાનાહો શુંળ રહ્યાં. આનંદ  
આનંદ છવાઈ રહ્યો. આખાતવૃદ્ધના હૃદય આનંદથી નાચી ઉઠ્યા.

આચાર્યશ્રીએ દેશના આપી. તમે કે પહ્યે મને ભાવ-  
પૂર્વક આપી છે. તે પહ્યેની જવાબહારી ધણી છે. આચાર્ય  
એટેલે સંઘના નેતા, શાસનના નાયક, સમાજના કલ્યાણકારી,  
ધર્મના ઉદ્ઘોત કરનાર અને ગામેગામ જૈન ધર્મનો પ્રચાર  
કરી અનેક લયોને ધર્મમાર્ગ તરફ દોરનાર શાસન દીપક. આ  
જવાબહારી નાની સૂની નથી. તે પૂર્ણ કરવા શાસનહેવ મને  
શક્તિ આપે તેવી હું મનોકામના રાખું છું. મેં તે સ્વીકારી  
છે. પણ તમારી જવાબહારી પણ વધી છે. મને સાચ્યા આનંદ  
તો ત્યારે જ થશે જયારે આપ બધા આગેવાનો પોત પોતાની  
શક્તિ અતુસાર તન, મત, ધનથી મદ્દગાર થઈને ધણી ઉત્સા-

હેઠી પ્રારંભ કરેલું શ્રી નૂતન જૈન મંહિરનું કામ જેમ અને તેમ જલ્દી પૂર્ણ કરી અંગનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવશે. તેમજ યાત્રાળુંઓને ઉત્તરવા લાયક વિશાળ ધર્મશાળા તથા વાસણું કુસણું ગાહલાં-ગોહલાં વગેરેની સગવડ કરીને આ થાણું નગરને એક પ્રાચીન તીર્થધામ બનાવી દેશો. માત્ર એ-પાંચ જાઈઓને અધા કામની જવાબહારી સોંપી ધીજા નિશ્ચિંત નહિ થઈ શકે. અધાએ શક્તિ અતુસાર તન, મન, ધનથી સેવા આપવાની રહેશે. વળી જે ભાગ્યવાનોને પૂર્વપુષ્યના ઉફેશે આ જન્મમાં લક્ષ્મીની પ્રાર્થિ થઈ છે અને સાથે ધર્મલક્ષ્મી પણ મળેલ છે તો આ તીર્થતુલ્ય નૂતન જૈન મંહિરમાં ઉફાર હીલથી મહદુ કરી પ્રામ થયેલી ચંચળ લક્ષ્મીનો સહૃદિપયોગ કરો. તમે તો બાણો છો કે લક્ષ્મી ચંચળ છે અને તેનો હાનમાં ઉપયોગ નહિ થાય તો નાશ થશે જ. તે માટે બુદ્ધિશાળી પુરુષોએ લક્ષ્મીનો ઉત્તમ કલ્યાણ કાર્યોમાં ને ધર્મના ઉત્કર્ષમાં ઉપયોગ અવસ્થ કરવો જેઠાંએ. લક્ષ્મીને જેમ જેમ પુષ્યકાર્યોમાં વાપરશે. તેમ તેમ તે વધતી જશે અને તમારે ત્યાં રિદ્ધિસિદ્ધિનો પ્રકાશ પાથરશે. આપણી પાસે આપણા જ ભાગ્યશાળી ધર્મનિષ્ઠ શ્રીમંત ગૃહસ્થોના દ્યાંતો છે. શેઠ માણેકલાલ ચુનિલાલ અને શેઠ કાનિતલાલ ધૃશ્યરલાલ બન્ને કરેડપતિ નથી છતાં તેમની ઉદ્ઘારતા, ધર્મશક્તિ, હાનવીરતા પ્રશંસનીય છે. અને ભાગ્ય તો જુઓ, જેટલી સખાવત તેઓ કરે છે તેનાથી સવાઈ લક્ષ્મી તેઓના પુષ્યપ્રતાપે આવી મળે છે. હાનનાં અરણું વહેતાં રહે તો એ અરણું સુકાય જ નહિ. લક્ષ્મીની આવક જગતને ચમકાવે છે. પણ લક્ષ્મીનાં હાન એ સૌરભને જગતનાં

ચોકમાં મધ્યમધતી કરી મૂકે છે. ભાગ્યશાળીઓ જેનાથી જે જાતની મહદુદ્ધ થાય તે આપો. સેવાનો હીએ પ્રકટાવો અને આ તીર્થ ધારને યશકિતિંની પુણ્યમાળ પહેરાવવા હાહિંક સાથ આપો.

આચાર્યશ્રીની દેશના પૂર્ણી થઈ. જયનાહોની ઘોષણાથી વાતાવરણ શુંલુંલદ્ધાણું. ઉત્સાહ અને આનંદની લહરીઓ લહેરાણી.

ખાતનિવાસી શેઠ મુણયંદ યુલાખીદાસ, રાધનપુરનિવાસી શેઠ ગીરખરલાલ ત્રીકમતાત અને શેઠ ગણેશમલલુ સોભાગ-મલળની પેઢીની અનુક્રમે આચાર્યશ્રીને કામળી ઓઢાડ-વામાં આવી હતી.

આચાર્યપહીને સંક્રાંતા ઈચ્છા ધણ્ણા તારો અને પત્રો દેશહેશાવરથી સુનિરાનો તથા ગૃહદસ્તો અને સંઘાતા આંધ્રા હતા, તે સલામાં વાંચી સંભળાવવામાં આંધ્રા હતા.

આ પ્રસંગે સૂરતવાળા શેઠ જવેરાઈ કેસરીયંદ તરફથી શ્રીકૃણની પ્રભાવના કરવામાં આવી હતી. જપોરના ધામધૂમ-પૂર્વક વરદીડો કાઢવામાં આંધ્રો હતો. મંડપમાં હાકમાઠથી પૂજા લણ્ણાવવામાં આવી હતી. સાંજના સંધજમણુ કરવામાં આંધ્રું હતું.






## पर्युषण व्याख्यानमां पुण्य के पाप ?

( ३६ )

जगत्पूज्य श्री मोहनदातल महाराजनी जयन्तीने। उत्सव थाणुना श्री संघे आनंदपूर्वक उज्जृयो। सं. १६६५ ना यैत्र वही १२ ने हिवसे सवारमां आठ वागे जयन्तीनायक श्रीमह मोहनदातल महाराजनी प्रतिमुर्ति एक शाणुगारेली मोटरमां पधरावी, थाणुना सरकारी ऐनड संहित रथयात्रा काठवामां आवी हती, जैन उपाश्रयना विशाणु डोलमां आचार्य श्री लुनकदिसूरीश्वरलुना अध्यक्षस्थाने जयन्ती उत्सव करवामां आ०यो। श्री मावलुभाई हामलु शाहे स्वरचित पदभय मोहन- अरित्र अने स्तुति गाई संभागांयां हतां, मास्तर विजयचंद मोहनदात शाहे मोहन स्तुति गाई संभागावी हती, श्री



શ્રી રવનમુણિને આચાર્યંપહ તથા શ્રી લળિધમુણિને ઉપાધ્યાયે પહેનન  
મહેરસભમાં આચાર્યું શ્રી અતનજીવિસુર્ગિ



લક્ષ્મીચંહ સુખલાલ, શ્રી માવળુભાઈ, શ્રી મંગળહાસ ત્રીકમ-  
લાલ અનેરી, શ્રી વિજયચંહ માસ્તર વગેરેએ મહારાજશ્રીના  
લુચનના અનેક પ્રસંગો પર મનનીય વિવેચનો કર્યો હતાં.  
શાંતમૂર્તિં સુનિશ્ચી શુલાખમુનિએ ગુરુદેવના આખા ચરિત્રનો  
સાર શ્રોતાઓને કંદી સંભળાયેલો હતો. આચાર્યશ્રીએ ઉપ-  
સંહારમાં ગુરુદેવના લુચન પ્રસંગો જણાવી જૈનસમાજનો  
દિલોત કરવા પ્રેરણું કરી હતી.

થાણુના સંધ તરફથી લાડુની પ્રભાવના કરવામાં આવી  
હતી. બહાર ગામથી આવેલા માણુસોને પ્રેમપૂર્વક જમાડ-  
વામાં આવ્યા હતા. જૈન મંહિરમાં પૂજા ભણુવી આંગી-રચના  
કરવામાં આવી હતી.

વૈશાખ શુદ્ધિમાં આચાર્યશ્રી વિજય પ્રેમસૂરીથરલુ પોતાના  
વિશાલ શિષ્ય સમુદ્ધાય સાથે મુંબધીથી વિહાર કરીને થાણા  
પદ્ધાયો અને આચાર્ય શ્રી લુનઅદ્ધિસૂરીથરલુ જ્યાં બિરાજતા  
હતાં તે જ સ્થાનમાં સ્થિરતા કરી હતી. તેઓશ્રી થાણુમાં  
દસ દિવસ રહ્યા હતા. વ્યાખ્યાનોનો સારો લાલ આપ્યો  
હતો. થાણુના શ્રાવકોએ સાંખુ સમુદ્ધાયની સેવા લક્ષ્મિનો સુંદર  
લાલ દીધો હતો, આ વખતે બન્ને સૂરિપુંગવોએ અનેકવાર  
સાથે એસીને વાર્તાલાપ કર્યો હતો. એક દિવસ શેડ રવળુભાઈ  
સોજપાળ તથા શેડ લુચતલાલ પ્રતાપસીની સાથે આચાર્યશ્રી  
શિષ્ય સમુદ્ધાય સહિત થાણુના નવા કલામય મંહિરતું નિરી-  
ક્ષણુ કરવા પદ્ધાયો હતા. શેડ રવળુભાઈએ કામકાજની વીગત-  
વાર સમજણું આપી હતી.

હેરાસરની બાંધણી, કલામય દૃશ્યો તથા વિશાળ જગ્યા

નોંધને આચાર્યશ્રીએ સંતોષ પ્રગટ કર્યો અને જણ્ણાંયું કે ખરેખર આ મંહિર એક તીર્થધામ બની રહેશે ને થાણાની ખૂબ ઉજ્જીવિ થશે.

વૈશાખ શુદ્ધ ૧૩ ના રોજ સવારમાં વિહાર કરીને આચાર્યશ્રી જિનત્રાંદ્રિસૂરીશ્વરલુ સુલુંડ, ભાંડુપ, ઘાટકોપર, કુરલા થઈ માંડુંગા પદ્ધાયો. શેડ નેબુશીલાઈના અત્યંત આગ્રહથી માંડુંગામાં જ ચાતુમૌસ રહેવાતું નક્કી થયું. પણ ચાતુમૌસને શોડા સમય હતો. તેથી શ્રી સિદ્ધચક્ર સેવા મંડળની વિનિતિથી આચાર્યશ્રી હાદર પદ્ધાયો. હાદરમાં આચાર્યશ્રીએ જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની પરીક્ષા લીધી. આચાર્યશ્રીએ ધાર્મિક શિક્ષણથી બાળકોને નાનપણુથી ધર્મના દ્રદ સંસ્કાર પડે છે, તથા માતા પિતાએ હરેક બાળકોને ધાર્મિક શિક્ષણ તથા સંસ્કાર આપવા ખાસ કાળજી રાખવી જોઈએ. બાળકોને પુસ્તકો તથા જરૂરી વસ્તુઓની પ્રભાવના આપી ઉત્સાહિત રાખવા નોંધાયે તેમજ ધાર્મિક શિક્ષકને પણ આરોપજાર આપી સંતોષ આપવો નોંધાયે, વગેરે પ્રેરણુત્તમક વચ્ચનો કુહી બાળકો તથા બાળાઓને ધનિયો વહેંચવામાં આવ્યા હતા.

ચાતુમૌસ માટે આચાર્યશ્રી માંડુંગા પદ્ધાયો. રાવ સાહેબ શેડ રવળુભાઈસોજપાળના શાન્તિ નિકેતનમાં હમેશાં વ્યાખ્યાન વંચાતું હતું. વ્યાખ્યાનમાં ઘણું ભાઈ બહેનો આવી લાલ લેતા હતા.

‘સાહેબ ! શ્રી કંચ્છી વીસાઓસવાળ ભાઈએ આપને વિનંતી કરવા આવ્યા છે.’ શેડ રવળુભાઈએ સૂચના કરી.

‘મધ્યેણું વંદ્દામિ !’ કંચ્છી વીસાઓસવાળભાઈએ વંદ્દા કરી.

‘ધર્મલાભ’ આચાર્યશ્રીએ ધર્મલાભ આપ્યો.

‘કૃપાળુ ! આપ જણો છો ભાત બજરમાં આવેલ શ્રી આહીંદુર લગવાનના મંહિરનો જુહોદ્વાર થઈ રહ્યો છે. બધો ચરસામાન પાલાગલીવાળી મહાજનવાડીમાં ભરવામાં આવ્યો। છે. જગ્યાની સંકદાશને લઈને કેાઈ સુનિરાજનું ચાતુર્માસ ત્યાં રાખી શકાયું નથી પણ પર્યુષથુના વ્યાખ્યાન માટે કૃપા કરેલો તો અમને ઘણો લાભ થશે.’ કંચ્છી વીસા એસવાળ આગેવાનોએ પ્રાર્થના કરી.

‘સાહેબ ! એક સુનિએ આવવા હા કહી હતી પણ પાછળથી તેમણે ના કહી’ એક ગૃહસ્થે સ્પષ્ટતા કરી.

‘હ્યાળુ ! આ ભાઈએ તો અમારી પાસે જ આંધ્યા હતા અને તેએને જણ્ણાંયું કે તમે તો બધા શ્રીમતો-ભાગ્યશાળીએ છો. આચાર્ય મહારાજને આગહલરી વિનિતિ કરી. માદુંગામાં લાંધા છો. તમને તો પર્યુષથુના અતુપમ વ્યાખ્યાનોનો લાભ મળશે. પણ આપનીજ જાતીના સુંભદ્રના પાંચ હજર ભાઈ-ખણેનોને પર્યુષથુપર્વના વ્યાખ્યાનોથી વંચિત રાખવા છે ? તેમાં આપની શોભા ગણુશે નહિ. ’ શેઠ રવળુભાઈએ વસ્તુસ્થિતિ રજુ કરી.

‘કૃપાળુ ! શેઠ રવળુભાઈ કહે છે તે વાત વિચારવા જેવી છે.’ શેઠ તેજુ કાચાવાળા શેઠ ખીમળુભાઈ જે. પી. એ વિનિતિ કરી.

‘સાહેબ ! સુંભદ્રના અંચળગચ્છના ભાઈ-ખણેનોને પણ પર્યુષથુપર્વના વ્યાખ્યાનો માટે આપશ્રીને વિનિતિ કરવાની છે.’ શેઠ પુનર્થિભાઈએ વિનિતિ કરી.

‘ હ્યાસ્તિન્ધુ ! અમે તો સંભળ્યુ છે કે તપાગચ્છનો ડોઈ સાધુ તપગચ્છ સિવાયના ડોઈ પણ ગચ્છના શ્રાવકેને વ્યાખ્યાન સંભળાવી શકે નહિ એમ કેટલાક આચારો માને છે અને તે માટે આગ્રહ રાખે છે.’ એક ગૃહસ્થે પ્રશ્ન પૂછ્યો.

‘ બાગ્યશાળી ! પર્વાધિરાં પર્યુંખણુ જે જે ગચ્છના જ્યારે જ્યારે આવતાં હોય ત્યારે ત્યારે થાય અને તે પર્યુંખણુ પર્વમાં કલપસૂત્ર આહિ વ્યાખ્યાનો સંભળાવવા તેમાં મુણ્ય કે પાપ ? અમારો સાધુનો ધર્મ તો જૈન ધર્મનું પાલન કરનાર અને જૈનેતરો જે અપી હોય તો તેઓને પણ લગવાનની વાણી સંભળાવી તેઓને આત્મકલ્યાણુને પંથે દોષવા તે, છે. તમે તો જાણો છો તપગચ્છ, અચળગચ્છ વગેરે અચ્છો તો પછી થથા છે. વળી આજે પણ જૈનધર્મ પાળનારા વાણીયા ઉપરાંત ખીલ પણ ધર્માં છે. પર્યુંખણુ પર્વના વ્યાખ્યાનો માટે તો જ્યાં જ્યાં અનુકૂળતા હોય ત્યાં ત્યાં અમારે વ્યવસ્થા કરી આપવી જોઈએ. તેમાં તો હનરો આત્માચ્છ્વાનું કલ્યાણ છે. વીતરાગનો ધર્મ તો જગતને અને જગતના જીવો માટે ખુલ્દો છે.’ આચાર્યશ્રીએ સ્પષ્ટતા કરી.


‘ ધન્ય ધન્ય ! અધા બોલી ઉઠ્યા.

‘ હું તમને નિરાશ કેમ કરું ! હું તમારી વાડીમાં પર્યુંખણુ પર્વના વ્યાખ્યાનો વાંચવા તૈયાર છું. પરંતુ મારી પાસે ખીલ એક સાધુની જરૂરત હોવાથી ઘાટકોપરથી એક સાધુને અહીં તેડાવો જેથી અમે બન્ને સુંબદ્ધ તરફ વિહાર કરીશું.’ આચાર્યશ્રીએ સંમતિ આપી.

અધિ આગેવાનો ખૂબ હંદિંત થયા. આચાર્યશ્રીની ઉહા-  
રતા, સૌભ્યતા અને સમયશતાની ભૂરિભૂરિ પ્રશાંસા થવા લાગી.

પાલાગલીમાં કુચ્છી ઓસવાળ મહાજનવાડીમાં અંગરેચ્છ-  
વાસીઓને આચાર્યશ્રીએ આડે હિ વસ વ્યાખ્યાનો સંભળાયાં.  
કુચ્છી વીસા ઓસવાળ તથા દશા ઓસવાળનો કુલપસૂત્રનો  
વરદોડા ધણે ઢાડમાઠથી નીકળ્યો. તપશ્રીયી પણ બહુ સારી થઈ.  
માદુંગામાં આચાર્યશ્રીની આજાથી શ્રી ગુલાબમુનિએ અંગરે-  
ચ્છવાળાને તથા અરતરગરચ્છવાળા ભાઈએ તથા બહેનોને  
પર્યુષણુના વ્યાખ્યાનો સંભળાયા. માદુંગા આજે તો સુંબંધિતું  
માનીતું રમ્ય પરે થઈ પડ્યું છે. માદુંગાનો જૈન સમાજ સંગઠિત  
અને શરૂઆતું છે. બંધ મનોહર મંદિર, ઉપાશ્રી, જૈન છાત્રાલય,  
જૈન હાઇસ્કૂલ-વગેરેથી માદુંગા શોકી રહ્યું છે. આચાર્યશ્રીના  
ધણ્યા અનન્ય ભક્તો માદુંગામાં છે.

હવે તપાગચ્છના પર્યુષણ આય્યા અને આચાર્યશ્રીએ  
તપાગચ્છના ભાઈઓની વિનતિ સ્વીકારી મુનિશ્રી ગુલાબમુનિને  
માદુંગામાં પર્યુષણ કરાવા આજા. આપી. આચાર્યશ્રી મુનિશ્રી  
મતિસાગરલુને સાથે લઈને હાડર પધાર્યો. લાંડારકર રોડ ઉપર  
આવેલા આસ્તિક સમાજના હોલમાં વ્યાખ્યાનોની વ્યવસ્થા  
કરવામાં આવી. પર્યુષણ પર્વમાં શેડ રવલુબાઈ સોજપાળ, શેડ  
હીરલુબાઈ લણુશાલી, શેડ છોગાલાલલ લલવાણી વગેરેએ  
પ્રભાવના વગેરેનો સારો લાલ લીધો. હાડરમાં આનંદ આનંદ  
થઈ રહ્યો, પર્યુષણ કરાવી આચાર્યશ્રી માદુંગા પધાર્યો. સં.  
૧૯૬૫ તું ૪૭ સું ચાતુર્મોસ માદુંગામાં તથા સં. ૬૬-૬૭ ના  
૪૮-૪૯ એ ચાતુર્મોસ સુંબંધમાં થયાં.



## તीર्थभिना અને જ્ઞાનપ્રયાર

( ૩૭ )

‘ગુરુદેવ ! આપના વચનામૃતો સાંબળી મારી ભાવના ભાગવતી દીક્ષા લેવાની થઈ છે. કૃપા કરી મને તારો.’ રતનશીલાઇએ વિનિતિ કરી.

‘રતનશીલાઇ ! તમારી ભાવના તો ઉંચી છે. પણ દીક્ષાના ભાવ ત્યારથી થયા છે ! તમારી હકીકત જણુંનો તો વિચાર કરી શકાય.’ આચાર્યશ્રીએ કસોટી કરી.

‘કૃપાળુ ! હું કચ્છ દેશના દુમરા ગામનો રહેવાશી હું. વીસા ઓસવાળ હું, ટેટલાક વર્ષોથી રંઘન તથા સુંખઈ રહું હું. કામ ધર્યો તો સારો ચાલે છે. પણ આપકી પહેલાં હાફર પધાર્યો હતા ત્યારથી આપના સુધાલર્યા બ્યાખ્યાનો સાંભળું હું. દીક્ષાની ભાવના તો એ વર્ષથી હતી પણ વિચારમાં ને વિચારમાં સમય ચાલ્યો ગયો. હવે તો ચોક્સ નિર્ણય કર્યો છે. છેલ્લા ત્રણુ ભહિનાથી તો હું આપકીની રાહ જાઈ રહ્યો હું. પર્યુષશુભ્રમાં મારી ભાવના દ્રઢ થઈ અને મેં પ્રબુલુ

સમક્ષ પ્રતિશ્બા પણું લીધી છે. હવે કૃપા કરો અને શુરૂદેવ ! મને તારો !’ રતનશીલાઈએ ગઢુગડુ ભાવે વિનતિ કરી.

‘રતનશીલાઈ ! મહામૂલા મતુષ્યજીવનને પામીને મોક્ષ-માર્ગ પ્રદર્શિક ભાગવતી દીક્ષાના તમારા ભાવતો ઉંચા છે. પણું દીક્ષા એ ખાંડાની ધાર છે. તેના પાલન માટે સતત જગૃત રહેવાની જરૂર છે. તપશ્ચિર્યો, જ્ઞાન ધ્યાન-તથા શુરૂ-અદિત અને સેવાએ રંગાઈ જશો તો ખરેખર આત્માનું કલ્યાણ થઈ જશો.’

‘શુરૂવય્ ! હું આપણી પાસે અભ્યાસ કરીશ. યથાશક્તિ તપશ્ચિર્યો કરીશ અને મારું કલ્યાણ સાધીશ. મને તારો મારા શુરૂદેવ ! મને બચાવો ! બચાવો !’ રતનશીલાઈએ પોતાનો દદ્દ નિશ્ચય જણાયો.

સું. ૧૯૬૮ ના માગશર શુદ્ધ દ ના હિવસે દાહર આગર તડ ઓસવાળ શ્રીસંઘ તરફથી ખંધાવેલ નૂતન ઉપાશ્રયના વિશાળ લંઘ હોલમાં આચાર્યાંશી જીતનાંદ્રિસૂરિજીએ શ્રી રતનશીલાઈને દીક્ષા આપીને શુલાભમુનિના શિષ્ય શ્રી રતનાકર-મુનિ નામ આપવામાં આંદ્રું મુનિલ પોતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા. સંઘના આભાલવૃદ્ધમાં આનંદ છવાઈરહ્યો.

X                    X                    X

આજ થાણુંમાં દીક્ષામહેત્સવની ધામધૂમ હતી. નૂતન કુલામય હંહેરાસરની બાજુમાં લંઘ મંડપ ઊલો કરવામાં આંદ્રો હતો. જૈન સમાજના આભાલવૃદ્ધમાં આનંદની લહ-રીએ લહેરાઈ હતી. પ્રાતઃકાળથી મુંબદીથી જૈન જનતા, આગેવાનો, વૃદ્ધો અને બહેનોના ટેળે ટેળાં ઉમટી રહ્યા હતા.

અપોરના આચાર્યપ્રવર શ્રી જિનત્રદિસ્ક્રિપ્શન શ્રી રાજે-ન્દ્રસુનિને ભાગવતી દીક્ષા આપી. આચાર્યશ્રીએ જૈન દીક્ષાની ઉચ્ચતા, જૈન સાધુઓનું જગતમાં સર્વશ્રેષ્ઠ સ્થાન, જૈન અહિસાનો વિશ્વમાં પ્રચાર અને જૈન તત્ત્વજ્ઞાનની મહત્ત્વા, વિષે મંગળ પ્રવચન કર્યું. આ પ્રસંગે સ્થાનકવાસી હેવા છતાં તીર્થયાત્રાએ અને તીર્થમહિમા વિષે પૂજ્યલાવ ધરાવનાર શ્રી જમનાદાસભાઈ ઉદાધ્યાત્રીએ તીર્થોદ્ધાર અને જાનોદ્ધાર વિષે એક મનતીય વિવેચન કર્યું હતું. તે વિવેચનનો સાર ભાગ મનન કરવા જેવો છે.

‘થાણુનગર જેવા પવિત્ર અને આચીન તીર્થધામમાં શ્રી ભાગવતી દીક્ષાનો મહેત્ત્સવ હોય, અતુવિંધિ સંધ ઉપસ્થિત હોય અને પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી જિનત્રદિસ્ક્રિપ્શન મહારાજ સ્વાહેય અધ્યક્ષસ્થાને બીરાજમાન હોય તેવા મંગળમય પ્રસંગે તીર્થોદ્ધાર અને સાહિત્યોદ્ધારના વિષય ઉપર વિવેચન કરવા મને નિમંત્રણ આપી આપે આપની ઉદારતા ફરજીવી છે. જન્મે અને આચારે હું સ્થાનકવાસી જૈન હું છતાં મૂર્તિંપૂજક સંધ અમૂર્તિંપૂજક જૈનને તીર્થોદ્ધાર ઉપર વિવેચન કરવા નિમંત્રણ આપે તે આપ સૌની વિશાળ અને ઉદારદિષ્ટ સૂચયે છે. તે માટે આપને અરેખર ધન્યવાદ ઘટે છે.

ભારતીય સંસ્કૃતિમાં જૈન તીર્થોનું સ્થાન અદ્વિતીય છે. જૈન તીર્થધામેમાં ઉપાસકોએ કુદરતની આકર્ષિતામાં કલાની મનો-હરતા ઉમેરી છે. ક્રેંચ કલાકાર કહે છે કે ‘સ્થાપત્ય કળાના પ્રદેશમાં જૈનોએ એવી પૂર્ણતા સાધી છે કે બીજ ડોઈ તેની સરખામણીમાં ઉભા રહી શકે તેમ નથી. જૈનોએ મહિરોના

નગરોની રચના કરીને તો હંડ કરી છે રે તો એક અદ્ભુત કળાસજ્ઝન છે.

જૈન સંધની ઐક્યતા અને જૈન સંધતું સંગઠન જૈન તીર્થોને જ આલારી છે. જૈનસમાજ, જૈનધર્મ, જૈન સંસ્કૃતિ અને જૈનશાસનને ટકાવી રાખવામાં જૈન તીર્થોનો ફાળો સવિશેષ છે. જૈન સંધની સંપત્તિ અને બકિત આ તીર્થોની શ્રદ્ધા પાછળ આપો આપ રેલાયાં છે. ભારતમાં એવાં મનોરમ્ય જૈનમૂલ તીર્થધારો છે જેના દર્શન-દર્શનનથી મનના પરિતાપ શરીર જાય છે. યુદ્ધિ નિર્મણ થાય છે. ચિત્તમાં આનંદ ઉર્મિઓ ઉંઘે છે અને પ્રભુતાના દર્શન થાય છે.

જેમ તીર્થધારો તેમ શાનસંડારો પણ આપણો મહામૂલો વારસો છે. હીરા, માણ્યુક અને મોતીથી વિશેષ ઢીમતી એ અંથરતનો જૈન સંસ્કૃતિનો ગ્રાણ છે. જગતના કેાઈ દેશમાં આવા શાન કંડારો, શાન રતનો સર્જન્યા નથી. જગતના કલ્યાણ માટે માનવજીવનની આત્મશુદ્ધિ, આત્મશાંતિ અને આત્મ-દર્શન માટે આ શાનગંગા છે. શાનની ઉપાસના સિવાય જીવનતું દર્શન હુલ્લંબ છે. શાનની 'સાચી પૂજા' શાનની પ્રભાવના છે. જગત એવા શાનની ગંગા માટે તત્ત્વી રહ્યું છે. જૈનસમાજે દેશ વિદેશમાં એ શાનનો પ્રચાર કરવા લગ્નિરથ કાર્ય કરવાનો સમય આવી લાગ્યો. છે. શાંતિને માટે જંખી રહેલા કરોડો માનવી અહિસાનો સંદેશ જીતવા તૈયાર છે. હાનશુર અને શાનપૂજામાં પુણ્ય માનનાર જૈનસમાજ જગતને વિધશાંતિને પંથે હારી જાય તો જૈનશાસનનો જગતમાં જયજયકાર થઈ રહે.

શ્રી જમનાહાસભાઈના વિવેચન પછી થાણું હંહેરાસરના બ્યાવસ્થાપક શ્રી મંગળહાસ ત્રીજમહાસ જીવેરીએ શ્રી સંઘના તરફથી શ્રી જમનાહાસભાઈ તથા બધા મહેમાનોનો હાર્દિક આલાર માન્યો અને પ્રાસાંગિક વિવેચન કર્યું. અપોરના ધામધૂમપૂર્વક વરદોડા નીકળ્યો હતો. હંહેરાસરમાં મોટી પૂજા લાણુવામાં આવી હતી. સાંજના સ્વામીવાત્સલ્યનું લોજન થયું હતું. સાયંકાળે શ્રી ભાગવતી દીક્ષાનો મહેત્સવ આનંદપૂર્વક સમાપ્ત થયો હતો. સં. ૧૯૬૮ તું ૫૦ સું ચાતુર્માસ થાણુભાં આનંદપૂર્વક થયું.

થાણુભાં તૈયાર થતા નવપહ જિનાલયના કાર્યની જવાબ-દારી શ્રી થાણું સંઘ તથા શ્રદ્ધેય શ્રી રવજીભાઈ સોજપાળ જે. પી. ને સોંપીને આચાર્યશ્રી થાણુથી વિહાર કરી એારીવલી પદ્ધાર્યો.

એારીવલીભાં સાધુ સાધ્વીને ઉત્તરવા માટે ઉપાશ્રય નહોતો. આચાર્યશ્રીએ સાહી નિવાસી શા જુહારમલણ ઉત્તમાલને શેઠશ્રી રવજીભાઈ સોજપાળ સમક્ષ ઉપદેશ આપ્યો. બાદથાણ-જીએ ચોતાની જમીન ઉપાશ્રય તથા હંહેરાસર માટે સંઘને અર્પણું કરી. એારીવલીના સંઘમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો. ઉપાશ્રયનું કામ પણ ચર્ચ કરાવવા પ્રથાંધ થઈ ગયો.


અગાસ્તી તીર્થની યાત્રા કરી પાલધર, દાહાણુ, જોલવડ, બોરડી, અચારી, વાપી, બગવાડા, પારડી, વલસાડ, ભીલીમારા, નવસારી, મરોલી થઈ સુરત શીતળવાડીમાં પદ્ધાર્યો. શ્રી સંઘે ભાવલયું સ્વાગત કર્યું. શા મોતીચંદ ભયુભાઈ તરફથી પાંચ દિવસનો ઉત્સવ કરવામાં આવ્યો. શ્રીસંઘના

અત્યાશ્રહથી ગોપીપુરા નવી ધર્મશાળામાં ચાતુર્માસ માટે પદ્ધાયો. જગતપૂજય શ્રી મોહનલાલજી મહારાજના જ્ઞાન કંડારના અંથ-રત્નોના કૃપાને ખફુલવાને પ્રબ્રહ્મ કર્યો. સૂરતના ચાતુર્માસમાં આચાર્ય શ્રીએ પાંચ પાંચ ઉપવાસની ઐ ભાસ સુધી દીર્ઘ તપ-શ્રયો કરી. સૂરતના આણાલવુદ્ધ ધન્ય ધન્ય એલી જિક્યાં.

સુરતમાં શ્રી મોહનલાલજી મહારાજનો ધણ્યા ધણ્યા ઉપકાર છે. આજે જૈન જોગનશાળા-પાઠશાળા, મનોરથ મંદિરો, જ્ઞાનમંદિર, જૈન સંદર્ભમાં એકતા, ધાર્મિક શ્રદ્ધા તથા જાહેરજ્ઞાલી વગેરે શ્રી મોહનલાલજી મહારાજની પ્રેરણ્યા અને પુષ્ય પ્રભાવને લીધે ગણ્યાય છે. સુરત ધર્મનગરી ગણ્યાય છે.

આચાર્ય શ્રીતું સં. ૧૯૯૯ તું ૫૧ સું ચાતુર્માસ સુરતમાં આનંદપૂર્વક થયું.





## ચાંગીરાજ સાથે જ્ઞાનગોણિ

(૩૮)

‘કૃપાળુ ! આપ ઘણું સમયે પધાર્યો છો. આ વખતે તો કૃપા કરી અતે ચાતુર્માસ કરો અને આપના અમૃતવયનોથી અમને તૃસુ કરો.’ ખંભાતના નગરથેડે વિનતિ કરી.

‘બાળશાળી ! તમે જણો છો માણ્યામાં નૂતન જીનાલયનું કામ ચાલે છે છતાં સ્થળીના પ્રહેશમાં આજે પરિસ્થિતિ વધું સતી જાય છે. કેઈ સુનિ મહારાજનો વિહાર તે તરફ ન હોવાથી ત્યાંના દોકોમાં જાગૃતિ નથી. આપણું ગુજરાતમાં તો જગ્યાએ જગ્યાએ સુનિ મહારાજની જેગવાઈ મળી રહી છે પણ સ્થળી પ્રહેશમાં કોઈ કોઈ બાળેજ જાય છે. ચુંદના ભાઈઓનો અત્યંત આશ્રણ છે વળી ત્યાંના ઓચવાળો ધર્મ શ્રદ્ધાથી ઉગતા જાય છે.’ આચાર્યશ્રીએ સ્થળી પ્રહેશની પરિસ્થિતિ સમજાવી.

‘જાહેર ! ગ્રંથ ત્રણ વર્ષથી અમારી વિનતિ છે. આપણી એક ચાતુર્માસ કરી સ્થળી પધારો. અહીં પણ ધર્મ કાયો થશે.

અમારા નવાખસાહેબ પણ આપની ધર્મવાખી સાંભળવા હતુંક  
છે.' શ્રી વાડીલાલ છાટાલાલે વિશેષ વિનિતિ કરી.

'ભાઇઓ ! નગરશેઠ અને તમે બધા આગઢ કરો. અને  
હું તમારા આગઢને માન ન આપું તે ન બને પણ ચુકુના સંઘને  
મેં સુંખદી વચન આપ્યું છે. ત્યાં જવાની ખાસ જરૂર છે.  
સૂરતથી ચૂકું ધ્યાનું ફર છે. ઉનાળો પણ આવતો જાય છે  
પણ પહેંચ્યા વિના છૂટકો નથી. નહિ તો હું જરૂર અહીં  
સ્થિરતા કરત.' આચાર્યશ્રીએ સ્પષ્ટતા કરી.

'દ્વારા ! શ્રી રાજુમતી શાંકિકાશાળાનો મેળાવડો કર-  
વાનો છે. આપશ્રી અતે પખાર્યો છે. સૂરી સમાટ આચાર્યશ્રી  
ને મીસૂરીશરલુના વિદ્ધાન શિષ્યરત્ન આચાર્યશ્રી અમૃતસૂરી-  
શરળ પણ અતે જ છે તો એ હિંસ સ્થિરતા કરી આપ  
સુઝેથી પખારો,' શાંકિકાશમના કાર્યવાહકોએ વિનિતિ કરી.

'જહાસુખમ્ ! તમારી ભાવના પૂરી કરો. ચૂકું બહુ ફર  
અને ઉનાળો આવે છે તેથી જ જરા ઉતાવળ છે.' આચા-  
ર્યશ્રીએ જંમતિ આપી.

'સાહેબ ! અમારા નામદાર નવાખસાહેબ, તેઓશ્રીના  
મામા સાહેબ તથા તેઓશ્રીના માશીઆઈ ભાઈસાહેબ આપના  
હૃદાને પખારે છે.' નગરશેઠે જમાચાર કહેવરાંધ્યા.

'આપ તો ખુદાના તુર છો. ચાતુર્માસ અહીં કરો. ના-  
રશેઠની ભાવના છે તેમ અમારી પણ ઈચ્છા છે. આપ અહીં  
રહેશો તો અમને પણ લાભ મળશો. તમારી દીર્ઘતપશ્ચિમાંની  
વાત નગરશેઠે કરી ત્યારે અમે તો અકિત થઈ ગયા.' નવાખ-  
સાહેબે ધન્યવાહ આપ્યા.

‘ધર્મ લાભ ! આપ તથા આપનું કુદુંબ જૈનધર્મ તરફ  
જે ભાવ રાખો છો તે ખરેખર પ્રશાંકનીય છે. નગરશૈઠ  
વળેરેનો ભાવ તો ધણો ધણો છે પણ સ્થળી પ્રદેશમાં જવાની  
આસ જરૂર છે. મેં ત્યાંના શ્રી સંધને વચ્ચન આપણું છે.’  
આચાર્યશ્રીએ ધર્મલાભ સાથે સ્પષ્ટતા કરી.

આચાર્યશ્રીએ નવાખસાહેબ વળેરેને માંગલિક સંભગાંયું,  
માનવજીવનની સાર્થકતા માટે જીવદ્યા તથા પરોપકાર માટે  
ઉપદેશ આપ્યો. આચાર્યશ્રીના ઉપદેશથી નવાખસાહેબને  
ખૂબ આનંદ થયો.

આચાર્યશ્રી સુરતથી વિહાર કરી સાયણ, ક્રીમચોકી, કોસંબા,  
પાનોલી, અંકોંશ્વર થઈને લડ્યા, સમની, આમોદ, જાંબુલ્સર  
થઈને રાલેજ આંયા. અહીં અંભાતના નગરશૈઠ ચંદુલાલ  
બાપુલાલ, શા વાડીલાલ છોટાલાલ, શા લોણીલાલ મગનલાલ,  
શા દ્વાપતભાઈ ભગુભાઈ તથા અંભાતના પાંચે જ્ઞાતિઓના આગે-  
વાનો આંયા હતા. આચાર્યશ્રીનું અંભાતના શ્રી સંદેશાલાલનું  
સ્વાગત કર્યું. શ્રી નગરશૈઠ તથા આગેવાનો અને નવાખ સાહેબે  
પણ ચાતુર્માસ માટે વિનિતિ કરી પણ ચૂર્ણ જવાની આવશ્યકતા  
હોવાથી મેળાવડા પછી વિહારનો નિર્ણય થયો.

આજ શ્રી રાજુમતી શ્રાવિકાશાળાનો વાર્ષિક ઉત્સવ તથા  
ઇનામી મેળાવડા હતો. આજ અંભાતના બહેન લાઈઓ મેટી  
સંખ્યામાં આવી પહેંચ્યા હતા. એક તરફ હીર્ઘાતપસ્વી આચાર્ય  
શ્રી જિનત્રદિસ્તુર પીરાજમાન હતા. સાથેજ એકજ પાટ ઉપર  
સૂરિસાટ આચાર્યપ્રવર શ્રી વિજયનેમીસૂરિશ્વરજીના વિદ્ધાન  
શિષ્ય આચાર્ય શ્રી વિજય અમૃતસૂરિજી બિરાજમાન હતા.  
અનેતું મિત્રત મધ્યે અનુપમ હતું.

આ સુખગ મિલન જેઠને અંભાતના આખાલવુદ્ધના આનં-  
હની સીમા નહેણી. અધાના મનમાં એકજ વિચાર આવવા લાગ્યો.  
આ રીતે મધુરાં મિલન આચાર્ય આચાર્યે વર્ષે અને સાધુ  
મુનિરાજે તેમજ સાધીલુ મહારાજેના ચોન્યા તો જૈન સમા-  
જના કેટલાએ પ્રશ્નો આપોઆપ ઉકુલી જય. જૈન સમાજની  
છિન્નબિન્ન હથાનો અંત આવે. સંગઠન અને એકયતાતું વાતા-  
વરણ સળું શકાય.


શ્રી રાજુમતી શાવિકાશાળાના વિદ્યાર્થીઓની પ્રાર્થના,  
સ્વાગતગીત, સંગીત, વિદ્યાલક્ષ્મીનો સંવાહ વગેરે મનોરંજન  
કાર્યક્રમ થયા પછી શાવિકાશાળાની કાર્યવાહીનો દુંક રિપોર્ટ  
મંત્રીશ્રીએ રણુ કર્યો. આચાર્યશ્રી અમૃતસૂરિલુએ ધાર્મિક શિક્ષણુ  
ઉપર મનનીય પ્રવચન કર્યો. આચાર્યશ્રી લુનઝડિસૂરિએ  
ખાળકો તથા બાળાઓ અને શાવિકાખણેનાને ધર્મ શિક્ષણમાં  
રસ લેવા તથા લુધનને ઉચ્ચય, આદર્શ ધનાવવા ઉપરેશ આપ્યો.

નગરશેઠના પુત્ર શ્રી પન્નાલાલભાઈએ પણ ધાર્મિક શિક્ષણુ  
ઉપર વિનેચન કર્યું. નગરશેઠના હસ્તે શાવિકાશાળાના છોકરા  
છોકરીઓને શ્રી વાડીલાલ છોટાલાલની તરફથી ઈનારો વહેંચ-  
વામાં આંદ્યાં. અધા લાઈ-ખણેનાના મન આનંદથી ઉછળી રહ્યાં.

આચાર્યશ્રીએ વિહાર કર્યો. સાચમા, તારાપુર, લીણાસી,  
માતર, રંધેન વગેરે ગ્રામાનુથામ વિહાર કરતાં કરતાં અમ-  
દાવાહ પખાયો. અમદાવાદમાં ખરતરગચ્છનો સુંદર ઉપાશ્રય  
કરાવવા માટે આચાર્યશ્રી લુનઝડિસૂરિની પ્રેરણું હતી. અમ-  
દાવાદના ભાઈઓએ ચાતુર્માસ માટે ધણો આગહ કર્યો પણ  
શૂરુ જદ્દી પહેંચવાનું હોવાથી વિહાર કર્યો, સાખરમતી,

કલોલ, પાનસર, ડાંગરવા જગુણે થઈ મહેસાણું પધાર્યાં.  
મહેસાણુંની સુપ્રસિદ્ધ પાડશાળાનું કાચ્યું લેઈ સંતોષ બ્યક્ત  
કર્યો. મહેસાણુંથી ઊજા, સિદ્ધપુર થઈ પાલણુપુર પધાર્યાં.  
પાલણુપુરમાં પંનાખ કેસરી આચાર્યશ્રી વિજયવદ્વાલસૂરીશ્વરજીના  
વિદ્ધાન, મરૂભૂમિમાં વિદ્ધાધામેના સર્જક આચાર્યશ્રી વિજય-  
લલિતસૂરીશ્વરજીનું મિલન પણ મધુદંહતું. આચાર્યશ્રી વિજય-  
લલિતસૂરીલુચે આપણા ચરિત્રનાયકનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું.  
પોતાની પાસે જ આથહપૂર્વક ઉતાર્યાં. બજેએ ખૂબ આનંદ-  
પૂર્વક જ્ઞાનગોધિ કરી અને પંનાખ-મારવાડની શિક્ષણ સંસ્થા-  
ઓની પ્રગતિનાં સમાચાર જાણ્યા. જૈન સમાજનું કલ્યાણ, જૈન  
સમાજનો ઉત્કષ્ટ અને જૈન સમાજનો ઉદ્ઘોત શિક્ષણ સંસ્થાઓ  
કારા થવાનો છે વગેરે વિચાર વિનિમય પ્રેમપૂર્વક કર્યો.

દૂરું જવાની ઉતાવળ હોવાથી પાલણુપુરથી વિહાર કરી  
ખરેરી આવી પહોંચ્યા. આખુના ઐનમૂન ડોરણીવાળાં કલામય  
મંહિરે. લેઈને જૈન સમાજની હાનશરૂરતા અને શ્રદ્ધાલુકિત  
યાદ આવ્યાં. આખુથી અચ્યતગઢ આવ્યાં અચ્યતગઢમાં મંહિ-  
રોના હર્ષન કરી ચોગીશ્વર શ્રી શાંતિસૂરીશ્વરજી પાસે ગયા.  
અન્નેનું મિલન આનંદપ્રદ, અપૂર્વ અને અલૌકિક હતું. રાણ  
મહારાજાન-શેઠ શાહુકાર અને વિહેણી લોકો પણ જેના ચોગ  
ચ્યાતકારથી સુગંધ હતા તે શાંતમૂર્તિ ચોગીરાજ સાથે ત્રણ  
કલાક સુધી જ્ઞાનગોધિ થઈ. અન્નેના હૃદયમાં આનંદ અને પ્રેમ-  
ભાવ રેલાઈ રહ્યો. ચોગ અને ધ્યાનમાં આપણા ચરિત્રનાયક  
પણ ખૂબ રસ ધરાવતા હતા તેથી તે વિષે પણ વિચાર વિનિ-  
મય થયો. તીર્થધામો પર આવતાં આકમણેં માટે જૈન-  
આરોની વિશેષ જવાબદારી છે અને હું તો તીર્થધામો માટે



જગતપૂજય શ્રીમહ શાંતિસૂરીધરજ મહારાજ



આ ક્ષયિકુઠ હેઠળી પણ પરવાવિના કાર્ય કરવા તમજા રાખું  
કૃષું, તથા જીવદ્યાએ તો પ્રાણી માત્ર-યૂરોપ-અમેરિકા કે  
હિંદના લોકોને પરમ ધર્મ છે તે માટે આપણે યથાશક્તિ  
પ્રયાસો કરવાના છે વગેરે વિચારણાએ થયા પછી યોગીરાજે  
આપણું ચરિત્રનાયકને આખુમાં ચાતુર્માસ કરવા આગ્રહ કર્યો.  
યોગના ચ્યામતકાર અનુભવાશે, આપણુંને બન્નેને બહુ આનંદ  
રહેશે. તમને કશી તકલીફ નહિ રહે, તમારી તપશ્રી-યોગદાસિ  
અને યશગાથા મેં બહુ બહુ સંબંધી હતી પણ આજના મહુર  
મિલનથી વિશેષ આનંદ થયો. આચાર્યશ્રીની ભાવના આખુમાં  
વિશેષ રહેવાની થઈ, યોગીરાજનો આગ્રહ તો હતો જ પણ ચૂર  
જદ્વિ પહેંચવાનું હોવાથી આચાર્યશ્રીએ ચોતાની મુર્ઢેલી હશોની.

યોગીરાજે એ હિંસ વિશેષ રેાક્યા, સ્થલી પ્રદેશની પરિસ્થિતિ  
હિંસ હિંસ વધુસતી જતી હતી. લોકો ધર્મથી વિસુધ થતા  
જતા હતા તે વાત જાણી યોગીરાજે આપણું ચરિત્રનાયકને સ્થલી  
જેવા પ્રદેશમાં જઈ ધર્મઓત કરવા વિશેષ પ્રેરણું આપી. યોગી-  
રાજે સુંભદ્રના મહાન ઉપકારી શ્રી મોહનલાલજી મહારાજને  
પણ યાદ કર્યા અને કલ્યાં કે ધર્મ છે એ સુનિરતનને જેમણે અનેક  
પરિસહેદા સહીને સુંભદ્રના હરવાળ સુનિ મહારાજે માટે ખુલ્લા  
મૂરી જૈન જનતાના હુદદ્યમાં ધર્મના ધીજ વાયં. તે સમયે પણ  
આચાર્યો તો તેમનાથી વિરુદ્ધ હતા પણ આજે સુંભદ્રમાં  
સુનિરાજે અને સાધીલ મહારાજે ધર્મપ્રકાશના કરી રહ્યા છે  
તે શ્રી જગતપુન્ય શ્રી મોહનલાલજી મહારાજને આભારી છે.

યોગીરાજની ભાવભીની પ્રેમભરી વિદ્યા લઈ આપણું  
ચરિત્રનાયકે વિહાર કર્યો.



## ચૂરુમાં ધર્મપ્રભાવ

( ૩૬ )

આખુથી વિહાર કરી શિરોધી, શીવગંજ, વાલી, મુંડારા, ખીંવેલ, મારવાડ-સોજત ઇલોધી થઈ કુચેરા પદ્ધાર્યો. સ્થળને પ્રદેશ, ગરમીની મોસમ, ધરઘગતી રેતી, કાંટા ને કાંકરા, ડાસોના ડેસ ચાલ્યાજ જાઓ. પણ ગામ મળે નહિ, વિસામા માટે વૃક્ષઘટા પણ ન મળે. પાણી કે આહારની પણ સુશ્કેલી. આપણું ચરિત્રનાયકને તો ચૂરુ-જન્મભૂમિનો સાદ સંભળાતો હતો. જલ્દી ચૂરુ પહેંચવાની તાતાવેલી હતી. સાધુ તો ચલતા ભલા-પરિસહેવિના ધર્મઉદ્ઘોત કેમ થાય !

કુચેરાના શ્રીસંધનો આચાર્યશ્રી તરફ ખૂબ લક્ષ્ણભાવ હતો. આચાર્યશ્રીનું 'ભાવભર્યું' સ્વાગત કર્યું. કુચેરાના શ્રી સંધના અશ્રેષ્ટ ધર્મનિષ્ઠ વયોવૃદ્ધ સંપત્તિશાળી શેઠ સુગનચંદ્લ સીધીએ પ્રાર્થના કરી. 'ગુરુહેવ આ ક્ષેત્ર તરફ આપના અનેક

હિપકાર છે. આપ તુ વર્ષો પધારો છો. અહીં સંવેગી સાધુ લાગ્યેજ પધારે છે. ગુજરાત-સૌરાષ્ટ્ર અને પંજાબ તો સાધુ-ઓથી લાગ્યેજ વંચિત રહે છે પણ આ સ્થલી પ્રદેશમાં સાધુના હર્ષન ફર્જબ થઈ ગયાં છે. ગુરુહેવ ! ઉપરેશ વિના ધર્મપ્રચાર અને ધર્મસંકાર કયાંથી ટકે ! નવયુવકોએ પણ પ્રાર્થના કરી. કુચેરામાં ધર્મજાગૃતિ આપશ્રી લાગ્યા છો. અમારા હૃદયમાં ધર્મપ્રેમ થોડા ધણો છે તેને ચોણ્ય સિંચન નહિયે મળે તો ધર્મનો આ જગીચો સુકાઈ જશો. 'આચાર્યશ્રીને આ ફર્જબથી વચ્ચનથી ફુખ થયું. સ્થલી પ્રદેશમાં ધર્મપ્રચારની લારે જરૂર છે અને જ્યારે મુનિરાજના હર્ષન પણ ન થાય તો ધર્મજાગૃતિ અશક્ય છે. ચૂર્ણના શ્રી સંધને વચ્ચન આપણું હતું તેથી બીજે ઉપાય નહોતો. પણ થોડા વધારે હિવસ સ્થિરતા કરી ધર્મ-ઉપરેશ આપી પધાના મન સંતોષી વિહાર કરો.

જેઠનો મહિનો. લૂ કહે મારું કામ, ગરમી તો સવારથી જાંજ સુધી ગરમ હવા ઝેંકતી. મોટા મોટા કોસોનો. વિહાર તો ઉથ હતો. પાણીથી જ સંતોષ માનવાનો. તે પણ કોઈ કોઈ જગ્યાએ મળતું નહિ. આવી પરિસ્થિતિમાં આપણું અરિત્ર નાયક તો ચોણીની જેમ શાંતિ અને સહનશીલતાની મૂત્રિંસમા ચાલ્યા જતા હતા. કોઈ કોઈ ગામ તો એવા આવતા કે જૈનધર્મ પાળવાનો હાવો કરનાર, ચોતાને અગવાન મહા-વીરના પુત્રો કહેવડાવનાર, સામાચિક-પ્રતિકમણ લલ્યનાર ધર્મના જનૂનથી સંવેગી સાધુને રોટી-હાળ તો શું, છાશ પણ નહિ અરે, પાણી પણ નહિ. આ સ્થલી પ્રદેશની દશા જોઈ આપણું અરિત્ર નાયક તો સમસમી ઉઠ્યા. આવા પરિસહે-

સહેન કરીને ચૂર્ણની પાસે રતનગઢ, મૌલીસર થઈ ડેપાલસર પધાર્યો. ચૂર્ણના આગેવાનો શેડ ચંપાલાલજી ધનપતસિંહલુ, શુષ્ણુંતલાલજી, ભમરલાલજી, વિજયરાજલુ, મંગતચંહલુ, બુધ-મલજી આદિ કોડારી કુંઠુંખો, શ્રી તોલામલજી બાંઠીયા, કોડારી ચિરંલુલાલજી, સ્વર્ગસ્થ યતિશ્રી ઝાંદ્રિકરણુલના શિષ્ય શ્રી ગણુપતચંદ્રલુ, લોકાગચ્છના યતિ શ્રી રાવતમલજી, શુરુભક્ત ટોડરમલજીના પુત્ર જીવરમલજી, ધર્મપ્રેમી શ્રી ધનસ્યામહાસલુ, લક્ષ્મીનારાયણલુ, ગંગાધરલુ, ગણેશમલજી, વડીલ શ્રી મુનિલાલજી ધારીવાદા, શ્રી હેવીદત્તલુ પોદાર, શ્રી રામલાલજી શાસ્ત્રી, આયુર્વેણ્યાચાર્ય કાલદાસલુસ્વામી, પંડિત રૂપરામલુ આદિ આવી પહોંચ્યા. શુરુદેવના દર્શનથી આનંદ આનંદ છવાઈ ગયો. જેઠ વહ ૧૨ ના પ્રભાતે ધામધૂમપૂર્વક શહેરમાં પ્રવેશ થયો. આચાર્યશ્રીએ માંગલિક સંભળાવ્યું.

ચૂર્ણના કોડારી કુંઠુંખના આસજનો તથા આણાલવુદ્ધમાં આનંદ આનંદ છવાઈ ગયો. શેડ ચંપાલાલજીએ ઉલા થઈને શ્રી સંધને ઉદેશીને કહ્યું, કે દીર્ઘતપસ્વી આચાર્યશ્રી સૂરતથી અનેક પરિસહેલાની વૈશાખ જેઠના અગન વરસતા તાપમાં સ્થલીના લાંબા લાંબા કાંટા-કાંકરાવાળા રસ્તાએ. પસાર કરી પોતાની જન્મભૂમિ ચૂર્ણનો સાફ સંલળી પધાર્યો છે તે આપણું અહોભાગ્ય છે. આપણે શુરુદેવના સુધારસ્યા વચનામૃતોનો લાલ કૃદ્ધએ અને આપણામાં જે થોડી ધણી ધર્મભાવનામાં મંહતા આવી છે તેમાં ધર્મપ્રેરણું મેળવી આપણાં જીવન ઉજવળ કરીએ. આપો ઉપાશ્રય જ્યનાહોથી ગુંજું ઉઠ્યો.

ચૂર્ણની પરિસ્થિતિ જરા વિચિત્ર હતી કોડારી જેવા ચુસ્ત

ધર્મભાવનાવાળા કુદુંએ સિવાય બીજા કુદુંએ સંવેગી સાધુને ગોચરી તો શું પણ પાણી પણ વહેરાવવામાં પાપ સમજતા હતા. ખીચો વિશેષ ચુસ્ત હતી અને પુરુષોની ભાવના છતાં તેઓ ગોચરીએ આવનારને વહેરાવવાને બદલે તેમની અવગણુના કરતા હતા. આ અગવાન મહાવીરના જૈન ધર્મના એક જ શહેરના જૈન સમાજની આવી હશા હતી તો આ પરિસ્થિતિએ ગામે ગામ ડેવી કરુણહશા ઉલ્લી કરી હશે! આચાર્યશ્રીની દીર્ઘતપદ્ધર્યા, સમભાવના, શાંતદિષ્ટ, અમી વધો તથા સૌભ્યતાના પ્રભાવથી થોડા જ હિવસોમાં બધા આચાર્યશ્રીના ભક્ત બની રહ્યા.

અખાદ શુદ્ધિ ૧૧ નો પવિત્ર હિવસ આવ્યો. સુપ્રભિદુઃખ યુગપ્રધાન શ્રી લુનહટસૂરિલુની જ્યંતિ ઉજવવાને નિર્ણય થયો. એક લાખ ત્રીસ હજાર જૈનતરોને જૈનધર્મમાં દ્રદ કરનાર મોટા દાદાના નામથી સુપ્રભિદુઃખ શ્રી લુનહટસૂરિલુના જ્યંતી પ્રસંગે દાદાલુનો મનોહર ફૈટો પાદભીમાં પદ્મરાવી વરધોડા કાઠવામાં આવ્યો. આ પ્રસંગે એક ચમત્કાર થયો. ચૂરુમાં વરસાદને માટે ચિત્તા રહેતી હતી. ધોામ ધર્મતો હતો. ગોટેજોડા ધૂળ ઉડ્યા કરતી, વરસાહું નામ નિશાન નહોતું. લોકો ચિત્તાતુર હતાં. પશુઓ, પંખીઓ બધા તરફડી રહ્યા હતા. લોકો હેવચોડી અગ્રિઆરશની રાહ જેઠને આશાલયી એડા હતા. આજે તો દાદાસાહેણ લુનહટસૂરીલુની જ્યંતીનો પ્રસંગ હતો. અને દીર્ઘતપદ્ધર્યા આચાર્યશ્રી લુનઅદ્ધિસૂરિ મહારાજની હાજરી હતી. આજ તો આજ ચીરીને પણ મેધરાજ આવવો જ જેઠાં. ચુરુહેવની પાદખી નીકળી ત્યારે તો

વાહળાતું નામનિશાન નહોંતું. તાપ અસદ્ય હતો પણ જ્યાં પાતખી શહેરમાં નીકળી અને મધ્યચોકમાં આવી ત્યાં કોણું જાણે કયાંથી વાહળાં ચરી આવ્યાં. ગજ'ના શરૂ થઈ અને અમૃતના છાંટણુંની જેમ વર્ષો આવી પહોંચી. રથયાત્રા પૂરી થઈ અને વાહળાં વરસી પડ્યાં. જૈન-આદ્યાશુ-વાણીયા, બાટ-કિસાન અધાના મનમાં આનંદ આનંદ થઈ રહ્યો. હાદાળના પ્રભાવ અને આચાર્યશ્રીની તપશ્ચર્થાની ભૂરિભૂરિ પ્રશંસા થવા લાગી. હાદાળ કલિકાળનાં કલ્પતરે છે. ધન્ય હાદાળ ! ધન્ય તપસ્વી આચાર્યશ્રી !

કૃષ્ણ જનમાષ્ટમીનો દિવસ આવી પહોંચ્યો. ચૂંદના કૃષ્ણ-ભક્તોએ આચાર્યશ્રીને જાહેર વ્યાખ્યાન આપવા વિનિતિ કરી. આચાર્યશ્રીએ અધ્યક્ષ સ્થાન લેવા સંભતિ ફર્શાવી. પોઢાર લુંબ-નમાં જનમાષ્ટમી નિમિત્તે મોટી સભા લારાણી. કૃષ્ણ અગવાનના જીવન ઉપર મનનીય વિવેચનો થયાં. આપણા ચરિત્રનાયક આચાર્યશ્રીએ અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરતાં જણાયું કે.

‘મહાજનો કૃષ્ણ અગવાનનાં લક્ષ્ય ગણ્યાય છે. ગૌમાતાની રક્ષા કરવી એ દરેકનો ધર્મ છે. કૃષ્ણજ્યંતીનો સંદેશ એ જ છે કે ગૌમાતાની રક્ષા કરો. હુધ-હંહીની નહીંએ વહેશે. ઐતી પણ સારી થશે અને અનાજની વૃદ્ધિ થશે. પાંજરપોળની દશા કેવી શોચનીય છે ! કૃષ્ણઅગવાન ગૌપાતક કહેવાય છે. ભક્તોએ ગૌમાતાની સેવા કરવી જોઈએ.’

કૃષ્ણજ્યંતીનો આચાર્યશ્રીનો સંદેશ સાંભળી અધાને આચાર્યશ્રીની સમભાવના માટે માન અને મૂળ્યભાવ ઉત્પત્ત થયાં.

પાંજરાપોળની વ્યવસ્થા સુધારવા માટે ૬-૧૧-૪૩ ના રોજ શ્રી રામલુમંહિર કટરામાં આપણા ચરિત્રનાયક આચાર્યશ્રી લુનકરદ્ધિસુરિલુના અધ્યક્ષસ્થાને સલા ભણી, ગૌરક્ષા સંબંધી પ્રલાવશાળી વ્યાખ્યાન થયું. આ પ્રસંગે શેઠ ચંપા-વાલલ કોઠારી, શુરૂભક્ત શ્રી ટોડરમલલના સુપુત્રો, પોહાર કુંદુંથીજનો, ચતિશ્રી ગણુપતિચંદ્રલુ, આયુર્વેદાચાર્યશ્રી કાલ-હાસલ સ્વામી આદીની હાજરી હતી. ચુડ પાંજરાપોળના ઉદ્ઘાર માટે આચાર્યશ્રીએ પ્રેરણુત્તમક પ્રવચન હયું. આ પ્રવચનની બાહ્ય અસર થઈ. પાંજરાપોળના માટે બાર જણાની કમીટી નીમાણી તેથી ચુડની પાંજરાપોળ વર્તમાનમાં સુંદર ચાલે છે.

ચુડના આ વખતના પચુખ્ણ ચાહગાર બની ગયા. બાવન વષે ચુડના જ એક ચતિરતન દીર્ઘિતપસ્તી પુષ્ય પ્રકાવક જૈના-ચાર્યની હાજરીમાં તપસ્થિયો, કલ્પસૂત્રનો વરદોડા; વ્યાખ્યાનો, સંધજમણુ આહિ ખૂબ શ્રદ્ધા અને આનંદપૂર્વક થયાં. ચુડના આણાલવૃદ્ધમાં ધર્મનાગૃહિ આવી. ધર્મપ્રલાવના ખૂબ ખૂબ થઈ.

આખુ અચળગઢથી સંહેશો આંદોલા કે યોગીરાજ આચાર્ય શ્રી શાંતિસૂરિલુ સમાધિપૂર્વક કાળધર્મ પાણ્યા. સંહેશો મળતાંજ આપણા ચરિત્રનાયકને આધાત લાંયો. હલ હમણુંજ વિહારમાં અને આચાર્યનું મધુર મિલન થયું હતું. યોગીરાજે આપણા ચરિત્રનાયકને આખુ ચાતુર્માસ માટે પ્રેમપૂર્વક આગહ કર્યો હતો અને છ મહિનામાં તો તેઓ સ્વર્ગે સીધાવી ગયા.

ચુડમાં યોગીરાજના સ્વર્ગવાસ નિમિત્તે આપણા ચરિત્રનાયકની પ્રેરણુથી રાન્યકોટ્ટ કચેરીએ બંધ થઈ. આખા-શહેરમાં બધા લોકોએ પાણી પાણી તથા ખરતરબચ્છના મોટા;

ઉપાક્ષે આચાર્યશ્રીના પ્રમુખસ્થાને શોક પ્રહર્થીક સલા થઈ. હાકેમસાહેબ આહિ રાજકર્મચારીએની હાજરી વરયે યોગીશ્વરના જીવન પર વિદ્ધાનોએ વિવેચનો કર્યો. ડાકારી શ્રી મંગલચંહળુએ જણ્ણાંયું કે યોગીશ્વર શ્રી શાંતિસૂરીશ્વરલુના દર્શનથી મારામાં પરિવર્તન થયું. અમે તેરાપંથી હતા પછી સ્થાનકવાસી ધર્મ માનવા લાગ્યા પણ યોગીશ્વરના પુણ્ય-પ્રભાવથી પ્રભુદર્શન, પ્રભુપૂજા, તીર્થયાત્રામાં શ્રદ્ધા થઈ અને અમે આચાર્યને જેને અન્યા, યોગીશ્વર ડેવાંશી પુરુષ હતા. આપણું અરિત્રનાયકે યોગીશ્વરના જીવનના પ્રસંગો આપીને શ્રદ્ધાંજલિ આપી.

આસો શુદ્ધ પૂર્ણિમાના દિવસે શ્રી જીનચંડ્રસૂરીશ્વરલુ મહારાજની જયંતી ડાકમાટી ઉજવવામાં આવી. ચૂર્ઘમાં પાણી પાળવવામાં આવી.

અપોરના પાલખીનો વરદોડા આખા શહેરમાં ફરીને હાદાવાડીમાં આવ્યો. અહીં હાદાસાહેબની પૂજા બાધ્યવવામાં આવી. પ્રભાવના થઈ.

આસો શુદ્ધ ૭ થી શ્રી નવપદલુની એળીની શરૂઆત થઈ. એળીમાં ધર્ષા બાઈ-ખણેનોએ હર્ષપૂર્વીક બાગ લીધે. આઠે દિવસ શ્રીપાળ મહારાજનો રાસ વાંચવામાં આવ્યો, એળીના દિવસોમાં સૂરત નિવાસી શ્રી ઇક્ષીરચંહ મગનલાલ બદામી તથા શ્રી મીતીચંહબાઈ ચુરમહારાજને વહંત કરવા આવ્યા. તેઓ પૂજા લાભિતમાં એવા તો લીન રહેતા કે સવારના પ્રભુપૂજા માટે ફેરાસરમાં જતા અને મનમોહક વિધ વિધ પ્રકારની આકર્ષેક અંગી કરી અપોરના એ વાગે ફેરાસરમાંથી

નીકળ્યા પછી લોજન લેતા. તેમની મનમોહક આંગીના હર્ષન માટે ચૂર્ણ શહેરના આખાતવુદ્ધ ઉમટી આવતા અને મેળા જેવું બની રહેતું.

સુંખદી આચાર્યશ્રીના અનન્ય ગુરુભક્ત ધર્મનિષ્ઠ અને ધર્મશર્દી શ્રી હરિચંહલાઈ માણેકયંહ કુદુંબ સહિત આચાર્યશ્રીના હર્ષન માટે સુંખદી જેટલા હુર પ્રહેશથી હુર હુરના ચુરુમાં આંધ્યા અને આચાર્યશ્રીના હર્ષન કરી પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. શ્રી હરિચંહલાઈનું આતિથ્ય ચૂર્ણના ભાઈઓએ બહુ લાવપૂર્વક કર્યું. શ્રી હરિચંહલાઈએ ગુરુદેવને સુંખદી પધારવા પ્રાર્થના કરી. આચાર્યશ્રીએ સિદ્ધાચળની ચાત્રા કરી સુંખદી તરફ આવવા લાવના હશ્યોવી.

‘કૃપાળુ ! આપ સિદ્ધાચળ પધારો છો તે જાણી અત્યંત આનંહ થયો. જસહણમાં અમારા ત્રણ નિવાસગૃહ તૈયાર થવા આંધ્યા છે. તેનું વાસ્તુ લેવાનું છે અને આપશ્રીના પગલાં ત્યાં કરાવવા અમારો ખાસ ભાવ છે. મારા પૂજય પિતાશ્રી, મારા પૂજય કાકાશ્રી તથા મારા વડીલ બંધુ શ્રી કુલચંહલાઈનો પણ તે માટે ધાર્ઘો આશ્રહ છે.’ શ્રી હરિચંહલાઈએ આશ્રહ લરી વિનિતિ કરી.

‘હરિચંહલાઈ ! શ્રી વીરચંહલાઈ તો મહાભાગ્યશાળી અને બડભાગી છે. તેમણે તો કુદુંબના પ્રત્યેક બાળકના શિક્ષણ-સંસ્કાર અને જીવનવિકાસ માટે ભારે જહેમત ઉઠાવી છે. બધાને પોતેજ ધંધાની તાલીમ આપી છે એટલું જ નહિ પણ નાની ઉંમરમાં તમને ધીકરી પેઢીનો કારોબાર સેંપી નિવૃત્ત થયા છે. એટલું જ નહિ પણ પોતાના જ નાનકડા ગામમાં

સેવા અભિતિદ્વારા સેવાનો હીથ પ્રગટાયો છે. તમારી લીલમ લીલી વાડી પાંચ બાઈઓનું વિશાળ કુંઠા, તમારી ધર્મભાવના, સાહંગી, સૌભ્યતા તથા ઐક્યતા જોઈને તો આદર્શ કુંઠાનું દર્શાન થાય છે. તમારી હંપતીની ધર્મશ્રદ્ધા અને શુદ્ધભક્તિ તો અનુપમ છે. સૌરાષ્ટ્રમાં તીર્થોધિરાજના દર્શાને આવવાનું થશે ત્યારે જરૂર તમારે ત્યાં આવવાનું રાખીશું. સમદીયાળા પણ જોવાની ભાવના છે.’ આચાર્યશ્રીએ આનંદથી સંમતિ દર્શાવી.

‘શુદ્ધેવ ! આપે તો ચૂર્મમાં ધર્મનો ધણ્ણો સારો ઉધોત છેં. અમારા ધણ્ણા કુંઠાઓમાં સાચી શર્દી ઉત્પત્ત થઈ છે. હવે કુપા કરી આપ આપના પૂર્વનેના આ મનોહર ઉપાશ્રયમાં વિશેષ સ્થિરતા કરો. આ વૃદ્ધાવસ્થામાં ચૂર્મને લાભ આપો.’ શેઠ ચંપાતાલણુંએ વિનતિ કરી.

‘ભાગ્યશાળી ! થાણુાની પ્રતિષ્ઠા કરવાની મારી જવાબદારી છે. તીર્થોધિરાજની યાત્રાની પણ ભાવના છે. વૃદ્ધાવસ્થા છે એટલે સ્થિરતા કરવાની તમારી વિનતિ તો બરાબર છે પણ સાધુ તો ચલતા ભલા. જે ધર્મ પ્રધોત થઈ શકે તે કરતા રહેવાની અમારી પ્રથમ ફરજ છે. વળી પૂર્વનેનો ઉપાશ્રય, હાઠાવાડી ઉપાશ્રય, વગેરેની સારસંભાળ શુદ્ધયેં તમને સોંપી છે’ તો તમે તે બધું જ્યથાસ્થિત રાખશો. અને ધર્મશ્રદ્ધા જવલાંત રાખશો એજ મારી ભલામણું છે. ચૂર્મનું સં. ૨૦૦૦ નું પર સું ચાતુર્માસ આનંદપૂર્વક પૂર્ણ કરી આખાએ શહેરના અહેન-શાઈઓની કાવભીની વિહાય કથ વિહાર કર્યો.





## બીકાનેર અને તીર્થયાત્રા-સંધ

( ૪૦ )

‘ હ્યાળુ ! સંવેગી દીક્ષા પછી આપ બીકાનેર પદ્ધાર્યો નથી. બીકાનેરમાં શ્રી મહેશ્વરાગરલુ મહારાજના ઉપહેશથી ઉપદ્ધાનતપનો કાલ બીકાનેરમાં થયો છે. અમારા શ્રી સંધની ઈર્બણ છે કે આપશ્રીના હસ્તે માળની કિંયા થાય તો આનંદ આનંદ થઈ જાય.’ સાહિત્યપ્રેરી હાહાસાહેણના લાકૃત શ્રી અગરચંડલુ નાહટાએ નાગોરમાં વિનતિ કરી.

‘ ભાગ્યશાળી ! બીકાનેર તો હું બહુજ ચાઠ છે’ છું. યતિ અવસ્થામાં ચૂઢથી હું બીકાનેર જ આવ્યો હતો. મારી ભાવના તો સિદ્ધાચળ જવાની છે. પણ બીકાનેરના શ્રી સંધના આશહને પણ માન આપવું રહ્યું. સ્થળી પ્રહેશમાં કરી કરી હું વિશેષ થાકી ગયો છું છતાં પ્રાયઃ હું બીકાનેર આવીને સિદ્ધાચળ જઈશ. આચાર્યશ્રીએ ખુલાસો કર્યો.

‘ શુરૂદેવ ! આપશ્રીના પગલાં બીકાનેર થશે તો ભીજ પણ ખમંઉદોતના કાચો થશે. આપને અનુકૂળતા હોય અને સુખશાતા રહે તેટલો જીમય જ અમે રોકીશું પણ નાગોર જેટલો

આંધ્રા છો તો બીકાનેર છોડીને કેમ જવાય !' શ્રી અગરચંહલુનાહટાએ વિશેષ વિનતિ કરી.

'જહાસુખમું ! તમારી ભાવના પ્રમાણે બીકાનેર આવીને પછી સિદ્ધાચળ જઈશું ' આચાર્યશ્રીએ સંમતિ આપી.

'સાહેબ ! બીકાનેરના સંધને તો આપના આગમનના સમાચાર ભાણી ખૂબ આનંદ થશે. અમારો ઉપધાનની માળનો ઉત્સવ શોલી ઉઠશે. શ્રી મણીસાગરજી મહારાજને પણ વિશેષ આનંદ થશે.' નાહટાલુએ આનંદ પ્રરૂપિત કર્યો.

આચાર્યશ્રીએ ચૂક્યી વિહાર કરી રતનગઢ, સુજાનગઢ, ડેહગામ આહિ આમાનુચામ વિચરતા નાગોર પદ્ધાર્યો. નાગોરના શ્રીસંઘે ભાવભયું સ્વાગત કર્યું. નાગોરમાં થોડા હિવસ સ્થિરતા કરી. નાગોરમાં સાહિત્યપ્રેમી શ્રી અગરચંહલુનાહટા બીકાનેરના સંધ વતી વિનતિ કરવા આંધ્રા. આચાર્યશ્રીએ બીકાનેરની વિનતિ સ્વીકારી.

નાગોરથી ગોગોલાવ, નોખામંડી, ભીનાસર, ગંગાસર પદ્ધાર્યો. ભીનાસર બીકાનેરનો ચતુર્વિધ સંધ આચાર્યશ્રીની સામે આયેલા. બીકાનેરનો પ્રવેશ ધામધૂમપૂર્વક થયો. સંધના આભાલ-વૃદ્ધમાં આનંદ આનંદ છબાઈ રહ્યો. લુનાલયોના ફર્શન કરી શ્રી નાહટાલુની ભાવભરી વિનતિથી આચાર્યશ્રીએ અગરચંહલુનાહટાના નવા મકાનમાં સ્થિરતા કરી. અહીં શ્રી મણીસાગરજી વિનયસાગરલુના મિલનથી આનંદ થયો. ઉપધાનતપના વિધાનની ડિયા આનંદપૂર્વક ચાલી રહી છે. કોકોને ધર્મપ્રત્યે ઉત્સાહ જેહને આચાર્યશ્રીને આનંદ થયો, આચાર્યશ્રી

હંમેશાં જુડા જુડા લુનાલ્યોના દર્થેન કરવા જાય છે અને ઉપધાનના તપસ્વીએને કોઈ કોઈ હિવસ પ્રવચન સંભળાવે છે:

આજે ચતુર્દશી હતી, વ્યાખ્યાન ચાલતું હતું. આજે ઘણું આગેવાને હાજર હતા. આચાર્યશ્રીએ તક જોઈને કહું.

‘લાગ્યવાનો ! બીકાનેર તો રાજસ્થાનનું સુપ્રસિદ્ધ ધામ છે. બીકાનેરના ધર્મપ્રેર્ણી સરદારો વિદ્યાપ્રેર્ણી પણ છે અને સમૃદ્ધિશાળી છે. તમારામાં ધર્મજાગૃતિ પણ સારી છે. શાળા-પાઠશાળા-સ્કૂલ, જ્ઞાનમંહિર વગેરે પણ તમે ચલાવો છો. તમારા શહેરમાં કલામય મનોહર મંહિરો છે અને જ્ઞાનકંડારો પણ છે પણ શ્રી નેમીનાથ-લુનું મંહિર લણું થઈ રહ્યું છે. જે શહેરમાં લક્ષ્મીનાનો વસતા હોય, જે શહેરની ધર્મભાવના પ્રક્ષિદ્ધ હોય, જે શહેરમાં હળવેના હાન થતાં હોય તે શહેરના મંહિરના લણોદ્ધારને માટે આવી ઉદ્ઘાસીનતા શોલે ખરી ! એક જ લાગ્યવાન તેનો લાભ લઈ તીર્થંકર જોત્ર બાંધી શકે છે.’

આચાર્યશ્રીના સુધાર્યો વચ્ચેનોની ભારે અસર થઈ. શ્રી સંદે શ્રી નેમીનાથના મંહિરના લણોદ્ધાર માટે નિર્ણય કર્યો. આચાર્યશ્રીના જ્યનાહોથી ઉપાશ્રય શુંલુ ઉઠ્યો.

‘સાહેબ ! અમારી શ્રી સંધની ભાવના છે કે શ્રી ભણી-સાગરલુ મહારાજને ચોંધ્ય પહોંચાનથી વિભૂષિત કરવા. આપશ્રી જેવા થાણું તીથોદ્ધારક દીર્ઘતપસ્વી આચાર્યશ્રી બીકાનેર પધાર્યો છો અને શ્રી ભણીસાગરલુ મહારાજે પ્રેરણું આપી બીકાનેરમાં ઉપધાન તપ આદિ ધર્મ ઉધોત કરાવ્યો છે તો આપશ્રીની સવાહ શું છે !’ બીકાનેરના આગેવાનોએ પ્રાર્થના કરી.

‘આગવાનો। શ્રી મહીસાગરજી મહારાજ તો શાંતમૂર્તિં છે. મારી તો તે માટે સંમતિ જ હોય પણ તમે શ્રીસંઘના નાના-મોટા આગેવાનો બરાબર વિચારી કેશો. આવા કાર્યમાં ડેઇનો પણ વિરોધ ન જ હોય પણ સંઘના ખંધારણું પ્રમાણે નિર્ણય કરી કૈવો સારો. તમે તો જણો છો આપણા સમાજમાં વિક્ષસંતોષીએ બહુ છે. અને ધર્મ-કાર્યમાં યણ તેઓ વિક્ષો લાવે છે.’ આચાર્યશ્રીએ માર્ગદર્શિન આપ્યું.

શ્રી સંઘના આગેવાનોને આચાર્યશ્રીની સલાહ ઉપયોગી લાગી અને સંઘની સંમતિ મેળવવા નિર્ણય કર્યો.

માળારોપણુંનો ઉત્સવ આરંભાયો. ધીકાનેરમાં ઉપધાન કરનાર આગ્યશાળીએના કુટુંભીજનો આવવા લાગ્યા. મંડપની રથના કરવામાં આવી. માળની ઘોલી ઉત્સાહપૂર્વક ઘોલાઈ ગઈ અને હંજારો બહેન-ભાઈએ મંડપમાં ઉમટી આવ્યાં.

ભાળ શ્રદ્ધાચારી ઉત્ત્રતપસવી થાણું તીર્થોદ્વારક આચાર્યશ્રી જિનત્રાદ્વિસ્તરજીના અધ્યક્ષ સ્થાને ઉત્સવ આરંભાયો. શ્રી મહીસાગરજી મહારાજ, પં. શ્રી રંગવિમલજી મહારાજ, શાસન સાંક્રાટ શ્રી વિજયનેમીસૂર્યિક્ષરજી મહારાજના શિષ્ય શ્રી મેરુવિજયજી મહારાજ, તપાગચ્છના વિક્ષાન સાધી કી હેવશ્રીજી મહારાજ, તથા અરતરગચ્છનો સાધી સમૃદ્ધાય વગેરે સમક્ષ માળારોપણુંનો વિધિ શરૂ થયો.

આચાર્યશ્રીએ કિયા કરાવી. બધાએ આનંદ-ઉત્સાહપૂર્વક માળાએ પહેની. આખાતવૃદ્ધમાં અનંદની ઉમિંએ ઉછળી રહી. જ્યાનાહોથી મંડપ શુંજ રહ્યો.

સાહિત્યપ્રેમી શ્રી અગરચંદળ નાહટા આચાર્યશ્રીની આજા લઈને ઉલા થયા. નાહટાજીએ ઉપધાન તપ શું છે! ઉપધાનની કિયાનું રહસ્ય શું છે! ઉપધાન તપ શ્રાવક-શાવિકાની કરણીનો મૂળ પાચો છે. જે જે ભાઇ બહેનોએ શાંતિપૂર્વક ઉપધાન તપની આરાધના કરી છે તે ધન્યવાહને પાત્ર છે. આચાર્યશ્રી લનત્રદ્વિસૂરીજી રસ્તાના વિહારની તકલીફી વેઢીને ખીકાનેરના શ્રી સંધના આખાતવૃદ્ધને અમૃત દેશનાને. તથા માળારેપણ કિયાનો જે લાલ આપ્યો છે તે માટે શ્રી સંધ આચાર્યશ્રીનો ઝણી રહેશે. ખીકાનેરમાં આવા પ્રકારના ઉત્તમ ઉપધાન તપતું ઉધાપન કરવીને જે ધર્મઉદ્ઘોત કર્યો છે તે માટે શ્રી મણીસાગરજી મહારાજને. ખીકાનેર ઉપર ધર્મા મેટો ઉપકાર છે. ઉપરાંત શ્રી મણીસાગરજી મહારાજે આપણા પૂર્વીચારો સામે કરેલા અપલાપોના શાખદિષ્ટો જડભાતોડ જવાખ આપીને શાસનની શોલા વધારી છે. ખીકાનેર શ્રી સંધની ભાવના છે કે શ્રી મણીસાગરજી મહારાજને યોગ્ય પહ્લવીથી અવંકૃત કરવા.

‘સાહિત્યપ્રેમી શ્રી અગરચંદળ નાહટાએ જે પ્રસ્તાવ શ્રી સંધ સમજ્ઞ રજુ કર્યો છે તેને મારું હર્દિક અનુમોદન છે. શ્રી મણીસાગરજી મહારાજ સુયોગ છે અને તેઓ શ્રીને આચાર્ય-પહ્લવી આપવા શ્રી સંધના આગેવાનોની ભાવના છે. આશા છે આપ સૌ સંમત થશો.’ શ્રી શેઠ કેરનાનજી ડોડારીએ અનુ-મોદન આપ્યું.

શ્રી સંધના આખાતવૃદ્ધે જ્યનાહોથી તે પ્રસ્તાવને વધાવી દીધો, આનંદના મોણ ઉછળી રદ્ધાં, હર્ષની રેલરેલાણી.

આચાર્યશ્રી લુનકરંદ્રિસ્તુરિજીના અધ્યક્ષ સ્થાને વિજય સુહૃત્તમાં શ્રી સંઘે શ્રી મહીસાગરજી મહારાજને આચાર્યાં પદનો વાસ્થેપ કરી હર્ષનાદો વર્ણે ચાહર ઓઠાડી જયનાહોથી મંડપ ગુંજુ રહ્યો. આનંદ ઉત્સાહ વર્ણે પ્રભાવના લઈ સૌ વિખરાયા. અપોરના અષ્ટોતરી સ્નાત થયું.

‘સાહેબ ! મારી ભાવના શ્રી મેડતા ફ્રેનોધી તીર્થ યાત્રાને છરી પાળતો સંઘ કાઠવાની છે. સુનિરાજશ્રી મેડવિજયજી મહારાજની તે માટે પ્રેરણ છે. આપશ્રી અતે પદ્માયો છે. અમને આપના અમૃતવચનોનો લાલ મળશે. આપ કૃપા કરી અમારા સંઘમાં પદ્મારો તો અમને ખૂબ આનંદ થશે.’ શીવ-ભક્તાંદ્રિસુરિ વિનતિ કરી.

‘ભાગ્યશાળી ! તમારી ભાવના ઉત્તમ છે. મારી ભાવના જેસલમેરની યાત્રા કરવાની છે પણ સ્થળી પ્રદેશના લાંબા વિહારાથી મારી તરીયત બગડી છે. બીકાનેર થોડો વખત તરીયત ઠીક રહી પણ હમણાં અશક્તિ વિશેષ જણ્ણાય છે.’ આચાર્યશ્રીએ ચોતાની તરીયત નરમ હોવા વિષે ખુલાસો કર્યો.

‘શુક્રહેવ ! આપશ્રી તો ત્રણે ઋતુમાં તપશ્ચર્યા ચાલુ રાખો છે. ઉનાળામાં પણ આપના અફુમ ચાલુ હોય છે. કૃપા કરી આપ તપશ્ચર્યા તરીયત સારી થાય ત્યાંસુધી જરા ઓછી કરો. તો સારું. સંઘમાં આપને બધી અનુકૂળતા રહેશે. અમને બધાને આનંદ થશે.’ શ્રી દક્ષતરીએ વિશેષ વિનતિ કરી.

આચાર્યશ્રીની ભાવના જેસલમેર તરફ યાત્રાએ જવાની હતી પણ તરીયત સારી રહેતી ન હોવાથી મેડતા ફ્રેનોધિના

સંધમાં જવા વિચાર કર્યો. આચાર્યશ્રી સંધમાં પદ્ધારે છે તે સાંલળી બધાને ખૂબ આતંક થયો. શુભ હિને સંઘે પ્રયાણ કર્યું. શહેર બહાર શ્રી પાર્થીચંદ્રસૂરિલુના બગીચામાં પ્રથમ મુકામ કર્યો. આપો દિવસ પરિશ્રમ પડ્યો. તથા ધૂપમાં ફરવાનું થવાથી આચાર્યશ્રીને તાવ આવી ગયો. તાવ વધીને ૧૦૪ ડીશી થઈ ગયો. સંધવી તથા પીળ આગેવાનોને ભારે ચિત્તા થવા લાગી. આચાર્યશ્રી તો બહુ જ નિંખિત હતા. રાત્રિના એ વાગ્યે ઉડીને ધ્યાનમાં બેસી ગયા. સવારના પ્રતિક્રિયા આહિ પતાવી પાડ કરીને તૈયાર થઈ પૂછવા લાગ્યા કે સંધના પ્રયાણુને કેટલી વાર છે ? બિમારી અને તાવ કર્યાંથે ચાલ્યાં ગયાં. બધા આ ચમત્કારથી ચક્કિત થઈ ગયા.

સંધવીએ તથીયતના ખખર પૂછ્યા. તાવની અશક્તિને લીધે આરામની જરૂર હોય તે. એ દિવસ પછી નીકળીએ પણ આચાર્યશ્રીએ તો કહ્યું કે તાવ છે જ કયાં ! ધર્મકાર્યમાં વિલંબ હોય જ નહિ. સંધ લીનાસર આવ્યો. લીનાસરમાં ત્રણ દિવસ સંઘે સ્થિરતા કરી. અહીં શેઠ ચંપાલાલજી, શેઠ સોહનલાલજી કર્ણાવટ, શ્રી બાદરમલજી બાંઠીયા આહિએ સંધને જમણું. આચાર્યશ્રી તો તાવમાં પટકાઈ પડ્યા. બધાને ચિત્તા થવા લાગી. વયોવૃદ્ધ વૈઘને બોલાવ્યા. તેમણે સલાહ આપી કે વિશેષ પરિશ્રમને લીધે તાવ તથા અશક્તિ છે. આરામની ખાસ જરૂર છે. બધાએ આચાર્યશ્રીને વિશ્રાંતિ લેવા વિનતિ કરી પણ સવારના પ્રયાણુના સમયે આચાર્યશ્રી તૈયાર થઈને આગળ ચાલ્યા. બધા તો ચક્કિત થઈ ગયા.

સંધીએ પ્રાર્થના કરી કે આપશી હમણાં એ હિવસ વિશ્રાતિ લ્યો પણી પધારશો. અમે પણ આપને માટે આગળ રોકાઈ જઈશું. આચાર્યશ્રીએ કહ્યું તાવ છે જ કૃયાં! આગળ વિશ્રાતિ લઈશું. યાત્રાનો અંતરાય મારા કારણુથી કોઈને ન થયો જોઈએ. ધીમે ધીમે યામનુથામ ફરતો ફરતો સંઘ ગોગોલાવ આવી પહોંચ્યો. આચાર્યશ્રીને તાવ તો ચાહુ જ હતો. હિવસ ભર તાવ રહે અશક્તિ અને તાવને લીધે ગોચરીમાં કાંઈ લેવાય નહિં-રત્ને તાવ હોય પણ ધ્યાનમાં એસે અને સવારના પ્રયાણ સમયે તાવ પણ દેખાય નહિં અને શક્તિ પણ લાગે, ધીમે ધીમે ગોગોલાવ સુધી તો આવી પહોંચ્યા. આચાર્યશ્રીને લાગ્યું કે મારે લીધે શ્રીસંઘના બધા લાઈ બહેનોને તકલીફ પડે છે. તાવ પીછો છોડતો નથી તો હવે સ્થિરતા કરીને સંઘને વિલંબ થાય તેમ ન કરવું, સંઘપતિને બધી હક્કી કરત જણાવી. સંઘપતિ અને આગેવાનોને બહુ હુંઅ થયું કે આચાર્યશ્રી અશક્તિના કારણે નહિં આવી શકે પણ બીજે ઉપાય નહોંતો. પણ સવાર થયું ત્યાં તો આચાર્યશ્રી કેડ બાંધીને તૈયાર હતા. બધા આશ્રીય ચક્કિત થઈ ગયા. આચાર્યશ્રીનું યોગયણ અને મજ્જેમતા જોઈ બધાના હિવિમાં નવા પ્રાણ પૂરાયા. સંઘ નાગોર આવ્યો. નાગોરના શ્રીસંઘે ભાવભયું સ્વાગત કર્યું. નાગોરમાં આચાર્યશ્રીની તથીયત વિશેષ ખરાખ રહેવા લાગી.

‘ શુરૂદેવ ! આપશીને આપો હિવસ તાવ રહે છે. અશક્તિ પણ ઘણી છે. ગોચરીમાં કાંઈ લેવાતું નથી. સંઘ માટે આપ સવારના તૈયાર થઈ જાઓ છો. પણ હિવસે હિવસે નથળાઈ વધતી જાય છે. હવે કૃપા કરી અમને આશીર્વાદ આપો. આપના પુણ્ય

પ્રભાવથી સંધ કુશળતાથી તીર્થ યાત્રાએ કરશે. આપણું ચોગભળ જળભર છે. પણ હવે નાગોરમાં સ્થિરતા કરો. ઔષધ અને આરામથી તથીયત સારી થયા પછી જ આગળ વિહાર કરશો.’ સંધવીજુએ પ્રાર્થના કરી.

‘સાહેબ ! સંધવીજુ કહે છે તે ખરાખર છે. શરીર ધાંખું હુર્ઝણ થઈ ગયું છે. નાગોરને આપણી સેવાનો અને વ્યાપ્યાનવાણીનો લાભ મળશે. આપ કૃપા કરી અહીં સ્થિરતા કરો. અમારા શીસંધને આનંદ થશે.’ નાગોરના આગેવાને સ્થિરતા માટે વિનિતિ કરી.

સંધવીજુ તથા નાગોરના આગેવાનોની વિનિતિને માન આપી તથીયતના કારણે આચાર્યશ્રીએ નાગોરમાં સ્થિરતા કરી. સંધે આગળ પ્રયાણુ કર્યું. આચાર્યશ્રીએ સંધવીજુ તથા શ્રી સંધને ભર્ગળ આશીર્વાદ આપ્યા. નાગોરમાં ઔષધ અને આરામથી ધીમે ધીમે તાવ થયો. અને શક્તિ આવવા લાગી. નાગોરમાં વ્યાપ્યાનોદ્વારા સારી ધર્મપ્રભાવના થઈ.

‘ગુરુદેવ ! ગોગોલાવ પાસે જ છે. સાધુ સાધ્વી વિહારમાં અમારે ગામ પધારે છે પણ વિહારની ઉતાવળમાં ડેઈ સ્થિરતા કરતા નથી. ધર્મભાવના તો ધણી છે પણ દેવ-ગુરુની જોગવાઈ વિના ધર્મભાવનામાં વૃદ્ધિ થતી નથી. આપશી પધારો તો અમારામાં ધર્મનગૃતિ આવશે અને આપણી અમૃત વાણીનો લાભ મળશે.’ શ્રી લેઝાનજુ ઓથરાએ વિનિતિ કરી.

‘લાગ્યશાળી ! તમારી ભાવના તો ધણી સારી છે. હું જરૂર ગોગોલાવ આવું’ પણ પ્રલુદર્શન વિના શું થાય !’ આચાર્યશ્રીએ સુશ્કેલી હશોવી.

‘કૃપાળુ ! આપ પધારશો તો પંચતીર્થી તથા સિદ્ધચક્ષુની વ્યવસ્થા કરીશું. આપ જરૂર પધારો.’ એથરાળુએ વચન આપ્યું.

‘સાહેબ ! ગોગોલાવમાં ધર્મભાવના સારી છે, પંચતીર્થી તથા સિદ્ધચક્ષુનું અમે નાગોરના ફેરાસરાળુમાંથી આપીશું.’ નાગોરના આગેવાને મુશ્કેલીનો ઉકેલ હશોંયે.

‘શુકન તો સારાં થાય છે. હવે તો કાયમી ફેરાસર જ કહાચ થઈ જશે.’ એથરાળુએ અવિષ્યવાળી કહી સંભળાવી.

‘ભાગ્યશાળી ! કહાચ શું ! હવે તો ફેરાસરાળુ થયું જ અમનો. ધર્મભાવના પ્રદિપ્ત રાખવા ગામેગામ નાના નાના મંહિરો તો હોવાં જ જોઈએ.’ આચાર્યશ્રીએ મજૂમતા હશોંની.

‘હ્યાસાગર ! આપ હીધેતપસ્વી, પુષ્યરાશી આચાર્યપ્રવરની સુધાવાણીમાં જાહુ છે. અમારી વર્ષોની મનોકામના પૂરી થશે જ.’ એથરાળુએ પોતાના હૃહયની વાત રણુ કરી.

આચાર્યશ્રી ગોગોલાવ પધાર્યો. ગોગોલાવમાં પ્રભુદર્શન માટે વ્યવસ્થા ન હોવાથી નાગોરથી પંચતીર્થી તથા સિદ્ધચક્ષુનું આવી શયાં. ગોગોલાવના ભાઈ-ભણેનોને આનંદ થયો. સવાર-સાંજ હશેન, પૂણ, ભાવના આદિનો લાલ બધા લેવા લાગ્યા.


આજે અષ્ટમી હતી. બધા ભાઈ-ભણેનો વ્યાપ્યાન સાંભળવા આવેલા. આચાર્યશ્રીએ તક જોઈને વાત ઉપાડી.

‘ભાગ્યવાનો ! તમારું ગામ કલે નાનું છે પણ તમારી ધર્મભાવના ઘણી પ્રખળ છે. જૈન ધર્મ જેવા ચિંતામણી

રતનની પ્રાપ્તિ છતાં પ્રલુદ્ધર્થન માટે સાધન ન હોય તો ધર્મના સંસ્કાર ક્યાંથી ટકે ! વેપાર અને આતું-પીતું તો છે જ. પણ જીવનમાં ધર્મ નહિ હોય તો આ માનવશવ હારી જવાના. તમારામાં કેટલાક ભાગ્યશાળી પણ છે જેને પરમાત્માએ એ પૈસા આપ્યા છે. તો સુકૃતની લક્ષ્મીનો સદ્ગુપ્ત્યોગ કરો. આ પણ તમારા અને તમારા બાળકોના આત્મકલ્યાણ માટે છે. પ્રલુદ્ધર્થન, પ્રલુદ્ધ પૂલથી આત્મશુદ્ધિ અને આત્મશાંતિ મળે છે. ભેં તો અહોં આવતાં પહેલાં શ્રી યોગરાજુને એજ વાત કહી હતી, અને હું માતું છું તમે નાનકડા મંદિર માટે જરૂર વિચાર કરશો. ’

આચાર્યશ્રીની અમૃતવાહિની લારે અસર થઈ. બધાના મનમાં ભાવનાની લહેર લહેરાણી. લહેરાસરળ માટે થોડા જ સમયમાં રૂ. ૨૫૦૦૦) થઈ ગયા. આચાર્યશ્રીની પ્રેરણું દ્રુણી. લહેરાસરનું કામ ચાલુ થઈ ગયું. શેઠ લેઝદાનળ તથા શેઠ હીરાચંહણુએ જવાખારી ઉપાડી. આખાલવૃદ્ધમાં આનંદ આનંદ થઈ રહ્યો.





## મધૂરાં મિલન

( ૪૧ )

‘સાહેબ ! પંબણકેસરી આચાર્યશ્રી વિજય વલ્લભ-સૂર્યિલુના શિષ્ય આચાર્યશ્રી વિજય લલિતસૂર્યિ અતે પધારે છે.’ સંધના આગેવાને સમાચાર આપ્યા.

‘બહુ આનંદની વાત છે. મહિદ્ધરના ઉદ્ઘારક આચાર્યશ્રીનો યોગ્ય સતકાર થયો. જેઠાં નાના મોટા અધ્યાત્મેમના સંમાન અર્થે ચાલો. હું પણ સુનિયોને લઈને આવું હું.’ આચાર્યશ્રીએ આનંદ પ્રદર્શિંત કર્યો.

ગોગોકાવના આગેવાનો તો આચાર્યશ્રીનો આવો વિનય અને સરળતા જેઠાં અકિત થઈ ગયા. દીર્ઘ તપસ્વી, વયોવૃદ્ધ ચોગચાધક હોવા છતાં કેવું નિર્મણ સ્ક્રિટિક જેવું હૃદય અને ઉદ્ઘાર બાવના છે !

ધામધૂમપૂર્વક આચાર્યશ્રી લલિતસૂર્યિનો પ્રવેશ કરાયો. અને આચારીના પ્રેમકાયો મધૂર મિલનથી પરસ્પર આનંદ આનંદ થઈ રહ્યો. ગુડવર્ય પંબણકેસરીની સુખશાતા પૂછી. મહિદ્ધરની સંસ્થાઓની પરિસ્થિતિ પૂછી અને સમાજના અનેક

પ્રક્રો વિષે વાર્તાવાપ થયો. આપણું અરિત્રનાયકની સૌભ્યતાથી આચાર્યશ્રી વિજય લખિતસૂરિલુને પણ ખૂબ આનંદ થયો. જુદા જુદા ગચ્છના આચાર્યો ડેવો પ્રેમભાવ હશાવે છે. બધા આચાર્યો-મુનિવરોમાં આવો જ પ્રેમભાવ હોય તો જૈનશાસનનો જ્ય જ્યકાર થઈ રહે.

ગોગોલાવથી આચાર્યશ્રી નાગોર પધાર્યો. નાગોરમાં હાહાવાડી સુપ્રસિદ્ધ છે. સત્તરમી સહીના મહાનશાસન પ્રભાવક તથા મુગલ સંગ્રહાલાલ અનુભૂતિ કરી રહેલાં હાહાવાડી જ્યંતી હર વધેં નાગોર ઉજવે છે. પચાસ હજાર નૂરન જૈનો બનાવનાર શ્રી જીન કુશળસૂરીશ્વરલુની જ્યંતી પણ ઉજવાય છે, પણ બડા હાહા તરીકે સુપ્રસિદ્ધ એક લાખ ત્રીસ હજાર જૈનો બનાવનાર જૈનશાસન પ્રભાવક શ્રી જીનદત્તસૂરીશ્વરલુની જ્યંતી માટે પ્રબંધ ન હોવાથી આપણું અરિત્રનાયકે શોઠ મીસરીમલલુને ઉપરેશ આપી રૂ. ૧૫૦૦ ની રકમ વ્યાજે મૂક્ખાવા પ્રબંધ કર્યો. હવે હર સાલ અશાડ શુદ્ધ ૧૧ ના હિવસે હાહાસાહેણની પાલખી સહિત વરદોડા નીકળે છે. હાહાસાહેણની પૂજા લણ્ણાવાય છે તથા રાત્રિ જગરણ પણ થાય છે. આચાર્યશ્રીને ચાતુમોસ માટે આગ્રહ કર્યો પણ આચાર્યશ્રીએ તો સ્પષ્ટ જણાયું કેનુંતમારા નાતનાતના અગડા ધર્મંકાર્યમાં લાવો છો તે છીએ નથી. જૈનશાસનના અને તમારા સંઘના ઉઘોત માટે તમારે એકદ્યતા અને સંગઠન સાધીને કાર્ય કરવાની જરૂર છે. આચાર્યશ્રી નાગોરથી વિહાર કરી ઇલોધીની યાત્રા કરી આમાતુથામ વિહાર કરતા કાપરડાળુ પદ્ધાર્યો, કાપરડાળુ તીર્થની યાત્રા કરી યાદી થઈ શુંઢોય, સાંડેરાવ,

શિવગંજ, સિરોહી, નાંદીયા પધાર્યા. નાંદીયા તીર્થને લુણોદ્વાર માટુંગાના ધર્મનિષ્ઠ શા છગનલાઈ હેવાળની ઉત્તમ પ્રેરણથી થયેલ છે. નાંદીયા મનોરચ્ચ તીર્થ છે.

નાંદીયાથી ધનારી થઈને ભીમાણુ તરફ વિહાર કર્યો. ભીમાણુમાં હલેરાસરળ ઉપર નૂતન ધ્વળ હંડ ચઢાવવાને હતો. ધનારીના શ્રી પૂજ્યાલુએ સુહૃત્તં પણ કાઢી આપેલું પણ ભીમાણુના આગેવાનોની ઘણી ઘણી તપાસ છતાં કોઈ હિંયા કરાવનાર ન મળવાથી; બધા ઉદ્ઘાસ હતા. હવે શું કરીશું તેમ વિમાસણમાં હતા, ત્યાં સમાચાર આવ્યા કે દીર્ઘાતપસ્તી આચાર્ય. પ્રવર શ્રી જીનકંડદિસુરણુ મહારાજ પધારે છે. બધાને અત્યંત આનંદ થયો. અધિકાયક હવે જ કૃપા કરીને બરાબર પ્રસંગે જ શુદ્ધેવને મોકલ્યા તેમ બધા ચક્કિત થયા. આચાર્યશ્રીનું ભાવભીતું સ્વાગત કર્યું. સંઘના આગેવાન શા કુચાળ જેચાંચાળ, શા મૂળચાંચાળ, શા ગોવિંદરામાળ, શા લગરાજાળ, શા ભભૂતમલાળ બધાએ મળીને અફૂઈમહોત્સવ કર્યો. આચાર્યશ્રીએ વિધિ વિધાનપૂર્વક હર્ષનાહેની વચ્ચે ઈડું તથા ધ્વળ-હંડ ચઢાવવાની હિંયા કરી. આભાવવુદ્ધમાં આનંદ આનંદ છલાઈ રહ્યો.

ભીમાણુથી આમાનુંગ્રામ વિહાર કરી પાલણુપર પધાર્યા. પાલણુસરના શ્રી સંઘની ચાતુર્માસ માટે પ્રાર્થના હતી. પણ અંભાતના શ્રી સંઘનો ચૂર્ણ જતાં આશ્રહ હેવાથી વિહાર કર્યો. મહેસાણા થઈ અમહાવાહ પધાર્યા. અમહાવાહ પણ ચાતુર્માસ માટે વિનતિ થઈ પણ અંભાત વચ્ચે આપેલું તેથી વિહાર કરી એડા, માતર પધાર્યા. અહો એડા તથા માતરના શ્રી સંઘની

આતુર્માસ માટે અત્યંત આગ્રહ ભરી વિનિથિઈ, માત્ર જેવા શાંત તીર્થસ્થાનમાં એક ચાતુર્માસ કરવા આચાર્યશ્રીની લાવના થઈ પણ ખંભાતના નગરશેઠ શ્રી ચંહુલાલભાઈ આવી પહોંચ્યા અને ચૂર જતાં જે વચન આપેલું તેની યાદી આપી તેથી ખંભાતની વિનિસ્વીકારી આચાર્યશ્રીએ માતરની યાત્રા કરી વિહાર કર્યો. આચાર્યશ્રી ખંભાત આપી પહોંચ્યા. પાંચ જાતિના શ્રી સંઘોએ લાવલચું સ્વાગત કર્યું. સંધમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.

ખંભાતનું ચાતુર્માસ ધર્મઉદ્ઘોતથી ઉજવળ થયું. તપશ્ચર્યા પણ ધર્ષી સારી થઈ.

ગોલવડખંડરના શા પૃથ્વીરાજલુ તથા શા જસરાજલુ તથા શા કુલચંહલુ તથા શા રાયચંહલુ, સુરતથી શા ક્રીરચંહ મગનલાલ બહામી તથા મુખ્યાઈના આગેવાનો આ પ્રસંગે આચાર્યશ્રીના દર્શનાર્થે આંદ્રા હતા. આચાર્યશ્રીની પ્રેરણુથી માણોકચોકના ઉપાશ્રયનો જીણોઢાર શરૂ થયો હતો. તે આ ચાતુર્માસમાં પૂર્ણ થયેલો જેઈને આનંદ થયો. સં. ૨૦૦૧ તું પત સું ચાતુર્માસ ખંભાતમાં આનંદપૂર્વક પૂર્ણ થયું.

આ ચાતુર્માસમાં આનંદપૂર્વક મિલન થયું તે ખરેખર મધુર અને અતુપમ હતું. શેઠ સુળચંહલાઈ જુલાભીદાસના ઉપાશ્રયે સૂર્યિસાટ આચાર્યપ્રવર શ્રી વિજયનેમીસૂરીધરલુ મહારાજ તથા આચાર્ય શ્રી વિજયનંહનસૂરિલુ મહારાજ તથા આચાર્ય શ્રી વિજય ઝાંદ્રિસૂરીલુ ઉપ ઠાણુા સાથે બિરાજમાન હતા. ભાહરવા શુદ્ધ પાંચમના હિવસે રથયાત્રા નીકળી. શ્રીમાન સૂર્યિસાટ તથા

તેમના વિદ્યાન આચાર્ય પ્રવરો, શિષ્ય પ્રશિષ્યો, સાધ્વીલુંઝો તથા ખંભાતના સંઘના આગેવાનો, ખંભાતના હિવાનસાહેબ, અધિકારીવર્ગ, જૈનસમાજના ખણેન-ભાઈઓ, જૈનેતર આગેવાનો ખધાનો સાથ જૈનશાસનની પ્રકાશના હશોક જણુતો હતો. આપણું ચરિત્રનાયક પણ સાથેજ હતા. સૂરિસાટ અને આપણા ચરિત્રનાયકનું મિલન ભધૂર અને હૃદયંગમ હતું.

‘કૃપાળુ ! સૂરિસાટ તથા વિદ્યાન સુનિરાને ચાતુમાંસ અદ્વારી સેવકને ત્યાં પગલાં કરે છે. મારી હાદિક ભાવના છે કે આપણી પણ તે પ્રસંગે મારે ત્યાં પગલાં કરે. અમારા કુદુંખને તેથી વિશેષ આનંદ થશે.’ મૂળચંહલાઈને આપણા ચરિત્રનાયકને ભાવભરી વિનિતિ કરી.

‘આચાર્યશાળી ! તમારી ભમતા છે તો હું જરૂર આવીશ. મને સૂરિસાટ સાથે શાનગોધિ માટે વિશેષ તક મળશે. તેમના વિદ્યાન શિષ્યોનો સંપર્ક સધારો.’ આપણા ચરિત્રનાયકે ભાવના વ્યકૃત કરી.

શ્રી મૂળચંહલાઈને આચાર્યશ્રીના વિનયથી બહુ જ આનંદ થયો. કાર્ત્તકી પૂર્ણિમાના હિવસે સૂરીસાટ તેમના વિદ્યાન આચાર્યો તથા શિષ્ય પરિવાર તેમજ સંઘ સમુદ્ધાય સાથે માણ્ણેકચેાક પધાર્યો. આપણા ચરિત્રનાયક પણ સૂરિસાટને આવી ભજ્યા. બન્ને આચાર્યોનું મિલન મનોરમ્ય હતું. શેઠ મુળચંહ ખુલાખીહાસની હવેલીમાં બન્ને આચાર્યો એક પાટ ઉપર બિરાજમાન થયેલા જોઈને ખધાને ભારે આનંદ થયો. આ દસ્ત અતુપમ હતું.

શ્રી સુધર્માસ્વામી ગ્યાનબંદર અમદાવાદ  
નિર્માણ કાર્યક્રમાં પ્રદેશીક રાજ્યાભિષેક






શેઠ સુળયંહભાઈએ સંઘની ઉત્તમ પ્રકારની લક્ષિતનો લાભ લીધે. બન્ને આચાર્યપ્રવરોતું આવું અપૂર્વ મધૂર મિલન જેઠને શ્રી સંઘના આખાતવૃદ્ધમાં આનંદની લહરીએ લહેરાણી.

આપણા ચરિત્રનાયકે જ્ઞાનગોષ્ઠિ કરતાં સૂર્યિસાટને જણ્ણાંયું કે સુરત તરફ વિહારની ભાવના છે. સૂર્યિસાટે પ્રેમભાવથી જણ્ણાંયું કે તમે મારવાડનો લાંબો વિહાર કરી આવો છો. સૂરત તો મુંબાં જતાં આવશે. તમે તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળની યાત્રા કરી આવો. તમે તો થાણાને તીર્થધામ મનાવી હોય. ત્યાં ગયા પછી શ્રી સિદ્ધાચળ તરફ નહિ નીકળાય.

શ્રીમાન સૂર્યિસાટની પ્રેમભરી વાણી સંભળી આચાર્ય-શ્રીની ભાવના સિદ્ધાચળ માટે લગ્ની અને યાતીતાણા તરફ વિહાર કરવા નિર્ણય કર્યો.

આ હૃદયંગમ મધૂરાં મિલનના સમરણો આચાર્યશ્રીના હૃદયમાં કોતરાઈ ગયાં.





ધન્ય વીરચંહલાઈ ! ધન્ય ગ્રામસુધારણા !

( ૪૨ )

‘ મથેણુ વંદામિ ! સેવકે વંદણા કરી.

‘ ધર્મલાલ ! તમારા શુરૂકળમાં તો બાળકો કિલ્લોલ કરે છે. ધર્મલાલના પણ સારી છે. ’ આચાર્યાશ્રીએ સંતોષ પ્રભટ કર્યો.

‘ સાહેબ ! શુરૂકળ ધણા વધોની જૂની સંસ્થા છે. સુનિરાજ આચિત્રવિજયલુ ( કચ્છી ) ની પ્રેરણના પાન કરીને સંસ્થા પ્રગતિ પામી છે. ત્રિપુટીરત્નો સુનિરાજ શ્રી હર્ષનવિજયલુ આદિની અમીદાદ છે. હમેશાં ૪-૫ આચાર્યાશ્રીના થાય છે. બાળકો જાંગીત-યાયામ-એન્ડની તાલીમ લ્યે છે. ’ સેવકે વીગત જણાવી.

‘ શ્રી હરિચંહલાઈ કહેતા હતા કે તમે વ્યાપારીશાળા શરૂ કરી છે ને ! ’

‘ લુ હા ! સા. ૧૯૬૬ માં શુરૂકળનો રજતજ્યંતી ઉત્સવ થયો અને તે પ્રસંગે વઠવાણુકેન્યવાળા કાન્નિકોટનમિલના માલેક જૈન-સમાજપ્રેર્ણી શેઠ શ્રી રતિલાલલાઈ વર્ધમાનની પ્રેરણાથી વાણીન્ય વિદ્યામંહિર શરૂ કરવામાં આવ્યું. તે બાળકો માટે એક આશી-વોહજનક સંસ્થા થઈ પડી છે. ’

‘સૌરાષ્ટ્રમાં આવી વ્યાપારી શિક્ષણ આપતી કેટલી સંસ્થા છે !’

‘ગુરુવર્ય ! સૌરાષ્ટ્રમાં ‘વાણિજ્ય વિદ્યામંહિર’ એકજ અને પ્રથમજ હાઇસ્ક્યુલ છે. અમહારાજમાં એક આર. સી હાઇસ્ક્યુલમાં તેથું શિક્ષણ અપાય છે.

‘તમારી સંસ્થાના પ્રસૂખ શ્રી ફકીરચંહભાઈ અમારા અનન્ય બક્તા છે. શ્રી જીનભદ્રવિજ્ય મહારાજ પણ અમારા પરમ પ્રેરી છે. આ ગુરુકુળની પ્રવૃત્તિ-પ્રગતિ જાણી ખૂબ આનંદ થાય છે.’

‘કૃપાળુ ! વાણિજ્ય વિદ્યામંહિર તો થયું પણ ખર્ચ ખૂબ વધી ગયો છે વળી હાઇસ્ક્યુલનું મકાન પણ કરવાનું છે.’

‘કુલચંહભાઈ ! તમારી સંસ્થામાં શ્રી ફકીરભાઈ તથા ચંહભાવભાઈ જેવા મહારથી છે. તમે પણ તેવાજ સેવાભાવી છો. જૈનસમાજમાં શિક્ષણપ્રેરી હાનવીરા ઘણ્યા છે. ગુરુકુળને વિકાસ થશે. પેસા પણ મળીજ રહેશે. તમે તો જણો. છોને શરૂ શરૂમાં આ સંસ્થાને કેવી કેવી સુશીલતો વેઠવી પડી હતી અને છતાં સંસ્થા પ્રગતિ સાધી રહી છે. લક્ષ્મીનાનો પોતાના સ્વામી-ભાઈઓને કેમ બૂલશે ! બાળકોના સદકાળયે બધાંચ રડાવાના થઈ રહેશે.’ આચાર્યશ્રીએ મંગળ આશીર્વિદ આપ્યા.

આપણું ચરિત્રનાયક ખંભાતથી વિહાર કરી ધૈલેરા, વળા, સોનગઢ થઈને પાલીતાણા પધાર્યો. શ્રી બશોવિજ્યલુ જૈન ગુરુકુળમાં એક હિવસ સ્થિરતા કરી. બીજે હિવસે ખામધૂમપૂર્વક પ્રવેશ થયો. કલ્યાણ ભુવનમાં પધાર્યો. માંગલિક સંભળાવી તીર્થાધિરાજના મહિમા વિષે પ્રવચન આપ્યું. પાલીતાણાના

ચાન્તિકોએ સારો લાખ લીધો. આચાર્યશ્રીને ગિરિજાજીનું તે મહાન આકર્ષણું હતું. કલ્યાણ જીવનમાં સ્થિરતા કરી સાડા હથ વાગ્યે અદૃમનો નિયમ ધારી ગિરિજાજની ચાત્રાએ પદ્ધાયો. ગિરિજાજના દર્શાન માત્રથી રોમરામ વિકુલર થયા. પગલે પગલે આત્મદૃષ્ટિ, આત્મશાંતિ અને આત્મપ્રકાશનો એઘ ઉછ્વાસ લાગ્યો. યુગાહિદેવના દર્શાનથી આત્મલાખ જાગી ઉઠ્યો. આનંદની લહરીએ લહેરાણી. હૃદય પુલકિત થયું. નવે હુંકના દર્શાન કરી જીવનતું સાચું દર્શાન મેળંબું. આત્મામાં આનંદ આનંદ ઉછળી રહ્યો. શાંતિની ગંગા લહેરાણી.

‘કૃપાળુ ! આપ ગિરિજાજની ચાત્રાએ પદ્ધાયો તે જાણ્યી શ્રી વીરચંદ કાકાને ખરુંજ આનંદ થયો. હવે કૃપા કરી જસહણુ પદ્ધારો. આપની રાહ જેવાય છે. મારા પિતાશ્રી અને આવતા હતા પણ મારે ચાત્ર કરવાના લાવ હતા તેથી હું આવ્યો. ’ હરિચંદભાઈએ વિનતિ કરી.

‘ભાગ્યશાળી ! હું તો સુભાઈ તરફ જવાનો વિચાર કરતો હતો. પણ ખંભાતમાં સૂરિસાટ શ્રી વિજયને મિસ્સૂરી ક્ષરળાએ ગિરિજાજની ચાત્રા માટે પ્રેરણું કરી અને તમારી વિનતિ પણ ખાતમાં હતી. ’ આચાર્યશ્રીએ ઝુકાસો કર્યો.

‘સાહેબ ! આપના પગલાં અમારા નૂતન નિવાસ ગૃહોમાં પ્રથમ કરાવવાના છે અને આપને વહેલાસર પદ્ધારવા વિનંતિ છે.’

‘હરિચંદભાઈ ! તમારા જેવા અનન્ય શુદ્ધકંતને ના શી રીતે પડાય ! વળી શ્રી વીરચંદભાઈ તો સૌરાષ્ટ્રનું ભૂષણ છે. તમે નિશ્ચિંત રહો. મારી ભાવના કહુંબગિરિ-તળાણ તરફ

જવાની હતી પણ હવે અમય ન હોવાથી હું જસદણું તરફે  
જ વિહાર લંબાવીશ.''

શ્રી હરિચંહભાઈને આચાર્યશ્રીની સંમતિથી અત્યંત  
આનંદ થયો.

આચાર્યશ્રીએ પાલીતાણ્યાથી વિહાર કર્યો. ઘેરી, શિવેદ્ધનગર,  
ગારીયાધાર, લાડી, જાંટવડ, કોટડા થઈ જસદણું પદ્ધાર્યો.  
જસદણુમાં આચાર્યશ્રીનું શ્રીસંદે લાવલયું સ્વાગત કર્યું.  
શ્રી વીરચંહભાઈ, શ્રી માણેકચંહભાઈ, શ્રી કુલચંહ ભાઈ,  
શ્રી હરિચંહભાઈ બધાને અત્યંત આનંદ થયો.


આચાર્યશ્રીના પદ્ધારવાથી શ્રી વીરચંહભાઈના પાંચે ભાઈઓના,  
વિશાળ પરિવારને બારે આનંદ થયો. પાંચ મનોહર નિવાસ-  
ગૃહેનું વાસ્તુ લેવાયું. અકૂઈમહેતસવ કરવામાં આંદોલન.  
દ્વિપ્લ વિધવિધ પૂજા ભણ્યાવવામાં આવી. સ્વામીભાઈઓની  
અકિતરૂપ સ્વામીવાતસલ્ય થયાં. આચાર્યશ્રીના મંગળ આરી-  
વીદથી આનંદ આનંદ છવાઈ રહ્યો.

શ્રી વીરચંહભાઈએ માદુંગાના તેમના પરમદનેહી-મુરખ્યી  
ધર્મનિષ્ઠ રાવસાહેબ શ્રી શેઠ રવળુભાઈ સોજપાળને તાર કરી  
આ પ્રસંગે ઓાવાંયા એટલું જ નહિ પણ મોટો મેળાવડો  
થોળું જસદણું સ્ટેટના નામદાર ઠાકેર સાહેબના હાથે શેઠશ્રી  
રવળુભાઈને સંમાનપત્ર આપી બહુમાન કર્યું. શેઠ રવળુભાઈએ  
વિનયપૂર્વક માનપત્રનો જવાબ આપતાં જણાંયું કે ઉદાર-  
ચરિત, શિક્ષણપ્રેરણી, નિવૃત્તિમાં પણ દેશની સેવામાં આનંદ  
માનતાના જ ગામમાં વધોથી ગ્રામસુધારણા માટે

તન-મન-ધનથી જીવન અર્પનાર વીરચંહલાઈ જ માનપત્રને  
શોણ્ય છે. હું જલે શ્રીમંત હોડિ પણ મેં શ્રી વીરચંહલાઈ  
જેવી કોઈ સંસ્થાની સ્થાપના પણ નથી કરી. નથી કોઈ  
સંસ્થામાં હું શ્રી વીરચંહલાઈની જેમ તન્મય થઈ ગયો. શ્રી  
વીરચંહલાઈ અને તેમના ધર્મપ્રેમી જગ્નીનાંઓ શ્રી કુલચંહલાઈ  
તથા શ્રી હરિચંહલાઈ વગેરેને ધન્ય છે. શ્રી વીરચંહલાઈ તો  
સૌરાષ્ટ્રના રન છે. તેમની સેવા કાર્યની સૌરલ સૌરાષ્ટ્ર, સુંખાઈ  
અને આક્રિકા સુધી પહેંચી છે.

શ્રી હરિચંહલાઈએ આચાર્યશ્રીને સમદીયાતા પગલાં કરવા  
પ્રાર્થના કરી અને આચાર્યશ્રીએ તે સ્વીકારી. આચાર્યશ્રી શ્રી  
વીરચંહલાઈ વિષે જાણુતા હતા. પણ તેમણે ચોતાની જન્મ-  
ભૂમિમાં સેવાનો દીપ પ્રગટાયો છે, તે હલદેરા નરનારીએને  
પ્રકાશ આપી રહ્યો છે તે જાણી લારે આનંદ થયો. આમ-  
સુધારણા સમિતિ તેના વિધવિધ મકાનો કાંતણુ-વણુટ વિભાગ,  
ઔષધાલય, અધ્યતન હવાખાતું, રાહત વિભાગ, અગીયો, ઐતી,  
પશુપાલન, વગેરે સંસ્થાઓ અને તે હરેકમાં શ્રી વીરચંહલાઈની  
ચોતાની ખાસ હેખરેખ તથા માર્ગદર્શન ઉપરાંત શ્રી વીરચં-  
હલાઈની સાહાઈ, વિનય, પ્રેમલાવના, દેશપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને  
શિક્ષણપ્રેમ, જેઠને ધન્ય! ધન્ય! એવા મંગળ આશીર્વાહ  
આપીને આચાર્યશ્રી સમદીયાળા-વીરનગરના મીઠાં મધુરાં  
સમરણો લઈને અત્યાંત આગહ હોવા છતાં સુંખાઈને સાહ  
સંભળીને વિહાર કર્યો.





अनन्य गुरुभक्त धर्मनिधि  
श्री शेठ हरिचंह माणेकचंह : मादुंगा





## ગુરુદેવનું પુણ્ય સ્મારક

( ૪૩ )

‘ શુક્રવર્ષ ! ઇંદ્રિયા રસ્તામાં જ આવે છે. આપ પધારે તો અમને આપની અમૃતવાહીનો લાભ મળશે. આપને અતુંઝુંતા હોય તેટલી સ્થિરતા કરશો ’ ઇંદ્રિયાના આગેવાનોએ વિનતી કરી.

‘ ભાગ્યવાનો ! શુક્રદેવ શ્રી મોહનલાલજી મહારાજની જ્યંતી આવે છે. તમે શ્રી સંઘ શુક્રમહારાજના કાર્યમાં સાથ આપો તો જ્યંતી ઇંદ્રિયામાં ઉજવી શકાય ’ આચાર્યશ્રીએ ટકોર કરી.

‘ સાહેબ ! યથાશક્તિ અમે જરૂર સાથ આપીશું. ઇંદ્રિયામાં શુક્રદેવ પ્રત્યે અજીતલાખ છે. આપની સુધાભરી વાહીનો લાભ મળશે. ’

આચાર્યશ્રી જસદાસ, વીઠીયા, પાલીયાદ, ઓટાદ, ધંધુકા, ફેદરા, ખંલાત થઈ રહેજ પધાર્યો. રહેજમાં શુક્રમહારાજની

તણીયત બગડી તેથી ખંભાતના આગેવાનો હોડી આંધ્યા. ખંભાતમાં શ્રી સંઘે ગુરુહેવની સેવા સુશ્રુષા કરી. તણીયત સારી થતાં આચાર્યશ્રીએ વિહાર કર્યો. રાતેજ, ૧૯૪૪સાર, બાર્દ્ય, અંકલેશ્વર, સાયણુ થઈ સુરત પદ્ધાર્યો. સુરત આચાર્યભિકૃતની એણી કરી લેસ્તાન, મરોલી, નવસારી, બીલીમેચા, વલસાડ, બગવાડા, વાપી, અચારી થઈ શ્રીગામ પદ્ધાર્યો. શ્રીગામ ઇણુસાના આગેવાનો આચાર્યશ્રીને વિનતિ કરવા આંધ્યા અને ગુરુહેવની જ્યંતી ઉજવવાની ભાવનાથી આચાર્યશ્રી ઇણુસા પદ્ધાર્યો. ઇણુસાના શ્રી સંઘે ભાવભર્યું સ્વાગત કર્યું. ગુરુહેવ શ્રી મોહનલાલજી મહારાજશ્રીની જ્યંતી ધામધૂમપૂર્વક ઇણુસામાં ઉજવવામાં આવી. આચાર્યશ્રીએ પુષ્યપ્રભાવક ગુરુહેવ શ્રી મોહનલાલજી મહારાજના પુષ્યદમરણો સંભળાંધ્યા. ગુરુહેવ ઇણુસા પણુ પદ્ધાર્યો હતા તેની યાદી આપી. ઉપરાંત સૂરતથી મુખ્ય સુધી જગ્યાએ જગ્યાએ ઉપાશ્રેયો, મંહિરો, પાઠશાળાઓ, જ્ઞાનલંડાર વગેરે જેવા ભળે છે તે ગુરુહેવના ઉપરેશનું ક્રણ છે. મુખ્યના દ્વાર અંધ્ય મુનિરાજે માટે ખુલ્લા કરવાનું માન ગુરુહેવ શ્રી મોહનલાલજી મહારાજને છેા. ઇણુસાનો સંઘ સુધી છે. તમે બધા ધર્મપદ્ધતિઓ સાર્વ કર્માચારો છે. તમારામાં ગુરુપ્રેમ અને ધર્મભાવના છે તે ગુરુહેવના નામથી સુરતમાં ને શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર છે તેના ઉદ્ધાર માટે યથાશક્તિ ઝાળો આપો તે ગુરુહેવની જ્યંતી ઉજાંધ્યાનું સાર્થક થાય.

આચાર્યશ્રીની અમૃતવાળીની જાહુઈ અસર થઈ. ઇણુસાના શાહ અમરચંદલુ ખુખ્યચંદલુ છાંઝેડે રૂ. ૩૦૧, શાહ પુનમચંદલુ ફેલીચંદલુ છાંઝેડે રૂ. ૨૦૧, શાહ ગંલીરમલજી

જસરૂપલું છાંજેડે હા. ૨૦૧, શાડ સુળયંદલુ મધ્યારામજલુ શુગળીયા હા. ૨૦૧, તથા બીજા બાઈ બહેનોએ મળી હા. ૧૩૧૬ કરી આપ્યા અને તે રકમ શ્રી મોહનલાલજી મ. ના જાનભંડારના વ્યવસ્થાપક ચુનીલાલભાઈ શુલ્કાખયંદ હાળીયા પર મોકદી આપી. તે રકમથી જાનભંડારમાં રીપોર્ટિંગ કામ સુંદર થયું છે અને શ્રી સંઘમાં આનંદ આનંદ છવાઈ ગયો. બપોરના આનંદપૂર્વક પૂલ લણ્ણાવવામાં આવી. પ્રભાવના થઈ.

કૃષુકાથી વિહાર કરી માણેકપુરથી સંભાણુ પદ્ધાર્યો. સંભાણુમાં આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી શિષ્ય પર્દ્દિવાર સાથે પદ્ધાર્યો. બન્ને આચાર્યોનું મધુર મિલન થયું. સંભાણુથી હીનીયર થઈ એસરડી પદ્ધાર્યો. એસરડીથી ગોલવડ પદ્ધાર્યો. સુંભર્થી આગર-તડના આગેવાનો હાહર ચાતુર્માસ માટે વિનતિ કરવા ગોલવડ આવ્યા. ગોલવડના શ્રી સંઘની પણ વિનતિ હતી પણ સુંભર્થી શુરૂઆતના પુષ્પ સમારક સર્ગી શ્રી મોહનલાલજી નૈન લાઈએરીના વિકાસ માટે કાર્ય ધ્યાવવાની જરૂરીયાત હોવાથી સુંભર્થી જરૂર ચાતુર્માસ માટે નિર્ણય અણ્ણાવવા છલ્યું. ગોલવડથી હાહાણુ પદ્ધાર્યો. હાહાણુ સ્ટેશનના આગેવાનોએ આચાર્ય શ્રીને સ્થિરતા કરવા વિનતિ કરી.

‘ભાગ્યશાળી ! તમારું હાહાણું સ્ટેશન તો સુંભર્થી જતા સાધુ-સાધીઓ માટેનું સુખ્ય સ્થાન છે પણ તમે ભવભવા ભાગ્યવાનો હોવા છતાં ઉપાશ્રયતું પણ ઠેકાણું નથી. હું તો ગમે તેમ રહીને એકાદ હિવસ પસાર કરી ચાલ્યો જઈશાં પણ સાધુ-સાધીને માટે વિચાર કરવાની જરૂર છે.’ આચાર્ય શ્રીની વાણીમાં ઝોડ એવી શક્તિ છે કે ઝોડ ઝોડ વાર તો અમતકાર

થઈ જાય છે. હાહાણું સ્ટેશનથી વિહારની તૈથારી હતી અને આગેવાનો પણ જાણુતા હતા કે આચાર્યશ્રી જડ્ઝર વિહાર કરશેજ. તેવામાં આચાર્યશ્રીએ મીઠી ટકેર કરી અને આગેવાનોએ આચાર્યશ્રીને વચન આપ્યું. વિહાર ખંધ રહ્યો. એને દિવસે વ્યાખ્યાનમાં આચાર્યશ્રીએ હાહાણું સ્ટેશનમાં ઉપાક્રમ માટે પ્રેરણુા આપી અને બધાના આશ્ર્ય વર્ણે શા. કચરાહાસળ લક્ષ્મીચંદળ કાપડીયા, શા. ડાદ્યાભાઈ શેચંહલાઈ, શા. તલકચંદળ લેરાળ, શા. અમૃતલાલ તથા શા. લક્ષ્મીચંદ, શ્રી કેશરીચંહલાઈ નાથુલાઈ તથા શા. ઓટરમલ વગેરે બધાએ મળીને ઇથીયા ખાર હન્દર લખાવી દીધા. ઉપરાંત હાહાણુંચંહરવાળા શેઠ ધનરાજણ ગેવરચંદળ બાક્ષણુએ પોતાની હાહાણું સ્ટેશન ઉપરની જમીન જૈન ફરેરાસરણ તથા ઉપાક્રમ માટે લેટ આપી. આચાર્યશ્રીના ઉપરેશથી હાહાણું સ્ટેશનમાં ફરેરાસરણ તથા ઉપાક્રમ થઈ ગયાં અને સુંખંખ જતાં આવતાં સાધુ સુનિરાને તેમજ સાધીજીએને હાહાણું સ્ટેશનમાં ખૂબ અતુકૂળતા થઈ ગઈ.

હાહાણું સ્ટેશનથી વિહાર કરી ખાણગામ, ખોઈસર, પાલધર, સફ્રાલા, વિરાર થઈને અગાસી પદ્ધાર્ય. અગાસીમાં જવેરી જવેરચંહલાઈ કેશરીચંહલાઈએ સહ કુદુંબ આવી અંગી-પુન તથા સ્વામીવાત્સલ્યનો લાલ લીધે. ૫ દિવસ સ્થિરતા કરી હશ્યાનનો લાલ લીધે. અગાસીમાં અમહાવાહનિવાસી શ્રી ચીમનલાલ ડાદ્યાભાઈ હવાઇર માટે આવ્યા હતા. આચાર્યશ્રી પાસે હંમેશ આવતા હતા. આચાર્યશ્રીની પુષ્યપ્રલા તથા સુધાલરી વાણી સાંકણી ચીમનભાઈને ખૂબ શાંતિ મળી. આચાર્યશ્રીને કામ સેવા માટે વિનતિ કરી. આચાર્યશ્રીએ જણાંયું કે તમે

તો ભાગ્યવાન છો. હામ-હામ ને હામ પુર્વ પૂછ્યે મળ્યા છે. સુકૃતની લક્ષ્મીનો સફુલ્પયોગ કરો. તમારી ભાવના હોય તો એરીવલીમાં લાભ કેવા જેવું છે. ઉપાશ્રય-હંડેરાસરની જેગવાઈ નહેતી. સાહીવાળા, શ્રી જૂહારમલજી ઉત્તમાજી બાંધુઓ ઉપાશ્રય તથા હંડેરાસર માટે ચોતાની જમીન આપી. ટીપ પણ થઈ અને ઉપાશ્રય થઈ ગયો છે પણ ચોમેર કોટ ન હોવાથી લોકો કચરો પુંને નાખી બગાડે છે વળી લરતી પણ કરવાની છે. એરીવલીમાં ને અધૂરું કાર્ય હોય તે ચોતાના તરફથી કરાવવા આચાર્યશ્રીને શ્રી ચીમનભાઈએ વિનિતિ કરી. આચાર્યશ્રી એરીવલી પદ્ધાર્યો. શ્રી ચીમનભાઈ પણ એરીવલી આંદ્રા અને એરીવલીના આગેવાનોને મળીને શ્રી ચીમનભાઈએ અધૂરા કાર્યની શરૂઆત કરાની. શ્રી ચીમનભાઈ ચોતે પણ પંદર હિવસ એરીવલીમાં રહ્યા અને ઉપાશ્રયના કામ પૂરું કરાવવાનો ઉત્તમ લાભ લીધો.

એરીવલીથી થાણુાના નૂતન નવપક્ષ જીનાલયના કાર્યનું નિરીક્ષણ કરી સુલુંડ, ભાંડુપ, ધાટકોપર, માદુંગા, લાલવાડી, લાયખતા થઈ સુંભાઈ પાયધુનીના શ્રી મહાવીરસ્વામીના હંડેરાસર પદ્ધાર્યો. આચાર્યશ્રીનું ભાવલીનું સ્વાગત કરવામાં આવ્યું. લાંબા વિહારને લીધે શરીરમાં ઘઉજ નથળાઈ આની જવાથી દેશી ઉપચાર શરૂ કરવામાં આવ્યા. ધીમે ધીમે તણીયત સારી થઈ ગઈ. સં. ૨૦૦૨ નું આચાર્યશ્રીનું ૫૪ સું ચાતુમોસ સુંબંધમાં થયું.

‘સાહેબ ! ગુરુદેવતા પુણ્ય સમારક સમી લાલભાગની શ્રી મોહનલાલજી સેન્ટ્રલ વાઇફ્રેરીના મકાન માટે તેમજ તેના

વિકાસ માટે આપની શ્રી યોજના છે ! શ્રી મોહનલાલ લગ-  
વાનહાસ જવેરીએ પ્રશ્ન કર્યો.

‘મોહનલાલ ! તમે તો વિકાસ છો તેમ જ શુદ્ધેવના  
અનન્ય ભક્ત છો. મારી ભાવના તો છે કે શુદ્ધેવના આ  
પુષ્યસમારક માટે સારું એવું ફરંડ થાય તો દ્વસ્તીઓને ચિંતા  
ન રહે. મકાન પણ કાળ અને સુંહર બને અને લાયઘેરીને  
વિકાસ પણ થાય. તમે શ્રી હીરાલાલભાઈ મંચાચંહ સોલી-  
સીટરને દ્વસ્તીઓની મીર્ટીંગ અહીં જ યોલાવવા મારી વતી  
સૂચના કરશો. આવતા રવીવારે પ્રાથમિક વાતચીત તો કરી  
શકશે.’ આચાર્યશ્રીએ પોતાની ભાવના હર્ષાની.

રવીવારે દ્વસ્તીઓની મીર્ટીંગ યોલાવી. રા. બ. અમૃતલાલ  
કાળીહાસ, શેઠ રવાજુલાઈ સોજયાળ જે. પી. શેઠ કાંતીલાલ  
ઇંદ્રલાલ જે. પી. શેઠ માણેશ્વરલાલ ચુનિલાલ જે. પી. શેઠ બણ-  
લચંહ ડેશપલાલ મોડી તથા શ્રી પ્રવીષુચંદ્ર હેમચંહભાઈ,  
શેઠ હીરાલાલ મંચાચંહ શાહ સોલીસીટર ઉપરાંત શ્રી લોઙીલાલ  
અમૃતલાલ જવેરી, શેઠ સુળચંહ ખુતાખીહાસ, શ્રી વીરચંહ  
પાનાચંહની કુ. વાળા શ્રી કુલચંહભાઈ માણેશ્વરચંહ, જવેરી  
મોહનલાલ ભગવાનહાસ સોલીસીટર, તથા શા છખીલાસ  
લેઝીંગભાઈ વગેરે ગુહદ્વયાની મીર્ટીંગ થઈ.

‘ભાગ્યવાનો ! તમે તો શુદ્ધેવના અનન્ય ભક્ત છો. શુદ્ધ-  
દેવના પુષ્ય રમરચ્છાયે’ ઈ. ચ. ૧૯૧૦ માં શ્રી મોહનલાલલુ  
સેન્ટ્રલ લાયઘેરીની સ્થાપના થઈ. ૪૦ વર્ષ પહેલા જૈન સમા-  
જમાં એક પણ લાયઘેરી નહોતી. ધીમે ધીમે તેનો વિકાસ થતો  
ગયો. આજે તો ૨૦૦૦૦) વીસ હજાર ઉપરાંત પુસ્તકો અને ૫૫

કખાટો છે. લાયણેરીમાં ધાર્મિક ઉપરાંત તાત્ત્વિક ચંદ્રા અને હસ્તલિભિત પુસ્તકોનો સારો સંશેડ છે. ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાઓના અનેક વિષયોના પુસ્તકોનો સંશેડ હોએ તેનો લાલ આમજનતા ઉપરાંત કોલેજના પ્રોફેસરો, એમ. એ. ના. વિદ્યાર્થીઓ તથા સ્કોલરો સારા પ્રમાણમાં દ્વે છે અને લાલભાગમાં ભીરાજતા મુનિરાજે પણ સંસ્કૃત પાઠશાળામાં શાખી પાસે સંસ્કૃત, પ્રાઙૃત, માગધી, કાંય-કોણ આહિનો અલ્યાસ કરે છે. વાંચનાલયનો લાલ પણ મારી સંખ્યામાં લેવાય છે. મારી લાવના છે કે ગુરુદેવના આ પુષ્ય સમારકને સમૃદ્ધ બનાવવા માટે એક વિશાળ મદાનની જરૂર છે ઉપરાંત તેનો વિશેષ વિકાસ કરવાની પણ જરૂર છે. તમે અધ્યાત્માશાળીઓ છો. પરમાત્માની કૃપાથી સંપત્તિશાળી પણ છો. ધર્મના ઉદ્ઘોત માટે અને જૈનસમાજના કલ્યાણ માટે તમે હર વર્ષે હબદાર ખચો છો. તમે ગુરુદેવના અનન્ય લક્ષ્ય છો. હું તો ધૂંઘું કે ઝંડની મંગળ શરૂઆત તમારી તરફથી થાય તો મને આત્મી છે કે થીલ શ્રીમંતો જરૂર સહિય સાથ આપશો. ગુરુદેવતું પુષ્ય સમારક ભંય અને અમર બનશે. તમારું રૂાન-હાન ઉજવળ બનશે.’

આચાર્યશ્રીની સુધાલરી લાવના ઝળી. ત્યાંને ત્યાં જ દ્રસ્ટીઓએ ઝંડની શરૂઆત કરી. વીસ હબદાર રૂપીઓ ત્યાં જ ભારાઈ ગયા. દ્રસ્ટીઓ અને આચાર્યશ્રીએ વિશેષ પ્રયાસ કરવા વિચારણા કરી. થોડા સમયમાં સારું એલું ઝંડ થઈ ગયું. પણ આચાર્યશ્રીના અનેક પ્રયાસો છતાં મદાન માટે ચોક્કસ નિષ્ઠુંચે. અછ શક્યા નહિં. જનતા વર્ષોથી એ જ્ઞામંહિરના

ભાવ્ય કુવનની આતુરતાથી રાહ જુએ છે. શાસ્ત્રનદેવ જો ભાવના જલદી સંક્રમણ કરે.' જૈનસમાજના ધર્મવૈદ્યાઓ, ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રીના ભક્તો આચાર્યશ્રીની ગુરુદેવના પુષ્ય દમારકની અંતિમ ભાવનાને મૂર્તિ સ્વરૂપ કથારે આપશે?

### શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરીના વિકાસ માટે થયેલા રૂંડની યાદી

- ૭૫૦૧) શ્રેષ્ઠ માણ્યોકલાત ચુનિકલાત જે પી.
- ૫૦૦૧) „ બાધુ ભગવાનલાત પનાલાત
- ૫૦૦૧) „ વીરચંડ પાનાચંદની કુંંઠ
- ૫૦૦૧) „ રવજી સોજપાળ જે. પી.
- ૪૪૫૦) „ બાધુસાહેબ નાનકચંદલ પુરણચંદલ
- ૫૦૦૧) „ લુલષુલાત કેશરીચંદ  
૬૦ ધીરજલાત લુલષુલાત
- ૧૫૦૧) „ મોહનલાત મગનલાત
- ૧૫૦૧) „ હાથીબાઈ ગલાલચંદ
- ૨૫૦૧) „ જેસીગલાઈ જગણવનહાસ જમનગરવાળા  
૬૦ છથીલહાસ
- ૨૫૦૧) „ સુણચંદ ખુલાખીલાસ
- ૨૦૦૧) „ પાલણ સોજપાત હું શીવળભાઈ  
તથા રતનરીભાઈ
- ૨૦૦૧) „ પ્રાણુળવનહાસ જેઠાભાઈ છલુક્તાવાળા  
૬૦ મજલાતભાઈ

- ૧૦૦૧) „ ચીમનલાલ નથુભાઈ કાપડીયા
- ૧૦૦૧) „ અંગળહાસ કલ્લુભાઈ મહેસાણુવાળા
- ૧૦૦૧) „ ગીરધરલાલ ત્રીકમભાઈ રાધનપુરવાળા
- ૧૦૦૧) „ જેસીંગભાઈ ઉગરચંદ અમહાવાહવાળા
- ૧૦૦૧) „ હરખચંદ કપુરચંદ બામનગરવાળા
- ૧૦૦૧) „ મોહનલાલ હેમચંદ જવેરી
- ૧૦૦૧) „ નેમચંદ ઉઢેચંદ પારડીવાળા
- ૧૦૦૧) „ અગવાનહાસ હીરાચંદ
- ૧૦૦૧) „ હેમચંદ મોહનલાલ જવેરી પાટણુવાળા
- ૧૨૫૧) „ છગનલાલ કસ્તુરચંદ  
      હો શેઠ રમણુલાલભાઈ
- ૧૦૦૧) „ સારાભાઈ હડીઝીંગ અમહાવાહવાળા
- ૧૦૦૧) „ હરકીસનહાસ મોહનહાસ કાપડીયા
- ૧૦૦૧) એક ગૃહસ્થ તરફેથી
- ૫૦૧) શેઠ નવલાલ જેઠમલાલ કાંકરીયા હવીયેરખંડર
- ૫૦૧) „ વાડીલાલ ડેલતરામ માણુસાવાળા
- ૫૦૧) „ ટોકરરી ચુનીલાલ ઓન્ડ સન્સ બામનગરવાળા
- ૫૦૧) „ મગનલાલ જગળુવનહાસ
- ૫૦૧) „ જેઠાભાઈ કુશળચંદ બામનગરવાળા
- ૫૦૧) „ મોહનલાલ એમ. જવેરી
- ૫૦૧) શાંતાષેન (સ્વ. શેઠ હેલકરણ સુલળના પુત્રી) તરફેથી
- ૫૦૧) અણુશાલી હીશલાલ રાયચંદ ચાવાળા (પાલણુપુર)
- ૫૦૧) શા. અમૃતલાલ કેથવળુ શાહ કોટ મુંબાઈ
- ૫૦૧) શા. ચંપકલાલ છોગલાલ કલવાણી માદુંગા

- ૫૦૧) ,,, રતીલાલ ઉજમશી શાહ થાણા
- ૫૦૧) શેઠ હરલુલન નાગરહાસ
- ૫૦૧) વોરા ખાંતીલાઈ અમરચંહ જસુરાજ ભાવનગર
- ૫૦૧) શેઠ કુંઠનલાલ હીરાચંહ જવેરી, સુરત ગોપીપુરા
- ૫૦૧) ઓક ગૃહસ્થ તરફથી
- ૫૦૧) શેઠ મનસુખલાલ તારાચંહ અમરેલીવાળા
- ૫૦૧) મહેતા નેમચંહ કચરાલાઈ કુપુરચંહ ઓંડ સંસ
- ૫૦૧) શેઠ રાયચંહ મોતીચંહ જવેરી
- ૫૦૧) શા. નરસી ધારસી ભાયખાળા જૈનચાલ
- ૫૦૧) શેઠ લાલજી ડેવલુ જામનગરવાળા
- ૫૦૧) ,,, લીલાધર મલુકચંહ હાદરવાળા હ. નવલખેન
- ૫૦૧) ,,, મોહનલાલ સુળજી
- ૫૦૧) ,,, ઇટેચંહ જવેરલાઈ ભાવનગરવાળા
- ૫૦૧) શ્રી શકુનનાઈ પનાલાલજી ભણુશાલી પાલીમારવાડ
- ૫૦૧) શેઠ કીશનલાલ બાળુલાલ
- ૫૦૧) ,,, પુનમચંહ શુલાણચંહ શુલેછા, મોટી ઇલોધી
- ૫૦૧) ,,, હાથીલાઈ ગલાલચંહ
- ૫૦૧) ,,, આર. મહીલાલ
- ૫૦૧) શા નટવરલાલ મોહનલાલની કુંઠ ખાંભાત
- ૫૦૧) શા લાલચંહલુ શેઠ હ. લક્ષ્મીચંહલુ શેઠ
- ૫૦૧) શ્રી મોહનલાલ તારાચંહ ભાવનગર
- ૫૦૧) ,,, ચંહલાલ ડાલ્યાલાઈ
- ૫૦૧) ,,, પ્રાગળુલાઈ હીરાચંહ
- ૫૦૧) ,,, લીલાલાઈ નીહાલચંહ

- ૫૦૧) „ છાટાલાલ લીખાખાઈ અમહાવાહ  
 ૫૦૧) „ હરગોવિનદાસ રામલુખાઈ સુહુનંડ  
 ૫૦૧) „ સાગરમલાલ ચમનાલુ સાંડેરાવ (મારવાડ)  
 ૫૦૧) „ છગનલાલ વાલચંડ ડ. બાલુખાઈ  
 ૫૦૧) „ કીશનલાલલુ પુનમચંહલુ  
 ૫૦૧) „ માણ્ણુકચંડ થાવર માંડવીવાળા

આ ઝંડ હજુ પણ ચાલું છે અને તેમાં ભાગ્યશાળી સજજનો પોતાનો હાળો ભાવપૂર્વક મીઠલતા રહે છે.

આચાર્યશ્રીના ૨૦૦૩ અને ૨૦૦૪ ના ૫૫ અને ૫૬ માં ચાતુર્ભાસ હાહર અને સુંબદ્ધમાં થયાં.






## ભીય પ્રતિષ્ઠા-મહોત્સવ

( ૪૪ )

‘કૃપાસાગર ! જે કલામય ઐનમૂન નવપદ જીનાલય આપની પ્રેરણુથી શરૂ કરવામાં આવેલ હતું તે આપ ગુરુદેવની કૃપા-દીણથી સંપૂર્ણ થયું છે. કૃપા કરી થાણું પદ્ધારો અને પ્રતિષ્ઠા-મહોત્સવ માટે શ્રી સંધને માર્ગદર્શન આપી અમારા મનના મનોરથ પૂર્ણ કરો. ’ થાણુના આગેવાનોએ ગ્રાર્થના કરી.

‘ભાગ્યવાનો ! ધર્મપ્રેમી શેઠ શ્રી રવાલભાઈ સોજપાળ જે-પી તથા તેમના સહશુદ્ધાનુરાગી ધર્મપલી શ્રી કંકુણેનના મંગળ હસ્તે જે કાર્ય થયું છે તે મહા મંગલકારી જ થાય, વળી તમારા શ્રી સંધનો આ નૂતન જીનાલય માટે પ્રેમ અને ઉત્સાહ અહૃત્ય હોધને મહિર પણ બન્ય ઐનમૂન બન્યું છે. શ્રીપાળ મહારાજ અને મહારાણી મયણાસુંહરીના ધર્મપ્રભાવથી પ્રશા-



શ્રેષ્ઠ શ્રી રવલુભાઈ સોજપાટ



વિત થયેલી આ ભૂમિ પ્રાચીન અને સુપ્રસિદ્ધ છે, અરેખર થાણા તીર્થભૂમિ ઘની ગયું છે. 'આચાર્યશ્રીએ સંતોષ વ્યક્ત કરો.

' શુરૂદેવ ! એ બધો યશ આપશ્રીને જ છે. આપે અમારો આર ખાર વર્ષનો કલેશ શમાંયો. અને શ્રી સંધની ઉજ્જ્વલિમાં પ્રકાશ પાથરો. આપેજ ભારે જહેમત ઉડાવી પ્રેરણું આપી આપીને આ નૂતન નવપદ જીનાલય તૈયાર કરાવવા શુલ્પ પ્રયત્નો કર્યો. આજે અમારા સહૃદાન્યે પ્રતિષ્ઠા મહેતસવ થશે. હવે તે કાર્ય પણું આપશ્રીની નિશ્ચામાં અને આપશ્રીના માર્ગદર્શન પ્રમાણે થાય તો શ્રી સંધને આનંદ થશે.' આગેવાનોએ ફરી વિનતી કરી.

'પ્રતિષ્ઠાતું' સુહૂર્તું તો બહુ સુંદર આંધું છે. મહા શુહિ પંચમી-વસંતપંચમીનો દિવસ મહામંગળકારી છે. થાણુને આ પ્રતિષ્ઠા મહેતસવ તો લંઘ થશે. મુંબઈ તથા આસપાસના હણરો અહેન-લાધાઓ. દર્શનાર્થે ઉમરી આવશે તો તે માટે પહેલેથી બધી નવરસ્થા કરી રાખવાની રહેશે. પ્રતિષ્ઠાના કાર્યો અંગે તમારા આગેવાનોમાંથી એક સમિતિ નીમે. અને તે પ્રમાણે કાર્ય થાય તે માટે કાળજી રાખો. શ્રી શેઠ રવલુભાઈ વગેરેની પણ સહાયતા લઈને પ્રતિષ્ઠા મહેતસવને દીપાવો' આચાર્યશ્રીએ માર્ગદર્શન આપ્યું.

' શુરૂદેવ ! આપ થાણુમાં પગલાં કરો આપના માર્ગદર્શન પ્રમાણે બધું થશે. અમારી શ્રી સંધની ભાવના તો શ્રી આહી શરદાદાના લુધનપ્રથમોના દર્શયો. અડાં કરવાની તેમજ તીર્થધિરાજ શ્રી શત્રુંજય, ગિરિવિહાર ગિરનારની મનોહર રચનાઓ કરાવવાની છે.' એક આગેવાને ભાવના દર્શાવી.

‘ ભાગ્યશાળી ! બહારથી આવનારાઓ માટે શરીરાણુ-તંધુઓથી સુશોભિત શ્રી શ્રીપાળનગર વસાવવાની ઠયવસ્થા કરવી પડ્યો.’ આચાર્યશ્રીએ નવી સૂચના કરી.

‘ કૃપાળુ ! આ સૂચના ખડુ જ સુંદર કરી. શ્રીપાળનગર પણ ખડુ થઈ જશે. હવે કૃપા કરી આપ વહેલા વહેલા પધારો’ આગેવાનોએ ઝરી વિનિતિ કરી.

આચાર્યશ્રી શિષ્ય પરિવાર સાથે થાણુ પધારો. થાણુમાં આચાર્યશ્રીનું ‘ ભાવલીનું સ્વાગત કરવામાં આંદ્રું. આચાર્યશ્રીએ આગેવાનોની જુહા જુહા કારોં માટેની સમિતિ માટે માર્ગદર્શન આપ્યું. થાણુની પ્રતિષ્ઠાની તૈયારી બેરશોરથી થના લાગી. થાણુના મહેમાનો, કાર્યકરો, સ્વયંસેવકો, ભાવિકોથી ધમધમી ઉઠ્યું, શ્રીપાળનગર વસી ગયું. વિદ્યુત શક્તિથી થમક્તા હાલતા-ચાલતા શ્રી આદીશર લગ્નંતના જીવન પ્રસંગોના દશ્યો આણેછૂણ ખડા થઈ ગયાં. તીર્થાધિકાર શ્રી શત્રુંભ્ય તથા ગિરિનગર શ્રી ગિરનારણ તીરોની આકર્ષક રચનાઓ કરવામાં આવી. મૂળનાયક શ્રી સુનિસુવતસ્વામી મહારાજના અતિ અદ્ભૂત બિલ લરાવનાર ખડલાગી શ્રી નેમીહાસભાઈ અલેચંદ્રાઈ તથા શ્રી સંધની વિનિતિને માન આપી આચાર્યપ્રવર શ્રી વિજયપ્રતાપસ્તૂરીશરણ આહિ દુંક સમય હોવા છતાં લાંબા લાંબા વિહારો કરી મહા શુદ્ધિ એકમના દિવસે પધારો. શ્રી સંઘે સુંદર સ્વાગત કર્યું.

ચૌદ દિવસનો મહોત્સવ થયો. મહોત્સવ મંડપમાં વિવિધ પૂજાઓ. તથા રાત્રે ભાવનાએની ધૂમ મચતી. સંગીત વિશારદો માસ્તર વસંત, ૫ં, હેવેન્ડ્ર વિજય, માસ્તર ફૈયાલાલ વગેરેને

ચાંદળવા હનરેા લાઇ બહેનોના ટોળેટોળાં જમા થતા હતા. મંડપ તો વિશાળ હતો છતાં ઉભા રહેવાની જગ્યા ન રહેવાથી શહેરમાં લાઉડ સ્પીકરાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કિયા કરાવનાર સ્વરતનિવાસી શ્રીયુત આલુભાઈની મંડળી શ્રદ્ધાભક્તિ-પૂર્વક ફરેક કાર્યમાં હાજર રહેતી. આચાર્ય શ્રી લુનકર્ણિ-સ્વરીશ્વરલુ તથા આચાર્ય શ્રી વિજયપ્રતાપસ્વરીશ્વરલુનું મિલન મધુર બન્યું હતું. શ્રી વિજયપ્રતાપસ્વરીશ્વરલુના માર્ગદર્શન પ્રમાણે અધાં અનુષ્ઠાનો થતાં હતાં.

મહા શુદ્ધિ ૫ ના હિંસે રથ, ઈન્દ્રધવળ, એન્ડવાળ, તથા સંપ્રયાખંધ મોટરો તથા વોડાગાડીઓ. વગેરે સામગ્રી સાથે હથહથા ભયો વરદોડા ચડયો હતો. વરદોડા જેવા હનરેા સી પુરુષો થાણ્યાની બજારો, અટાનીઓ અને ગલીઓમાં જમા થયા હતા. બંધ લુનપ્રાસાદના સુખદારે હાથી ઉપર ચઢીને તોરણું બાંધવામાં આંધું હતું. પ્રતિષ્ઠા સમયે વિમાનક્ષારા પુરુષવૃદ્ધિનું દસ્ય અનુપમ હતું.


સં. ૨૦૦૫ ના મહા શુદ્ધિ પંચમી-વસંત પંચમીના મંગળ હિંસે હનરેા સી પુરુષોનો માનવ મહેરામણુ ઉમઠી રહ્યો હતો.

મૂલનાયક શ્રી સુનિસુપ્રતસ્વામી મહારાજની ભાગ તેજના અંબાર સમી જ્યોતિર્મંય મૂર્તિની પ્રતિષ્ઠા ઝા. ૧૩૦૧) ના આદેશથી ધર્મપરાયણ માંગરોળનિવાસી શેડ શ્રી નેમીહાસભાઈ અલેચંદ તથા તેમના અ. સૌ. ધર્મપત્ની શ્રી પ્રલાવતીણહેને અતિ ઉદ્વાસપૂર્વક શુલ લગ્ને હનરેા જ્યનાડો વર્ચે કરી હતી.

વિશેષ આનંદની વાત તો એ હતી કે આ લાગ્યશાળી

હંપતીએ જ એ વિશાળ જિનબિંબ શ્યામ રંગના કુસોટીના પત્થર ઉપર જ્યાપુરમાં પોતાની ડેખરેખ નીચે તૈયાર કરાવી સં. ૨૦૦૪ માં વઠવાણુ શહેરમાં ઉજવાયેલ શ્રી અંજનશાલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શાસનસાટ આચાર્ય પ્રવર શ્રી વિજય નેમીસ્કુરીશ્વરલુ મહારાજના વરહ હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી તેમ જ એ પ્રતિમાલનો થાણુમાં પ્રવેશ કરાવવા માટે ૧૦૮ બળદના રથમાં સારથી તરીકે એસવાનો આહેશ લઈને તેમણે જ પ્રવેશ કરાવ્યો હતો. આ વખતે પ્રતિષ્ઠાનો લાલ વૈનાર પણ એ જ પુન્યશાળી બડલાળી આત્માએ હતા. ધન્ય અક્ષિતા, ધન્ય લક્ષ્મી, આ પ્રતિષ્ઠા પ્રસંગે ઝૂપીઆ એક લાખની ઉપજ થઈ હતી. આ એનમૂલ જીનમંહિરમાં આરસ ઉપર તૈયાર કરવામાં આવેલા શ્રીપાળ મહારાજ તથા મય-શ્યામુંદરીના જીવનના અનુપમ દસ્તીએ તથા નવપદલુ મહારાજનુ વિશાળ મંડળ ઉપરાંત અનેક જીવાંત કળામય દસ્તીએ આ જીનપ્રાસાદ ઈંદ્રલુલન બની રહ્યું હતું. મંહિરની શોલા અનુપમ હતી. થાણું ખરેખર તીર્થધામ બની ગયું હતું.

પ્રભુને ગાડી ઉપર બિરાજમાન કરવાના સમયે ત્રણ ચાર કલાક સુધી પ્રભુના અંગોમાંથી અમી જરણાની ધારાએ છુટી હતી. પ્રતિષ્ઠાના ફર્શને ૫૦ હજાર એન ભાઇઓ આંથ્યા હતા. થાણું શ્રીસંઘે સ્વામી ભાઇઓની અક્ષિત માટે નવકારશી કરી હતી. આજ થાણુમાં આનંદ આનંદ છલાંદ રહ્યો હતો. જીનશાસનનો જ્ય જ્યકાર થધ રહ્યો હતો. પ્રતિષ્ઠાના ધીજે હિવસે દ્વારોદ્ધાટન વિધિ થયા બાદ હેરાસરલુના મંડપ સ્થળે એકાએક નાગહેવે દેખાવ દીધેલ હતો. જનતાએ કેસર-કૂલથી



મૂળનાયક શ્રી સુનિસુવતસ્વામી : થાણુા  
( ઇંગ્રિયા : કુસુમચંદ ગુલાંચંદ જવેરી )



વધાંથા હતા. જનતાની મેહની એકત્ર થઈ તે સમયે શાલુહોએ  
સુકેવ દુધના કટોરાતું દુગધપાન કરી નાગરાજ પ્રેમથી હેઠે  
જનતાની સામે અમીદદિ. જોતા અદ્રશ્ય થયા હતા. આ દ્રશ્ય  
અમત્તાર ગણ્યાય.

આજથી થાણું જૈન જગતમાં સુપ્રચિદ્ધ થયું. થાણુાના  
શ્રી સંધમાં પણ શાંતિ અને આનંદ પ્રસથો. થાણુવાસીઓની  
આર્થિક ઉત્તેત્તિ પણ થઈ. હેવ-ગુરુ ધર્મ તરફ શ્રદ્ધા વિશેષ  
દ્રશ્ય બની. દીર્ઘતપસ્વી વચનચિદ્ધ આચાર્યશ્રી લુનઅદ્વિસ્તુરના  
પુણ્ય પસારે થાણું હળરોતું યાત્રાધામ બની ગયું.





## શ્રી ધંટાકરણની ભૂર્તિની પ્રતિષ્ઠા

( ૪૫ )

૨૦૦૩ ની સાત ચાલતી હતી. શુરૂવર્યની તથીયમ નરમ રહેતી હતી દ્વારા કરતાં હવાની જરૂર વિશેષ હતી. શ્રી હરિચંદ્રાદીપની ભાવના ધણ્ણા સમયથી આચાર્યશ્રીને માટુંગા લઈ આવવાની હતી. આચાર્યશ્રી માટુંગા પધારે તો ચોતાને શુરૂ દેવની અક્ષિત અને સેવાનો લાલ મળે ઉપરાંત માટુંગાના ધણ્ણા શુરૂદેવના લક્ષ્યો શુરૂદેવ માટુંગા પધારે તેમ ભાવના રાખતા હતા. એક દિવસ શુરૂદેવને માટુંગા લઈ આવવાના નિર્ણયથી શ્રી હરિચંદ્રાદીપ પાયધુની ગયા અને પ્રાર્થના કરી.

‘કૃપાળુ ! આપની તથીયત હુમણાં બરાબર નથી રહેતી. અમને ચિંતા રહ્યા કરે છે. આપશ્રી થોડો સમય માટુંગા પધારે. આપની તથીયત હુવાઝેન્થી સારી થઈ જશે. અમને આપની અક્ષિતનો લાલ મળશે.’ હરિચંદ્રાદીપને પ્રાર્થના કરી.

‘ભાગ્યશાળી ! તમે તો હમેશાં મારી ચિંતા કર્યાન્ન કરેા છો. તમે બન્ને કેવાં બડાભાગી છો ! અમારાં શ્રાવિકા હેમકુંવર-

બહેન પણ શુદ્ધભક્તિમાં ઉત્તરે તેવાં નથી. માદુંગાથી વારંવાર અતે આવીને લાલ વ્યે છે.' આચાર્યશ્રીએ હંપતીની અભિજ્ઞાનો ઉલ્લેખ કર્યો.

'સાહેબ ! આપની અતુકૂળતા હોય ત્યાંસુધી સ્થિરતા કરશો. શૈઠ રવળુભાઈનો પણ આશહ છે. શૈઠ બાળુભાઈની પણ ખાસ ભાવના છે. કાલેજ ત્રીજ છે. કાલે ધીમેધીમે વિહાર કરી પદ્ધારો. રસ્તામાં કોઈ તકલીફ નહિ રહે. 'હરિચંહભાઈએ ખુલાસો. કર્યો.

'હરિભાઈ ! તમારી આશહભરી વિનતિ સ્વીકાર્યો વિના કાંઈ ચાલશો ! હું પાંચમના વિહાર કરીને આવીશ. તમારે ત્યાં તો તમને બન્ને કુદુંઘોને તકલીફ રહેશો. શૈઠ રવળુભાઈના શાંતિનગરમાં અતુકૂળતા રહેશો.'

'ગુરુદેવ ! મારે ત્યાં શાન્તિસહનમાં બધી વ્યવસ્થા થઈ ગઈ છે. મારા ભાઈ ઉત્તમચંહ તો અમેરિકા ગયા છે ને ! તેમનો ફ્લોયાન્ડ આલી છે. બીજુ બધી વ્યવસ્થા થઈ ગઈ છે. મારા મોટાભાઈ કુલચંહભાઈનો પણ આશહ છે. કૃપાકરી શાન્તિસહન જ પદ્ધારશો. હાઈ તો અમે આપને દેવા આવીશું જ'

આચાર્યશ્રીની તથીયત ધણ્યા સમયથી નરમ રહેતી હતી. તપશ્ચયો તો ચાલુ જ હોય. રાત્રિના એ અઢું વાગ્યે ઉઠવાતું. સ્વારના પ્રતિકમણું પછી તુરત જ ધ્યાનમાં એસે. માંગલિક સ્તોત્રાદિ, મંત્રાદિ પૂણ્ય કરીને પછી જ પ્રાતઃક્રિયા કરવાની.

માંદગી હોય, અદૃમ હોય કે તથીયત સારી હોય ચોગ-ધ્યાન-જ્ઞાપ અને મંત્રાદિ કાયમ ચાલુ જ હોય. આચાર્યશ્રીની તથીયત નરમ જરમ સાંભળી શ્રી હરિચંહભાઈ માદું-

ગાથી આવ્યા, આશ્રમહોદ્ધરી વિનતિ કરી અને આચાર્યશ્રીને આરામ માટે માંગુંગા લઈ આવ્યા, માંગુંગાના ખણેન-સાઈઓ આચાર્યશ્રીની સામે આવ્યા, ભાવપૂર્વક લઈ આવ્યા. શેઠ રવાનુભાઈ કહે મારા શાન્તિનગરમાં બધી વ્યવસ્થા છે. શ્રી હરિચંદ્રભાઈ કહે શાન્તિસદ્ધનમાં મેં બધી વ્યવસ્થા કરી છે. શ્રી હરિચંદ્રભાઈના આખા કુંભનો લારે આશ્રમ હતો. આચાર્યશ્રી માંગુંગામાં શાન્તિસદ્ધનમાં પદ્ધાયો. બધાને આનંદ આનંદ થઈ રહ્યો.

હવાફેરથી તેમ જ શ્રી હેમકુંવરખણેનની શુરૂઆતિથી આચાર્યશ્રીને ખૂબ સ્વસ્થતા અને શાંતિ રહ્યાં. ધીમે ધીમે તબિયત સારી થતી ગઈ.

‘શુરૂદેવ ! આપની સુધાવાળીનો લાલ તો એવો મળે છે કે મેં તો મારી લંઘાળામાં આવી અમૃતવાળી સાંભળી નથી.’ શેઠ ખાયુભાઈ ગણુષ્પતે આનંદ પ્રદાન કર્યો.

‘લાગ્યશાળી ! તમે તો મોટા વ્યવસાયી રહ્યા, તમને પૂરો ખાવાનો પણ સમય ક્યાં મળે છે ! લક્ષ તમે અને ભલી તમારી મોટર, અલો તમારો ટેલીફોન અને લલી તમારી એંક. મહિનામાં એ દિવસ કુરસાદ મેળવો તો લાખનું લાખું મળી જય. હરિભાઈ કેવા પુણ્યશાળી છે. ચેરી તેમને પણ સંભાળવાની છે. પણ પહેલો ધર્મ અને પછી ચેરી. પહેલા શુરૂ અને પછી કામકાજ. તમે પણ લાગ્યશાળી છો. જ્ઞાનની ગંગા ચાલી જય છે. લાલ લેવાય તેટલો લેશો તો આત્મસંતોષ મળશો.’ આચાર્યશ્રીએ પ્રેરણું આપ્યું.

કૃપાળુ ! જ્યારથી આપની સુધાવાણી સાંભળું છું ત્યારથી આપની અમીદદિલ્હી મને વેપારમાં પણ લાલ મળતો જાય છે. મેં થોડી રકમ તેમાંથી શુદ્ધ કાર્ય માટે કાઢી છે. આપ કૃપા કરી તે માટે માર્ગદર્શિન આપો તે પ્રમાણે ખર્ચવાની મારી ભાવના છે.' બાધુલાઈએ ભાવના હશોવી.

'બાધુલાઈ ! જે મળે છે તે યુષ્ણયોહયથી મળે છે. બાગ્યશાળીને ત્યાં ભૂત રણે. તમારી ભાવના ઉત્તમ છે. જગતમાં નાગતી જ્યોતા દાદાશુરુ શ્રી અનકુશલસૂરીલુ મહારાજ તથા શ્રી ધંટાકરણ મહાવીર છે. મને તો તેમનો પ્રત્યક્ષ અનુભવ છે. શ્રી ધંટાકરણ દેવની ભૂતી તમારા તરફથી તૈયાર કરાવવામાં આવે અને તેની પ્રતિષ્ઠા કરવામાં આવે તો ઉત્તમ લાભકારી થશે તેમ તમે પણ યશભાગી બનંશો.''

'સાહેબ ! આપકીની આ ચોજના બહુજ મંગલકારી છે. શ્રી ધંટાકરણદેવની ભૂતી આધેદ્ભૂત-કળામય મનોરચય આપના આહેશ પ્રમાણે કરાવશો અને તેની પ્રતિષ્ઠા પણ આનંદપૂર્વક કરાવીશું. જે ખર્ચ થશે તે હું આપીશ. શ્રી હરિયંદલાઈ આ માટે જ્યારે જ્યારે જે રકમ મંગાવશે તે હું મોકલી આપીશ.' બાધુલાઈએ સંમતિ હશોવી.

'બાધુલાઈ ! થોડા પરિચયમાં તમે લારે યશ અને લાલ મેળવી ગયા. આ શ્રી ધંટાકરણદેવની ભૂતી અને પ્રતિષ્ઠાની ભાવના તો મારી હતી.' શ્રી હરિયંદલાઈએ પોતાની ભાવના ન્યકૃત કરી.

'હરિલાઈ તમે તો બડભાગી છો. શુરુદેવની કેવી અનુપમ સેવા ભક્તિનો લાલ લ્યો છો. શુરુદેવ તો વારંવાર કહે છે કે

શુરૂઆતિત તો ધર્માની જોઈ પણ શ્રી હરિબાઈ અને શ્રી હેમ-  
કુંવરભણનની અકિત અદ્વીતીય છે. તમે હંપતિ અને આખું  
કુંદુંબ શુરૂઆતિતમાં તો અનેડ છો. થાડા શુરૂઆતિતનો લાભ  
મને પણ આ રીતે મળશેને. શ્રી ધંટાકરણુની મૂર્તિં તથા  
પ્રતિક્રિયાનો લાભ તો હું જ કહીશ. તેની બધી વ્યવસ્થા તો  
હરિબાઈ! તમારે જ કરવાની છે.' બાધુલાઈએ હરિબાઈને  
જવાબદારી સોંપી દીધી.

શ્રી હરિચંહાઈએ શ્રી મહાલીર સ્વામી હેરાસુરલુના  
દ્રસ્તીએને શ્રી ધંટાકરણુલુની મૂર્તિં અને શ્રી બાધુલાઈની  
ઉદ્ઘારતાની વાત કરી. બધી રક્મ પણ દ્રસ્તીએને સોંપી દીધી.  
દ્રસ્તીએએ આચાર્યશ્રીની સલાહ પ્રમાણે બધી વ્યવસ્થા કરવા  
નિર્ણય કર્યો.

આચાર્યશ્રીએ સંસ્કૃત પાકૃત તેમજ જ્યોતિષ અને મંત્ર-  
શાસ્ત્રના નિષ્ણાત શુરૂઆત રા. શ્રી મોહનલાલ ભગવાનહાસ  
અવેરી-સોલીસીટરને બોલાવી શાસ્ત્રીય અને શિદ્ધપ દ્યષ્ટિએ  
કૃળામય મનોરભ્ય શ્રી ધંટાકરણુદેવની મૂર્તિં કરાવવા યોજના  
કરી. શ્રી મોહનલાલભાઈએ ખૂબ મહેનત કરીને અવેરી  
અવેરચંહાઈને સાથે રાખી મહામંગળકારી મૂર્તિં તૈયાર  
કરાવી, શ્રી ધંટાકરણુદેવની મૂર્તિં એવી તો આક્ષર્ણ, તેજસ્વી,  
મનોહર, કૃળામય અને ભગતી જ્યોત સમી તૈયાર થઈ હતી  
કે હંબરોના મન સુગંધ થઈ જતાં.

શ્રી ધંટાકરણુની મૂર્તિં માટે શ્રી મહાલીર સ્વામીના હંદે-  
શસ્ત્રરમાં નીચેના બાગમાં શ્રી શુરૂ મંહિરમાં સુંદર ગોખ  
તૈયાર કરાવવામાં આવ્યો.

પ્રતિષ્ઠાનો દિવસ નાચી કરવામાં આવ્યો. પણ થાણાના કળામય મંહિરની પ્રતિષ્ઠા હોવાથી ગુરૂવર્યં થાણા પદ્માર્થી. થાણાની પ્રતિષ્ઠા આનંદ ઉલ્લાસપૂર્વક કરાવી શ્રી ધંટાકરણુની મૂર્તિની પ્રતિષ્ઠા માટે આચાર્યશ્રી પાયધુની પદ્માર્થી. પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક કરવવાની શ્રી બાણુભાઈ નાગળ ગણુપતની ભાવના હતી પણ આ દિવસોમાં તેમને જરૂરી કાગે વિલાયત જવું પડ્યું. શ્રી બાણુભાઈએ શુલ્ષ સુહૃત્તે પ્રતિષ્ઠા કરી લેવા શ્રી હરિચંદ્રભાઈને લલામણુ કરી હોવાથી પ્રતિષ્ઠા માટે અહુદી મહેતસ્વ કરવામાં આવ્યો. આચાર્યશ્રીના મંગળ આશીર્વાદથી સં. ૨૦૦૫ ના મહાવદી ૬ ના રેઝ શ્રી હરીચંદ્રભાઈના પિતાશ્રી શ્રી માણેકચંદ્રભાઈએ શ્રી ધંટાકરણુહેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. શ્રી ધંટાકરણુહેવની મૂર્તિની પ્રતિષ્ઠા સમયે આવી જાગતી જયોત સમી તેજસ્વી મૂર્તિના દર્શાન કરી હજરે બહેન-ભાઈઓએ શ્રી મહાવીર સ્વામીના હરેરાસરળને જયનાહોથી જળવી મુક્યું. શ્રી સુખદી સંઘના હૃદયમાં આનંદ આનંદ છવાઈ રહ્યો.

x

x

x

‘હરિભાઈ ! આજ કેમ જરા ઉદ્ઘાસ દેખાઓ છો. !’ આચાર્યશ્રીએ પ્રશ્ન કર્યો.

‘કુપાળ ! નાના મયંકકુમારને ગળે એક હે ગાંડો નીકળી છે. ડોક્ટર ઓપરેશનની વાત કરે છે. ઓપરેશન કરવવા મન માનતું નથી. મારા માતા-પિતાને પણ મયંક માટે ચિંતા થાય છે.’ હરિભાઈએ ચિંતા વ્યક્ત કરી.

‘હરિબાઈ! મયંકની ચિંતા ન કરો. તેને હમેશ સવારના માંગવિકના ટાઇમે આઠેક હિવસ અહીં લાવવો પડશે. પછી તો મંત્રેલું જળ વિધ જશો. તો ચાલશે, આપણું જાગતી જયેતા સમા શ્રી ધંટાકરણુંને તમારી ચિંતા દૂર કરશે.’ આચાર્ય-શ્રીએ ઉપાય હશોંયે.

શ્રી હરિબાઈ તો અનન્ય ગુરુભક્ત હતા. શ્રદ્ધા પણ અજળ હતી. શુરૂદેવ પણ વચનસિદ્ધ હતા. રાત્રિના ઐ અહીં વાગ્યે ધ્યાનમાં એસતા. સવારના માતાંકિયા કરી તુરત પાઠ કરતા અને મંત્રજળ ધણા કાઈ-ખણેનો લઈ જતાં. શ્રી હરિચંહભાઈ ચિ. મયંકુમારને લઈને સવારમાં આવવા લાગ્યા. ગાંડો પણ એને બહલે થાર પાંચ દેખાવા લાગી. એપરેશન કરાવવું પડશે તેમ બધા સલાહ દેવા લાગ્યા પણ હરિબાઈ તો અનન્ય શ્રદ્ધાળું હતા. આચાર્યશ્રીની પાસે હમેશાં પાઠ સાંભળવો અને મંત્ર-જળ વિધ જવું. પૂરા પંદર હિવસ તો નહિ થયા હોય બધાના આશ્રયું વચ્ચે ગાંડો ગળી ગઈ અને મયંક તો નિરોગી બની ગયો. આ ચમત્કારની વાતો જાણી લારે આશ્રયું ફેલાયું. ગુરૂદેવની કૃપાથી મયંકર રોગ ઔષધિ વિના દૂર થઈ ગયો. શ્રી હરિચંહભાઈના વિશ્વાળ કુદુર્ભમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો.

ધન્ય શુરૂદેવ, ધન્ય તપશ્ચયો.





## છેદલો મહેત્ત્સવે

( ૪૬ )

‘કૃપાળુ ! અમારા શ્રી વાલઠેંકર જૈન સંધની ભાવના આપના મંગળમય હસ્તે શ્રી આદીક્ષર જૈન મંહિરમાં યાંચ પ્રતિમાએની પ્રતિષ્ઠા કરાવવાની છે. કૃપા કરી આપ વાલઠેંકર પદ્ધારો. ’ બાણુસાહેબ હોલતચંહલુએ વિનતિ કરી.

‘સાહેબ ! પ્રતિષ્ઠા નિમિત્તે આઠ દિવસનો અહૃત્મહેત્વ શ્રી સંધ તરફથી તથા આઠ દિવસનો મહેત્ત્સવ શ્રી અંધાલાલ કલ્લુભાઈ તરફથી કરાવવાનો છે. આપશ્રીની નિશ્રામાં ઘૂણ આનંદ થશે ’ બાણુ રતનલાલલુએ ૧૬ દિવસના ઉત્ત્સવ વિષે ઉદ્દેખ કર્યો.

‘ભાગ્યવાને ! મારે અહુમની તપશ્ચયો ચાલે છે અને અહુમે અહુમે પારણું ચાલુ રાખવા ભાવના છે. નહિતો હું જરૂર આવત. પ્રતિષ્ઠા મહેત્ત્સવ માટે તો હું ના નજ કહું. ’ આચાર્યશ્રીએ તપશ્ચયોની વાત કરી.

શુરૂદેવ ! આપની દીર્ઘતપશ્ચયોથી તો અમને મંગળ આશીર્વાંડ મળશે. અમારો ઉત્ત્સવ વિશ્રેષ મંગળમય થશે. આપની

સેવાસુષુપ્તા અચે કરીશું. અમને પધાને આપના આગમનથી ખૂબ આનંદ થયો. આપ થોડી તકલીફ વેઠીને પણ જરૂર જરૂર પધારો.’ બાયુસાહેબ હોલતથંહળુએ વિશેષ આશ્રહભરી વિનતિ કરી.

‘સાહેબ ! આપની તથીયત હવે બરાબર રહેતી નથી. આપે જીવનમાં ઘણી ઘણી તપદ્ધયાંએ કરી. હવે ઉમર પણ થઈ. શરીર પણ હવે નબળું હેખાય છે. કૃપા કરી હવે અદુભની તપદ્ધયાં પૂરી કરો. શરીર વિશેષ કથળશે તો પછી ચિંતા થશે.’ ગુલાબમુનિએ પ્રાર્થના કરી.

‘ગુરૂવર્ય ! ગુલાબમુનિ તો આપના અનન્ય ભક્તા છે. સેવા-મૂર્ત્તિ અને શાંતમૂર્ત્તિ છે. એ તો અગ્વાન મહાવીરને જેમ ગૌતમસ્વામી હતા તેમ આપના પ્રાણુભ્યારા છે. પણ તેમની વાત સાચી છે.’ બાયુસાહેબ રતનલાલલુએ પણ ગુલાબમુનિ છુની વિનતિને અનુમેદન આપ્યું.


‘વાલકેશ્વરની પ્રતિક્રિયા સુધી તો તપદ્ધયાં ચાહુ રાખવા આવના છે. શરીરનો તો બરાબર કસ કાઢવો નોઈએ. અદુભ અદુભે પારણું તો કરવું જ પડે છે. અને એ અદુભની તપદ્ધયાંમાં પણ મારી સાધના, ચોગ, જાપ અને પાઠ બધું કેવું નિશ્ચિંતતા અને સંપૂર્ણ શાંતિથી થાય છે ! છતાં શરીર કથળશે તો તો જરૂર વિચાર કરીશ.’ આચાર્યશ્રીએ સંમતિ આપી.

સં. ૨૦૦૬ ના મહા શુહિ બીજના હિવસે વાલકેશ્વર પધાર્યો. શ્રી સંદે ભાવભયું સ્વાગત કર્યું. આભાદવૃદ્ધને આચાર્યશ્રીના પધારવાથી ખૂબ ખૂબ આનંદ થયો. અદુધ-

મહોત્સવની તૈયારી ચાલી. વાલકેશ્વરમાં ૮ હિવસનો ઉત્સવ શ્રી વાલકેશ્વર જૈનસંઘ સમસ્ત તરફથી તથા ૮ હિવસનો ઉત્સવ શેડ અંબાલાલ લલુલાઈ તરફથી થયો. હંમેશાં વિધવિધ રાગરાગણી સાથે પૂજાઓ ભષ્યાવાતી. ભાવનાઓ એસ્તી. વાલકેશ્વરના ફેરાસરે મુંબઈથી હબદારી બાઈ-ખણેનો દર્શનાથે ઉમટી આવતા હતા.

મંગળ સુહૂતો પાંચ પ્રભુજીની પાંચ પ્રતિમાણ પધરાવવાની માંગલિક કિયા કરાવવામાં આવી. આચાર્યશ્રી જીન-અદ્ધિસૂરિલુએ પ્રતિક્રિયા કરાવી, ઉપજ પણ સારી થઈ. આનંદ આનંદ છવાઈ રહ્યો. આચાર્યશ્રીને થોડા સમય વિશેષ સ્થિરતા કરવા આગેવાનોએ વિનતિ કરી પણ શ્રી મહાલીર સ્વામીના ફેરાસરના દૂસીઓની આગહભરી વિનતિને માન આપી પાયુની પખાંઓ. વાલકેશ્વરનો મહોત્સવ છેલ્દો ૯ હશે તેની કેને કદ્યપના હતી ! પણ અરેખર આચાર્યશ્રીના જીવનમાં આ ઉત્સવ છેલ્દો ૯ ગણ્યાયો.





## આખરી સંદેશ

( ૪૭ )

‘ સાહેબ ! આપની તણીયત સારી નથી રહેતી. તાવ પણ થોડા આવે છે. આપ શક્તિ આવે તેવી કોઈ વસ્તુ પણ લેતા નથી. કૃપા કરી થોડા હિવસ આપ માટુંગા પધારો. અમારી બધાની જીવના છે. હવાફેરથી તણીયત સારી થઈ જશે. અમને આપની સેવાભક્તિનો લાભ મળશે.’ હરિયંહભાઈએ વિનતિ કરી.

‘ હરિભાઈ ! વાલકેશ્વરથી આંચ્યા પછી અશક્તિ તો રહેજ છે અને તાવ રહે છે. ડા. પુનમચંદ તો હંમેશાં આવે છે પણ તેમની હવા કામ કરતી નથી.’ આચાર્યશ્રીએ પરિસ્થિતિ જણ્ણાવી.

‘ કૃપાળુ ! આવી તણીયત હોવા છતાં હજુ પણ આપ રાત્રિના ૩-૪ વાગે ઉડી જાઓ છો. ધ્યાન અને જાપ તો ચાલુજ હોય છે. સવારના સાત સુધી પાઠ ચાલે છે. તાવ અને અશક્તિમાં આ વણુ કલાકનો માનસિક પરિશ્રમ લારે ગણ્ણાય. શુલાણમુનિલુ મહારાજને જાપ અને પાઠની જવાબદારી આપો તો થોડા વિશેષ આરામ મળે.’ હરિયંહભાઈએ પ્રાર્થના કરી.

‘હરિબાઈ! એ ધ્યાન, જાપ અને પાઠથી તો મને આપો હિવસ રકૂતિં અને આનંદ રહે છે. સ્વારના તો મને કાંઈ જણું નથી. તાવ વગેરે ૧૦ વાગ્યા પછીજ ચડે છે અને આપો હિવસ રહે છે.’ પ્રાતઃકાળમાં તો કોણ જણે કયાંથી શક્તિ આવી જય છે. શાસનહેવની કૃપા છે કે હજુ સુધી શાન ધ્યાન ને જ્યથી તેમજ પાઠમાં કોઈ હિવસ વિક્ષેપ નથી પડતો. અને તેજ મારે માટે આત્મ શાંતિ અને આત્મ લક્ષ્મી છે. હવે તો માદુંગા સુધી આવી શકાયે નહિ. અહીં બધા ભક્તિ કરે જ છે.’

વાતકેશ્વરથી આંદ્યા પછી મહા શુહિ ૧૪ નો ઉપવાસ કર્યો. પૂર્ણાંમાંએ પારણું કર્યું. ગોચરી વખતે, વાપરી શક્તા નહિ. પણ તેજ વખતે સખત ઢંડી લાગી. આપો હિવસ તાવ રહ્યો. રાત્રિના ધ્યાન માટે ઊઠયા ત્યારે તાવ નહોતો. પણ સ્વારના તાવ ચડી આંદ્યો. આમ બનતું ચાલયું. ડા. પુનમચંદ-ભાઈ શાહની હવા શરૂ કરી. શ્રી હરિચંહભાઈ માદુંગા બધ જવા વિનતિ કરી ગયા પણ પાયધુનીના ભાઈ બહેનો અને શ્રી મહાવીરસ્વામી દહેરાસરળના ટ્રસ્ટીઓએ ગુરુ મહારાજની સેવાસુશ્રુતા-હવા વગેરેથી પૂણ્યઘૂલ સેવા કરી. શેઠ દામજ જેઠા હાશીયાર હોમીયોપ્થેયિક ડાક્ટરને તેડી લાંદ્યા.

ડાક્ટરની દ્વારથી તાવ ગયો નહિ. અશક્તિ વધતી ચાલી. દેશી વૈધને તથીયત બતાવવાની ટ્રસ્ટીઓની ભાવનાથી શ્રી જાધવજીભાઈ ત્રીકમજ આચાર્યને બોલાંદ્યા. કષ્ટપ્રધાન તાવનું નિહાન કર્યું. તેની પણ ૨૧ હિવસ સુધી હવા કરી પણ ઝાયદો જણ્યાયે. નહિ. ડા. મંગળદાસ મહેતાને બોલાવવામાં આંદ્યા

પણ તેમણે ન્યુભોનીચા જણાંયો. તેની પણ હવા કરી. ખાંચ ક્ષાયડો થયો નહિ. બધા ચિંતાતુર થઈ ગયા. શરીર ઘસ્તાતું ચાલ્યું. સેવાભક્તિમાં તો બધા ખડે પગે તૈયાર હતા. સેવા-મૂર્તિં શિષ્યરત્ન શુલાખમુનિલુએ તો ગુરુદેવની સેવા અનન્ય ભક્તિપૂર્વક કરી.

‘ શુલાખ ! તમે રાત હિસ્સ ઉલાગરા કરી મારી સેવાભક્તિ કરો છો. પણ તમારી તથીયત પણ કયાં સારી રહે છે ! તમે થાડો ધણો આરામ લ્યો. મારો મંહવાડ તો ચીકણો છે. લાંધો ચાલશે. તમારી તથીયત બગડશે તો શું કરીશું.’ આચાર્યશ્રીએ પોતાના શિષ્ય માટે ચિંતા ફર્શીવી.

‘ ખારા ગુરુદેવ ! આપની સેવાભક્તિથી ને આનંદ થાય છે. તે બીજા કશાથી નથી. હું તો મારી જલને ભાગ્યથાળી માનું છું કે આપની સેવાનો લાભ અહેનિશ મને મળે છે. મને તો શું થવાનું છે. આપ મારે માટે ચિંતા ન કરશો, આપની તથીયત સારી થાય તો મારે તો પ્રભુ ! આપના વિના બિને કર્યો આખાર છે ! શુલાખ મુનિએ આરજી કરી.

‘ શુલાખ ! તમે સેવામૂર્તિ છો. તમે જીવનભર મારી સેવા જ કરી છો. આ શરીર તો જીણું થયું. હવે તેને બદ્વિવાનો સમય આવી લાગ્યો છે. મને તો પૂર્ણશાંતિ છે. આત્માનંદ માર્દ ધેય છે. ગુરુદેવોની મારા પર પૂર્ણકૃપા છે. વીર ધંટા-કરણુણ મારા હૃદયમાં છે. હવે મને આ શરીરનો ભરણોસો નથી, તમે ગુરુદેવ શ્રી મોહનલાલજી મહારાજના નામને ઉજા-વળ કરનો. જૈન શાસનના ઉધોત માટે કલ્યાણકારી કાર્યો કરશો.’ ગુરુદેવે આખરી સંહેચ આપ્યો.

‘ શુક્રહેવ ! અમને મંગળ આશીર્વાહ આપો ॥ શ્રી હરિચંહ-  
બાઈ તથા શ્રી હેમકુરખેણે આશીર્વાહ માગ્યા ॥

‘ લાગ્યવાન દંપતી ! તમે તો બડલાગી છો, તમારી ધર્મ  
ભાવના અને શુક્રલક્ષ્મિ અન્નેડ છે. તમારા કુદુંબ ઉપર સહાયે  
શુક્રપા રહેશે. તમારી યશકીર્તિ દિનપ્રતિહિન વૃદ્ધિ પામશે.  
તમે કલ્યાણુકારી કામો કરશો ॥’ શુરૂહેવે સુધાલર્યા આશીર્વાહ  
આપ્યા.

‘ કૃપાળુ ! શ્રી મહાવીરસ્વામીના દહેરાસર અને ઉપાશ્રય  
તથા જ્ઞાનલંડારની સુંધરસ્થા અને તેની પ્રસિદ્ધિનો યશ  
આપશીને છે. આપે કૃપા કરી વખતો વખત ચાતુર્મોસ કરી  
અનેક પ્રશ્નોને ઉકેલ કરાવી અમારા વહીવટને સરળ ઘનાવવા  
ને પ્રેરણાઓ કરી છે તે ભૂલી શકાય તેમ નથી. આપ બીજુ  
કંઈ સૂચના કરો તો અમને વિશેષ માર્ગદર્શન મળશે ॥’ શ્રી  
મહાવીરસ્વામી દહેરાસરના દ્વસ્તીઓએ વિનિતિ કરી.

‘ લાગ્યશાળીએ ! તમે ભધા ઐક્યતા અને સહકારથી  
સુંદર કાર્ય કરી રહ્યા છો. તમારો વહીવટ સુંદર છે. તમે ભધા  
અનન્ય શ્રદ્ધાળુ અને શુક્રપ્રેમી છો. દહેરાસરલુની ને પ્રતિષ્ઠા  
છે તેમાં વધારો કરશો. ઉપાશ્રયમાં પણ વ્યાખ્યાનાદિનો  
પ્રભાંધ ચાલુ રાખશો. જગતી જ્યોત સમા શ્રી ધંટાકરણુલુની  
ભૂતીની પ્રતિષ્ઠાથી તો લીલાલહેર થઈ રહેલ છે. પૂજ્ય શુક્ર-  
હેવેના જ્યંતી ઉત્સવો ઉજવવાની પ્રેરણું ચાલુ રાખશો.  
અંથ-લંડાર વ્યવસ્થિત રાખી તેનો વિશેષ લાભ કેવાય તે  
માટે યથાશક્તિ પ્રયાસો કરશો. ધર્મના ઉધોતના કાર્યોમાં  
હંમેશાં જગૃત રહેશો. સુનિવચોની સેવાલક્ષિત વિષે તો મારે

શું કહેવાતું હોય ! તમે તો સેવાકાવથી રંગાચેલા છો જેવો ચોક્કો વહીવટ છે તેવો જ રાખશો—રખાવશો અને તમારામાં ને સંગડન, એક્યતા તથા કુશળતા છે તે હંમેશાં જળવી રાખશો.’ ગુરુવયે આખરી સંદેશ આપ્યો.

‘મથેણુંબામિ !’ ગુરુહેવ સુખશાતા છે કે ! હવે તથિયત કેમ રહે છે !’ શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્લ લાયધેરીના દ્રસ્ટીઓએ આચાર્યશ્રીને સુખશાતા પૂછી.

‘ગુલાખમુનિની અનન્ય સેવા અને શ્રી સંધની પ્રેમભક્તિથી જેટલા દ્વિવસ આ શરીરની લેણુદેણ હશે તેટલી લેવાશે. ૮૨ વર્ષના આ શરીરને હવે થાક પણ લાગેને ! હવે તો જરૂર ઐળીયું બદલવું રહ્યું. ભાગ્યવાનો ! તમે તો બધા સુખ, શાંતિ અને સમૃદ્ધિ પાંચા છો. વીતરાગ જગવાન જેવાતું શરણ પાંચા છો. ધર્મઉદ્ઘોત-જ્ઞાનપ્રચાર અને સમાજતું કુલ્યાણું એ હાનવીરાતું પરમ કર્તાંય છે. ધર્મ વિના તો પ્રાણીમાત્રને. ઉદ્ધાર નથી. જ્ઞાન એ કલ્પવૃક્ષ છે. અને સમાજ-જૈનસમાજનો મધ્યમ-વર્ગ જ્યાંસુધી રોઠી અને રોળુ-કામ અને જીવનનિર્ધિહના સાધન વિનાના હશે ત્યાંસુધી તમારી હાનવીરતા, ગગનચુંભી મંહિરો, મહોત્સવો કે મહાકથેણ શા કામનાં ? જૈનસમાજ હાનશર છે. પૂર્વ પુરુષોનો લભ્ય વારસો તમને મળ્યો છે. સમાજને ધર્મના ભૂષણસમા વીર વસ્તુપાળ-તેજપાળ, દેશભક્ત ભામાશાહ, જગતના પાલનહાર જગતુશાહ, વીર મંત્રીવર વિમળશા, કર્મચંદ્ર વછાવત તથા સહા સોમણ વગેરે મહા-પુરુષોના તમે સુપુત્રો છો. સમાજ હુઃખી હશે, ભૂખ્યો હશે, અજ્ઞાત હશે અને રોઠી-રોળુ વિનાનો હશે તો ધર્મનો

ઉદ્ઘોત-સમાજનો ઉત્કર્ષ કયાંથી થશે? તમે સમાજના ભાગ્ય-શાળી નેતાઓ અને ધર્મવૈયાચ્છ્રાણીઓ છો. એક એક હાનવીર એક એક સમાજ-કુલયાધુ-જ્ઞાનપ્રચાર અને શિક્ષણપ્રચારતુ' કામ સંભાળી વધો તો આવતીકાવનો સમાજ બળવાન, ખમુદુ અને શક્તિશાળી બને.' આચાર્યશ્રીએ આગેવાનોને સમાજના સર્વાંગી વિકાસ વિષે અમર સંદેશ આપ્યો.

'ગુરુહેવ! આપની સુધા બરી વાણી અમારા હૃદયમાં કોતરાઈ ગઈ છે. અમે અમારાથી શક્ય શાસનઉદ્ઘોતના અને સમાજ ઉત્કર્ષના કાર્યમાં સંકિય ફાળો આપીશું.' શ્રી શેઠ રવળુભાઈ સોજપાલ જે. પી.એ આચાર્યશ્રીને ખાત્રી આપી.

'રવળુભાઈ! એક ઉપયોગી અને મહત્વતુ' કામ બાકી રહી જાય છે. પૂજ્ય મોહનલાલજી મહારાજશ્રીનો સુંબદ્ધ ઉપર ધર્ષે। ધર્ષેનું ઉપકાર છે. તેમના જેવા પ્રભાવશાળી, શાસનની ધગશવાળા મહાપુરુષેં એછા ફેખાય છે. તેમના નામની સેન્દ્રા લાઈફ્ટ્રેરી જૈન સમાજનુ' ભૂષણુ છે. એ જ્ઞાનતુ' એક માંહિર છે. તમે જાણો. છો આપણે બધાયે પ્રયાસો. કરીને મોદુ' ઝંડ પણુ કર્યુ' છે. અને તમારી દૂર્દીઓની જવાખારી વિશેષ છે. ભારી અંતિમ જાવના એ છે. કે વહેલામોડુ' એ જ્ઞાનમાંહિરતુ' ભંય મકાન તૈયાર થાય તો જૈન સમાજની તે શોભા બની રહેશે.' આચાર્યશ્રીએ ચોતાની અંતિમજાવના હશીવી.


'ગુરુહેવ! અમે દૂર્દીઓ તે વાત બરાબર જાણીએ છીએ. આપની અંતિમજાવના પૂરી કરવા અમે પ્રયત્નશીલ રહીશું. ઝંડ તો છે અને મકાન માટે જગ્યા મેળવવાના પ્રયાસો. પણ

ચાહે છે. સમયનો પરિધાક થશે એટલે કંય મકાન તૈયાર થશે. આપ નિશ્ચિંત રહેશો.' શ્રી કાન્તિલાલલાઠ દુષ્પરલાદે આચાર્યશ્રીને નિશ્ચિંત કર્યો.

આચાર્યશ્રીએ પોતાનો આખરી સંદેશ પોતાના પ્રાણ ખારા શિષ્ય ગુદાખમુનિ મહારાજને, શ્રી મહાવીર દહેરાસર-ળના દુસ્તીએને તથા શ્રી મોહનલાલ જૈન સેન્ટ્રલ લાઇબ્રેરીના દુસ્તીએને સંભળાવ્યો. આચાર્યશ્રીની સૌભ્યતા, પરમશાંતિ, ચેણહણિ, તપશ્ચિર્યા, ત્યાગ, ઉદ્ધારતા જૈન સમાજના કલ્યાણ માટેની ધગશ, શાસનઉંડોત માટેની તમન્ના, તેમની વાણીમાં ધખકતાં હતાં. આચાર્યશ્રીની સુધાકરી વાણી અને નૂતન વિચારસરણીની બધા ભૂરિ ભૂરિ પ્રશંસા કરતા હતા.

ધન્ય ત્યાગ, ધન્ય તપશ્ચિર્યા.





## ધૂન્ય તપશ્ચિર્યા

( ૪૮ ) .

‘સાહેબ ! આ થોડી હવા વાપરશો ?’ શુદ્ધાભમુનિએ પ્રાર્થના કરી.

‘શુદ્ધાબ ! હવે શરીર થાકૃયું છે. હવા તો ધણી કરી. તમે તો અહોરાત્ર ખડે પગે તૈયાર જ છો પણ હવે તો આ કાયાનો શો ભરાસો !’

‘શુદ્ધાબ ! એમ ન કહો. આપને આરામ થઈ જશે. થોડી થોડી હવા દ્યો, જે અનુકૂળ પડે તે પેય દ્યો. શરીરમાં થોડી થોડી શક્તિ રહેશે તો જરા શાતા રહેશે. શાંતિ રહેશે.’ શુદ્ધાભમુનિએ ગઠગઠબાવે વિનિતિ કરી.

‘શુદ્ધાબ ! મથ્યેખુ વંદ્ધામિ ! શાતા છે સાહેબ !’ શ્રી હરિશ્ચિંહભાઈ તથા શ્રી હેમકુવરભડેન, શ્રી હરિભાઈના બાતથા અહેને વંદ્ધા કરી

‘ધર્મલાભ !’

‘ સાહેબ ! મારા પૂજ્ય બા, મારાં બહેન, હું અને તમારી આવિકા ચારેની ભાવના વરસીતપણી થઈ છે. કૃપા કરી પચચાણું આપો. અને મંગળ આશીર્વાદ આપો.’ શ્રી હરિચંહ-ભાઈએ વિનિતિ કરી.

‘ હરિભાઈ ! ધન્ય ધન્ય ! તમારા બા તો મહાબાળયશાળી અને જખરાં છે. પગની તકલીફ હોવા છતાં પહેલાં વરસીતપ કર્યો હતો. અને આ બીજે વરસીતપ કરવાની ભાવના થાય તે તો બહુજ ઉત્કૃષ્ટ. સમરથ બહેન પણ બાની સાથે તપદ્ધ્યાં શરૂ કરે છે. તે ઘણું જ પ્રશંસનીય છે.’

‘ સાહેબ ! આપતા મંગળ આશીર્વાદથી મહા પાવનકારી વરસીતપ થઈ જશે અને તેજ સાચું ભાતું છે ને !’ શ્રી હરિભાઈના બાંધે ચોતાની ભાવના પ્રદર્શિત કરી.

‘ ભાળયશાળી ! તમારા બા અને બહેન તો વરસીતપ પૂર્ખું કરશે. પણ તમે રહ્યા વ્યવસાયી. ચેઢીના કામની વિશેષ જવાભાની તમારા ઉપરજ છે. વળી કોઈ કોઈ વખત દિલહી સુધી પણ જવું પડે. વળી વરસીતપ તો મહાન તપ ગણ્યાય. ૧૩-૧૪ મહીના સુધી ચાલે અને તેમાંથે ગરમીની મોસમમાં તકલીફ રહેશે.’ આચાર્યશ્રીએ વ્યવહાર સુધીકેલી દર્શાવી.

‘ શુરૂદેવ ! આપ તો જણો છો. હું જ વાગે તો ઉઠી જઉં છું. નોકારવાળી ગણીને સ્નાન કરી પૂલ કરવા જઉં છું. લા લગભગ તો ત્યાંજ થાય છે. હું લગભગ ૧ વાગે ઓઝીસે આતું છું. પાંચ વાગ્યા પહેલાં નીકળી જઉં છું. વળી વરસીતપ જેવા પરમ પાવનકારી તપને માટે સમય મળીજ રહેશે.

આપના મંગળ આર્થીવીહથી તપશ્ચયો નિવિદને સંપૂર્ણ થશે.' હરિચંહલાદુએ તપશ્ચયો માટે આશહ ફર્ણોંયે।

'પણ અમારાં શાવિકાને તો સુશ્કેલી રહેશે. તેમને ગૃહ કાર્યની જવાબદારી. બાળકોને શાળાએ મોાછવા. પૂજય માતા પિતાની પણ સેવા કરવાની. અતિથિ અને સ્નેહીજનોને પણ સંભાળવા અને વ્યવહારમાં ઉભા રહેલું. વળી તેમની તથીયત પણ કયાં સારી રહે છે!' આચાર્યશ્રીએ શ્રી હેમકુંવર બહેનને માટે ચિંતા વ્યક્ત કરી.

'સાહેબ! મારા પણ લાવ છે. આવી સાથે તપશ્ચયો કરવાની અમોદી તક કયારે મળે. બાળકો તો માટાં થયાં છે. ચિ. કુષ્ણા અને ચિ. મધુબહેન પણ મને મહા કરે છે. પૂજય બા અને બાપાના તો આર્થીવીહ મળી ગયા છે. વળી પૂજય બા તેમજ મારા ઠંડાલાં નષુંદ, બધાનો લાવ ડોવાથી મારા ભાવ પણ લગ્યા અને મેં પણ નિર્ણય કર્યો. આપના આર્થીવીહથી વરસીતપ પૂર્ણ થઈ જશે.' હેમકુંવર બહેને પોતાની ભાવના વ્યક્ત કરી.

'જહાસુખમ्! તમારી ભાવનાએ ઉચ્ચ છે. મારા મંગળ આર્થીવીહ છે. નિવિદને આ પાવનકારી પવિત્ર તપશ્ચયો પૂર્ણ કરો અને પુષ્ટયશાળી અનો.

'ધન્ય તમારી ભાવના! ધન્ય તમારું બડલાગી કુદુંય!'  
આચાર્યશ્રીએ મંગળ આર્થીવીહ આપ્યા.





મૃત્યુ મરી ગયું રે લોલ

( ૪૬ )

યૈત્ર મહિનો તો ખૂબ કાચ ભર્યો ગયો। પણ દેરી ઔષધીથીજ જરા ઠીક રહ્યું પણ ભૂખ ચાલી ગઈ. પેય માટે પણ ઈચ્છા થતી ન હતી. પછી ઔષધ માટે પણ ઈચ્છા થતી નહિ. વૈશાખ મહિનો આવ્યો ને અશક્તિ વધી. પથારીમાંથી એઠા થવામાં પણ તકલીફ થવા લાગી. અજ્ઞનો તો ત્યાગજ કરી દ્વારા. શુલાખસુનિની અતન્ય લક્ષ્ણ અને સેવાથી જરા શાંતિ રહેતી પણ શક્તિ તો હતીજ નહિ. વૈશાખની ચૌદશ-અમાસ બહુ લારે ગયાં. હીપક કયારે જુઝાઈ જશે તેમ થતું હતું. માદુંગા, સુલુંડ, થાણ્યા, પોરીવલી બધેથી લક્ષ્ણનો શુરૂવર્યની સુખશાતા પૂછવા આપતા હતા. શુરૂદેવ આંખોથી અમી ભરી દ્વિદ્વારા બખાને ધર્મવાસ આપતા હતા.

ગુરુહેવની નિર્મણ, પ્રશાંત, પ્રભાભરી કુંતિ અને તેજસ્વિતા વધતાં જતાં હતાં. જાપ તો ચાલુ જ હતો. અનન્ય ગુરુભક્ત ગુલાખમુનિ તો ગુરુહેવની આખરી ઘડીઓ જેઈ જેઈને એ અશુભિહુઓને અટકાવી સેવામાં લીન થઈ જતા. જેઠ શુદ્ધ એકમ થઈ ને ચિંતા ઓછી થઈ. ભારે હિવસો તો ગયા. હું પણ ઓછું થઈ ગયું. જરા ઉકાળો. પણ વાપયો.

ધીજના હિવસે વળી તથીયત બગડી. ડેક્ટર પુનમચંદ્રભાઈ ડેડી આવ્યા. શ્રી મહાવીરસ્વામીના ડેરાસરના ટ્રસ્ટીઓ આવી પહેંચ્યા. માદુંગાથી શ્રી હરિચંદ્રભાઈ તથા શેઠ રવજીભાઈ પણ આવ્યા. અપોરના જરા નિદ્રા આવી ગઈ અને શાંતિ જણ્ણાઈ. ધીજની રત્નિ ભારે વસમી હતી. અરિહંત-અરિહંતના જાપ ચાલુ હતા. ડેં શાંતિ ડેં શાંતિના મંત્રોચ્ચારે. ધીમા ધીમા ચાલતા હતા. દીપક ખૂઝાવાની ઘડીઓ આવી લાગી હતી પણ સવાર થયું અને થોડી શાતા લાગી, પણ તે ક્ષણિક હતી.

ત્રીજનો આણો. હિવસ અશાતા રહી. ભક્તજનો સેવા માટે તૈયાર હતા. પણ તથીયત બગડતી ચાલી. ગુલાખમુનિ મહારાજે ધીરજપૂર્વક અહતશાંતિ, ધીજા સ્તોત્રો તથા હસ આરાધના અને પદ્માવતી વગેરે સંભળાવ્યા, તે શાંતિપૂર્વક સંભળયા. આચાર્યશ્રી મનમાં જાપ જપતા હતા. છ વાગે વધારો લાગ્યો. તે જ સમયે ચાર આહારના પચ્ચાખખાણ કરાવ્યા. બરાબર છ ને ચાલીશ મીનીટે હંસદો ઉડી ગયો.

બાતથ્રદ્ધચારી, દીર્ઘતપસ્વી, ચારિત્ર રત્ન, પૂષુગરાશિ, મહાપ્રતાપી, વચ્ચનસિદ્ધ આચાર્ય શ્રી લુનત્રદિસ્ત્રુતિ અનન્ય

ગુરુભક્તા શાંતમૂર્તિ શુલાખમુનિ, સુનિશ્ચી રત્નાકરમુનિ, ક્રદ્ધાનિષ  
શ્રાવક સમૃદ્ધાય અને જૈન સમાજના હંજરેને અશ્રુ સારતાં  
છોડી સ્વર્ગે સીધાંબા.

મુંખાઈ અને પરામાં વીજળીવેગે સ્વર્ગવાસના સમાચાર  
પહોંચી ગયા. શ્રી હરિચંદ્રાઈને તો ટેલીક્રોન સાંલળી આધાત  
દાખલે. હંજરે સ્ત્રી-પુરુષે ગુરુહેવના દર્શાનાર્થે ઉમટી આવ્યા.  
શ્રી મહાવીરસ્વામીના દહેરાસરલુનો ઉપાશ્રય માનવ મેહનીથી  
ઉભરાઈ રહ્યો. રાત્રિના અગ્યાર વાગ્યા સુધી સ્ત્રી-પુરુષેનો  
ધ્રસારો ચાલુ રહ્યો.

પ્રાતકાળથી થાણ્યા, સુહુંદ, માહુંગા, ધાટકેપર, ચેમણુર,  
ભાયખાલા, અધેરી, શાંતાકુઝ, બોરીવલી, મરીનલાઈન, ડેટ  
અધેરી હંજરે સ્ત્રી-પુરુષે દર્શાનાર્થે ઉમટી આવ્યા.

સાડાકથા વાગે પૂજયપાદ આચાર્ય પ્રવરના દેહને જરીયાન  
પાલખીમાં પાલનપુર નિવાસી શેઠ હીરાચંદ રાયચંદ ભણુશાળીએ  
રૂ. ૪૫૦ ની બોલીથી પદ્ધરાંબા. હંજરેની માનવ મેહનીવાળી  
ભાવ્ય સમશાન યાત્રા નીકળી. ગુરુહેવના દર્શાનાર્થે બંજરે અને  
અટારીએ તથા અગારીએમાં સ્ત્રી-પુરુષેની લીડ જમી હતી.  
બાહેર રસ્તાએ ઉપર થઈને પાલખી વાતકેશ્વર ખાલુ ગંગા  
પર લાવવામાં આવી. સુખડનો મોટો ઠગ થઈ ગયો. ચંહનની  
ચિત્તા ઉપર ગુરુવર્યને દેહ મૂકવામાં આવ્યો. અનન્ય ગુરુભક્તા  
શ્રી હરિચંદ્રાઈ માણેનુક્યાંહે રૂ. ૬૫૦)ની બોલીથી ગુરુહેવના  
દેહને અગિનસ્કટાર કર્યો. બધાની આંખો અશ્રુબિંહુઓથી  
છલકાઈ ગઈ.

હા ! હા ! પુષ્યરાશિ શુરૂહેવ સ્વર્ગ સીધાવી ગયા. એ પ્રશાંત મુખાકૃતિ, ચોગમૂર્તિં, દીર્ઘતપસ્વી, પુષ્યપ્રતાપી હુલે કથાં જોવા મળશે ! હા હેવ ! તારે પણ એ ચોગમૂર્તિંની જરૂર પડી છે શું ! ધન્ય લુલા ! ધન્ય ત્યાગ ! એવા ઉદ્ગારો વાતાવરણુમાં પ્રસરી રહ્યા. આચાર્યશ્રીના જયનાહોથી આકાશ શુંલુ ઉઠયું. હજારો ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓએ શુરૂહેવને અંજલી આપી.

શ્રી મહાવીરસ્વામીના હલેરાસરના ઉપાશ્રે આચાર્યશ્રીના અનન્ય શુરૂભક્ત શાંતમૂર્તિં મુનિશ્રી શુલાભમુનિએ શાંતિ સંભાવી. ઉદ્ઘાસ હુદ્ધે બધા વિભરાયા.

શુરૂહેવના સ્વર્ગવાસના સમાચાર હેશોહેશ પહેંચી ગયા. જૈન શાસનનો તેજસ્વી દીપક બૂઝાઈ ગયો. જૈન સમાજના જ્યોતિર્ધરેમાંથી એક જ્યોતિર્ધરની ન પૂરાય તેવી ઓટ પડી.

ત્રણેકમાસ બિમારી રહી પણ કોઈ હિસ્સ મોઢામાંથી ઉંચાંકાર કર્યો નથી. સહનશીલતાની મૂર્તિં સમા અરિહંત અરિહંતનો જાપ જપતા જપતા હેઠના કષ્ટ હેઠે સહવાના છે તેમ માનીને શાંતિપૂર્વક મૃત્યુની રાહ જોઈને તૈયાર જ હતા. અને આવા ભાગપ્રદ્યારી, દીર્ઘતપસ્વી ચોગીને મૃત્યુ શું કરી શકે. આવાં સિદ્ધ શુરૂખને માટે તો મૃત્યુ મરી ગયું રે લોલ થઈ પડ્યું.

શુરૂહેવની સેવાસુશ્રૂષા અનન્ય શુરૂભક્ત શાંતમૂર્તિં શુલાભમુનિએ તો અહોરાત કરી પણ શ્રી સુંબર્ધના મહાવીરસ્વામીના હલેરાસરના દ્રસ્તીએ, શ્રી જોડીલુનો શ્રી સંધ, શ્રી હરિચંદુરાઈ

માણેકચંહ, શ્રી કેશવલાલ દ્વારાટાઈ જવેરી, પાટણપુર નીવાસી શ્રી ચીમનલાલ પારેખ, બાધુ રતનલાલજી તથા શેડ રવીલાલભાઈ શાન્તીલાલ, શ્રી આશકરણુભાઈ, શ્રી નાગરહાસ-ભાઈ તથા શ્રી અગવાનહાસભાઈ, શેડ હીરાચંહ લણુશાળી તથા શ્રી તેજરાજજી તથા શ્રી માણેકચંહભાઈ થાવર તથા ચંહલાલ પટવા તથા શ્રી રાયચંહભાઈ કુંગરસી તથા શ્રી તલકચંહભાઈ ઘોધાવળા, અંભાતાનીવાસી શ્રી ચીમનલાલ ડી. શાહ, પાટણ-નીવાસી શ્રી ડાદ્યાભાઈ છગનલાલ, શ્રી ચુનીલાલભાઈ ખાંડવાળા, શ્રી કુંગરશીલભાઈ કર્ચી, શ્રી ઘાટકોપરવાળા મોહનભાઈ, શ્રી પુનમચંહભાઈ ડેકટર, શ્રી લલલુભાઈ છગનલાલ વીગેરે ધણા ધણા ભાઈઓ તેમ જ અન્ય બહેનોએ વ્યાપાર અને ગૃહસ્થીના કામ તેમ જ લક્ષ્મીનો મોહ છોડી શુરૂહેવની સેવામાં જે સહ-કાર શુરૂભક્તિ ભાવે આપ્યો છે તે અત્યંત પ્રશાંસનીય હતો. ઉપરાંત સુરતનીવાસી શ્રી જવેરચંહભાઈ કેશરીચંહ જવેરી તથા શ્રી જવેરચંહભાઈ ભવાનજી કર્ચીનો ઝાળો પણ સુંદર હતો.





## શ્રદ્ધાજલિ

( ૫૦ )

જૈનસમાજના મહાન તપસ્વી, પ્રભાવિક, ચોગદીપક, સિદ્ધ-  
વચની, શાંતમૂર્તિ આચાર્ય શ્રી લુનજ્ઞિસ્તૂરીખરના સ્વર્ગ-  
વાસના દેશ દેશાંતરમાં સમાચાર પહેંચી ગયા અને શ્રદ્ધાં-  
જલિના સમાચાર તારો અને પત્રોદ્વારા આવવા લાગ્યા. જગ્યાએ  
જગ્યાએ શોંક સભાએ ભરવામાં આવી. આચાર્યશ્રીલુની લુણ-  
પ્રભા અને લુણકાર્યને અંજલિ અપાઈ. મુંબદ્ધમાં શ્રી મહાવીર-  
સ્વામીના જૈન ઉપાશ્રયમાં અનન્ય શુરૂબક્તા, શાંતમૂર્તિ મુનિરાજ  
શ્રી શુદ્ધાખમુનિલુના અધ્યક્ષસ્થાને સભા ભરવામાં આવી કંબિ  
લોગીલાક રતનચંડે શુરૂદેવની વિરહ-વેહના સંભળાવી. સેવક  
પણ તે સમયે મુંબદ્ધમાં હતો ( કુલચંહભાઈ હોશી ). સેવકે  
શુરૂદેવના મુંબદ્ધથી સુરત સુધીના અનેક ધર્મ કલ્યાણના ડારો

તેમજ પૂજ્ય શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરીને સમૃદ્ધ ઘનાવવાની શુરૂદેવની અંતિમ ધ્યાનને મૂર્ત્તસ્વરૂપ આપવા અનુ-રોધ કર્યો હતો તેમજ સંગठનકારા જૈનસમાજનો સર્વાંગી ઉત્કર્ષ ચાખવા હર્દીભરી અપીલ કરી હતી. શ્રી લાધ્યાંહલાઈ નગીનહાસ અવેરીએ શુરૂવર્યના પોતાની દસ વર્ષની ઉભર હતી : ત્યારથી આજસુધીના જીવનપ્રસંગો રઘુ કર્યો હતા. શ્રી લલ્લુલાઈ કરમ-ચંહ દ્વારે શુરૂવર્યની ઉદ્ઘારતા, સહિષ્ણુતા અને દીર્ઘતપશ્યાંને અંજલિ આપી હતી. શ્રી મોહનલાલ દીપચંહ ચોકચીએ આચાર્યશ્રીના અનેક ધર્મકાર્યો અને જૈનસમાજમાં તેમના જેવા સમલાવી આત્માચોની પડતી જતી જોટ માટે ઉલ્લેખ કરી જૈનશાસનના ઉદ્ઘોત માટે રથનાત્મક કાર્ય કરવા કટિબદ્ધ થવા હાકલ કરી હતી. શ્રી રતિલાલ વેલજી શેડે શુરૂદેવના પ્રેમ લર્યા ઉદ્ઘાર હૃદયની અને શ્રીમંત-ગરીબ-બાળક-કે યુવાન ફરેક ગ્રત્યે સમાનલાવ તેમજ દીર્ઘતપશ્યાં અને શાસનના કલ્યાણ માટેની ધગશ વગેરે હશોંવી તેમના જેવા મહર્ષિની જોટ કયારે પૂરાશે ! તેમ જણ્ણાંયું હતું.

સેવાભાવી સુનિશ્ચી શુભવિજ્યલુચે તેમના પોતાના પ્રસંગો હશોંવી શુરૂદેવના ઉદ્ઘાર હૃદયની અંધી કરાવી હતી. સુનિરાજશ્રી જીનલદ્રવિજ્યલુચે શુરૂમહારાજની શાનપ્રચારની અંખના તેમજ પોતાના શુરૂદેવ શ્રી મોહનલાલજી મહારાજના સંદેશને ગામેગામ પહેંચાડવાની તેઓશ્રીની તમજા જણ્ણાવી અંજલિ આપી હતી. છેવટે શુરૂદેવના અનન્ય શુરૂબક્તા શાંત-મૂર્તિ શ્રી શુલાભમુનિજી મહારાજે શુરૂદેવની પુસ્તકાલયને સમૃદ્ધ ઘનાવવાની અંતિમ લાવના, શુરૂવર્યની ઉદ્ઘારતા, દીર્ઘતપશ્યાં,

ભક્તાજનોને પડેલી મહાન ખોટ અને તેઓશ્રીની લુધન પ્રભાના અનેક ચમત્કારો દર્શાવી શુદ્ધેવના અધૂરાં કાગેને સંભાળવા અને તેઓશ્રીનું સ્મારક કરવા પ્રેરણું કરી હતી. છેવટે જૈનશાસનના કલ્યાણ માટે પ્રાર્થના કરી શુદ્ધેવને શ્રીદ્વાજલિ આપવામાં આવી હતી.

જગ્યાએ જગ્યાએ સભાએ થઈ હતી. શ્રીદ્વાજલિએ અપાઈ હતી. અદ્વાઈમહેતુસવો કરવામાં આવ્યા હતા. શોકપ્રદર્શિક ઠશવો થયા હતા અને સુનિમહારાજ શ્રી શુલાભમુનિજીને મોદ્દલવામાં આવ્યા હતા.

સુપ્રસિદ્ધ દાધિસ એાદુ ધનીયાના હિન્દી પત્ર 'ધર્મયુગ,' સુધીએ સમાચાર, જૈન વૈતાંખર, જૈન હિંદી, જૈન જ્યોતિ મરાઠી, જનમજૂમિ, વંહેમાતરમ આદિ અનેક પત્રોમાં આચાર્યશ્રીના સ્વર્ગવાસના સમાચારો ઉપરાંત આચાર્યશ્રીની લુધનપ્રભાના તેજકિરણો આવ્યા હતા.

બુદા બુદા શહેરો તથા સંઘો તરફથી  
આવેલ તારો અને પત્રોની યાદી

નગરશેઠ સંધપતિ સૂરત, શ્રી વીસાઓસવાળ સંધ ખંભાત, શ્રી ઉત્તમચંદ ભાગત સૂરત, શ્રી ચંદ્રનમદલજ નાગોતી છેઠી સાદરી, શ્રી કેશરીચંદ ભાણુભાઈ બિલીમોરા, ઘોલવડ જૈનસંધ-ઘોલવડ, શ્રી હેમેન્દ્રસાગર તથા શ્રી છાન્તિસાગર પાલીતાણું, શ્રી ચીમનગાલ જવેરભાઈ ભાવનગર, શ્રી લુણુકરણું આથ્રા, લુનહટસૂરિ અદ્ધાર્યાશ્રમ-પાલીતાણું, નગરશેઠ ભાણુભાઈ સૂરત, શ્રી હામળ જેઠાભાઈ કરણ, ઉપાધ્યાય

શ્રી સુખસાગરલુ મહારાજ નાંદગાંવ (સી. પી.) ચીમનવાલ  
એન શાહે સુરલી બજાર, શ્રી નેમીદાસ અલયચંહ લુણાવાડા,  
શ્રી મણીલાલભાઈ અમહાવાહ, શ્રી રાયચંહ શુલાખચંહ અચ્છારી,  
શ્રી મહાવીર જૈનવિદ્યાલય-સુંબાઈ, આચાર્યશ્રી જીનરતનસૂરીલુ  
મહારાજ મોઝલસર, શા બાયુભાઈ પ્રાગળુ કુઠા નંહરબાર,  
શ્રી રતનચંહ બાગરેચા ખંભાત, શ્રી શ્વેતાંબર જૈન આચા,  
સાધીશ્રી રતનશ્રીલુ તથા રામશ્રીલુ પાલીતાણુ, સાધીશ્રી  
કળ્પશ્રીલુ તથા લક્ષ્મીશ્રીલુ પાલીતાણુ, શ્રી લેણદાન શુલ-  
યરાજ બીજાનેર, શ્રી અગરચંહ અન્નવાલ બીજાનેર, શ્રી જવા-  
હરવાલ લોઢા આચા, શ્રી ભાઈચંહ નેમચંહ સુરત, શ્રી નેમચંહ  
તલકચંહ સૂરત, શ્રી મોહનવાલલુ જૈન જાન બંડાર સૂરત,  
શ્રી જૈન વિદ્યાર્થી જીવન-ઝોરડી, શ્રી જૈન સંધ ચુડુ,

શ્રદ્ધાંજલિઓ અને પત્રોમાં એક જ સૂર હતો કે જૈન-  
સમાજમાં દીર્ઘતપસ્વી, પ્રલાવશાળી, ચોગદીપક, સમભાવી,  
શાંતિમૂર્તિં સંતની ન પૂરી શકાય તેવી મહાન ખોટ પડી છે.

જન્મ લે સંસારમેં વહે કોન જો મરતા નહીં,  
મૃત્યુ જીવનકા નિરન્તર ચક્ક ચલતા સથ કહીં.  
જન્મ પાના બસ ઉસીકા હૈ સર્ઝી સંસારમેં;  
જો ખપા હેતા સ્વયંકો ધર્મ ઔર ઉપકારમેં.





## પુણ્યોજના તપસ્વી

( ૪૧ )

આદ્યાણુકુળમાં જન્મ પામનાર બાળ રામકુમારતું ગોડાં  
મનોહર મુખ કુમળ જોઈને માતા પિતા મહાન સમર્थ્ય કર્મ-  
કંડીના સ્વમ સેવતા હતા. એ લોળા લલા માતા પિતાને  
સ્વમમાં પણ કલ્પના કયાંથી હોય કે અમારો એ લાલ-રામ  
કુમાર જૈન જગતમાં મહાન પ્રભાવિક, દીર્ઘતપસ્વી, ચોગ-  
સિદ્ધિ સાધક, અટોરક જૈનાચાર્ય થશે અને જૈનશાસનનો  
જ્યઝ્યકાર કરશે.

આદ્યાણુ રામકુમાર માતા પિતાને છોડી અસ્યાસ માટે  
ચૂરુ આવે છે અને ચૂરુના યત્તિવર્યના સંપર્કમાં તેમના શિષ્ય  
થવા આકર્ષાય છે. યત્તિશુરુના એ શિષ્યો ઋદ્ધિકરણ અને રામ-  
કુમાર જન્મભૂમિ ચૂરુ-મારવાડમાં આનંદ કરે છે પણ શુરુની  
સમૃદ્ધિની વ્યવસ્થામાં આપણું ચચિત્તનાચક સુંલઈ જાય છે.

ત્રણું ત્રણું વખત શુરૂઆધ, ચૈતીવર્ષ તથા સમૃદ્ધિ છોડી ચાલ્યા  
ભાય છે અને શુરૂ ઘોધી લાવે છે.


છેબટે તીર્થયાત્રામાં શાંતિ અને પ્રેરણા મળે છે. જિરનરિના  
યોગીના આશીર્વાદ મળે છે અને સુપ્રસિદ્ધ શુરૂહેવ શ્રી મોહન-  
લાલભાઈ મહારાજના ચરણમાં લુધન સમર્પણ કરી સંવેગી  
દીક્ષા થણ્ણું કરે છે. તીર્થધિરાજ શત્રુંજ્યમાં ખીજેજ હિવસે  
ચંદ્રન તલાવડીની શિલા ઉપર અટૂમ તપ કરી લવિધના તપસ્વી  
લુધનની જાંખી કરાવે છે.

શુરૂહેવની સેવા અને શુરૂહેવના બોધ વચ્ચેનો લુધનમાં  
ઉતારતાં શુરૂહેવની ખાંચે રહી અફ્યાસ વધારી વિદ્ધાન બને છે.  
સં. ૧૬૭૬ માં જ્વાલીયરમાં પન્યાસ પહોંચે મળે છે. સંવત  
૧૬૯૫ માં થાણુામાં આચાર્ય પહોંચે મળે છે.

સાધુ લુધનમાં તપશ્ચયો એ આત્મ સાક્ષાત્કાર માટે અમોદ  
ઉપાય ગણ્યાય છે. આચાર્ય શ્રી લુધનભર તપસ્વી રહ્યા. ૮૧-૮૧  
આચાર્યભિત. ચાર ચાર માસ, ત્રણું ત્રણું માસ એકાંતરે ઉપવાસ  
તપ અને આચાર્યભિત અને વૃદ્ધાવસ્થા હોવા જતાં ઉત્ત્ર તપશ્ચયો  
રૂપ અટૂમે અટૂમે પારણું ચાર ચાર માસ સુધી અટૂમની પર-  
પરા ચાલુ રાણી કાક્યો અને શિષ્યોને પણ ચક્કિત કરી મૂડેલા.

વરોથી મહાયોગીની જેમ રાત્રિના બધે વાગે ઉઠીને  
ધ્યાનમાં એસી જતા અને સ્વારસના માંગલિક સ્તોત્રોનો પાઠ  
કરતા. તેઓ યોગનિષ્ઠ, વચનસિદ્ધ અને પ્રલાવિક હતા.

વલસાડથી સુંબદી સુધીના નાના મોટા શહેરો અને ગામોમાં  
લુનમંહિરો અને ઉપાશ્ર્યો કરાવવામાં તેમનોજ ઉપદેશ હતો.



આચાર્યશ્રીના ચાતુર્માસ સ્થાનો।



બેસ્તાન, વાપી, હવીયેર, મોરડી, કલેણુ સ્ટેશન, એરીવલી,  
શાન્તાકુણ, હાઇર, માટુંગા, થાણા, ચેરબુર, ખંભાત, ઝીજુંગાડા  
ઇસરવાડા, સમની, વલસાડ, રેણ્ડિટા, પુહારી, કોર, નંદરખાસ,  
યારા, ટાંકેલ, સામટા, ઇણુસા, ઘોલવડ, કોંદ, મરોલી,  
સરખોણુ વગેરે જગ્યાએ તેઓશ્રીએ મંહિરો અને ઉપાશ્રીએ  
માટે પ્રેરણું આપી હતી.

મોરડીમાં જૈન વિધાર્થી ભવન કરાવવામાં આચાર્યશ્રીએ  
મોટો ફ્રાણો આપ્યો હતો. જગ્યાએ જગ્યાએ સંદોમાં નાના  
મોટા ભતલેહો અને કુસંપો મીટાવી શાંતિ સ્થાપી શાસન  
ઉદ્ઘોતના કાર્યો કરાયાં છે.

ખંભાતમાં હાઢાશ્રી લુનકુશળસૂરીલુ તથા શ્રી લુનચંદ્ર-  
સુરિલુની ભૂતિએની પ્રતિક્ષા કરાવી મનોહર હાઢાવાડી  
અનાવરાવી છે.

ખંભાતમાં ચમતકારિક શ્રી માણીભદ્રની ડેરીનો લુણોદ્વાર  
પણ કરાયો હતો.

સુરતમાં શ્રી શામળા પાર્ખનાથની પ્રતિક્ષા કરાવી હતી.  
કુચેરામાં લગ્ન પ્રસંગે થતા રાત્રિ જમણો ખંખ કરાવવામાં,  
ખીઓ સ્વામીવાત્સલ્યમાં જઈ શકતી નહેતી, તેમજ ખીઓ  
માસિક ખમ્બ નહેતી પાળતી તે પાળવા વગેરે સુધારા કરાવ-  
વવામાં આચાર્ય શ્રી યશભાગી નીવડયા હતા.

સુરતમાં શ્રી મોહનલાલલુ જૈન જાનમંડાશને ખરોંગ સુંદર  
અનાવવામાં શેઠ નગીનહાસ કપુરચંદ તથા શેઠ કંકીરચંદભાઈ તથા  
મેતાજુ કપુરચંદભાઈ જેવેરીને પ્રેરણું આપનાર તેઓઝ હતા.

તપસ્વી આચાર્યશ્રીએ ધણી ધણી જગ્યાએ ઉપધાન તપતું  
ઉધાર્પન કરાવી, સેકડો બહેન ભાઈઓને તપક્રિયાનું રહ્ય  
સમજવી ધર્મઉધોત કરાયો હતો.

સ્થલી પ્રદેશમાં હલરે ભાઈઓનો વિકટ વિહાર કરી  
ધર્મથી વિમુખ થતા જતા હલરે આમવાસીઓને ધર્મનો  
સચોટ ઉપદેશ આપી ધર્મમાર્ગમાં વાળવાનું લગીરથ કાર્ય  
પણ આચાર્યશ્રીએ કર્યું હતું.

સુંબદ્ધમાં શ્રી મોહનલાલજી જૈનસેન્ટ્રલ લાઇફ્રેરીને સમૃદ્ધ  
બનાવવા જૈન સમાજના આગેવાનોને પ્રેરણું આપી મોટું ઇંડ  
કરાયું હતું અને આચાર્યશ્રીની અંતિમલાવના શુરૂઆતની એ  
ઉપયોગી સેન્ટ્રલ લાઇફ્રેરીને સમૃદ્ધ બનાવવા આચાર્યશ્રીના  
લકૃતો અને સેન્ટ્રલ લાઇફ્રેરીના ટ્રસ્ટીઓ કયારે પૂર્ણ કરશે !  
આચાર્યશ્રી ઘરતર ગચ્છના આચાર્ય હોવા છતાં એવાતો  
ઉદ્ઘાર હિલના અને સમાજ કલ્યાણ સાધક હતા કેતપગચ્છના  
કે અંચળગચ્છના બહેન લાઈઓને તે પૂજય હતા અને તેઓના  
પણુંધુમાં વ્યાપ્તયાનો સંભળવવા પોતે જતા અને શિષ્યો  
ક્ષારા પ્રથંધ કરી આપતા.

થાણુમાં ભાર ભાર વર્ષનો કુસંપ મીઠાવી ઐક્યતા કરવા  
આચાર્યશ્રીએ સુધાર્યા પ્રવચનોથી ચમતકાર સર્જાંયો હતો.  
થાણુના કગામય બેનમૂન જીનાલય માટે આચાર્યશ્રીએ ભારે  
જહેમત ઉડાવી હતી. થાણુની પ્રતિકાનો લંઘ મહોત્સવ  
આજે પણું હલરે ભાવિકે. યાહ કરે છે. આજે થાણું તીર્થીંગમ  
બની ગયું છે.

આત્માર્થશીની જીવનની પ્રભા, તપશ્ચયોતુંતેજ, યોગદિની નિર્ભેગતા, જ્ઞાનની અંગા, હૃદયની ઉદ્ધારતા, વચનની સિદ્ધિ, પ્રેમની અરિતા, સેવાની સૌરભ પરમ પાવનકારી અને પુષ્ટોજવળ હતાં.

ધન્ય ખરતુરગણ્ય

ધન્ય ગુરુદેવ

ધન્ય તપશ્ચયો

ધન્ય ત્યાગ

ધન્ય જીવન

ધન્ય જ્ઞાનપ્રભા

ધન્ય યોગસિદ્ધિ





## ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા

( ૫૨ )

‘ સાહેબ ! ગુરુદેવ તો સ્વર્ગે સીધાંયા. તેમના વચનામૃતો, તેમની શાંત-સૌભ્ય-પ્રલાભરી મૂર્તિ—આકૃતિ, તેઓ શ્રીની કુલયા-ખુલાવના, ભૂલ્યાં ભૂલાતાં નથી. મને તો કોઈ કોઈવાર ગુરુદેવ સ્વર્ણમાં દર્શાન આપે છે. મારી જાવના છે કે ગુરુદેવની મૂર્તિની પ્રતિષ્ઠા આપણું શ્રી મહાવીરસ્વામીના દહેરાસરળુમાં કરવામાં આવે તો ગુરુદેવનું સમરણ હંમેશાં રહ્યા કરે.’ શ્રી હરિચંદ્રસાઈએ ગુરુદેવના અંતેવાસી અનન્ય ગુરુભક્ત શ્રી ગુલાબ મુનિજી મહારાજને વિનંતિ કરી.

‘ ભાગ્યશાળી ! ગુરુદેવ તો તપેનિધિ હતા. તમે તો ગુરુદેવના પ્રાણુભ્યારા ભક્ત છો. તમને ગુરુદેવ દર્શાન આપેજ ને. તમારી જાવના ઉત્તમ છે. આપણે શ્રી મહાવીરસ્વામીના ટ્રસ્ટી-ઓને વાત કરીએ. તેઓની જાવના પણ છે. ઘણું લક્ઝો પણ તે માટે જાણે છે.’ શ્રી ગુલાબમુનિજી સંમતિ આપી.

શુરૂહેવના સ્વર્ગવાસ પણ શુરૂહેવના પરમ ભક્ત શ્રી હરિ-  
ચંદ્રલાલની ભાવના ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા માટે થઈ. તેમણે શુરૂ-  
હેવના અંતેવાસી અનન્ય શુરૂભક્ત શ્રી શુદ્ધાબ્દમુનિનું વાત  
કરી. શ્રી મહાવીરસ્વામીના હરેરાસરળના દ્રસ્તી ભાઈઓની  
ભાવના પણ હતી. શુરૂમૂર્તિની પ્રતિષ્ઠાનો નિર્ણય કરવામાં  
આવ્યો. ગુરૂહેવનો સુંદર આકૃતિનો ફોટો જ્યાપુર મોહનવામાં  
આવ્યો. જ્યાપુરમાં સુંદર મનોહર આકર્ષક શુરૂહેવની મૂર્તિં  
તૈયાર થઈને મુખ્ય આવી ગઈ. શુરૂમૂર્તિના ફર્ણન કરી શ્રી  
હર્ષિત થયા.

સં. ૨૦૦૮ ના મહા વદ દ શુરૂવારે સુંભર્ચ પાયધુની  
શ્રી મહાવીરસ્વામીના જૈન હરેરાસરમાં પૂજયપાદ પુષ્ટ્યપ્રભાવક શ્રી  
મોહનલાલજી મહારાજના પ્રશિષ્ય દીર્ઘતપસ્વી, કોકણ થાણ્ણ  
જૈન તીર્થીકારક, જૈનાચાર્યશ્રી લુનત્રદ્વિસ્તુરિધિરજી મહારાજ-  
શ્રીની મૂર્તિની પ્રતિષ્ઠા નીચેના એક ગોખમાં શ્રી હરિચંદ્રભાઈ  
માણેકચંદ્ર તરફથી કરવામાં આવી. એ પ્રસંગ ઉપરાંત શ્રી  
ધંટાકર્ણીરની ચોથી સાલગીરી ઉજવવામાં આવી હતી. આ  
ખંને પ્રસંગોએ શ્રી મહાવીરસ્વામી જૈન હરેરાસરમાં નવ દિવ-  
સનો ઉત્સવ આનંદ-ઉત્ત્વાસપૂર્વક ચોજવામાં આવ્યો. હતો.  
મહેતસ્વની કિયાઓ સુરતનીવાસી સુપ્રસિદ્ધ કિયાકારક શેઠ  
બાલુભાઈ ઉત્તમચંદ્ર કરાવી હતી.

શ્રી ધંટાકરણીરનું પૂજન તથા હવન કિયા યતિશ્રી શાંતિ-  
વિજયજી મહારાજે ઉત્તમ વિધાનથી કરાવી હતી. મહા શુદ્ધિ  
૧૪ ને હિવસે કુંભસ્થાપન થયું. મહા વદી ૫ ના આચાર્યશ્રીની  
મૂર્તિનો અભિષેક અને મહા વદી દ ના શુરૂહેવની મૂર્તિની

પ્રતિધા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. શુરૂહેવના જ્યથોખથી મંહિર શુંલ રહ્યું હતું. હનરો બકોમાં આનંદની લહરીઓ લહેરાએ. શુરૂહેવની તેનેમય મૂર્તિને હનરો હૃદયેને ઉલ્લભિત કરી દીધા હતા.

જ્યથાત્રાના વરધોડામાં તેમજ અષોત્સરીસ્નાત્રમાં આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરલુ મહારાજ પોતાના શીષ્ય સમુદ્દ્રાય સાથે પદ્માયો હતા. આચાર્ય શ્રી અમૃતસૂરીશ્વરલુના શિષ્ય પણ. શ્રી કુરંધરવિજયલુ, તપસ્વી શ્રી ધર્મસાગરલુ મહારાજ તથા આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરલુના પ્રશિષ્ય ઉપાધ્યાય શ્રી સમુద્રવિજયલુ તથા શ્રી લક્ષ્મિસુનીલુ, શ્રી નીપુણસુનીલુ તથા શ્રી શુભલવિજયલુ તથા શ્રી હેવેન્દ્રસુનીલુ આહિ સુનીલાને હાજરી આપી હતી. મહાવીરસ્વામી હંગેરાસરલુના ઉપાશ્રયમાં બિરાજમાન સદ્ગત આચાર્ય શ્રી લુનાંડિસુરિના પદ્મધર, અંતેવાસી, અનન્ય શુરૂભક્ત સુનિ શ્રી શુક્રાખસુનિલુએ શુરૂહેવની મૂર્તિની વાસ્ક્રેપાહિની હિયા પરમાદ્વાસાપૂર્વક કરી હતી. પૂજય સુનિશ્ચીના શિષ્ય રત્નાઠર સુનિ તથા વચોવૃદ્ધ શાંતમૂર્તિં શ્રી લુનશદ્રવિજયલુ મહારાજે બધી હિયાઓમાં ભાગ દીધે હતો.



## ગુરુ નથન રસ જ્યોત

પ્રથમ સંવત્સર.

( રામ-લીમપલાસી એક જવાલા જલે તુજ નેનનમેં )

રસ જ્યોત જ્વલંત શુરૂનથને, રસ જ્યોત શ્રી રિદ્ધિસૂરીલુ નમું,  
મહા મોહમથી એારીવલીમાં, ગુરુહેવશ્રી રિદ્ધિસૂરીલુ નમું.  
શ્રી મોહનલાલજી સિદ્ધ મહા, આવી રામકુમાર ચરણ નમતા,  
જેને પગલે સાંહુતા ને ધર્મ હતા. ગુરુહેવ, શ્રી૦

ગુરુ મોહનલાલજી તુછ થયા, જિનરિદ્ધિમુનિજી નામ ધર્યો.

એના પરિમલ દ્વિંદ્ય શુવાળ સમા, શુરૂહેવ૦  
સુનિ રત્ન સમા એ સિદ્ધ થયા, પારસથી પારસ એ પ્રકટયા,  
તથ ત્યાગ તિતિક્ષા અભય હતા. ગુરુહેવ૦  
જેણે જ્ઞાન-ક્રિયામૃત પાન કર્યો, ઉદ્ધાર સુતિર્થ અનેક કર્યો.

પરિશીલન થયો અનેક કર્યો. ગુરુહેવ૦  
સદ્ગ્રહમના ધ્વજ ફરકાવી ગયા, ખરતરગચ્છ ડ'કો બજાવી ગયા,  
વીરધંટાકરણ બજાવી ગયા. ગુરુહેવ૦  
પ્રભુવીરના ધર્મની હેરે ધ્વનિ, જેને વયણે શિર અનેક નમ્યાં,  
તુછિ પુછિ સુંભાપુરી શ્રી સંઘમાં. ગુરુહેવ૦  
ઉપકારક તારક લાખોતણ્ણા, સંસ્થાએ અનેકના સ્થાપક હા,  
થાણા. જિનમંહિરના સૃધા. ગુરુહેવ૦

એ હજારને સાતના જેઠ અહા, શુક્લા તૃત્યાએ પરવરિયા.  
ગુરુ અમર ધામ સિધાવી ગયા. ડેરુહેવ૦  
આજે પ્રથમ જ્યાંતિ ઉત્ત્સવ હા, ગુરુ રૈમે રૈમે ઉભરાઈ રહ્યા,  
અરણે અર્પણ મધ્યિમાળ અહા. ગુરુહેવ૦

—પાદરાક્ર

## ગુરુ ગુણુ કિર્તન

( રામ ભજનનો )

સદ્ગુરુ ડેવ હ્યાળુ રે, જાતા દૃષ્ટા વિશ્વના હોળ,  
 પુરેપુરા આતમ તત્ત્વના બાણુ. સદ્ગુરુ  
 શાંતિ સંયમ ધારી રે, હ્યા લરી આંખડી હોળ,  
 અંતર ઉંઘેણ અનુભવ ફેરે બાણુ. સદ્ગુરુ  
 પારસ્પરભિંનુ ચાચો રે, લોહને કંચન કરે હોળ,  
 અજ્ઞાનીમાં પુરે તત્ત્વજ્ઞાનના ઉલ્લાસ. સદ્ગુરુ  
 પચનસિદ્ધ વૈરાગી રે, અંતર ત્યાગી આકરા હોળ,  
 ટાણ્યા જેણે હંસ અને અભિમાન. સદ્ગુરુ  
 નિર્મણ તન મન વાણી રે, લુધન જ્યોતિ જગતી હોળ,  
 નથને વહેતી પ્રેમ તણી રસ ધાર. સદ્ગુરુ  
 વાણી અમૃત વહેતી રે, આનંદ મૂર્તિ ઓલિયા હોળ,  
 રોમે રોમે ધર્મતણુ જંકાર. સદ્ગુરુ  
 સાધક આતમ યોગી રે, કુપા સિંહું પ્રેમનો હોળ,  
 હસ્તો સુખડે સંત જિવનના ઉલ્લાસ. સદ્ગુરુ  
 ઉદ્યા આભાસ વેગેરે માનવ હેઠ ત્યાગીને હોળ,  
 અમરાપુરની ઉચ્ચી અટારી પ્રકાશ. સદ્ગુરુ  
 આંખડી અનલો રમતી રે, અદ્વિતી અભાડે ઘેલતા હોળ,  
 ભળીઆ પોતે આહિ અનાહિમાં સંત. સદ્ગુરુ  
 વખ્ય પુરુ વિત્યું રે, શુરૂવરના નિવોણુ ને હોળ,  
 હિંદુ દેવળીએ મણિમય શુરૂલનાં સ્થાન. સદ્ગુરુ

—પાદરાકે

અરતરગાચલભૂપણ શ્રીમદ જિનરિદ્ધિસૂરીધીરજ મહારાજ  
શ્રી બોરીવલી પ્રથમ સ્વર્ગારોહણ જ્યાંતિ  
ગીતમણિમાળા

શ્રી ગુરૂસ્તુતિ  
( કલ્યાણ ) .

પરમ શાન મૂર્તિં ઽં.  
આત્મ આત્મ યોગી ઽં, નિલનંદ યોગી ઽં.  
જગતી લુલન જયોતિ ઽં,  
જનમના ઓ જોગી ઽં. ૫૨૮૦

પંચ મહાવૃત્ત રક્ષણ સ્વ-પર હ્યા પ્રતિપાળ;  
આત્મ જયોત રખ્યાળ,  
શ્રી જિનરિદ્ધિસૂરી ઽં. ૫૨૮૦

પ્રથમ ચંવત્સર ઽં, જ્યાંતિનીજયોતિ ઽં,  
બોરીવલી નગર ઽં,  
નેન આત્મ સંભર ઽં. ૫૨૮૦

શારૂહ શુત શાન ઽં, પલપલ સંભગ ઽં,  
રગ રગ વિરાગ ઽં,  
સાધક ભણ્ય રિદ્ધિ ઽં. ૫૨૮૦

—પાદરાક્ર

પરમપ્રભાવિક શ્રીમહ નાનાંદ્રસુરીથી આરસ શુરૂમૂર્તિ  
પ્રતિષ્ઠા પ્રસંગે ગાવાનાં

### શુરૂઆતિત ગુણગાન

( રાગ જાલા વીર જિનેશ્વર જન્મ જરા. સોરઠ )

ચેતન અનંત રિદ્ધિ આતમની ન વિસારજે રે !

આતમચેણી મૂર્તિં સૂર્યિબનેય સંભારજે રે ! ચેતન૦  
આત્મ ઉભગર ત્યાણી તપસ્વી, યમતકારની ચેતનમૂર્તિં,

પુરુષાર્થ પ્રતિમા જિનનગરાંદ્રસુરી ધ્યાવજે રે ! ચેતન૦  
પરમપ્રભાવિક ચેતનમૂર્તિં, મોહનલાલજી દશહિંશ કીર્તિં !

થઃસૂરી પદ્મશિખ ઋદ્ધિ ગાવશો રે ! ચેતન૦  
અસંખ્ય શાસન સુકાર્ય કીધા, મંહિર નૂતન ઉપાશ્રય પ્રકટયા;

થાણુ હેવ વિમાન જિનાલય ધ્યાવશો રે. ચેતન૦  
અનેકને તારી ઉદ્ઘારી, ઉપહેશીને બહુ નર નારી,

સ્વર્ગ સંચયો સમાધિવંત સ્મરાવશો રે. ચેતન૦  
શ્રી વીરધંટાકણું આરાધક, શાસનકાજ સુમંત્રો સાધક,

વીરની પ્રતિમા પધરાવી ન વિસારશો રે. ચેતન૦  
શુરૂમૂર્તિં શ્રી ઋદ્ધિસુરીની, આરસની અલએલી અનેલી,

શુદ્ધાણ અભિષેકે શુરૂઆતિત સુહાવશો રે. ચેતન૦  
માધુકૃષ્ણ પણી શુરૂવારે, મહાલીર જિન મંહિર દ્વારે,

પ્રાતઃપ્રાણુ પ્રતિષ્ઠા નિવિધને થશો રે. ચેતન૦  
માણેકસુત હરિચંહ શ્રીભક્તિ, શુરૂમૂર્તિં કરનાર પ્રતિષ્ઠિત,

ઉત્સવ અષ્ટોતરી સ્નાત્રગુરુ આવશો રે. ચેતન૦  
અલએલી આંગી પ્રભુ અંગે, વરદ્વાડા પૂજના રંગે,

શુરૂ પ્રતિષ્ઠા ઉત્સવ અજખ રવાવશો રે. ચેતન૦

રતન હીરાને જવેર ચમકે, ઉત્સવ વેલાં બાકતો ઠમકે,  
ધંટાકણુંની સાલગ્રેહ ચોથી ભળે રે. ચેતના૦  
બાગવન મહાવીર ઝડિસૂરીશર, ધંટાકણુંનાં ગાન ધરેાધર,  
ખરતરખન્દે ગૌરવ ગીત લલકારશો રે. ચેતના૦  
આરસ પ્રતિમા મંગલકારી, થાય પ્રતિષ્ઠા શી બલહારી,  
પાવનકારી હર્ષન અહિત વધારશો રે. ચેતના૦  
પાયધુની પદવમ લુનમંહિર, વાજે નોભતો ધર્મ ધરેાધર,  
ઉત્સવ મણિમય હેવો સંકૃત બનાવશો રે. ચેતના૦

—પાદરાકુર

### ગુરૂ નામસમરણુ

( લેરવી )

શુરૂ શુરૂ સુખસે બોલ, મનવા. ઓ શુરૂ ઓ શુરૂ બોલ,  
નાહિં પડત ક્રુષુ મોલ, બાળા ! શુરૂ શુરૂ સુખસે બોલ.  
અશરણ શરણ અધમ ઉદ્ઘારઠ, ચેતન અજળ અડોલ.  
તારઠ ભવસાગરસે નૈયા, એવછાલ અનમોલ. મનવા૦  
અંધેરેમે જયોત સહારા, નિર્ઝલક અનયોલ.  
પરમ પ્રેમવત્સલતા સાગર, રિદ્ધિસૂરિલ અડોલ. મનવા૦  
કોઈ સુહાગી પાવત સદ્ગુરૂ, કાટત કર્મ કિલોલ.  
મણુ શુરૂપે ન્યોછાવર હિલ, શુલાખરતન અમોલ. મનવા૦

—પાદરાકુર

### જ્ઞાનમણિ શ્રી ગુરુદેવ

જ્ઞાનમણિ, હિનમણિ, ર્ઘર્ષમણિ, નરમણિ !

ધ્યાનમણિ, પ્રેમમણિ, રૂપ જોતે !

જગમણિ, રસમણિ, સુનિમણિ, સુરીમણિ !

ત્યાગમણિ છો સ્વર્ય આત્મ જોતે ! જાન૦

અલખમણિ, લખમણિ, સુરમણિ, નૂરમણિ !

સત્યમણિ, સદગુરુદેવ તો છે !

આત્મમણિ, કલ્પમણિ, તત્ત્વમણિ, સત્ત્વમણિ !

રિદ્ધિસુરીમણિ જાનનો છે ! જાન૦

આત્મ આધ્યાત્મમણિ, ચોગ અધ્યાંગમણિ !

સરળ સંવેગમણિ થા ઉધોતે !

નિગમ આગમમણિ, સત્ત્વમાગમમણિ !

કલ્પતરૂવરમણિ વિશ્વનો છે ! જાન૦

ॐ અહુમણિ, પ્રાણુ ! લક્ષ્મિમણિ !

મંત્રશક્તિમણિ જાન જોતે !

રિદ્ધિસુરીવર મણિ ! મોહન યશ : મણિ !

જોત પ્રકટાવો મણિ આપ જોતે ! જાન૦

—પાદરાકૃ

શ્રીમહુ જિનાકદ્વિસૂરીશ્વર સ્વગરિણી પ્રથમ જ્યંતિ પ્રસંગે

### આંજલિ

(ગીત દેશી-આશાવરી)

કોણુ કરે સંધ સહાય ! શુરુ વિન કોણુ કરે સંધ સહાય !

કોણુ કરે..... ! શુરુ વિન..... ! ૩૫૦

શુરુણ સ્વરો આપ સીધાંયા, સંધ બન્યો નિરાધાર;

બાળપ્રદ્યાચારી સુયોગી, સુભટ સંવિજ્ઞ મોઝાર. શુરુ ૧

શુરુ દેશની સાહિણી છાંડી, કરો પાઠ વિહાર;

શ્રીપૂજયપદવી ત્યાગી; નહાસી પાદલીસને દ્વાર. શુરુ ૨

શુરુ મોહનનાં પાઠ ધરીને, બન્યા સંધ આધાર;

મોહનમુનિના થશઃસૂરીશ્વર, તસ શિષ્ય આપ શ્રીકાર. શુરુ ૩

અહૃદાઈ અહૃદાઈ તપને તપતાં, ઉત્તરવા ભવપાર;

કરો કરો પહીએ લાલી, થયા સૂરીશ્વર સાર. શુરુ ૪

થાણુ દેશમાં નરપદ પ્રલુને સ્થાપી કરી જ્યકાર;

તીર્થોદ્વારે જશ જગ પ્રગટ્યો, થશઃ શુરુને પ્રતાપ. શુરુ ૫

થાણુ તીર્થ ઉદ્ઘારજ કીધો, નવપદને મહિમાંય;

નવપદ આરાધક સૂરીશ્વર, દાહા કુશળકૃપાય. શુરુ ૬

ધંટાકણુણુ વીર આરાધી, સ્થાપ્યા મોહમયિ દ્વાર;

દેશવિહેશે જળકયો મહિમા, ધંટાકણુ ઉદ્ઘાર; શુરુ ૭

ચિત્તે ચેતી સમતા ધારી, કરતા પુંજલ ત્યાગ;

પુંજલ ત્યાગે આનંદ અનેરો, શ્રી ક્રદ્વિસૂરી મહાભાગ! શુરુ ૮

શુદ્ધાયમુનિણ સેવા સારી, હુદ્ધે શુરુપદ ધાર;

નત્સર એક સ્વખનવત્ત વીત્યું, શુરુવર હિલ એકતાર! શુરુ ૯

દીક્ષાતું દ્વિતીય તૃતીય અતુથો, મુંબા-સૂર્યં ચાતુમાંસ;  
શિશુપણેથી અરણે લોટયા, અપૂરવ તહારી છાંય ! શુરૂ ૧૦  
કાકાશી રહેવયંદ સંધાતે, નિત વંદતો તુમ પાય;  
ગુલુ જીવનની જેડી આવી, વહતા વયણુ સહાય. શુરૂ ૧૧  
આશિષ દેતા શુદ્ધ હૃદયથી, ‘ધર્મલાભ ઉત્સરાય;  
જયજ્યવંત રહો શ્રીગુરૂવર !’ “જીવન” સાલુવન થાય ! શુરૂ ૧૨

સ. ૨૦૦૮; જેઠ } જીવણયંદ સાકેયંદ જીવેરી  
શુક્લ તૃતીયા, સોમવાર } મુંબઈ તા. ૨૬ મે ૧૯૫૨

દીર્ઘ તપસ્વી આચાર્યશ્રી જિનાંકદિસ્તુરિથરણા

સ્વર્ગવાસ નિમિત્તે

ગુરૂ-વિરહ ગીત

( રાગ લૈરવી )

કુણ્ણો ચંદ્ર નભ મંઠળમાં, થયું દિલ દોર અંધારું,  
અસ્ત થયો ભાતુ અમારો, ગુરૂવર, ગુણુને ચંભારું. ૧  
ગુલાખ તમોને યાહ કરીને, અંતર અંસુ સારે.  
વિરહવેહના ના સહેવાયે, હૃદય રડે ચોધારે. ૨

નાંકદિસ્તુરિથરણ દાઢા ગુરૂવર, પરમ પર ઉપગારી.

એ યુગના અવતારી.

૧ મુંબા અને સુરતમાં. ૨ એષિ દેવયંદ લાલભાઈ જીવેરી.  
૩ ગુલાખયંદ દેવયંદ જીવેરી અને ઝં. ૪ નામતો નિર્દેશ.

ભક્તજનો સૌ આંસુ સારે, સંભારી સંભારી.  
ઓ યુગના અવતારી. ૧

સત્ય વચનની અદ્વા સમ તું, અદ્યાતમ યોગી જ્ઞાનામૃત તું,  
મન, વચન કાયાથી ગુરૂ, અહિંસાના વૃત્થારી. ઓ યુગ૦ ૨  
જ્યાં પાથરતો તું અજવાળા, ત્યાં છે વાદળ કાળાં કાળાં.

હિંય પ્રભાકર અસ્ત થયો તું, છે રજની અંધારી. ઓ યુગ૦ ૩  
મન્દુભૂમિનું નામ દીપાંશું, માતપિતાનું કુળ અજવાણશું.  
જ્ઞાની ગુરૂની પાટ યોલાવી, સમતા સંયમધારી. ઓ યુગ૦ ૪

જીવ-પ્રતિષ્ઠા મંહિરો અંધાંશા, ઘંટાકરેણુંબીશને પધરાંશા,  
ચાદી ગુણુની અમર રહી ગુરૂ, અખંડ બાળઅદ્ધ્યારી. ઓ યુગ૦ ૫

જ્ઞાન, ધ્યાન તથ, ત્યાગ સમાધિ, અંતરમાં મહાવીર આરાધી,  
કામ કોધના ત્યાગી ગુરૂલુ, પંચ, મહાત્મતધારી. ઓ યુગ૦ ૬

મહાવીર વિષુ ગૌતમ ટળવળતા, વીરપ્રભુ ! વીરપ્રભુ ! કરી કરતા,  
એજ દ્રશા ગુલાભમુનિની, ગુરૂ વિરહતા ભારી. ઓ યુગ૦ ૭

ગુલાબ ! ગુલાબ ! કરી કોણ બોલાવે, ગુરૂ વિષુ હવે કોણ રાહ બતાવે.  
કથાં છૂપાયો વિરહ હંસ તું, ગુરૂવર કૃપા આધારી. ઓ યુગ૦ ૮

સાધુ મુનિ સક્ત સંધ મળીને, ગુરૂવર ગુણુને યાહ કરીને.  
સૌનાં ડૈયાં અશ્રુલીનાં છે, ગુરૂગુણુને સંભારી. ઓ યુગ૦ ૯

જેઠ સુહિ ત્રીજને ગુરૂવારે, રાહ લીધો જવા મોક્ષ દ્વારે.  
ભાવભરી ગણેશાની અંજલી, સ્વીકારને દ્વાધારી. ઓ યુગ૦ ૧૦

—ગણેશભાઈ પરમાર

श्रीमान् मोहनलालजी महाराजना समुदायना आचार्य श्री  
जिनरत्नस्वरिजी महाराज तथा उपाध्याय श्री लब्धिमुनीजी  
महाराज कृत श्री जिनकद्विष्टि गुणानुवाद

### कुलःक म्

आसीद्विप्रकुले मरुस्थल गते यज्जन्म चुरुपुरे,  
पूर्वं यो यतिदीक्षितः खरतरे गच्छे गुणै राजितः।  
नाम्ना 'रामकुमार' आर्य चिमनीरामस्य शिष्योत्तमः  
स्वात्मारामि जिनदिं सूरि सुगुरु जीयात्स सूरीश्वरः ॥ १ ॥  
प्रातः संस्मरणीय मोहन मुनेः शिष्यो गुणालंकृतो  
भास्वत्कीर्तियशा गुरुजिनयशः सूरीश्वर सुव्रती ।  
यस्या भूत्स्व परोपकार मनसो ज्ञानक्रिया धारिणः ॥

स्वात्मा० ॥ २ ॥

दीक्षा यस्यबभूव सिद्धशिखरे खेटा बिं खेटा वनौ  
वर्षे भागवती गुरोर्गुणवतो संशुद्ध चारित्रिणः ।  
पन्यासास्पदभस्य गोपनगरे बाणाङ्क खेटा वनौ  
स्वात्मा० ॥ ३ ॥

यस्याचार्य पदं बभूव सुगुरोर्बाणाङ्क खेटा वनौ,  
स्थानाख्ये नगरे गजाभ्रखकरे श्री मोहमयां पुरि ।  
ध्येय ध्यानमनाः समाधि मरणं लातोत्तमायौगतः

स्वात्मा० ॥ ४ ॥

स्वात्मानं वरसंवरेण तपसा यो भावयन् स्थापयन्  
 सन्मार्गे प्रतिबोध्य भव्य जनतां कुर्वेत् धर्मोन्नतिम् ।  
 सत्कृत्यैर्व्यचरत्समं सुविहितैः संविज्ञ वाचं यमैः  
 स्वात्मा० ॥ ५ ॥

श्राद्धै देशनया सुधामधुरया जीर्णान्समुद्वारयन्  
 भव्यान्वृतन् दर्शनीय विशदार्हचैत्य चैत्यालयान् ।  
 प्रत्यस्थापयदार्य सत्तम गुरुः स्थानाख्य पुर्यादिषु  
 स्वात्मा० ॥ ६ ॥

धर्मस्थान मुपाश्रया भविजनैर्यस्यो पदेशेनहि  
 जीर्णा उद्वरिता नवाश विहिता द्रव्यं घनं सप्तसु  
 क्षेत्रेषु व्ययितं दयास्यदजने जन्तौ दयाधारिणः  
 स्वात्मा० ॥ ७ ॥

श्री गुलाबमुनि मुनिर्गिरिवरो रत्ना कराख्यो मुनि  
 रित्याद्या विनयान्विताः समभवन् शिष्य प्रशिद्याः शमाः  
 दान्ता यस्य तपस्त्विनः खरतराङ्गुष्ठानकर्तुर्गुरोः  
 स्वात्मा० ॥ ८ ॥

यो जातो गुरु सदूगुणैः सुविहिते पूज्योगरिष्टोगणे  
 सङ्घादौ स्तवितो गुणेन महितो नित्यंतिरो भावताम् ।  
 आविर्भावतयाऽगमाज्जिनवृषं लोके प्रस्त्वानवं  
 स्वात्मा० ॥ ९ ॥

पूज्यः श्री मुनि मोहनो जिनयशः सूरीश्वरसत्पद-  
लीनः पूज्य जिनद्दिसूरिसुगुरुः सङ्कीर्तिः संस्तुतः ।  
सदूभू तार्थ गुणे श्री लब्धि मुनिना श्री रत्न स्मर्याङ्गया  
पूज्यानां गुण कीर्तनाद्गुणिजनः स्यात्पुष्टतैलं यथा

स्वात्मा० ॥१०॥

स्वात्मानं वरसंवरेण तपसा यो भावयन् स्थापयन्  
सन्मार्गं प्रतिबोध्य भव्यजनतां कुर्वश्च धर्मान्वतिम्  
सत्कृत्यव्यचरत्सदा यतिगुण ज्ञानक्रिया सत्तमः  
दुःखीधात्सजिनद्दिसूरि सुगुरुः सूरीश्वरः पातुनः

स्वात्मा० ॥११॥



श्रीमान् श्री १००८ श्री मोहनलालजी महाराजानां सुरत  
ज्ञानभंडारस्य शास्त्री श्री सन्मुखराम केशवरामज्योतिषिकृत  
श्लोकाः

शार्दूल विक्रीडित

पंचाभ्रान्त कराङ्किताब्द तपसि श्री कृष्ण षष्ठ्यां भृगौ  
जैनाचार्य जिनद्विस्थरि वचसा वीरस्य प्रासादके ॥  
नानी खाखर कच्छ देश वसतिः श्री हर्षचन्द्राभिधो  
घंटाकर्ण सुयक्ष मूर्ति मचलाम स्थापयद्गतिः ॥ १ ॥

“ मालिनी ”

वसुखखकर वर्षे ज्येष्ठ शुक्लाग्नि जीवे  
शुभ खचर समेते प्रातरैज्यै मुहूर्ते ॥  
गुरुवर जिनक्रद्धिः सूरिवियौऽति भव्यो  
द्विवसुमित वयस्कः कालधर्मं प्रपेदे ॥ २ ॥

“ स्त्रग्धरा ”

मृग्बाषुर्यो सुसंघो वसुमित दिवसं पुष्कलोत्साहण्व  
चक्रे भव्योत्सवं श्री जिनवर गुरुदेवस्य मूर्तिप्रसंगे ॥

ଆଚାର୍ୟସ୍ୟାନୁମଲ୍ୟା ଜିନପଦକ ଭୂତୋ ରତ୍ନଦ୍ସରୀଶ୍ୱରସ୍ୟ  
ବାସକ୍ଷେପଚକାର ପ୍ରସୁଦିତ ମନସା ଶ୍ରୀ ଗୁଳାବୋମୁନୀନ୍ଦ୍ରଃ ॥ ୩ ॥

“ ସ୍ଵାମୀ ”

ନନ୍ଦାଭ୍ରାନ୍ତିଶି ବର୍ଣ୍ଣ ତପସି ବଦିତିଥୌଜୀବ ବାରେଚ ପଢ୍ୟା  
ମାଦେଶଂ ପ୍ରାପ୍ୟ ରାୟା ବିହିତ ବିଧିକୁତେ ଶ୍ରୀହରି ଶ୍ରେଷ୍ଠିଵର୍ଯ୍ୟଃ ॥  
ଶ୍ରେଷ୍ଠ ଶ୍ରୀ ବାଲୁଭାଈ ସୁବିଂଧି ମଘଟଯତ୍ସନ୍ମୁଖୋଜଦାନ୍ମୁହୂର୍ତ୍ତ  
ଚକ୍ରେ ଶ୍ରୀ ମଜ୍ଜିନର୍ଦ୍ଦି ପ୍ରଖର ଵରଦଦ୍ସରୀନ୍ଦ୍ରମୂର୍ତ୍ତେଃ ପ୍ରତିଷ୍ଠାମ୍ ॥ ୪ ॥

सं. २००७ श्री गोडीजी जैन उपाश्रयमां चातुर्मास विराजता  
 आचार्य श्री विजयप्रतापसूरीश्वरजी तथा आचार्य श्री  
 विजयधर्मसूरीश्वरजी महाराजना शिष्योने काशीथी  
 अभ्यास कराववा आवेला पंडित श्री जीवेश्वर झाए  
 पूज्य गुरुर्वर्य श्री जिनऋद्धिसूरिजी महाराजना  
 गुणोर्थी आकर्षाइ रचेला श्लोको-

### श्री छाँ ज लि

---

#### शार्दूल

गुञ्जन्तो मधुरां शुभां मुनिहित शास्त्रस्य वार्तां सदा,  
 लालित्यां सुरराजमोदनकरां भक्ति गुरुणां मुहुः ।  
 वन्दे चारु पदाम्बुजे हितकरे कृत्वा प्रभूणां स्वयम्,  
 मुञ्चन्तः सब्लु पापकर्मनिवहान् ऋद्धीश्वरत्वं जगुः ॥ १ ॥

#### स्नग्धरा

नित्यं योगासनस्थाः ददति गुरुकुले श्रावकेभ्यो मुनीन्द्राः,  
 जीर्णाऽवस्था विक्षास्तदपि च विविधान् झानिनशोपदेशान् ।

कीर्तिर्धूर्या यदीया विलसति गगने विज्ञवृन्दस्य मध्ये,  
जायाचेषां प्रकामं दिशि दिशि भुवने सिद्धिमार्गप्रचारः ॥ २ ॥

उपेन्द्रवज्रा

यस्मिन् गुरौ निरतिभक्तिमती च श्रद्धा,  
यस्यास्ति विज्ञस्य सुशान्तमूर्तेः ।  
तस्मिन् प्रभौ विहितपूजन तत्परस्य,  
शानिश्च भूयात् किळ देवलोके ॥ ३ ॥

शार्दूल

स्वच्छे खरतरसंज्ञकेति विश्रुतेगच्छे विधातेव यः,  
संयातो गुरुपृष्ठव विमले भव्येषु सदूचोध कृत् ।  
द्रव्याद्यैश्चतुराननैश्च सततं तच्चौघमारुयापयन्,  
जीयाच्छ्रीजिनऋद्धिसूरिरनिशं स्याद्वादहंसस्थितः ॥ ४ ॥

जेयं जेयमजीजयद्विजयिनं मोहं महादुर्धरं,  
गेयं गेयमजीगमज्जिनमतं स्याद्वादसंशोभितम् ।  
तप्यं तप्यमतीतपद् बहु तपः कमौघविध्वंसकम्,  
बोध्यं बोध्यमबुधद् भुवि जनं जीयात् स ऋद्धिर्गुरुः ॥ ५ ॥

ध्येयं ध्येयमदीधरच्छिवकरं चारित्ररत्नार्हतं,  
सेव्यं सेव्यमसीषिवद्गुरुपदं सर्वार्थं संसाधकम् ।  
दीप्यं दीप्यगदीदिपतस्वचरणं सदूब्रह्मज्योतिर्मयम्,  
गेयं गेयमचीकरन्निजयशः कुन्देन्दु गौरं गुरुम् ॥ ६ ॥

सौजित्राऽमिध सुन्दरे पुरवरे प्रत्यक्षमालोकितः,  
यक्षेन्द्रः समुदाय रक्षणकरः श्री माणिभद्राभिधः ।  
गत्वा कारथ मन्दिरं मम नवं जीर्णश्च यत् स्तम्भने,  
तस्याङ्गापरि पालिताऽशु मुनिना स्तादक्रद्धिस्त्रिः श्रिये ॥ ७ ॥

### मालिनी

जिनपति जलयात्रा स्नात्रमात्रेण येना—  
ऽकृत नगरकुचेरे भीष्मदुष्कालशान्तिम् ।  
प्रशमरस सुधाभि शोभितैर्वर्णिसूत्रैः,  
रचयति वहु सङ्घे पुष्पमालेव संपूर् ॥ ८ ॥

### शार्दूल

आस्ते सर्वसमृद्धिशालिनगरं मुम्बेतिनाम्ना पुरं,  
तन्मध्ये प्रथितश्च नूतनतमं ठाणेति सम्भास्पदम् ।  
तत्र श्रीचरणैरुदारचरितैर्देवालयं निर्ममे,  
लब्धं ज्ञानबलेन शास्त्रनिष्पौर्णनित्यं यशः साधुभिः ॥ ९ ॥

### उपेन्द्रवज्रा

बोरीबली-दादर-मोहमय्या-मचीकरद् राजदुषाश्रयान् वै,  
जिनालयं साधु समादरन्तु, वशीकृतज्ञो बहुशश्वकार ॥ १० ॥

### अनुष्टुप्

पायधून्यां प्रयत्नेन, महावीरस्य मन्दिरे ।  
घटाकर्णस्य देवस्य, प्रतिष्ठाऽकारि स्त्रिभिः ॥ ११ ॥

### शार्दूल

गौदाख्य द्विजवंश जन्म विलसनमान्यः सतामग्रणीः  
 सम्पासच्च पुराभवेन विधिना सज्जानयुक्तिमदम् ।  
 आयातोऽहंतसिद्धधर्मगहने साधुप्रवर्यश्च यः  
 सार्थं जन्म कृतश्च तस्मुनिपदैः शिष्यैः समालङ्घकृतैः ॥१२॥

युज्ञन् योगबलं तिरस्कृतमिदं भूमण्डले विग्रहम्,  
 ज्येष्ठे मासि सिते बृहस्पतिदिने पक्षे तृतीयातिथी ।  
 तस्य श्रीचरणाऽविन्दयुगले पूजां बुधाः श्रावकाः,  
 कृत्वा भक्तवराश्च कृत्यमस्तिलं संस्कारसंवर्द्धकम् ॥१३॥